Dr. Babasaheb Ambedkar Open University

ના અભ્યાસક્રમ મુજબ

'CCC'

Question Bank with Answers



An ISO 9001:2008 Certified Company

VISIT…

LANZAROTE Caliente.COM

Dr. Babasaheb Ambedkar Open University
ના અભ્યાસક્રમ મુજબ

'CCC'

Question Bank with Answers





COMPUTER WORLD

43, 5th Floor, Sanidhya Complex,
Nr. M. J. Library, Opp. Sanyas Ashram,
Ashram Road, Ahmedabad-380 009.
Ph. : (079) 66611180, 26580723–823

A Division of Live Education System Pvt. Ltd.

URL : www.computerworld.ind.in
www.cworld.co.in
e-Mail : info@computerworld.ind.in

'CCC-BAOU'
(ૂટ્ટફીકેટ ઈ કમ્પ્ૂટર કન્ૂપ્ટ - ટી.એ.ઓ.ુ.)
Question Bank with Answers

Publish By :

COMPUTER World

A Division of Live Education System Pvt. Ltd.
An ISO 9001 : 2008 Certified Company

Prepare by :

Computer World Research Department
Ravindra S. Parmar

Price : 110/-

ISBN : 978-93-80010-64-9

1st Edition

Offset Printing

COMPUTER WORLD : Ph. : (079) 66611180, 26580723 (M) 9724011150

Babasaheb Amabedkar
Open University

CCC

Question Bank with Answers

Introduction

આ પુસ્તક તૈયાર કરવાનો મુખ્ય હેતુ જે લોકો Tally સોફ્ટવેરની જાણકારી ધરાવે છે પરંતુ વ્યવહારું જીવનમાં Tallyનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું પ્રેક્ટીકલી જ્ઞાન ધરાવતા નથી, તેવા લોકોનું Tally નું પ્રેક્ટીકલી જ્ઞાન વધારવાનો છે. બજારમાં Tally શીખવા માટેના ઘણાબધા પુસ્તકો ઉપ્લબ્ધ છે, પરંતુ એ પુસ્તકોમાં Tally અંગેનું થીયરીકલ જ્ઞાન વધારે આપવામાં આવે છે અને પ્રેકટીકલ જ્ઞાનની ઉપેક્ષા કરવામાં આવે છે. ખરેખર તો વાસ્તવિક જીવનમાં Tally ના પ્રેકટીકલી જ્ઞાનની વધારે જરૂર પડે છે. આથી જ અમે Tally અંગેના પ્રેકટીકલ જ્ઞાનમાં વધારો થાય તે માટે Tally-ERP9 ની પ્રોજેક્ટ બુક તૈયાર કરી છે.

આ પુસ્તકમાં Accounts થી શરૂ કરીને હવાલાનોંધ સુધીના પ્રોજેક્ટ આપેલ છે. તેમજ વિવિધ Tax જેવા કે VAT, TDS, Service Tax, Excise, CST વગેરેના પણ Project તૈયાર કરીને આપેલ છે, જેથી વાંચક Tax ને લગતાં પ્રેકટીકલ જ્ઞાનથી પરિચિત થાય. આ ઉપરાંત Tally ની વિવિધ વિશિષ્ટ સવલતો જેવી કે, ગુજરાતી એન્ટ્રી, Payroll, Price List, POS, Bill of Materials, Bank Reconciliation વગેરેના અલગથી પ્રોજેક્ટ આપેલ છે.

આ પ્રોજેક્ટ બુકની તમામ માહિતી Screen સાથે સમજાવેલ છે. Tally નો વ્યવહારું જીવનમાં ઉપયોગ કરવા માંગતા દરેક વ્યક્તિ માટે આ પુસ્તક યોગ્ય માર્ગદર્શક બની રહેશે. આ પુસ્તક અંગે આપના સૂચનો અને અભિપ્રાયો આવકાર્ય છે. આપના તરફથી જો કોઈ નવા પ્રોજેક્ટ અંગે સૂચન મળશે તો તે પ્રોજેક્ટનો સમાવેશ અમારી નવી આવૃતિમાં કરવાનો અમે જરૂર પ્રયત્ન કરીશું.



Babasaheb Amabedkar
Open University

CCC

Question Bank with Answers

Contents

વિભાગ-1 થિયરી OMR — 1 થી 64

CCC-01 ફાઉન્ડેશન [Foundation] 2

CCC-02 એપ્લીકેશન [Application] 17

- MS-Word
- MS-Excel
- MS-PowerPoint

CCC-03 ઈન્ટરનેટ [Internet]

વિભાગ-2 પ્રેક્ટીકલ પ્રોજેક્ટ — 65 થી 114

- MS-Word 66
- MS-Excel 84
- MS-PowerPoint 102

વિભાગ-3 પેપર સેટ — 115 થી 187

- થિયરી પેપર 116
  - કસોટીપત્ર-1
  - કસોટીપત્ર-2
  - કસોટીપત્ર-3
  - કસોટીપત્ર-4
  - કસોટીપત્ર-5

- પ્રેક્ટીકલ પેપર 179
  - કસોટીપત્ર-1
  - કસોટીપત્ર-2
  - કસોટીપત્ર-3
  - કસોટીપત્ર-4
  - કસોટીપત્ર-5

વિભાગ-4 હિંદ સ્વરાજ 188 થી 210

- હિંદ સ્વરાજ 189
  - કસોટીપત્ર-1
  - કસોટીપત્ર-2
  - કસોટીપત્ર-3
  - કસોટીપત્ર-4
  - કસોટીપત્ર-5

Babasaheb Amabedkar
Open University

CCC

Question Bank with Answers

“એટલા બધા મીઠા પણ ના બનો કે લોકો તમને ગળી જાય, અને
એટલા બધા કડવા પણ ના બનો કે લોકો તમને થુંકી નાખે.”

વિભાગ-1

CCC-01 [Foundation]

ફાઉન્ડેશન [Foundation]

1. કમ્પ્યૂટરની મેમરીનો નાનામાં નાનો યુનિટ કયો છે ?

[A] Byte [B] Bit [C] MIPS [D] એક પણ નહિ

Ans.B

2. કમ્પ્યૂટરની ઝડપ શેમાં મપાય છે ?

[A] Bit [B] Byte [C] MIPS [D] એક પણ નહિ

Ans.C

3. CPU નું પૂરું નામ શું છે ?

[A] કમ્પ્યૂટર પ્રોગ્રેસ યુનિટ [B] કન્ટ્રોલ પ્રોગ્રેસ યુનિટ

[C] સેન્ટ્રલ પ્રોસેસીંગ યુનિટ [D] કમ્પ્યૂટર પ્રોસેસ યુનિટ

Ans.C

4. HD નું પૂરું નામ શું છે ?

[A] Hard Disk [B] Hard Data [C] Hard Document [D] એક પણ નહિ

Ans.A

5. મોડેમની ઝડપ શેમાં મપાય છે ?

[A] Kbps [B] Mbps [C] Gbps [D] એક પણ નહિ

Ans.B

6. ઓડીયો કેસેટ રેકોર્ડરમાં ડેટા કયા સ્વરૂપે લખાય છે ?

[A] Analog [B] Digital

[C] Analog અને Digital બંને [D] એક પણ નહિ

Ans.A

7. CD માં કેટલા MB ડેટા સંગ્રહી શકાય છે ?

[A] 550 [B] 650 [C] 850 [D] 900

Ans.B

8. Firmwave શાનો ભાગ છે ?

[A] CU [B] ALU [C] Register [D] એક પણ નહિ

Ans.A

9. CRT નું પૂરું નામ શું છે ?

[A] કોમન રોમ ટીપ [B] કેથોડ રે ટ્યુબ [C] કોથોડ રે ટીમ [D] એક પણ નહિ

Ans.B

10. LCD નું પૂરું નામ શું છે ?

[A] Liquid Crystal Display [B] Large Screen Display

[C] Liquid Screen Display [D] એક પણ નહિ

Ans.A

11. GUI એટલે શું ?

[A] Graphical User Interest [B] Graphical User Enterfece

[C] Graph User Interest [D] Gega Byte Enteger

Ans.B

12. CPU અને કમ્પ્યૂટરની આસપાસ નિયંત્રણનું કાર્ય કોણ કરે છે ?

[A] ALU [B] CU [C] Register [D] એક પણ નહિ

Ans.B

13. કમ્પ્યૂટર શટ ડાઉન કરવા માટેની શોર્ટકટ કી કઈ છે ?

[A] Alt + F4 [B] Ctrl+F4 [C] Ctrl+F1 [D] Alt+F1

Ans.A

14. નીચેનામાંથી કઈ ઉચ્ચસ્તરીય ભાષા નથી ?

[A] C++, VC++, C [B] JAVA [C] VB [D] DBASE

Ans.D

15. નાનામાં નાના કમ્પ્યૂટર તરીકે કયું કમ્પ્યૂટર ઓળખાય છે ?

[A] Laptop [B] PDA [C] PC [D] Note Book

Ans.B

16. OCR નું પૂરું નામ શું છે ?

[A] Open Character Reader [B] Optical Character Reader

[C] Optical Charter Reader [D] એક પણ નહિ

Ans.B

17. નીચેના પૈકી કોણ CPU નો ભાગ નથી ?

[A] હાર્ડડિસ્ક [B] CU [C] ALU [D] રજીસ્ટર

Ans.A

18. કમ્પ્યૂટર દ્વારા જે માહિતીનું નિર્માણ કરવામાં આવે છે તેને શું કહે છે ?

[A] આઉટપુટ [B] ઈનપુટ [C] પ્રોગ્રામ [D] સી.પી.યુ.

Ans.A

19. કમ્પ્યૂટર નીચેના પૈકી કયું કાર્ય કરી શકતું નથી ?

[A] વિચારી શકતું નથી [B] પ્રક્રિયા કરી શકતું નથી

[C] છાપી શકતું નથી [D] માહિતી વાંચી શકતું નથી

Ans.A

20. ખૂબ જ ઉચ્ચ ઘનતા ધરાવતી ફ્લોપી ડિસ્કની સંગ્રહણ ક્ષમતા કેટલી હોય છે ?

[A] 2.88 MB [B] 2.88 GB [C] 5.6 MB [D] 5.6 GB

Ans.A

21. હાર્ડડિસ્કની ગતિ કલાકના કેટલા કિ.મી. હોય છે ?

[A] 100 [B] 150 [C] 250 [D] 350

Ans.B

22. નીચેના પૈકી કોણ ઓપ્ટીકલ ડિસ્ક નથી ?

[A] HD [B] CD ROM [C] WORM [D] DVD

Ans.A

23. સામાન્ય રીતે નોટપેડ દ્વારા કયાં કાર્યો કરવામાં આવે છે ?

[A] નાનો પ્રોગ્રામ લખવા [B] ગણતરી કરવા

[C] ફાઈલ સેવ કરવા [D] એક પણ નહિ

Ans.A

24. નોટપેડ એપ્લીકેશનની ડાયરેકટ બહાર નીકળવા કઈ ફંકશન કીનો ઉપયોગ થાય છે ?

[A] Alt+F1 [B] Alt+F2 [C] Alt+F3 [D] Alt+F4

Ans.D

25. Computer પાસેથી ઈચ્છિત કાર્ય કરવા માટે જરૂરી સૂચનાઓ અને માહિતી શેના દ્વારા આપી શકાય છે ?

[A] Input Device [B] Output Device

[C] Processor [D] એક પણ નહિ

Ans.A

26. નીચેના પૈકી કઈ સ્મૃતિ ખૂબ જ ઝડપી છે ?

[A] RAM [B] ROM [C] રજીસ્ટર [D] PROM

Ans.C

27. નીચેના પૈકી કોણ RAM નો પ્રકાર નથી ?

[A] PRAM [B] DRAM [C] SRAM [D] SDRAM

Ans.A

28. નીચેના પૈકી કોણ ROM નો પ્રકાર નથી ?

[A] EPROM [B] PROM [C] EROM [D] EEPROM

Ans.C

29. નીચેના પૈકી કયું કમ્પ્યૂટરનું વિશિષ્ટ લક્ષણ છે ?

[A] ચોકસાઈ [B] બુદ્ધિમત્તા [C] લાગણી [D] વિચાર શક્તિ

Ans.A

30. કમ્પ્યૂટરના જે ભાગોને જોઈ શકાય, સ્પર્શ કરી શકાય તેને કયા નામથી ઓળખવામાં આવે છે ?

[A] હાર્ડવેર [B] સોફ્ટવેર [C] કમ્પાઈલર [D] ઓપરેટીંગ સિસ્ટમ

Ans.A

31. નીચેના પૈકી કોણ બાષ્પીભૂત સંગ્રહક છે ?

[A] RAM [B] ROM [C] CD [D] DVD

Ans.A

32. કમ્પ્યૂટરની પ્રારંભિક આજ્ઞાઓ શામાં સંગ્રહ થયેલી હોય છે ?

[A] RAM [B] ROM [C] CD [D] FD

Ans.B

33. DVD ની સામાન્યત: ઓછામાં ઓછી સંગ્રહક્ષમતા કેટલી હોય છે ?

[A] 4.7 GB [B] 6.2 GB [C] 17 GB [D] 71 GB

Ans.A

34. DMP એટલે શું ?

[A] ડાયરેક્ટ મોબાઈલ ફોન [B] ડાયરેક્ટ માર્ક-અપ

[C] ડોટ મેટ્રીક્સ પ્રિન્ટર [D] આપેલ તમામ

Ans.C

35. કમ્પ્યૂટર્સ કઈ પદ્ધતિ પ્રમાણે કામ કરે છે ?

[A] દશાંકી [B] દ્વિઅંકી [C] અષ્ટાંકી [D] સોળ અંકી

Ans.B

36. ASCII કોડ કેટલા બીટનો હોય છે ?

[A] 7 [B] 8 [C] 7 અથવા 8 [D] 9

Ans.C

37. 1 GB = ———

[A] 1024 MB [B] 1024 TB [C] 1024 KB [D] એક પણ નહિ

Ans.A

38. Netscape Navigator કયા પ્રકારનું Software છે ?

[A] ડેટા મેનેજમેન્ટ [B] ઈન્ટરનેટ બ્રાઉઝર [C] ડેટા એનાલીસીસ [D] વર્ડ પ્રોસેસીંગ

Ans.B

39. નીચેના પૈકી નેટવર્કનો ફાયદો કયો છે ?

[A] વિશ્વસનીયતા [B] કિંમતમાં ફાયદો [C] રીસોર્સ શેરીંગ [D] આપેલ તમામ

Ans.D

40. નીચેના પૈકી કઈ સમસ્યા કમ્પ્યૂટર્સને કારણે ઉદ્ભવે છે ?

[A] કમ્પ્યૂટર ગુના [B] પરાવલંબીપણું [C] માનવીય અહંકાર [D] આપેલ તમામ

Ans.D

41. નીચેના પૈકી કયો શબ્દ મોનીટર સાથે સંકળાયેલ છે ?

[A] SVGA [B] UPS [C] SCSI [D] IBM

Ans.A

42. Nibble નું કદ કેટલું હોય છે ?

[A] 4 bits [B] 8 bits [C] 16 bits [D] 24 bits

Ans.A

43. નોટબુક પ્રકારના કમ્પ્યૂટરમાં કયું મોનીટર વપરાય છે ?

[A] VCD [B] LCD [C] CRT [D] DVD

Ans.B

44. ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રિન્ટીંગ માટે કયું પ્રિન્ટર ઉપયોગી છે ?

[A] લેઝર પ્રિન્ટર [B] DMP [C] લાઈન પ્રિન્ટર [D] ડ્રમ પ્રિન્ટર

Ans.A

45. Oracle કયા પ્રકારનું સોફ્ટવેર છે ?

[A] વર્ડ પ્રોસેસીંગ [B] ડેટા મેનેજમેન્ટ

[C] પ્રેઝન્ટેશન [D] ગ્રાફિક્સ ટુલ્સ

Ans.B

46. RMB શબ્દ કોની સાથે સંકળાયેલ છે ?

[A] માઉસ [B] કી-બોર્ડ [C] હાર્ડડિસ્ક [D] ફ્લોપી ડિસ્ક

Ans.A

47. કમ્પ્યૂટર હાર્ડવેર અને કમ્પ્યૂટરના ઉપયોગકર્તા વચ્ચે સેતુનું કામ કોણ કરે છે ?

[A] VLSI [B] IC [C] Operation System [D] LSI

Ans.C

48. Windows માં Start બટન કયાં આવેલું છે ?

[A] Taskbar ઉપર [B] Formatting bar ઉપર

[C] Menu bar ઉપર [D] View bar ઉપર

Ans.A

49. કમ્પ્યૂટરને સંપૂર્ણ બંધ કરવા કયા બટન પર ક્લિક કરવામાં આવે છે ?

[A] Turn off [B] Log off [C] Switch User [D] Restart

Ans.A

50. નવું ફોલ્ડર બનાવવાની પ્રક્રિયા કઈ છે ?

[A] New → File → Folder [B] Folder → New → File

[C] File → New → Folder [D] આપેલ તમામ

Ans.C

51. Windows ને નાની કરી સુષુપ્ત અવસ્થામાં મૂકવા માટે કયું બટન ઉપયોગી છે ?

[A] Close [B] Restore [C] Minimize [D] Maximize

Ans.C

52. Date and Time વિકલ્પ શાની ઉપર પ્રાપ્ય છે ?

[A] Control Panels [B] Windows Messenger
[C] My Documents [D] My Music

Ans.A

53. કમ્પ્યૂટરમાં નવું મોડેમ ઉમેરીએ ત્યારે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે ?

[A] Add Hardware [B] Add Programs [C] Add Modem [D] MSN Explorer

Ans.A

54. DIR કેવા પ્રકારનો કમાન્ડ છે ?

[A] બાહ્ય [B] ખાસ [C] આંતરિક [D] સામાન્ય

Ans.C

55. CLI નું પૂરું નામ શું છે ?

[A] Close Last Report [B] Close Long Report
[C] Close Life Report [D] Command Line Interface

Ans.D

56. કમાન્ડ આપવાનો સૌથી સરળ રસ્તો કયો છે ?

[A] સ્ક્રોલ [B] મેનુ [C] ટાઈટલ [D] સ્ટેટ્સ

Ans.B

57. એકબીજા સાથે જોડાયેલા કમ્પ્યૂટરના સમૂહને શું કહે છે ?

[A] MAC [B] OS [C] Network [D] આપેલ તમામ

Ans.C

58. Desk Top ની નીચેની બાજુ આવેલી પટ્ટીને શું કહે છે ?

[A] Menu Bar [B] Title Bar [C] Task Bar [D] Tool Bar

Ans.C

59. Help મેનુ ખોલવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે ?

[A] Ctrl + H [B] Alt+H [C] Alt + Shift + H [D] Shift + H

Ans.B

60. સિસ્ટમની તારીખ અને સમય બદલવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ?

[A] Control Panel [B] Network Places [C] My Computer [D] File Manager

Ans.A

61. ફોલ્ડરનું નામ બદલવાની પ્રક્રિયા કઈ છે ?

[A] File → New Name [B] File → Rename
[C] File → Change Rename [D] એક પણ નહિ

Ans.B

62. Disk Cleanup નો વિકલ્પ કયા Sub Menu માં આવેલો છે ?

[A] Entertainment [B] Accessibility
[C] System Tools [D] Communications

Ans.C

63. CD-Player નો વિકલ્પ કયા Sub-Menu માં આવેલો છે ?

[A] Entertainment [B] System Tools
[C] Accessibility [D] Communications

Ans.A

64. ભૂલથી દૂર થઈ ગયેલી ફાઈલ પુનઃ પ્રાપ્ત કરવા નીચેનામાંથી કયા કમાન્ડનો ઉપયોગ થાય છે ?

[A] Restore [B] Store [C] Add [D] Undelete

Ans.A

65. Recycle bin ખાલી કરવા કયો વિકલ્પ ઉપયોગી છે ?

[A] Delete Recycle Bin [B] Delete
[C] Empty Recycle Bin [D] Empty All

Ans.C

66. Windows Explorer માં કેટલા ભાગ આવેલા છે ?

[A] 1 [B] 2 [C] 3 [D] 4

Ans.B

67. DOS માં ફાઈલનું નામ બદલવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે ?

[A] Ren [B] Copy [C] Copy Con [D] આપેલ તમામ

Ans.A

68. DOS માં બનાવેલ ફાઈલમાં સુધારા-વધારા કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે ?

[A] Copy [B] Ren [C] Edit [D] Copy Con

Ans.C

69. DOS માં નવી ફાઈલ બનાવવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે ?

[A] Copy [B] Copy Con [C] Ren [D] MD

Ans.B

70. DOS માં નવી ડિરેક્ટરી બનાવવા માટેનો કમાન્ડ કયો છે ?

[A] Copy [B] Copy Con [C] New [D] MD

Ans.D

71. DOS નું પૂરું નામ શું છે ?

[A] Dos Operating System [B] Disk Operating System
[C] Direct Operating System [D] આપેલ તમામ

Ans.B

72. DOS માં ફાઈલનું નામ વધુમાં વધુ કેટલા કેરેક્ટર હોઈ શકે ?

[A] 6 [B] 7 [C] 8 [D] 10

Ans.C

73. DOS માંથી મૂળ પ્રોસેસમાં પાછા ફરવા કયો કમાન્ડ ઉપયોગી છે ?

[A] Close [B] Exit [C] Go To [D] Return

Ans.B

74. C નામના ડ્રાઈવમાં રહેલ બધી ફાઈલો તથા ફોલ્ડરને હારબંધ જોવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે ?

[A] DIR [B] DIR/S [C] DIR/W [D] DIR ???

Ans.A

75. DOS માં બનાવેલી ડિરેક્ટરીનું નામ બદલવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે ?

[A] Ren [B] MD [C] CD [D] RD

Ans.A

76. MS-DOS માં કોઈપણ કમાન્ડ વિશે વધુ માહિતી મેળવવા માટે કમાન્ડના નામ પછી કઈ સંજ્ઞાનો ઉપયોગ થાય છે ?

[A] ? [B] $ [C] # [D] એક પણ નહિ

Ans.A

77. DIR/P કેવા પ્રકારનો કમાન્ડ છે ?

[A] બાહ્ય [B] આંતરિક [C] ખાસ [D] સામાન્ય

Ans.B

78. Edit કેવા પ્રકારનો કમાન્ડ છે ?

[A] બાહ્ય [B] આંતરિક [C] ખાસ [D] સામાન્ય

Ans.A

79. નીચેના પૈકી કયું Micro Processor સૌથી ઝડપી છે ?

[A] DX [B] DX2 [C] SX [D] SX2

Ans.B

80. EPROM માં કોનો ઉપયોગ થાય છે ?

[A] EGA [B] UV-Light [C] EDP [D] GUI

Ans.B

81. નોટપેડ કયા પ્રકારનો પ્રોગ્રામ છે ?

[A] DTP [B] Utility [C] System Software [D] Database

Ans.B

82. એક કરતાં વધુ ઉપયોગકર્તા એક સાથે એક કમ્પ્યૂટર ઉપર કામ કરી શકે તે પ્રકારની પરિસ્થિતિને .... કહેવાય છે.

[A] સીંગલ યુઝર [B] મલ્ટી યુઝર [C] નેટવર્ક [D] એક પણ નહિ

Ans.B

83. એક કમ્પ્યૂટર પર એક જ ઉપયોગકર્તા કાર્ય કરી શકે તેવી પરિસ્થિતિને .... કહેવાય છે.

[A] સીંગલ યુઝર [B] મલ્ટી યુઝર [C] નેટવર્ક [D] એક પણ નહિ

Ans.A

84. વિશાળ શ્રેણીના સોફ્ટવેર તરીકે કયું સોફ્ટવેર જાણીતું છે ?

[A] યુટીલીટી [B] સામાન્ય [C] વર્ડ પ્રોસેસર [D] ટેક્સ્ટ એડિટર

Ans.A

85. HYBRID પ્રકારના કમ્પ્યૂટરને કેવા પ્રકારના કમ્પ્યૂટર તરીકે પણ ઓળખવામાં આવે છે ?

[A] મિશ્ર [B] ડીઝીટલ [C] એનાલોગ [D] એક પણ નહિ

Ans.A

86. નોટપેડ એપ્લીકેશનમાં કોઈ માહિતીની કોપી કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે ?

[A] Ctrl+X [B] Ctrl+C [C] Ctrl+V [D] Ctrl+B

Ans.B

87. નોટપેડ એપ્લીકેશનમાં કોઈ માહિતીની જગ્યા બદલવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે ?

[A] Ctrl+X [B] Ctrl+C [C] Ctrl+V [D] Ctrl+B

Ans.A

88. નોટપેડમાં Cut અથવા Copy કર્યા પછી .... શોર્ટકટ કી આપવી ફરજિયાત છે.

[A] Ctrl+V [B] Ctrl+B [C] Ctrl+C [D] Ctrl+X

Ans.A

89. કમ્પ્યૂટર ભાષાઓમાં પ્રોસીઝરલ ભાષા કઈ છે ?

[A] C [B] JAVA [C] VB [D] આપેલ તમામ

Ans.D

90. DOS માં સમગ્ર સ્ક્રીનમાં ફક્ત પ્રોમ્પ્ટ જ દેખાય તે માટેનો કમાન્ડ કયો છે ?

[A] CLR [B] CLS [C] CLB [D] એક પણ નહિ

Ans.B

91. DOS માં ફાઈલને દૂર કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે ?

[A] RD [B] Del [C] Remove [D] એક પણ નહિ

Ans.B

92. DOS માં ડિરેક્ટરીને દૂર કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે ?

[A] RD [B] Del [C] Remove [D] આપેલ તમામ

Ans.A

93. કમ્પ્યૂટરમાં સી. પી. યુ.ની વિશેષતા કઈ છે ?

[A] ઉચ્ચ કાર્યક્ષમતા [B] સુસંગતતા [C] વિસ્તરણ [D] આપેલ તમામ

Ans.D

94. .... એ આઉટપુટ ડિવાઈસ નથી.

[A] પ્રિન્ટર [B] પ્લોટર [C] સ્પીકર [D] ટ્રેક બોલ

Ans.D

95. કોણ રજિસ્ટર અને સ્મૃતિ સ્થાનોના સમૂહને સમાવે છે ?

[A] CU [B] ALU [C] MU [D] RAM

Ans.B

96. વિન્ડોઝમાં કમ્પ્યૂટર શટડાઉન કરવા માટે કયું બટન ઉપયોગી છે ?

[A] Menubar [B] Viewbar [C] Taskbar [D] એક પણ નહિ

Ans.C

97. ટેપ ડ્રાઈવમાં ડેટા કયા સ્વરૂપે લખાય છે ?

[A] ANALOG [B] DIGITAL [C] HYBRID [D] એક પણ નહિ

Ans.B

98. DOS માં Delete કમાન્ડની અસર દૂર કરવા માટે બીજા કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે ?

[A] Remove [B] Undelete [C] Xcopy [D] એક પણ નહિ

Ans.B

99. ગાણિતીક અને તાર્કિક એકમને કયા નામથી ઓળખવામાં આવે છે ?

[A] MU [B] CU [C] ALU [D] CPU

Ans.C

100. W3ને સામાન્ય રીતે કેવી રીતે ઓળખવામાં આવે છે ?

[A] WEB [B] WAB [C] WAP [D] WEP

Ans.A

101. સામાન્ય રીતે કી બોર્ડમાં કુલ કેટલી ફંકશન કી હોય છે ?

[A] 10 [B] 11 [C] 12 [D] 15

Ans.C

102. ઉચ્ચ ઘનતાવાળી ફ્લોપી ડિસ્કની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે ?

[A] 1.2 MB [B] 1.44 MB [C] 2.88 MB [D] 1.44 GB

Ans.B

103. ડેસ્કટોપ ઉપર ઘડિયાળ ના દેખાય તે માટે કયા ઓપ્શનની જરૂર પડે છે ?

[A] ટાઈટલ બાર [B] મેનુબાર [C] ટાસ્કબાર [D] ટૂલબાર

Ans.C

104. માઉસની ક્લિક બદલવા માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે ?

[A] File [B] Font [C] Control Panel [D] Windows

Ans.C

105. વિન્ડોઝમાં બનાવેલ ફોલ્ડરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ?

[A] ફાઈલ [B] સબ-ફાઈલ [C] ડિરેક્ટરી [D] એક પણ નહિ

Ans.C

106. વિન્ડોઝમાં વોલપેપરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ?

[A] સ્ક્રીન સેવર [B] સેટીંગ્સ [C] બેકગ્રાઉન્ડ [D] એક પણ નહિ

Ans.C

107. નોટપેડ એપ્લિકેશનનું એક્ષટેન્શન શું હોય છે ?

[A] .doc [B] .txt [C] .pdf [D] .exe

Ans.B

108. રેન્ડમ એકસેસ મેમરીનો સમાવેશ કયા પ્રકારની મેમરીમાં થાય છે ?

[A] પ્રાયમરી [B] સેકન્ડરી [C] રજિસ્ટર્સ [D] રીડ ઓન્લી મેમરી

Ans.A

109. વિન્ડોઝમાંથી ડોસના કમાન્ડ ચલાવવા માટે સ્ટાર્ટમેનુમાં કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે ?

[A] Run [B] System [C] Control [D] Wordpad

Ans.A

110. DOS માં એક ડિરેક્ટરીમાં આવેલ બધી જ ફાઈલોને, બીજી ડિરેક્ટરીમાં કોપી કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે ?

[A] Copy Con [B] Copy [C] Edit [D] Xcopy

Ans.D

111. બજારમાં ઓછામાં ઓછા કેટલા Mbps ઝડપ ધરાવતા મોડેમ પ્રાપ્ય છે ?

[A] 26.7 [B] 33.6 [C] 43.6 [D] 33.7

Ans.D

112. નીચે જણાવેલ કયા સોફ્ટવેરનો સમાવેશ ડેટા એનાલીસ સ્પેડશીટમાં કરવામાં આવ્યો છે ?

[A] Ventura [B] MS-Word [C] DBZ [D] Scoprofessional

Ans.D

113. સ્ક્રીન સ્ક્રોલીંગને કામચલાઉ અટકાવવા કઈ કીનો ઉપયોગ થાય છે ?

[A] Stop [B] Pause [C] End [D] Shift

Ans.B

114. બ્લેક એન્ડ વ્હાઈટ મોનીટર કયા નામથી ઓળખાય છે ?

[A] Mono VGA [B] Mono Disk [C] Mono Crome [D] Mono System

Ans.C

115. Command Line Interfaceને ટૂંકમાં .... તરીકે પણ ઓળખવામાં આવે છે.

[A] CLA [B] Command [C] CLI [D] એક પણ નહિ

Ans.C

116. સ્થાયી RAMને .... તરીકે ઓળખવામાં આવે છે.

[A] Static RAM [B] Standard RAM [C] Simple RAM [D] એક પણ નહિ

Ans.A

117. નીચેનામાંથી .... નો સમાવેશ ઈનપુટ ડિવાઈસમાં થતો નથી.

[A] માઉસ [B] સ્પીકર [C] ટ્રેક બોલ [D] કી-બોર્ડ

Ans.B

118. IBM નું પૂરું નામ શું છે ?

[A] International Business Mask [B] International Binary Machine

[C] International Business Machine [D] Internet Business Machine

Ans.C

119. જોય સ્ટીકનો સમાવેશ કયા સાધનોમાં કરવામાં આવે છે ?

[A] નિર્દેશ સાધનો [B] આગમન સાધનો [C] બહિર્વેશ સાધનો [D] એક પણ નહિ

Ans.A

120. લાઈન પ્રિન્ટર એક મિનિટમાં ઓછામાં ઓછી કેટલી લાઈન પ્રિન્ટ કરી શકે છે ?

[A] 400 [B] 500 [C] 600 [D] 700

Ans.B

121. કયું પ્રિન્ટર સરળ અને સસ્તું છે ?

[A] DMP [B] લેઝર [C] ઈન્કઝેટ [D] લાઈન

Ans.A

122. DVD ની સામાન્યત: વધુમાં વધુ સંગ્રહક્ષમતા કેટલી હોય છે ?

[A] 4.7 GB [B] 6.2 GB [C] 17 GB [D] 20 GB

Ans.C

123. નીચેના પૈકી કયા કમ્પ્યૂટરનાં લક્ષણો છે ?

[A] ચોકસાઈ [B] ઝડપ [C] વિશ્વસનીયતા [D] આપેલ તમામ

Ans.D

124. રિસાઈકલ બિનની રચના કઈ બાબતને ધ્યાનમાં રાખી કરવામાં આવી છે ?

[A] સ્વચ્છતા રાખો [B] કચરો મને આપો

[C] મનુષ્ય માત્ર ભૂલને પાત્ર [D] દિલ સાફ રાખો

Ans.C

125. .... ના સમૂહને રાખવાની જગ્યાને ફોલ્ડર કહે છે.

[A] સંગ્રાહક [B] સોફ્ટવેર [C] ફાઈલ [D] પ્રોગ્રામ

Ans.C

126. CD-ROM ડ્રાઈવની ગતિ .... હોય છે.

[A] 40X [B] 48X [C] 52X [D] આપેલ તમામ

Ans.D

127. માઈક્રોપ્રોસેસરની ત્રીજી જનરેશન .... છે.

[A] 8088 [B] 80286 [C] 80386 [D] 80486

Ans.C

128. .... પ્રકારના પ્લોટર હોય છે.

[A] ફ્લેટ બેડ [B] ડ્રમ

[C] ફ્લેટ બેડ અને ડ્રમ બંને [D] એક પણ નહિ

Ans.C

129. ફ્લોપી ડિસ્કની રચનામાં કોનો ઉપયોગ થાય છે ?

[A] આયર્ન ઓકસાઈટ [B] હાઈડ્રોકલોરીક એસિડ

[C] કોપર ઓકસાઈટ [D] એક પણ નહિ

Ans.A

130. DOS માં ડિરેકટરી બદલવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે ?

[A] MD [B] CD [C] RD [D] CD..

Ans.B

131. નીચેના પૈકી કયા માઉસની ગુણવત્તા ઉચ્ચ હોય છે ?

[A] યાંત્રિક [B] ઓપ્ટીકલ લેઝર

[C] ઓપ્ટો મિકેનીકલ [D] એક પણ નહિ

Ans.B

132. સામાન્ય રીતે જોયસ્ટીકને કોની સાથે જોડવામાં આવે છે ?

[A] ગેમ પોર્ટ [B] સીરીયલ પોર્ટ [C] પેરેલલ પોર્ટ [D] એક પણ નહિ

Ans.A

133. SCSI નો સંબંધ કોની સાથે છે ?

[A] LCD [B] HD Drive [C] CVD [D] DVD

Ans.B

134. ટ્રેકને શામાં વિભાજીત કરવામાં આવે છે ?

[A] સેકટર [B] બ્લોક [C] રંગ [D] ડિવિઝન

Ans.A

135. નીચેના પૈકી કયું સૌથી ઝડપી પ્રક્રિયા કરે છે ?

[A] ડિરેકટરી [B] ટ્રી [Tree] [C] સબ-ડિરેકટરી [D] બ્રાન્ચ

Ans.B

136. આમાંની કઈ ચાલક પદ્ધતિ નથી ?

[A] DOS [B] Windows XP [C] Linux [D] WS

Ans.D

137. જ્યારે તમામ કાર્ય થઈ ગયું હોય તથા બીજા કોઈએ કાર્ય કરવાનું ના હોય ત્યારે કયો વિકલ્પ પસંદ કરશો ?

[A] Switch Off Computer [B] Turn Off Computer
[C] Remove Recycle Bin [D] Close Computer

Ans.B

138. બાયનરીમાં કેટલા ડિઝીટ (અંકો) હોય છે ?

[A] 0 [B] 2 [C] 3 [D] 4

Ans.B

139. બાહ્ય સંગ્રાહક પર કોની અસર થાય છે ?

[A] ભેજ [B] તાપમાન [C] ભેજ અને તાપમાન [D] એક પણ નહિ

Ans.C

140. અવાજને કમ્પ્યૂટરમાં ઈનપુટ કરવા કોનો ઉપયોગ થાય છે ?

[A] માઈક્રોવેવ [B] સ્પીકર [C] વુફર [D] માઈક

Ans.D

141. કમ્પ્યૂટરમાં વીજપ્રવાહ ચાલુ કરતાં થતી પ્રક્રિયાને શું કહેવાય ?

[A] પ્રોસેસિંગ [B] લોગઓન [C] બુટિંગ [D] એક પણ નહિ

Ans.C

142. Computer પાસેથી ઈચ્છિત કાર્ય કરવા માટે જરૂરી સૂચનાઓ અને માહિતી શેના દ્વારા આપી શકાય છે ?

[A] Input Device [B] Output Device [C] Processor [D] એક પણ નહિ

Ans.A

143. કમ્પ્યૂટરની ઝડપ વધારવા નીચેના પૈકી કોનો ઉપયોગ કરવામાં આવે છે ?

[A] Cash Memory [B] CD-ROM [C] વિદ્યુત પ્રવાહ [D] ઓપ્ટીકલ ફાઈબર

Ans.A

144. બાહ્ય સંગ્રાહક પર કોની અસર થાય છે ?

[A] CPU ની ઝડપ [B] મોનીટરનો પ્રકાર [C] ભેજ [D] આપેલ તમામ

Ans.C

145. Dot Matrix પ્રિન્ટરની ઝડપ શામાં મપાય છે ?

[A] CPS [B] DPS [C] LPM [D] KB

Ans.A

146. નીચેના પૈકી કોનો વિસ્તાર મર્યાદિત હોય છે ?

[A] LAN [B] MAN [C] WAN [D] SAN

Ans.A

147. નીચેના પૈકી કોનો સમાવેશ System Tool માં થતો નથી ?

[A] Disk Cleanup
[B] Backup
[C] Disk Defragmenter
[D] CD Player

Ans.D

148. નીચેના પૈકી કોણ યુટિલીટી પ્રોગ્રામ નથી ?

[A] PowerPoint [B] Calculator [C] Notepad [D] Disk Cleanup

Ans.A

149. બાહ્ય કમાન્ડની ઓળખ કઈ છે ?

[A] .exe [B] .out [C] .bat [D] .sys

Ans.A

150. DOS ફાઈલનો અંત દર્શાવવા માટે કયો કમાન્ડનો ઉપયોગ થાય છે ?

[A] F6 [B] Ctrl+Z [C] F6 અને Ctrl+Z બંને [D] એક પણ નહિ

Ans.C

151. DOS માં કોઈ સબ-ડિરેક્ટરી ઉપરથી સીધા જ મુખ્ય ડિરેક્ટરી કે રૂટ ડિરેક્ટરી પર જવા કઈ નિશાનીનો ઉપયોગ થાય છે ?

[A] * [B] / [C] \ [D] ^

Ans.C

152. એક જ બિલ્ડિંગ અથવા રુમમાં આવેલા કમ્પ્યૂટર જોડવા માટે કયા નેટવર્કનો ઉપયોગ થાય છે ?

[A] WAN [B] LAN [C] MAN [D] SAN

Ans.B

વર્ડ પ્રોસેસીંગ [MS–WORD]

1 Save, Open, Print વિકલ્પ કયા મેનુમાં પ્રાપ્ય છે ?

[A] File [B] Edit [C] View [d] એક પણ નહિ

Ans.A

2 કોઈપણ ચોક્કસ વર્ડની જગ્યાએ બીજો વર્ડ લખવા માટે કોનો ઉપયોગ થાય છે ?

[A] Copy [B] Find [C] Replace [d] એક પણ નહિ

Ans.C

3 વર્ડમાં ફાઈલનું નામ વધુમાં વધુ કેટલા અક્ષરોનું લખી શકાય છે ?

[A] 8 [B] 256 [C] 65536 [d] એક પણ નહિ

Ans.B

4 ફાઈલને બંધ કરવા કયા કમાન્ડનો ઉપયોગ થાય છે ?

[A] Ctrl+S [B] Ctrl+W [C] Ctrl+X [d] એક પણ નહિ

Ans.B

5. છેલ્લે કરેલ સુધારા દૂર કરવા કયા બટન ઉપર ક્લિક કરવામાં આવે છે ?

[A] Redo [B] Undo [C] Delete [d] એક પણ નહિ

Ans.B

6. વર્ડમાં લખેલ લખાણના ફોન્ટ નાના કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે ?

[A] Shift+Ctrl+< [B] Shift+Ctrl+> [C] Alt+Ctrl+< [d] એક પણ નહિ

Ans.A

7. વર્ડ એપ્લીકેશનમાં ડોકયુમેન્ટને બેકગ્રાઉન્ડ Effect આપવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ?

[A] Theme [B] Bold [C] Italic [d] એક પણ નહિ

Ans.A

8. વર્ડ એપ્લીકેશનમાં કુલ કેટલા પ્રકારના Break છે ?

[A] 7 [B] 8 [C] 6 [d] 3

Ans.A

9. વર્ડ એપ્લીકેશનમાં ઓપન ફાઈલને બંધ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે ?

[A] Alt+F+O [B] Alt+F+C [C] Ctrl+F+C [D] એક પણ નહિ

Ans.B

10. વર્ડ એપ્લીકેશનમાં એક સાથે એક કરતાં વધારે વ્યક્તિઓને પત્ર મોકલવાની પદ્ધતિ કઈ છે?

[A] Mail Merge [B] Macro [C] Mailmacro [d] એક પણ નહિ

Ans.A

11. સામાન્ય રીતે વ્યાકરણની ભૂલ હોય ત્યાં કયા રંગની વાંકી-ચુકી રેખા દેખાય છે ?

[A] લીલા [B] લાલ [C] સફેદ [d] એક પણ નહિ

Ans.A

12. ફાઈલને Open કરવા નીચેનામાંથી કયો વિકલ્પ પસંદ કરી શકાય છે ?

[A] સ્ટાન્ડર્ડ ટૂલબારનું Open બટન [B] File મેનુમાંથી Open ઓપ્શન

[C] ઉપરના બેમાંથી કોઈ એક [d] એક પણ નહિ

Ans.C

13. વર્ડમાં નીચેનામાંથી કયું Tab stop અલાઈમેન્ટ નથી ?

[A] Left [B] Center [C] Right [d] Justify

Ans.D

14. Cut, Copy, Paste વિકલ્પ કયા મેનુમાં હોય છે ?

[A] File [B] Edit [C] Insert [d] એક પણ નહિ

Ans.B

15. લખાણ (text) ને બોલ્ડ અથવા ઈટાલિક કરવા માટેના બટન કયા ટૂલબાર પર આવેલ હોય છે ?

[A] ફોર્મેટિંગ [B] સ્ટાન્ડર્ડ [C] ડ્રૉઇંગ [d] એક પણ નહિ

Ans.A

16. વર્ડ એપ્લીકેશનમાં ટેબલ મેનુમાં કોઈપણ Formula કઈ નિશાની સાથે જ શરૂ થાય છે ?

[A] = [B] + [C] / [d] એક પણ નહિ

Ans.A

17. વર્ડ એપ્લીકેશનમાં નવું પેજ ઉમેરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે ?

[A] Ctrl+Enter [B] Alt+Enter [C] Alt+Shift+Del [d] એક પણ નહિ

Ans.A

18. વર્ડમાં બનાવેલી ફાઈલને SAVE કરવા માટે કઈ શોર્ટકટ કી-નો ઉપયોગ થાય છે ?

[A] Ctrl+C [B] Ctrl+S [C] Ctrl+V [d] એક પણ નહિ

Ans.B

19. વર્ડ એપ્લીકેશનમાં ડોકયુમેન્ટ પ્રિન્ટ કરવા માટે કેટલા પ્રકારના Orientation હોય છે ?

[A] 3 [B] 1 [C] 2 [d] એક પણ નહિ

Ans.C

20. વર્ડ એપ્લીકેશનમાં દરેક પેજ પર પેજનંબર લખાઈને આવે તે માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ?

[A] STATUS BAR [B] PRINT VIEW [C] PAGE SETUP [d] એક પણ નહિ

Ans.D

21. વર્ડ એપ્લીકેશનમાં ટેબલ બનાવ્યા બાદ તેમાં રહેલ માહિતીને શોટિંગ કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે ?

[A] Sort [B] Change [C] Sum [d] એક પણ નહિ

Ans.A

22. વર્ડ એપ્લીકેશનમાં બનાવેલ ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે ?

[A] .EXE [B] .DOC [C] .XLS [d] એક પણ નહિ

Ans.B

23. વર્ડમાં પેરેગ્રાફ કમાન્ડમાં .... ઓપ્શન હોય છે.

[A] Alignment [B] Indentaion [C] Spacing [d] આપેલ તમામ

Ans.D

24. લખાણની સાઈઝ વધારવા માટે .... Toolbar માં આવેલ Option નો ઉપયોગ કરવો પડે છે.

[A] ફોર્મેટીંગ [B] સ્ટાન્ડર્ડ [C] ફાઈલ [d] વેબ

Ans.A

25. ....એ વર્ડના કમાન્ડની Series છે.

[A] Mail Merge [B] Macro [C] Micro [d] એક પણ નહિ

Ans.B

26. Type કરેલ Text માં ભૂલો શોધવા તેમજ દૂર કરવા માટે નીચેનમાંથી કયા Command નો ઉપયોગ કરી શકાય છે ?

[A] Auto Text [B] Auto Correct

[C] Auto Text અને Auto Correct [d] એક પણ નહિ

Ans.B

27. Theme ડાયલોગ બોકસ કેટલા Option હોય છે ?

[A]એક [B] બે [C] ત્રણ [d] ચાર

Ans.C

28. વર્ડમાં વેબપેજ બનાવવા માટેની Web Page Wizard ની રીત કેવી છે ?

[A]મુશ્કેલ [B] સરળ [C] સૌથી સરળ [d] એક પણ નહિ

Ans.C

29. WordArt ની મદદથી અલગ-અલગ પ્રકારની કઈ Effects (ઈફેકટ) આપી શકાય છે ?

[A] Text Effect [B] Movie Effect [C] Design Effect [d] Picture Effect

Ans.A

30. Mail Merge માં નીચેનામાંથી કોનો ઉપયોગ ડેટા સોર્સ તરીકે થાય છે ?

[A] Access [B] Foxpro [C] Excel [d] આપેલ તમામ

Ans.A

31. મેઈલ મર્જ પ્રક્રિયા માટેનું કયું મહત્વનું પગથિયું ડેટા સોર્સ ફાઈલ તૈયાર કરવા માટે ઉપયોગી છે ?

[A]પહેલું [B] બીજું [C] ત્રીજુ [d] ચોથું

Ans.C

32. કયા મેનુમાં જઈને Mail Merge શરૂ કરી શકાય છે ?

[A] Insert [B] Edit [C] Tools [d] View

Ans.C

33. Word માં મેઈલ મર્જ માટે કઈ બે ફાઈલોની જરૂર હોય છે ?

[A] મુખ્ય ફાઈલ [B] ડેટા ફાઈલ

[C] મુખ્ય ફાઈલ અને ડેટા ફાઈલ [d] એક પણ નહિ

Ans.C

34. મેઈલ મર્જ માટે જરૂરી સ્ટેપ્સ કેટલા છે ?

[A] 4 [B] 6 [C] 8 [d] 10

Ans.B

35. વર્ડમાં આવેલ........ કમાન્ડ ઓબ્જેકટને વર્ટીકલી દિશાત્મક અસર આપવા મદદ કરે છે.

[A] ફ્લિ-અપ [B] રોટેટ [C] ટર્ન [d] એક પણ નહિ

Ans.B

36. Word માં કોઈ ફકરાને News Paper Style થી લખવા માટે .... મેનુનો ઉપયોગ થાય છે.

[A] Edit [B] Insert [C] Format [d] Tools

Ans.C

37. Word માં પેજ બ્રેક કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે ?

[A] Alt+Delete [B] Alt+End [C] Ctrl+End [d] Ctrl+Enter

Ans.D

38. Word માં સામાન્ય રીતે કઈ સાઈઝ ધરાવતું પેપર પ્રિન્ટ માટે વપરાય છે ?

[A] 8.5" × 12" [B] 8.4" × 11" [C] 8.5" × 11" [d] 11" x 12"

Ans.C

39. Alignment of Paragraph ની મદદથી પેરેગ્રાફને ....ની મદદથી અલાઈમેન્ટ કરી શકતા નથી.

[A] લેફ્ટ [B] રાઈટ [C] સેન્ટર [d] એક પણ નહિ

Ans.D

40. વર્ડમાં Defaul Margins ઉપરની તરફ કેટલું હોય છે ?

[A] 1" [B] 1.50" [C] 1.25" [d] 2"

Ans.A

41. કેટલા Pt. Spacing એક Single ખાલી લાઈન જેટલી છોડેલ જગ્યા જેટલી હોય છે ?

[A] 9 [B] 12 [C] 7 [d] 14

Ans.B

42. કયા ફંકશન દ્વારા મોટા Font હોવા છતાં પણ Word ઓછામાં ઓછી Line Spacing દર્શાવે છે ?

[A] Double [B] Exactly [C] At Least [d] Multiple

Ans.C

43. કયા Orientation માં પેપર એની લંબાઈ કરતાં વધારે પહોળું હોય છે ?

[A] Portrait [B] Landscape [C] Toggle [d] એક પણ નહિ

Ans.B

44. Drag અને Drop પદ્ધતિથી પસંદ કરેલ Text ને ખસેડતી વખતે.........કી Press કરી રાખવી જરૂરી છે.

[A] Shift [B] Alt [C] Ctrl અને Alt [d] Ctrl

Ans.A

45. વર્ડમાં પસંદ કરેલ Text Copy થઈને Windows માં કઈ જગ્યાએ જાય છે ?

[A] Art Box [B] Text Box [C] Office Clipboard [d] Cmobo-Box

Ans.C

46. File ની માહિતીને Organize કરતી વખતે કયા View ની જરૂર પડે છે ?

[A] Normal View [B] Web Layout View

[C] Print Layout View [d] Outline View

Ans.D

47. વ્યાકરણની ભૂલો સુધારવા માટે........ કમાન્ડનો ઉપયોગ થાય છે.

[A] AutoCorrect [B] Spelling and Grammar

[C] Auto Text [d] આપેલ તમામ

Ans.B

48. શોર્ટકટ કી Ctrl+B ના ઉપયોગ વડે લખાણ (માહિતી)ને .... કરી શકાય છે.

[A] Black [B] Blue [C] Bold [d] Brown

Ans.C

49. સ્પેલીંગની ચકાસણી કરવા કી-બોર્ડની કઈ ફંકશન કીનો ઉપયોગ થાય છે ?

[A] F1 [B] F2 [C] F5 [d] F7

Ans.D

50. Page Setup, Print Preview કમાન્ડ .... મેનુમાં હોય છે.

[A] ફોર્મેટ [B] ટુલ્સ [C] એડિટ [d] ફાઈલ

Ans.D

51. Find ઓપ્શન .... મેનુમાં હોય છે.

[A] Insert [B] Edit [C] Format [d] Tools

Ans.B

52. વર્ડમાં તારીખ લખવા માટે........ ઓપ્શન હોય છે.

[A] Date and Time [B] Date [C] Time and Date [d] Time

Ans.A

53. સમાન્ય રીતે ડોક્યુમેન્ટને કેટલા View માં જોઈ શકાય છે ?

[A] 2 [B] 5 [C] 1 [d] 3

Ans.B

54. વર્ડમાં પેજ બ્રેક કમાન્ડ........ મેનુમાં હોય છે.

[A] Format [B] Edit [C] Tools [d] Insert

Ans.D

55. Ms-Word માં નવી ફાઈલ બનાવવા માટે ....મેનુમાં જવું પડે છે.

[A] File [B] View [C] Insert [d] Tools

Ans.A

56. વર્ડ એપ્લીકેશનમાં સૌથી છેલ્લે આવેલ લાઈનને........ તરીકે ઓળખવામાં આવે છે.

[A]STATUS BAR [B] TITLE BAR [C] MENU BAR [d] Rular BAR

Ans.A

57. વર્ડમાં ખૂલ્લી ફાઈલનું પ્રિન્ટ લેવા માટે.........ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે.

[A]ફોર્મેટ [B] સ્ટાન્ડર્ડ [C] ટેબલ [d] એક પણ નહિ

Ans.B

58. Word માં બિનજરૂરી અક્ષરોને દૂર કરવા કયા કમાન્ડનો ઉપયોગ થાય છે ?

[A]Backspace [B] Delete

[C] Backspace અને Delete બંને [d] એક પણ નહિ

Ans.C

59. વર્ડમાં Language/Thesaurus ઓપ્શન કયા મેનુમાં આવેલ છે ?

[A]View [B] Insert [C] Format [d] Tools

Ans.D

60. વર્ડ એપ્લીકેશનમાં બોર્ડર બનાવવા માટે ઉપયોગમાં આવતું બોર્ડર ટૂલ .... ટૂલબારમાં જોવા મળે છે.

[A]સ્ટાન્ડર્ડ [B] ફોર્મેટ [C] ડ્રોઈંગ [d] એક પણ નહિ

Ans.B

61. વર્ડ એપ્લીકેશનમાં Clear, Select All ઓપ્શન કયા મેનુમાં આવેલ હોય છે ?

[A]FILE [B] VIEW [C] FORMAT [d] EDIT

Ans.D

62. વર્ડ એપ્લીકેશનમાં સ્પેશયલ ફોન્ટ ફોર્મેટીંગ ઈફેકટ કયા ઓપ્શનમાં જોવા મળે છે ?

[A] TEXT [B] BOOK [C] EFFECT [d] FONT

Ans.D

63. વર્ડની કોઈપણ ફાઈલને માઉસની મદદથી ખોલવી હોય તો કેટલીવાર માઉસની ક્લિક કરવી પડે છે ?

[A] 1 [B] 4 [C] 2 [d] 3

Ans.C

64. વર્ડ એપ્લીકેશનમાં વારંવાર પુનરાવર્તીત થતા કાર્ય માટે કયા ઓપ્શનનો સરળતાપૂર્વક ઉપયોગ કરી શકાય છે ?

[A]મેક્રો [B] ઓટોમેટીક [C] ઓટોઈફેકટ [d] ઓટોરાઈટર

Ans.A

65. ઇન્ટરનેટના ઉપયોગમાં લેવામાં આવતી દરેક ફાઈલ ....ની મદદથી એકબીજા સાથે જોડેલી હોય છે.

[A]હાઈપરલીંક [B] હાઈપરવર્ક [C] હાઈપર એકસેલ [d] હાઈપર નોટપેડ

Ans.A

66. વર્ડ એપ્લીકેશનમાં મેઈલ-મર્જ નામનું ટૂલબાર આવે છે તેમાં જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે ?

[A] Alt+F [B] Shift+F [C] Ctrl+F [d] Alt+Sift+F

Ans.D

67. .... એ માઉસના જમણા બટનની શોર્ટકટ કી જેવો જ કમાન્ડ છે.

[A] SMART TAGS [B] SMART [C] SMART TABS [d] SMART TEGS

Ans.A

68. વર્ડ એપ્લીકેશનમાં ઓપન ફાઈલમાં ડોકયુમેન્ટની શરૂઆતમાં પહોંચવા કઈ કીનો ઉપયોગ કરવો પડે છે ?

[A] Ctrl [B] Alt [C] Ctrl+Home [d] Shift+Home

Ans.C

69. વર્ડ એપ્લીકેશનમાં ડીલીટ કીની મદદથી INSERT ON POINT થી કઈ બાજુનું લખાણ ભૂંસી શકાય છે ?

[A]જમણી [B] ડાબી [C] ઉપર [d] નીચે

Ans.A

70. વર્ડ એપ્લીકેશનમાં દરેક પેજ ઉપર પેજ નંબર લખાઈને આવે તે માટે........ ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે.

[A] STATUSBAR [B] HEADER & FOOTER

[C] PRINT VIEW [d] એક પણ નહિ

Ans.B

71. વર્ડ એપ્લીકેશનમાં અલગ-અલગ શેપમાં લખાતા શબ્દો........ ઓપ્શનની મદદથી લખાય છે.

[A] CLIPART [B] WORDART [C] FILE [d] WORD CREATE

Ans.B

72. વર્ડ એપ્લીકેશનમાં પીક્ચર દાખલ કરવા માટે........ ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે.

[A] ક્લીપઆર્ટ [B] ફાઈલ [C] ચિત્ર [d] એક પણ નહિ

Ans.A

73. વર્ડમાં બનાવેલ ફાઈલમાં કુલ કેટલા શબ્દો છે, કેટલી લાઈન છે, કેટલા પેરેગ્રાફ છે, તે વિગતો જાણવા માટે........ કમાન્ડનો ઉપયોગ થાય છે.

[A] AUTO CORRECT [B] SPELL CHECK
[C] WORD COUNT [d] AUTO TEXT

Ans.C

74. વર્ડમાં તૈયાર કરેલી ફાઈલની પ્રિન્ટ આઉટ લેતા પહેલા પેજ લે-આઉટ કેવો લાગે છે, તે જોવા માટે........ ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે.

[A] PRINT PREVIEW [B] PRINT-OUT [C] PRINT [d] એક પણ નહિ

Ans.A

75. વર્ડ 2000 એપ્લીકેશનમાં........ મેનુ આવેલા હોય છે.

[A] 10 [B] 12 [C] 09 [d] 13

Ans.C

76. H_2O માં 2 ને નીચે દર્શાવવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ?

[A] strikethrough [B] superscript [C] subscript [d] style

Ans.C

77. વર્ડ એપ્લીકેશનમાં અલાઈમેન્ટ સેટ કરવા માટે કયા ઓપ્શનમાં જવું પડે ?

[A] Text [B] Book [C] Effect [d] Paragraph

Ans.D

78. વર્ડ એપ્લીકેશનમાં F3 ફંક્શન કી નો ઉપયોગ કયા ઓપ્શન માટે કરવામાં આવે છે.

[A] Auto Word [B] Auto Correct [C] Auto Paragraph [d] Auto Text

Ans.D

79. વર્ડ એપ્લીકેશનમાં પેપર સાઈઝ બદલવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ?

[A] Page Setup [B] Change Size [C] Paper Setup [d] Change Paper

Ans.A

80. નીચેનામાંથી કયા કોન્ટ્રોલ્સનો સમાવેશ ડાયલોગ બોક્સમાં થતો નથી ?

[A] પુલડાઉન મેનુ [B] લંબચોરસ બોક્સિસ [C] બટન્સ [d] ચેક બોક્સ

Ans.B

81. વર્ડ એપ્લકેશનમાં નવી ફાઈલને ખોલવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે ?

[A] Ctrl+N [B] Ctrl+Y [C] Ctrl+S [d] Ctrl+X

Ans.A

82. વર્ડમાં Sizing Handle દ્વારા શું કરી શકાય ?

[A] Object નું કદ વધારી શકાય

[B] Object નું કદ ઘટાડી શકાય

[C] Object નો રંગ બદલી શકાય

[d] Object નું કદ વધારી શકાય અને Object નું કદ ઘટાડી શકાય

Ans.D

83. Arial, Times New Roman શું સુચવે છે ?

[A] Font [B] Statusbar [C] Font Style [d] આપેલ તમામ

Ans.A

84. નીચેનામાંથી કયો શબ્દ પ્રક્રિયક (વર્ડ પ્રોસેસીંગ) પ્રકારનો પ્રોગ્રામ છે ?

[A] વર્ડ [B] પેઈન્ટ [C] પાવરપોઈન્ટ [d] આપેલ તમામ

Ans.A

85. ડોકયુમેન્ટ વિસ્તારમાં બ્લીન્કીંગ થતી નાનકડી લાઈન કયા નામથી ઓળખાય છે ?

[A] Insert Point [B] View Buttons [C] Check box [d] Scrollbar

Ans.A

86. સામાન્ય રીતે હાયપરલીંક શેના માટે વપરાય છે ?

[A] એક ખાના પરથી બીજા ખાના પર જવા

[B] એક પાના સાથે બીજા પાનાને જોડવા

[C] એક કમ્પ્યૂટર સાથે બીજા કમ્પ્યૂટરને જોડવા

[d] ઈન્ટરનેટ શરૂ કરવા

Ans.B

87. Ms-Word માં ગ્રાફ દાખલ કરવાની રીત કઈ છે ?

[A]View-Graph [B] Insert-Picture-Chart

[C] Insert-Graph [d] View-Picture-Graph

Ans.B

88. જો કોઈ Text ની પાસે પિકચર ગોઠવતા લખાણ Wrap થઈ જાય તો તે મુશ્કેલી દૂર કરવાની પ્રક્રિયા કઈ છે ?

[A] Format-Arrange-Picture [B] Format-Picture-Wrap

[C] View-Picture-Wrap [d] Format-Picture-Layout

Ans.D

89. Ms-Word માં Table ને આકર્ષક બનાવવા કયા વિકલ્પનો ઉપયોગ થાય છે ?

[A] Auto Fit [B] Auto Adjust
[C] Table Auto Format [d] Formula

Ans.C

90. Table ના નાનામાં નાના ભાગને શું કહેવામાં આવે છે ?

[A] Rows [B] Cell [C] Columns [d] Range

Ans.B

91. ડોક્યુમેન્ટમાં કુલ કેટલા પાના છે તે કયા બાર પરથી જાણી શકાય છે ?

[A] મેનુ [B] ટાઈટલ [C] સ્ટેટ્સ [d] ફોર્મેટીંગ ટુલબાર

Ans.C

92. ફાઈલ મેનુ ખોલવા કઇ કીનો ઉપયોગ પણ થઈ શકે ?

[A] Alt+K [B] Alt+O [C] Alt+X [d] Alt+F

Ans.D

93. નવું બ્લેન્ક ડોક્યુમેન્ટ બનાવવા કયા બટનનો ઉપયોગ થાય છે ?

[A] Standard Toolbar-New [B] Menubar-New
[C] Formatting Toolbar-New [d] Statusbar-New

Ans.A

94. Spelling અને Grammar Checking કરવા માટે કયા મેનુનો ઉપયોગ થાય છે ?

[A] Table [B] File [C] Tools [d] Format

Ans.C

95. સામાન્ય રીતે કઈ ભૂલ હોય ત્યારે લાલ રંગની વાંકીચુંકી રેખા દેખાય છે ?

[A] વ્યાકરણની [B] રચનાની [C] સ્પેલીંગની [d] માનવીય

Ans.C

96. Symbol ઓપ્શન કાર્યાન્વિત (Open) કરવા કયું મેનુ ઉપયોગમાં લેવાય છે ?

[A] View [B] Symbols [C] Insert [d] Print

Ans.C

97. શોર્ટકટ મેનુ કાર્યાન્વિત (Open) કરવા કયું બટન ઉપયોગમાં લેવાય છે ?

[A] માઉસનું જમણું બટન [B] માઉસનું વચ્ચેનું બટન
[C] માઉસનું ડાબું બટન [d] આપેલ તમામ

Ans.A

98. પેરેગ્રાફને કેટલી રીતે ગોઠવી (Align) શકાય છે ?

[A] એક [B] બે [C] ત્રણ [d] ચાર

Ans.D

99. સામાન્ય રીતે MS-Word દર કેટલા અંતરે Tab ગોઠવે છે ?

[A] 1" [B] 0.5" [C] 1.5" [d] 1.2"

Ans.B

100. પેરેગ્રાફ ડાયલોગ બોક્સ ખોલવા માટે કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે ?

[A] File-Paragraph [B] Format-Paragraph
[C] View-Paragraph [d] Table-Paragraph

Ans.B

101. લખાણમાં બોર્ડર ઉમેરવા કયા વિકલ્પનો ઉપયોગ થાય છે ?

[A] File - Borders Shading [C] Format - Shading
[B] Format - Borders [d] Format - Borders and Shading

Ans.D

102. Header અને Footer નો વિકલ્પ કયા મેનુમાંથી મળે છે ?

[A] Format [B] File
[C] View [d] Header and Footer

Ans.C

103. Envelopes તૈયાર માટે કયા મેનુનો ઉપયોગ થાય છે ?

[A] File [B] Envelopes [C] Tools [d] Insert

Ans.C

104. વર્ડનાં ટેબલમાં રહેલી માહિતીને લખાણ મુજબ set કરવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ?

[A] Autofit to Window [B] Autofit to Contents
[C] Fixed Column Width [d] એક પણ નહિ

Ans.B

105. વર્ડ એપ્લીકેશનમાં લાલ રંગની લાઈનવાળા શબ્દમાં માઉસનું જમણું બટન Press કરતાં કયા શબ્દની યાદી બતાવતું શોર્ટકટ મેનુ બતાવે છે ?

[A] સમાનાર્થી [B] ગ્રામર [C] સાચા [d] ખોટા

Ans.C

106. વર્ડ એપ્લીકેશનમાં ઉપયોગમાં લેવાતા ડાયલોગ બોકસ મુખ્યત્વે કેટલા પ્રકારના કન્ટ્રોલસનો સમૂહ છે ?

[A] 3 [B] 2 [C] 4 [d] 5

Ans.D

107. વર્ડમાં Untitle ફાઈલનું નામ કયું હોય છે ?

[A] Document [B] Document1 [C] Text File [d] Book1

Ans.B

108. રૂલરબારની નીચે દર્શાવાતી વિન્ડોને સામાન્ય રીતે શું કહેવામાં આવે છ ?

[A] વિન્ડો [B] ડોકયુમેન્ટ [C] ડોકયુમેન્ટ વિન્ડો [d] એક પણ નહિ

Ans.C

109. Tab ગોઠવવા કે રદ કરવા કયા બારનો ઉપયોગ થાય છે ?

[A] ટાઈટલબાર [B] રૂલરબાર [C] મેનુબાર [d] સ્ટેટસબાર

Ans.B

110. માઉસની મદદથી ટ્રિપલ-ક્લિક કરવાથી શું પસંદ થાય છે ?

[A] શબ્દ [B] વાક્ય [C] ફકરો [d] ડોકયુમેન્ટ

Ans.C

111. Ctrl સાથે માઉસની મદદથી ક્લિક કરવાથી શું પસંદ થાય છે ?

[A] શબ્દ [B] વાક્ય [C] ફકરો [d] ડોકયુમેન્ટ

Ans.B

112. નીચેનામાંથી કઈ કીના ઉપયોગ દ્વારા ટેબલ (કોષ્ટક)ના એક ખાનામાંથી બીજા ખાનામાં જઈ શકાય છે ?

[A] ESC [B] Ctrl [C] Tab [d] Shift

Ans.C

113. નીચેનામાંથી શેમાં વર્ડની પ્રારંભિક સ્કીન પર પ્રોગ્રામનું નામ તથા ખૂલેલ દસ્તાવેજનું નામ જોઈ શકાય છે ?

[A] સ્ટાન્ડર્ડ ટૂલબાર [B] ટાઈટલબાર [C] રૂલરબાર [d] મેનુબાર

Ans.B

114. Ms-word માં સામાન્ય રીતે........મોડ ચાલુ હોય છે.

[A] ટેક્ષ્ટ [B] ઈન્સર્ટ [C] રાઈટ [d] ટાઈપ

Ans.B

115. Word માં Cut કમાન્ડની શોર્ટકટ કી કઈ છે ?

[A] Ctrl+N [B] Ctrl+X [C] Ctrl+C [d] Ctrl+V

Ans.B

116. Word માં શબ્દાકૃતિની આકર્ષક રજૂઆત કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ?

[A] Clip Art [B] WordArt

[C] Chart [d] AutoShepes

Ans.B

117. Word માં કર્સરથી ડાબી બાજુના અક્ષરોને ભૂંસવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે ?

[A] Ins [B] Del [C] Spacebar [d] Backspace

Ans.D

118. Word માં Paste કમાન્ડની શોર્ટકટ કી કઈ છે ?

[A] Ctrl+V [B] Ctrl+X [C] Ctrl+W [d] Ctrl+S

Ans.A

119. Word માં ચિત્ર ઉમેરવા........મેનુમાં આવેલ Picture કમાન્ડનો ઉપયોગ થાય છે.

[A] Edit [B] View [C] Insert [d] Format

Ans.C

120. Format Menu ઓપન કરવા માટે કી બોર્ડની મદદથી.........ઉપયોગમાં આવે છે.

[A] Alt+F+O [B] Ctrl+O [C] Alt+O [d] એક પણ નહિ

Ans.C

121. વર્ડમાં ફકરાને જસ્ટીફાઈ કરવા.........શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે.

[A] Alt+J [B] Ctrl+G [C] Ctrl+J [d] એક પણ નહિ

Ans.C

122. MS-Word માં ફોન્ટની ડીફોલ્ટ સાઈઝ.........હોય છે.

[A] 10 [B] 11 [C] 12 [d] 14

Ans.C

123. વર્ડની ફાઈલમાં રહેલા કોઈ શબ્દને શોધવા માટેની શોર્ટકટ કી.........છે.

[A] Ctrl+A [B] Ctrl+F [C] Alt+F [d] Ctrl+H

Ans.B

124. વર્ડમાં આખી ફાઈલને સિલેક્ટ કરવા માટે.........શોર્ટકટ કી ઉપયોગી છે.

[A] Alt+A [B] Ctrl+F [C] Shift+Ctrl+A [d] Ctrl+A

Ans.D

125. વર્ડ એપ્લીકેશનમાંથી બહાર નીકળવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે ?

[A] Alt+F1 [B] Alt+F2 [C] Alt+F3 [d] Alt+F4

Ans.D

126. વર્ડ એપ્લીકેશનમાં ફાઈલની કોપી કરવા માટે કઈ શોર્ટકટ કી નો ઉપયોગ થાય છે ?

[A] Ctrl+C [B] Alt+C [C] Ctrl+X [d] Ctrl+F

Ans.A

127. Ms-Word માં Macro નો અમલ કરવા........ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે.

[A] Alt+F6 [B] Ctrl+F6 [C] Ctrl+F8 [d] Alt+F8

Ans.D

128. વર્ડમાં Bullets and Numbering કમાન્ડ કયા મેનુમાં આવેલો હોય છે ?

[A] Edit [B] Format [C] View [d] File

Ans.B

129. MS-Word માં Hyperlink કમાન્ડની શોર્ટકટ કી કઈ છે ?

[A] Ctrl+H [B] Ctrl+K [C] Ctrl+W [d] Ctrl+L

Ans.B

130. કયા કમાન્ડની મદદથી વેબપેજના બેકગ્રાઉન્ડ, ફોન્ટ, કલર, બુલેટ્સ વગેરે એકસરખા આવે છે ?

[A] Background [B] Autoformat [C] Theme [d] Font

Ans.C

131. કયા કમાન્ડની મદદથી પેરેગ્રાફનો પ્રથમ અક્ષર મોટા Font માં જોઈ શકાય છે ?

[A] Paragraph [B] Change Case [C] Text Direction [d] Drop Cap

Ans.D

132. વર્ડમાં ડોક્યુમેન્ટના અંતમાં જવા માટે કઈ કી નો ઉપયોગ થાય છે ?

[A] Ctrl+E [B] Ctrl+End [C] Alt+End [d] Shift+End

Ans.B

133. વર્ડ એપ્લીકેશન બંધ કરવા માટે કઈ શોર્ટકટ કી નો ઉપયોગ થાય છે ?

[A] Alt+F+O [B] Alt+F+C [C] Alt+F+X [d] Alt+F+N

Ans.C

134. કયા કમાન્ડની મદદથી એક જ વીન્ડોને અલગ-અલગ Section (વિભાગ) માં વહેંચી શકાય છે ?

[A] Theme [B] Frames [C] Tabs [d] Paragraph

Ans.B

135. નીચેનામાંથી કોના ઉપર **B**, *I*, U, Font, Font Size માટેના બટન જોઈ શકાય છે ?

[A] સ્ટાન્ડર્ડ ટૂલબાર [B] ફોર્મેટિંગ ટૂલબાર [C] રૂલરબાર [d] સ્ટેટ્સબાર

Ans.B

વિભાગ-1

CCC-02 [Application]

એક્સેલ [MS-Excel]

1. Excel માં દરેક Cell ને એક અજોડ...........હોય છે.

[A] સૂત્ર [B] કિંમત [C] એડ્રેસ [D] એક પણ નહિ

Ans.C

2. Excel માં વર્કશીટ ટેબનો ઉપયોગ શા માટે થાય છે ?

[A] ફાઈલને ઓપન કરવા માટે [B] ફાઈલને સેવ કરવા માટે

[C] એક વર્કશીટમાંથી બીજી વર્કશીટમાં જવા [D] એક પણ નહિ

Ans.C

3. એકસેલના સેલમાં કયા પ્રકારની માહિતી લખી શકાય ?

[A] ફકત આંકડાકીય [B] ફકત શાબ્દિક

[C] આંકડાકીય, શાબ્દિક તથા સૂત્ર [D] એક પણ નહિ

Ans.C

4. Excel માં =Len("DIPAK") આપતાં કયો જવાબ મળશે ?

[A] 6 [B] 5 [C] 4 [D] એક પણ નહિ

Ans.B

5. Excel શ્રેણીની રચના કરવા માટે કોનો ઉપયોગ શકય છે ?

[A] Autofill [B] Range [C] Series [D] આપેલ તમામ

Ans.D

6. Excel માં Save, Open, Print વિકલ્પ કયા મેનુમાં આવેલા છે ?

[A] File [B] Edit [C] View [D] એક પણ નહિ

Ans.A

7. નિરપેક્ષ એડ્રેસ લખવા માટે કઈ નિશાનીનો ઉપયોગ થાય છે ?

[A] ^ [B] $ [C] } [D] એક પણ નહિ

Ans.B

8. વર્કબુક અને વર્કશીટ શબ્દ કયા પ્રોગ્રામ સાથે સંબંધ ધરાવે છે ?

[A] Windows-XP [B] Word [C] Excel [D] એક પણ નહિ

Ans.C

9. એકસેલમાં ચોક્કસ સેલમાં લખેલ લખાણમાં ફેરફાર કરવા માટે કઈ ફંકશન કી નો ઉપયોગ થાય છે ?

[A] F1 [B] F3 [C] F2 [D] એક પણ નહિ

Ans.C

10. એક્સેલમાં શીટનું નામ બદલવા માટે કયા ઓપ્શનની જરૂર પડે છે ?

[A] Cut [B] Copy [C] Rename [D] એક પણ નહિ

Ans.C

11. એક્સેલમાં ગુજરાતીમાં માહિતી લખવા માટે કયા ઓપ્શનમાં જવું પડે છે ?

[A] Font [B] Filter [C] Font Size [D] એક પણ નહિ

Ans.A

12. એક્સેલમાં સૌથી છેલ્લા સેલનું એડ્રેસ શું હોય છે ?

[A] A65536 [B] IVI [C] IV65536 [D] એક પણ નહિ

Ans.C

13. એક્સેલમાં PIVOT TABLE WIZARD કેટલા સ્તરમાં પૂરું કરી શકાય છે ?

[A] 2 [B] 3 [C] 4 [D] એક પણ નહિ

Ans.B

14. સામાન્ય રીતે એક્સેલમાં એક સેલની પહોળાઈ કેટલી હોય છે ?

[A] 6.43 [B] 12.75 [C] 8.43 [D] એક પણ નહિ

Ans.C

15. એક્સેલમાં Goal Seek ઓપ્શન કયા મેનુમાં હોય છે ?

[A] Tools [B] Data [C] Window [D] એક પણ નહિ

Ans.A

16. Excel માં કુલ કેટલી Row હોય છે ?

[A] 65563 [B] 65536 [C] 256 [D] એક પણ નહિ

Ans.B

17. Excel માં સ્પેલિંગની ચકાસણી કરવા કઈ કીનો ઉપયોગ થાય છે ?

[A] F1 [B] F3 [C] F7 [D] એક પણ નહિ

Ans.C

18. Excel માં વર્કશીટની ચોથી હારના ત્રીજા સ્તંભના સેલને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે ?

[A] D3 [B] C4 [C] A4 [D] એક પણ નહિ

Ans.B

19. Excel માં ઘાત માટે કયા ચિહ્નનો ઉપયોગ થાય છે ?

[A] $ [B] * [C] ^ [D] એક પણ નહિ

Ans.C

20. Excel માં ગુણાકાર માટે કયું ચિહ્ન વપરાય છે ?

[A] x [B] * [C] ^ [D] એક પણ નહિ

Ans.B

21. કોઈપણ સેલમાંથી વર્કશીટના પ્રથમ સેલ પર જવા કઈ કી નો ઉપયોગ થાય છે ?

[A] Home [B] Ctrl+Home [C] Shift+Home [D] એક પણ નહિ

Ans.B

22. એકસેલમાં ડેટાને ક્રમમાં ગોઠવવા માટે મહત્તમ કેટલી કળનો ઉપયોગ કરી શકાય છે ?

[A] બે [B] ત્રણ [C] પાંચ [D] એક પણ નહિ

Ans.B

23. એકસેલમાં કયા ફંકશન દ્વારા આપેલ કિમતોનો ગુણાકાર મેળવી શકાય છે ?

[A] MOD [B] MUL [C] SUM [D] PRODUCT

Ans.D

24. ROUND(310.1997,2) નો જવાબ શું થાય ?

[A] 310.19 [B] 310.20 [C] 300 [D] એક પણ નહિ

Ans.B

25. એકસેલમાં ચારથી પાંચ ફાઈલો ખુલ્લી હોય અને તે બધી જ ફાઈલોને એક જ ઓપ્શન થી સેવ કરવામાં આવે તો તે ફાઈલનું એકસ્ટેન્શન શું હોય ?

[A] .XLS [B] .XLM [C] .XLB [D] .XLW

Ans.D

26. એકસેલમાં એક કરતાં વધારે કોલમને સિલેકટ કરવા કઈ Key ને પ્રેસ કરી રાખવી પડે છે ?

[A] Alt [B] Shift [C] Spacebar [D] એક પણ નહિ

Ans.B

27. એકસેલમાં ત્રણ વિષયના માર્કસનો કુલ સરવાળો શોધવા માટે કયા ફંકશનનો ઉપયોગ થાય છે ?

[A] SUM [B] TOTAL [C] COUNT [D] એક પણ નહિ

Ans.A

28. કઈ એપ્લીકેશનમાં એક બુકની અંદર સામાન્ય રીતે 3 શીટ હોય છે ?

[A] પાવરપોઈન્ટ [B] એકસેલ [C] વિન્ડોઝ [D] એક પણ નહિ

Ans.B

29. Cell A1 અને C2 ની કિંમતનો સરવાળો કરવા માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે ?

[A] = SUM(A1:C2) [B] A1+C2 [C] = SUM(A1+C2) [D] એક પણ નહિ

Ans.C

30. એકસેલમાં ન્યુમેરીક લખાણને ડાબી બાજુએ લખવા માટે કયા સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવે છે ?

[A] ' [B] @ [C] $ [D] "

Ans.A

31. એકસેલમાં ગ્રાફ કેટલા પ્રકારના દોરી શકાય છે ?

[A] 11 [B] 12 [C] 13 [D] 14

Ans.D

32. વર્કબુકએ કોનો સમૂહ ?

[A] ફાઈલ [B] પત્ર [C] વર્કશીટ [D] એક પણ નહિ

Ans.C

33. એકસેલમાં કરેલ ગાણિતિક પ્રક્રિયાઓની ફોર્મ્યુલા સંપૂર્ણપણે દૂર થાય તેને માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે ?

[A] CLEAR [B] FILL [C] CUT [D] એક પણ નહિ

Ans.A

34. Excel માં Validation કમાન્ડ ________ મેનુ હોય છે.

[A] Tools [B] Data [C] Format [D] Insert

Ans.B

35. Cell A1 અને B2 ની કિંમતનો સરવાળો કરવા માટે .... સૂત્રનો ઉપયોગ થાય.

[A] A1-B2 [B] A1+B2 [C] =A1-B2 [D] =A1+B2

Ans.D

36. સૂત્રને ઉકેલતાં મળતો જવાબ ઘણો મોટો હોય તો...... મેસેજ આવે છે.

[A] #NAME? [B] #N/A [C] ### [D] એક પણ નહિ

Ans.C

37. Excel માં જમણી બાજુના પછીના સ્તંભમાં જવા માટેની કી કઈ છે ?

[A] Home [B] Enter [C] Ctrl+Tab [D] એરો

Ans.D

38. ચોથા સ્તંભ અને 10 મી હારથી બનતા ખાનાનું નામ.........છે.

[A] A10 [B] D10 [C] E10 [D] J10

Ans.B

39. સ્પ્રેડશીટમાં 27 મું સ્તંભ.........થી ઓળખાય છે.

[A] CA [B] DD [C] AA [D] AB

Ans.C

40. દરેક વર્કશીટમાં છેલ્લો સ્તંભ....... હોય છે.

[A] IV [B] AZ [C] IK [D] એક પણ નહિ

Ans.A

41. Excel કયા પ્રકારનો પ્રોગ્રામ છે ?

[A] વર્ડ પ્રોસેસર [B] ઓપરેટીંગ સિસ્ટમ [C] સ્પ્રેડશીટ [D] પ્રેઝન્ટેશન

Ans.C

42. Excel માં ચાર્ટને મથાળું (Chart Title), Chart Wizard ના કયા Step માં આપી શકાય છે ?

[A] પ્રથમ Option [B] બીજા Option [C] ત્રીજા Option [D] અંતિમ Option

Ans.C

43. Excel માં સૂત્રની શરૂઆત........ચિહ્નથી થાય છે.

[A] / [B] = [C] - [D] *

Ans.B

44. Excel માં ભાગાકારની પ્રક્રિયા માટે..........ચિહ્નનો ઉપયોગ થાય છે.

[A] / [B] \ [C] - [D] એક પણ નહિ

Ans.A

45. Excel માં Range નું નામ વધુમાં વધુ..............અક્ષરોનું હોઈ શકે.

[A] 255 [B] 256 [C] 8 [D] 11

Ans.B

46. Formula bar........... પ્રોગ્રામમાં હોય છે.

[A] Word [B] Excel [C] WordPad [D] PowerPoint

Ans.B

47. એકસેલમાં Chart કમાન્ડ કયા Toolbar માં હોય છે ?

[A] Standard Toolbar [B] Formatting Toolbar

[C] Formula bar [D] Status bar

Ans.A

48. એકસેલમાં Insert Function માટેની *fx* નિશાની .... માં જોવા મળે છે.

[A] Statusbar [B] Formulabar

[C] Standard Toolbar [C] એક પણ નહિ

Ans.B

49. એકસેલમાં ત્રણ વિષયના સરેરાશ માર્કસ શોધવા માટે કયા ફંકશનનો ઉપયોગ થાય છે ?

[A] SUM [B] TOTAL [C] COUNT [D] AVERAGE

Ans.D

50. એકસેલમાં ચોક્કસ પ્રકારની રોને સંતાડવા માટે.........મેનુનો ઉપયોગ કરવામાં આવે છે.

[A] FILE [B] EDIT [C] VIEW [D] FORMAT

Ans.D

51. એકસલમાં આપોઆપ નંબર આવી જાય તેને માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે ?

[A] Autofill [B] Autoform [C] Autolate [D] Automatic

Ans.A

52. એકસેલમાં બનાવેલ માહિતીને એક જ ફિલ્ડ પર ચોક્કસ પ્રકારના માળખામાં લેવા માટે.......... ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે.

[A] VIEW [B] INDEX [C] FILTER [D] એક પણ નહિ

Ans.C

53. એકસલમાં એક કરતાં વધારે કોલમની બરાબર વચ્ચે લખાણ લાવવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે ?

[A] Merge [B] Center [C] Macro [D] Merge and Center

Ans.D

54. એકસેલમાં લખાણને ત્રાંસા કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે ?

[A] Ctrl+I [B] Ctrl+V [C] Ctrl+B [D] Ctrl+X

Ans.A

55. એકસેલમાં ચોક્કસ પ્રકારના ડેટા પ્રોટેકટ કરવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ?

[A] Protect [B] Protection [C] Save [D] Save as

Ans.B

56. એકસેલમાં ડેટાને ફિલ્ટર કરવાની સરળ રીત કયા નામથી ઓળખાય છે ?

[A] Autofilter [B] Automatic [C] Filter [D] એક પણ નહિ

Ans.A

57. એકસેલમાં આપણું કર્સર કયાં છે તે જોવા માટે કયા બારની જરૂર પડે છે ?

[A] ફોર્મેટબાર [B] ફોર્મ્યુલાબાર [C] ડેટા બાર [D] એક પણ નહિ

Ans.B

58. એકસલમાં બનાવેલ ટેબલની માહિતીને એસેન્ડીંગ ઓર્ડરમાં ગોઠવવા માટે કયા મેનુનો ઉપયોગ કરવામાં આવે છે ?

[A] Insert [B] Format [C] Sort [D] Data

Ans.D

59. એકસેલમાં ચોક્કસ પ્રકારના અંશે(ખૂણે) માહિતી લખવા કયા મેનુની જરૂર પડે છે ?

[A] File [B] Format [C] Edit [D] View

Ans.B

60. એકસેલમાં એક શીટમાંથી બીજી શીટમાં ડેટાની કોપી કરવા માટે પ્રથમ કયો સિમ્બોલ મૂકવો પડે છે ?

[A] $ [B] @ [C] # [D] }

Ans.A

61. એકસેલમાં કોઈ ગાણિતીક પ્રક્રિયા કરતી વખતે નિર્ણયાત્મક સ્થિતિ માટે કયા ફંકશનનો ઉપયોગ કરવામાં આવે છે ?

[A] Product [B] Sum [C] IF [D] Count

Ans.C

62. સામાન્ય રીતે એકસેલમાં સેલની હાઈટ કેટલી હોય છે ?

[A] 12.75 [B] 13.75 [C] 14.75 [D] 15.75

Ans.A

63. સામાન્ય રીતે એક્સેલમાં એક બુકની અંદર કેટલી શીટ હોય છે ?

[A] 4 [B] 3 [C] 2 [D] 1

Ans.B

64. એક્સેલમાં ફંક્શન કયા મેનુમાં જોવા મળે છે ?

[A] View [B] Insert [C] Format [D] Data

Ans.B

65. એક્સેલ એપ્લીકેશનનો સમાવેશ કયા ગ્રુપમાં કરવામાં આવ્યો છે ?

[A] Ms-word [B] Ms-Excel [C] Ms-Office [D] Ms-Access

Ans.C

66. એક્સેલમાં નવી શીટ દાખલ કરવા માટે કયા મેનુનો ઉપયોગ કરવો અનિવાર્ય છે ?

[A] File [B] Edit [C] View [D] Insert

Ans.D

67. એક્સેલમાં અંતિમ કોલમમાં જવા માટે કઈ કી નો ઉપયોગ થાય છે ?

[A] Ctrl+Down Arrow key

[B] End+Left Arrow key

[C] End+Right Arrow key

[D] Ctrl+Left Arrow key

Ans.A

68. વર્કશીટનું પ્રથમ સ્તંભ (કોલમ) એટલે........

[A] A [B] 1 [C] First [D] Start

Ans.A

69. .... ના નામનો પ્રથમ અક્ષર મૂળાક્ષર અથવા Under Score આપવામાં આવે છે.

[A] સેલ [B] રેન્જ [C] સૂત્ર [D] એક પણ નહિ

Ans.C

70. એક્સેલમાં Column ની Width બદલવા માટે કયા મેનુનો ઉપયોગ થાય છે ?

[A] View [B] Insert [C] Format [D] Tools

Ans.C

71. કોની મદદથી ડેટા ઉપર વિશેષ પ્રક્રિયા કરીને સારાંશ કે વિશ્લેષણ સરળતાથી કરી શકાય છે ?

[A] Pivat-Table [B] Vlookup [C] What-IF [D] Table

Ans.A

72. એક્સેલમાં કયો ચાર્ટનો પ્રકાર નથી ?

[A] XY [B] AB [C] Line [D] Column

Ans.B

73. વર્કશીટની ચાલુ હારના પ્રથમ સ્તંભ [A] પર જવા કઈ કીનો ઉપયોગ થાય છે ?

[A] A [B] Tab [C] Home [D] Enter

Ans.C

74. એકસેલમાં Background કમાન્ડ કયા મેનુમાં છે ?

[A] View [B] Insert [C] Tools [D] Format

Ans.D

75. ચાર્ટ વિઝાર્ડમાં કુલ કેટલા સ્ટેપ આવેલ છે ?

[A] એક [B] બે [C] ત્રણ [D] ચાર

Ans.D

76. Excel માં કોઈ એક કિંમત સૂત્રને પૂર્ણ કરવા જરૂરી છે, પરંતુ તે આપેલ ન હોય તો કઈ ભૂલ દર્શાવે છે ?

[A] ### [B] #N/A [C] #NAME ? [D] #REF

Ans.B

77. Excel માં Print Preview વખતે લખાણને નાનું મોટું કરવા માટે કયો ઓપ્શન પ્રાપ્ય છે ?

[A] Next [B] Reduce [C] Enlarge [D] Zoom

Ans.D

78. Excel નો ઉપયોગ નીચેના પૈકી કયા કાર્ય માટે થઈ શકે ?

[A] બજેટ બનાવવા [B] આવકવેરો ગણવા [C] પગાર બનાવવા [D] આપેલ તમામ

Ans.D

79. Excel માં એક વર્કશીટમાંથી બીજી વર્કશીટમાં જવા કોનો ઉપયોગ થાય છે ?

[A] વર્કશીટ ટેબ [B] સ્ક્રોલબાર [C] સ્ટેટ્સબાર [D] આપેલ તમામ

Ans.A

80. Excel માં Vlookup કોનાથી ઓળખાય છે ?

[A] ટૂલબાર [B] ફંક્શન [C] મેનુ [D] એક પણ નહિ

Ans.B

81. Excel માં ટાઈટલબાર પર Book1 શું સુચવે છે ?

[A] વર્કબુકનું નામ [B] વર્કશીટનું નામ

[C] એકસેલ પ્રોગ્રામનું ઉપનામ [D] એક પણ નહિ

Ans.A

82. Excel માં આલેખ તૈયાર કરવા કયા મેનુમાંથી કયો વિકલ્પ પસંદ કરવા આવે છે ?

[A] File-New Chart [B] Insert - Chart

[C] Insert-New Chart [D] Insert-Chart View

Ans.B

83. સામાન્ય રીતે Excel નો ઉપયોગ કયા કાર્ય માટે થાય છે ?

[A] પત્ર તૈયાર કરવા માટે

[B] ચિત્રો દોરવા

[C] કોષ્ટક સ્વરૂપની માહિતી પર ગણતરી કરવા

[D] એક પણ નહિ

Ans.C

84. Excel માં મહિતીને ક્રમમાં ગોઠવવા કયા મેનુનો કયો વિકલ્પ ઉપયોગી છે ?

[A] Data - Arrange [B] Data - Sort [C] Data - Set [D] Data - View

Ans.B

85. Excel ની પ્રથમ હરોળ (Row) ના અંતિમ ખાનાનું એડ્રેસ જણાવો.

[A] A100 [B] IV100 [C] IV1 [D] A1

Ans.C

86. Excel માં સરવાળો કરવા ઉપયોગ લેવાતું Autosum ટૂલ કયા ટૂલબાર પર પ્રાપ્ય છે ?

[A] Standard [B] Formatting [C] Drawing [D] એક પણ નહિ

Ans.A

87. Excel માં નીચેનામાંથી કયા પ્રકારના આલેખ (ચાર્ટ) તૈયાર કરી શકાય છે ?

[A] Column [B] Line [C] XY [D] આપેલ તમામ

Ans.D

88. Excel માં હાર (રો)ની ઊંચાઈ બદલવા કયા મેનુનો ઉપયોગ થાય છે ?

[A] File [B] Format [C] Tools [D] Window

Ans.B

89. Excel માં Filter નું કાર્ય કયા મેનુ દ્વારા થઈ શકે છે ?

[A] File [B] Edit [C] Data [D] Window

Ans.C

90. Excel માં સ્ટાન્ડર્ડ ટૂલબાર પર Σ નિશાની કયું કાર્ય કરે છે ?

[A] Save [B] Print [C] AutoSum [D] Open

Ans.C

91. Excel માં વર્કશીટની 30 નંબરની હારના 27 માં સ્તંભના સેલ(ખાનું) ને કઈ રીતે ઓળખવામાં આવે છે ?

[A] 30AA [B] 30Z [C] AA30 [D] A30

Ans.C

92. Excel માં ફાઈલનું એક્ષટેન્શન કયું હોય છે ?

[A] .exl [B] .xls [C] .xsl [D] એક પણ નહિ

Ans.B

93. Excel માં Untitle ફાઈલનું નામ કયું હોય છે ?

[A] Book [B] Sheet1 [C] Book1 [D] Sheet

Ans.C

94. Copy, Paste કાર્ય કરવા માટે કયા મેનુનો ઉપયોગ થાય છે ?

[A] File [B] Edit [C] Insert [D] Data

Ans.B

95. નીચેના પૈકી કયું કાર્ય Excel માં શક્ય નથી ?

[A] વર્કશીટનું નામ બદલવું [B] વર્કબુકમાં નવી વર્કશીટ ઉમેરવી

[C] આલેખ તૈયાર કરવા [D] આપેલ તમામ

Ans.D

96. તાર્કિક કાર્ય કરવા નીચેનામાંથી કયા ઓપરેટરનો ઉપયોગ થાય છે ?

[A] = [B] > [C] >= [D] આપેલ તમામ

Ans.D

97. Excel માં Hyperlink ની શોર્ટકટ કી કઈ છે ?

[A] Ctrl + H [B] Ctrl + K [C] Ctrl + L [D] Ctrl + R

Ans.B

98. સ્તંભને હારમાં રૂપાંતર કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે ?

[A] Paste [B] Paste Special [C] Fill [D] Auto Filter

Ans.C

99. Excel માં Form કમાન્ડ કયા મેનુમાં આવેલો છે ?

[A] Insert [B] Tools [C] Data [D] View

Ans.C

100. વર્કબુકને Open કરવા કઈ શોર્ટ-કીનો ઉપયોગ થાય છે ?

[A] Ctrl+W [B] Ctrl+O [C] Shift+W [D] Shift+O

Ans.B

101. Excel પ્રોગ્રામ કઈ કંપની દ્વારા વિકસાવવામાં આવેલ છે ?

[A] Intel [B] Microsoft [C] LG [D] IBM

Ans.B

102. નીચેનામાંથી કયું મેનુ Excel માં પ્રાપ્ય નથી ?

[A] File [B] Edit [C] Data [D] Table

Ans.D

103. કયા ફંકશનનો ઉપયોગ એનાલીસીસ કરવા માટે થાય છે ?

[A] What if [B] Vlookup [C] Sum [D] એક પણ નહિ

Ans.A

104. એકસેલમાં 28 માં સ્તંભને કેવી રીતે ઓળખવામાં આવે છે ?

[A] 28 [B] AB [C] AA [D] AB28

Ans.B

105. Excel માં લખાણ (Text) Paste કરવા માટે સૌપ્રથમ શું કરવું પડે છે ?

[A] Cut [B] Copy [C] New [D] Cut અથવા Copy

Ans.D

106. Excel માં લક્ષ્ય શોધવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે ?

[A] Sum [B] Goal Seek [C] IF [D] VLookup

Ans.B

107. Excel માં લખાણની નીચે Underline કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે ?

[A] Ctrl+I [B] Ctrl+B [C] Ctrl+V [D] Ctrl+U

Ans.D

108. એકસેલ પ્રોગ્રામની પ્રથમ લાઈનને.........બાર તરીકે ઓળખવામાં આવે છે.

[A] ટાઈટલ [B] મેનુ [C] સ્ટેટ્સ [D] સ્ક્રોલ

Ans.A

109. Ms-Excel માં સિલેકટ કરેલ સેલમાં કન્ટેન્સની કોપી કરવા કયો કમાન્ડ ઉપયોગી છે ?

[A] Fill [B] Copy [C] Cut [D] એક પણ નહિ

Ans.B

110. એકસેલમાં.........ફંકશન દ્વારા શેષ શોધી શકાય છે.

[A] Mod() [B] MUL() [C] Product() [D] Sum()

Ans.A

111. ....ફંકશન આપેલ સંખ્યા પ્રમાણે અઠવાડિયામાં આવતો દિવસ જવાબ સ્વરૂપે આપે છે.

[A] Now() [B] Today() [C] Weekday [D] Day()

Ans.C

112. =Round (3263.2670,2) નો જવાબ.............મળશે.

[A] 3263.26 [B] 3263 [C] 3263.27 [D] 3263.2670

Ans.C

113. એકસેલ ડેટાને ઊતરતાક્રમમાં ગોઠવવા કયો ઓપ્શન ઉપયોગી છે ?

[A] Ascending [B] Descending [C] Data [D] એક પણ નહિ

Ans.B

114. Format Menu ઓપન કરવા માટે કી બોર્ડની મદદથી.......... Key નો ઉપયોગ કરવામાં આવે છે.

[A] Alt+F+O [B] Ctrl+O [C] Alt+O [D] એક પણ નહિ

Ans.C

115. Excel માં ફાઈલને પ્રિન્ટ કરવા માટેની શોર્ટકટ કી........... Key નો ઉપયોગ કરવામાં આવે છે.

[A] Alt+P [B] Alt+Ctrl+P [C] Ctrl+D [D] એક પણ નહિ

Ans.D

116. Excel માં Toolbar Screen ઉપર લાવવા માટેનું ઓપ્શન...........મેનુમાં છે.

[A] View [B] Format [C] Insert [D] એક પણ નહિ

Ans.A

પાવરપોઈન્ટ [MS–PowerPoint]

1. પાવરપોઈન્ટને કયા સોફ્ટવેર તરીકે ઓળખવામાં આવે છે ?

[A]વર્ડ પ્રોસેસર [B] ટેક્સ્ટ એડિટર [C] પ્રેઝન્ટેશન [D] સ્પ્રેડશીટ

Ans.C

2. પાવરપોઈન્ટ એપ્લીકેશનમાં કેટલા પ્રકારના લે-આઉટ જોવા મળે છે ?

[A]20 [B] 24 [C] 21 [D] 25

Ans.B

3. પાવરપોઈન્ટ એપ્લીકેશનમાં સ્લાઈડને ડેકોરેટીવ કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે ?

[A]Desing Template [B] Decorate [C] Animation [D] Slide Design

Ans.A

4. પાવરપોઈન્ટ એપ્લીકેશનમાં એકના જેવી જ બીજી સ્લાઈડ બનાવવા કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે ?

[A]Ctrl+D [B] Alt+D [C] Shift+D [D] Ctrl+Alt+D

Ans.A

5. પાવરપોઈન્ટમાં બનાવેલી ફાઈલનું પ્રેઝન્ટેશન જોવા માટે કઈ ફંકશન કીનો ઉપયોગ થાય છે ?

[A]F3 [B] F4 [C] F5 [D] F7

Ans.C

6. પાવરપોઈન્ટમાં બનાવેલ ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે ?

[A].PPC [B] .PPPT [C] .PPT [D] .PXT

Ans.C

7. પાવરપોઈન્ટ એપ્લીકેશનમાં અવાજ દાખલ કરવા માટે કયા ઓપ્શનની જરૂર પડે છે ?

[A]Recorder [B] Audio [C] Sound [D] Record Sound

Ans.D

8. પાવરપોઈન્ટ એપ્લીકેશન મુખ્યત્વે કયા કામમાં ઉપયોગમાં લેવામાં આવે છે ?

[A]પ્રેઝન્ટેશન [B] ગાણિતિક [C] શાબ્દિક [D] એક પણ નહિ

Ans.A

9. પાવરપોઈન્ટ એપ્લીકેશનમાં કાર્ટૂન દાખલ કરવા માટે કયા ઓપ્શનની જરૂર પડે છે ?

[A] Clipart [B] Wordart [C] Clipbox [D] Cliping

Ans.A

10. પાવરપોઈન્ટમાં નવી સ્લાઈડ ઉમેરવા માટેની શોર્ટકટ કી કઈ છે ?

[A] Ctrl+N [B] Ctrl+M [C] Ctrl+D [D] Ctrl+I

Ans.B

11. પાવરપોઈન્ટ એપ્લીકેશનમાંથી બહાર નીકળવા કયા કમાન્ડનો ઉપયોગ થાય છે ?

[A] Alt+F+X [B] Alt+F+C [C] Alt+F+D [D] Alt+F+E

Ans.A

12. પાવરપોઈન્ટમાં બનાવેલ એક ફાઈલની અંદર દરેકે–દરેક સ્લાઈડમાં ચોક્કસ જગ્યાએ તારીખ અને સમય દર્શાવવા માટે કયા મેનુનો ઉપયોગ થાય છે ?

[A] View [B] File [C] Edit [D] Help

Ans.A

13. પાવરપોઈન્ટ એપ્લીકેશનમાં સ્લાઈડને ટાઈમીંગ આપવા માટે કયા ઓપ્શનની જરૂર પડે છે ?

[A] Rehearse Timings [B] Effect [C] Short [D] Transition

Ans.A

14. પાવરપોઈન્ટ એપ્લીકેશનમાં Slide માં રહેલ ચોક્કસ પ્રકારના શબ્દને બદલવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે ?

[A] Ctrl+F [B] Ctrl+H [C] Ctrl+E [D] Ctrl+X

Ans.B

15. પાવરપોઈન્ટ એપ્લીકેશનમાં સ્લાઈડની અંદર રહેલા ચોક્કસ પ્રકારના લખાણને ઈફેક્ટ આપવા કયા ઓપ્શનની જરૂર પડે છે ?

[A] Effect [B] Layout

[C] Design [D] Custom Animation

Ans.D

16. પાવરપોઈન્ટ એપ્લીકેશનમાં કુલ કેટલા મેનુ હોય છે ?

[A] 9 [B] 8 [C] 7 [D] 10

Ans.A

17. પાવરપોઈન્ટમાં સ્લાઈડ તૈયાર કરવા...............મેનુના જુદા-જુદા Layout નો ઉપયોગ કરી શકાય છે.

[A] File [B] Edit [C] Insert [D] Format

Ans.D

18. PowerPoint ની મદદથી જે ફાઈલ બનાવો છો તેને............થી ઓળખવામાં આવે છે.

[A] Ravi.xls [B] Ravi.ppt [C] Ravi.txt [D] Ravi.doc

Ans.B

19. PowerPoint માં નીચેનામાંથી કયા ઓપ્શન દ્વારા સ્લાઈડમાં ફક્ત ટેક્સ્ટ ઉમેરી શકાય છે ?

[A] Text Layouts [B] Text and Content Layouts

[C] Content Layouts [D] Other Layouts

Ans.A

20. તમે જેવું પ્રેઝન્ટેશનને શરૂ કરો કે તરત જ એક ખાલી Title Slide બતાવે છે અને સાથે New Presention ની .... પણ બતાવે છે.

[A] Slide [B] Task Pane [C] Window [D] એક પણ નહિ

Ans.B

21. PowerPoint માં Animation કેટલા પ્રકારના હોય છે ?

[A] એક [B] બે [C] ત્રણ [D] ચાર

Ans.B

22. પાવરપોઈન્ટના પ્રેઝન્ટેશનમાં રહેલ તમામ સ્લાઈડને એકસરખુ બેકગ્રાઉન્ડ આપવા માટે.......... Option નો ઉપયોગ થાય છે.

[A] Apply [B] Apply To All

[C] Apply Effect [D] એક પણ નહિ

Ans.B

23. પાવરપોઈન્ટ પ્રોગ્રામ દ્વારા શું તૈયાર કરી શકાય છે ?

[A] સ્લાઈડ [B] પત્રો [C] ગણતરી [D] આપેલ તમામ

Ans.A

24. પાવરપોઈન્ટ દ્વારા તૈયાર કરાયેલ સ્લાઈડમાં Movie અને Sound કયા મેનુ દ્વારા ઉમેરી શકાય છે ?

[A] File [B] Insert [C] Format [D] આપેલ તમામ

Ans.B

25. પાવરપોઈન્ટમાં સ્લાઈડને સ્ક્રીન પર રજૂ કરવા કયા મેનુમાંથી Slide Show વિકલ્પ પસંદ કરવામાં આવે છે ?

[A] File [B] View [C] Window [D] Format

Ans.B

26. પાવરપોઈન્ટ પ્રોગ્રામ બંધ કરવા કયા મેનુમાંથી કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે ?

[A] File-Close [B] File-Exit [C] File-Quit [D] File-Stop

Ans.B

27. પાવરપોઈન્ટમાં તૈયાર થતી સ્લાઈડમાં સુધારા-વધારા કયા View માં કરી શકાય છે ?

[A] Normal View [B] Slide Sorter [C] Slide Show [D] આપેલ તમામ

Ans.A

28. પાવરપોઈન્ટમાં નીચેના પૈકી કઈ સુવિધાનો ઉપયોગ શકય છે ?

[A] Movie [B] Sound [C] Clipart [D] આપેલ તમામ

Ans.D

29. PowerPoint માં બધી જ સ્લાઈડને એક સાથે આડી લાઈનમાં (Row મુજબ) દર્શાવવા કયો View ઉપયોગી છે ?

[A] Normal View [B] Slide Sorter View

[C] Notes Page View [D] Slide Show

Ans.B

30. Speaker's Note બનાવવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ કરવો પડે છે ?

[A] Notepad [B] PowerPoint [C] Excel [D] Word

Ans.B

31. પાવરપોઈન્ટમાં સ્લાઈડને સ્કીન પર રજૂ કરવા કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે ?

[A] Slide Show [B] View Show [C] F5 [D] આપેલ તમામ

Ans.D

32. પાવરપોઈન્ટ એપ્લિકેશનમાં ચાર્ટની સુવિધા કયા મેનુમાં હોય છે ?

[A] File [B] Insert [C] Format [D] એક પણ નહિ

Ans.B

33. પાવરપોઈન્ટમાં સ્લાઈડને ઈફેકટ આપવા માટે કયા ઓપ્શનની જરૂર પડે છે ?

[A] Effect [B] Slide Transition

[C] Custom Animation [D] Design

Ans.B

34. પ્રેઝેન્ટેશનમાં માહિતી, ડિઝાઈન બધી જ વસ્તુઓ જાતે તૈયાર કરવા માટે કોની પસંદગી કરશો ?

[A] ઓટોકન્ટેન્ટ વિઝાર્ડ [B] ડિઝાઈન ટેમ્પ્લેટ

[C] આઉટલાઈન [D] બ્લેક પ્રેઝન્ટેશન

Ans.D

35. પ્રત્યેક સ્લાઈડને એક પછી એક હાથ ધરીને તેના પર કાર્ય કરવા માટે કયો View પસંદ કરવામાં આવે છે ?

[A] નોટ્સ પેજ [B] સ્લાઈડ [C] સ્લાઈડ સોર્ટર [D] આઉટલાઈન

Ans.B

36. કયા પાવરપોઈન્ટ View નો ઉપયોગ વકતા સ્લાઈડ દેખાડતી વખતે બોલવાના અગત્યના મુદ્દાઓ તૈયાર કરવા માટે કરે છે ?

[A] નોટ્સ પેજ [B] સ્લાઈડ [C] સ્લાઈડ શોર્ટર [D] આઉટલાઈન

Ans.A

37. પાવરપોઈન્ટમાં Default File Name કયું હોય છે ?

[A] Book1 [B] Presentation1 [C] Document1 [D] Text1

Ans.B

38. Custom Animation અને Slide Transition કમાન્ડ કયા મેનુ છે ?

[A] Insert [B] Format [C] Slide Show [D] Tools

Ans.C

39. સાઉન્ડ ફાઈલનું એકસ્ટેન્શન કયું છે ?

[A] .Avi [B] .PPT [C] .Wav [D].vaw

Ans.C

40. પાવરપોઈન્ટમાં પ્રેઝન્ટેશન અધવચ્ચેથી બંધ કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે ?

[A] ESC [B] Alt [C] Ctrl [D] F5

Ans.A

41. પાવરપોઈન્ટમાં ડુપ્લીકેટ સ્લાઈડ બનાવવા માટે કયા મેનુનો કે કમાન્ડનો ઉપયોગ થાય છે ?

[A] Ctrl+D [B] Insert [C] Edit [D] આપેલ તમામ

Ans.D

42. કયા વિકલ્પની મદદથી દરેક પાના પર સ્લાઈડ અને વકતાની નોંધ છપાય છે ?

[A] Notes [B] Handouts [C] Outline [D] View

Ans.A

43. પાવરપોઈન્ટમાં નવું પ્રેઝન્ટેશન બનાવવાનો વિકલ્પ કયા મેનુમાં આવેલ છે ?

[A] File [B] Edit [C] View [D] Insert

Ans.A

44. શેમાં પ્રેઝન્ટેશનની ડિઝાઈન પહેલેથી જ તૈયાર હોય છે ?

[A] AutoContent Wizard [B] Open a Presentation

[C] Blank Presentation [D] Design Template

Ans.D

45. પાવરપોઈન્ટમાં ઝડપથી અને સરળ રીતે પ્રેઝન્ટેશન બનાવવાની રીત કઈ છે ?

[A] AutoContent Wizard [B] Design Template

[C] Template [D] Blank Presentation

Ans.A

46. AutoContent Wizard ની મદદથી પ્રેઝન્ટેશન બનાવવાના સ્ટેપ કેટલા છે ?

[A] 2 [B] 3 [C] 4 [D] 5

Ans.D

47. AutoContent Wizard વિકલ્પ પસંદ કરાતા પાવરપોઈન્ટ આપણા પ્રેઝન્ટેશન માટે કઈ વસ્તુ પૂરી પાડે છે ?

[A] જરૂરી મુદ્દા [B] કોરુ પ્રેઝન્ટેશન

[C] રચનાની ડિઝાઈન [D] જરૂરી મુદ્દા અને રચનાની ડિઝાઈન

Ans.D

48. સ્લાઈડ ટ્રાન્ઝિશન બોક્સ નીચેનામાંથી કઈ સવલત આપે છે ?

[A] Speed and Sound [B] Apply to All Slide

[C] Advance Slide [D] આપેલ તમામ

Ans.D

49. Insert/Movies and Sounds કમાન્ડ ધ્વનિ માટે કયો વિકલ્પ આવે છે ?

[A] Sound From File [B] Record Sound

[C] Sound From Clip Organizer [D] આપેલ તમામ

Ans.D

50. પાવરપોઈન્ટમાં દરેક સ્લાઈડનું બેકગ્રાઉન્ડ અલગ-અલગ દર્શાવવા માટે કયા Option નો ઉપયોગ થાય છે ?

[A] Apply [B] Apply to All [C] All [D] એક પણ નહિ

Ans.A

51. પાવરપોઈન્ટમાં બનાવેલ Slide માંથી ચોક્કસ શબ્દને શોધવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે ?

[A] CTRL+F [B] CTRL+H [C] CTRL+E [D] CTRL+X

Ans.A

52. પાવરપોઈન્ટમાં F5 ફંક્શન કી નો ઉપયોગ શું છે ?

[A] ફાઈલ બંધ કરવા [B] ફાઈલ ખોલવા

[C] ફાઈલને બદલવા [D] ફાઈલના પ્રેજન્ટેશન માટે

Ans.D

53. પાવરપોઈન્ટમાં “Movies and Sounds” કમાન્ડ કયા મેનુમાં છે ?

[A] Format [B] File [C] Insert [D] Edit

Ans.C

54. Animation Schems કમાન્ડ કયા મેનુમાં આવેલો છે ?

[A] View [B] Slide Show [C] Insert [D] Format

Ans.B

55. પ્રેઝન્ટેશન સતત ચાલુ રાખવા માટે કયા Option નો ઉપયોગ થાય છે ?

[A] Kiosk [Full Screen] [B] Slide Transition

[C] Animation Schems [D] Custom Animation

Ans.A

ઈન્ટરનેટ [Internet]

1. ઇ-મેઈલનો ફાયદો કયો છે?

   [A] ઝડપ [B] ઓછી કિંમત [C] સલામત [D] આપેલ તમામ

   Ans.D

2. amazon.com શું છે?

   [A] નદી [B] બંધ [C] ઓનલાઈન બુકસ્ટોર [D] બેન્ક

   Ans.C

3. Network ની સ્થાપના માટે દરેક કમ્પ્યૂટર્સમાં કયું કાર્ડ હોવું જોઈએ?

   [A] NIC [B] NOC [C] Intel [D] IBM

   Ans.A

4. નીચેના પૈકી કોણ વેબ-બ્રાઉઝર છે?

   [A] ઈન્ટરનેટ એક્સપ્લોરર [B] મોઝેઈક

   [C] ઓપેરા [D] આપેલ તમામ

   Ans.D

5. IE [ઈન્ટરનેટ એક્સપ્લોરર] ની મદદથી જોવા મળતાં Page ને છાપવા માટે IE ના કયા બટનનો ઉપયોગ થાય છે?

   [A] Back [B] Save [C] Print [D] Save As

   Ans.C

6. POP નું પુંરું નામ શું છે?

   [A] Post Office Protocol [B] Push or POP

   [C] Post On Protocol [D] Post Online Process

   Ans.A

7. ઈન્ટરનેટથી પ્રાપ્ય વિવિધ સેવાઓ પૈકી કઈ સેવાનો સૌથી વધુ ઉપયોગ થાય છે ?

   [A] EFT [B] E-Commerce [C] EBB [D] E-Mail

   Ans.D

8. નિયમિત રીતે જરૂરી Page ને કયા વિકલ્પ હેઠળ સંગ્રહ કરી શકાય, જેથી તેનું URL યાદ રાખવું ન પડે?

   [A] Save [B] Save as [C] Favorites [D] Download

   Ans.C

9. IE ચાલુ કરતાં પ્રથમ જે Page દેખાય તે કયા નામથી ઓળખાય છે?

   [A] Home Page [B] Original Page [C] Main Page [D] First Page

   Ans.A

10. KBPS નું પૂરું નામ શું છે?

[A] Kilo Bits Per Second [B] Kilo Byte Per Second

[C] Kilo Bits Per Sagment [D] એક પણ નહિ

Ans.B

11. FTP નું પૂરું નામ શું છે?

[A] File Transfer Protocol [B] File Transfer Program

[C] File Transfer Programmer [D] File Taking Protocol

Ans.A

12. નીચેના પૈકી કયું માપ સૌથી વધુ છે?

[A] KBPS [B] MBPS [C] GBPS [D] PBPS

Ans.C

13. નીચેના પૈકી કોણ ઈલેક્ટ્રોનિક સિગ્નલ્સને પ્રકાશ કિરણોમાં રૂપાંતર કરી એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલે છે?

[A] Co-Axial Cables [B] Fiber Optics [C] Microware [D] Satellite

Ans.B

14. શરૂઆતમાં ARPANET માં કેટલા IP એડ્રેસ શક્ય હતા?

[A] 256 [B] 572 [C] 132 [D] 255

Ans.A

15. હાલમાં ઈન્ટરનેટમાં કેટલા IP એડ્રેસ શક્ય છે?

[A] 2 અબજ [B] 3 અબજ [C] 1 અબજ [D] 4 અબજ

Ans.D

16. E-Mail વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખશો?

[A] ત્વરિત જવાબ [B] શિષ્ટભાષા [C] ટૂંકાણ [D] આપેલ તમામ

Ans.D

17. DNS નું પૂરું નામ શું છે?

[A] Domain Name System [B] Data Network System

[C] Data Name System [D] Domain Network System

Ans.A

18. નેટવર્ક માટે કયું ક્ષેત્ર નામ વપરાય છે?

[A] .gov [B] .org [C] .net [D] .com

Ans.C

19. આપણા અંગત કમ્પ્યૂટર પરથી જરૂરી ફાઈલને સર્વર કમ્પ્યૂટર પર મોકલવાની પ્રક્રિયાને કયા નામે ઓળખવામાં આવે છે?

[A] Download [B] Upload [C] FTP [D] એક પણ નહિ

Ans.B

20. વેબપેજ મોકલવા માટેની વિનંતી નવેસરથી મોકલવા માટે IE ના કયા બટનનો ઉપયોગ થાય છે?
[A] Back [B] Forward [C] Stop [D] Refresh
Ans.D

21. Outlook Express કયા પ્રકારનું સોફ્ટવેર છે?
[A] Word Processor [B] DBMS [C] E-Mail Client [D] Graphics
Ans.C

22. આપણને ઈ-મેઈલ આઈડી કોણ ફાળવે છે?
[A] ARPANET [B] Inter/NIC [C] ISP [D] UPS
Ans.C

23. LAN ની રચનામાં નીચેના પૈકી કોનો ઉપયોગ થાય છે?
[A] Satellite [B] Microware [C] Co-Axial Cables [D] Fiber Optic
Ans.C

24. નેટવર્કમાં ભાગ લેતા વિવિધ કમ્પ્યૂટર્સ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે, તે વ્યવસ્થાને કયા નામે ઓળખવામાં આવે છે?
[A] ટોપોલોજી [B] FTP [C] કેબલીંગ [D] HTTP
Ans.A

25. કમ્પ્યૂટર નેટવર્કનો સૌપ્રથમ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ કયા નામે ઓળખાયો?
[A] WWW [B] INTERNET [C] ARCNET [D] ARPA
Ans.D

26. ચેટીંગ માટે નીચેના પૈકી કયું Software આપણા કમ્પ્યૂટરમાં હોવું જોઈએ?
[A] Internet Relay Chat [B] Word
[C] Ms-Dos [D] Outlook Express
Ans.A

27. નીચેના પૈકી કઈ સેવા ઈન્ટરનેટથી મળી શકે છે?
[A] E-Mail [B] BBS [C] FTP [D] આપેલ તમામ
Ans.D

28. Website નું અજોડ સરનામું કયા નામે ઓળખાય છે?
[A] IE [B] LYCOS [C] URL [D] FTP
Ans.C

29. OSI મૉડેલ કોણે તૈયાર કર્યું છે?
[A] ISO [B] IBM [C] WIPRO [D] MICROSOFT
Ans.A

30. નેટવર્ક ટોપોલોજીના મધ્યસ્થ નિયંત્રકને કયા નામે ઓળખવામાં આવે છે?
[A] Hub [B] Switch
[C] Hub અથવા Switch [D] એક પણ નહિ
Ans.C

31. નીચેના પૈકી કોણ સૌથી મજબૂત નેટવર્ક પ્રદાન કરે છે?

[A] બસ [B] રીંગ [C] મેશ [D] સ્ટાર

Ans.C

32. નીચેનામાંથી કોણ શોધ એન્જીન છે?

[A] Yahoo [B] Google [C] Lycos [D] આપેલ તમામ

Ans.D

33. મારૂતિ ઉદ્યોગ લિમિટેડે નીચેના પૈકી કયા મૉડેલનો ઉપયોગ કરી માલસામાન પુરો પાડનારી અન્ય કંપનીઓ સાથે વ્યવસ્થા ગોઠવેલ છે?

[A] B2C [B] B2B [C] C2B [D] C2C

Ans.B

34. SBI જેવી બૅન્કો પોતાના ગ્રાહકોને સગવડ પૂરી પાડવા E-Commerce નું કયું મોડેલ અપનાવે છે?

[A] B2C [B] B2B [C] C2B [D] C2C

Ans.A

35. કમ્પ્યૂટર નેટવર્કનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સૌપ્રથમ ક્યારે હાથ ધરવામાં આવ્યો?

[A] 2-1-1969 [B] 3-1-1969 [C] 4-1-1959 [D] 1-2-1969

Ans.A

36. આખા વિશ્વમાં પુસ્તકોનું વધુમાં વધુ ઈન્ટરનેટની મદદથી વેચાણ કરતી વેબસાઈટ કઈ છે?

[A] AMAZON [B] AMAZAN [C] AMEZON [D] AMAZEN

Ans.A

37. નીચેનામાંથી કઈ નેટવર્ક ટોપોલોજી છે ?

[A] Ring [B] Star [C] Mesh [D] આપેલ તમામ

Ans.D

38. www.naukari.com વેબસાઈટ શેના માટે જાણીતી છે

[A] જીવનસાથી [B] પુસ્તકો [C] રોજગાર [D] સમાચાર

Ans.C

39. ભારતની અંતરીક્ષ ક્ષેત્રે સંશોધન કાર્ય કરતી ઈસરો સંસ્થાની વેબસાઈટનું ક્ષેત્ર કયું છે?

[A] .net [B] .org [C] .edu [D] .gov

Ans.B

40. નીચેનામાંથી કઈ ટોપોલોજીનો સમાવેશ નેટવર્ક ટોપોલોજીમાં થાય છે?

[A] વાય ટોપોલોજી [B] બસ ટોપોલોજી

[C] લેન ટોપોલોજી [D] અમેરિકન ટોપોલોજી

Ans.B

41. કોને કમ્પ્યૂટર નેટવર્કના નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે?

[A] ઈન્ટ્રાનેટ [B] ઈન્ફ્રારેડ [C] ઈન્ટરનેટ [D] બ્લ્યુ ટુથ

Ans.C

42. આપણા ઈ-મેઈલમાં મેઈલના ભરાવાને દૂર કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરવો જોઈએ ?

[A] Inbox [B] Outbox [C] Delete [D] Write

Ans.C

43. ઈ-મેઈલમાં કોઈ એક ફાઈલને જોડવી હોય તો તેને માટે કયા ઓપ્શનની જરૂર પડે છે?

[A] BIDVU [B] ANOTHER [C] BIDAN [D] ATTACHMENT

Ans.D

44. ઈ-મેઈલમાં એક કરતાં વધારે વ્યક્તિઓને મેઈલ મોકલવા માટે કયો ઓપ્શન આપેલ છે?

[A] ACC [B] ANOTHER [C] BCC [D] એક પણ નહિ

Ans.C

45. કોઈ વ્યક્તિને મેઈલ મોકલવો હોય તો કયા બટનનો ઉપયોગ કરવામાં આવે છે?

[A] New Mail [B] Attachment [C] Send [D] Folder

Ans.C

46. ઈ-મેઈલ આઈડી બે ભાગમાં વહેંચાયેલો હોય છે, આ બંને ભાગને જુદા પાડવા કયા ચિહ્નો ઉપયોગ થાય છે?

[A] @ [B] # [C] / [D] એક પણ નહિ

Ans.A

47. ઈ-મેઈલમાં નીચે આપેલ શબ્દોમાંથી કયા એક શબ્દનો ઉપયોગ થતો નથી?

[A] SEND [B] ATTACHMENT [C] ROM [D] NEW MAIL

Ans.C

48. ઈ-મેઈલમાં એક સાથે વધુમાં વધુ કેટલી વ્યક્તિઓને એક સમાન મેસેજ મોકલી શકીએ છીએ?

[A] એક [B] બે [C] ત્રણ [D] અનેક

Ans.D

49. ઈ-મેઈલનું ઈન્ટરનેટના માધ્યમથી આદાન-પ્રદાન કરવા માટે કોનો ઉપયોગ થાય છે?

[A] POP [B] POMP [C] PIP [D] FTP

Ans.A

50. નેટવર્કનો ફાયદો કયો છે ?

[A] માહિતીની આપ-લે [B] ઓછી પડતર કિંમત

[C] ઝડપી આંતરિક જોડાણ [D] આપેલ તમામ

Ans.D

51. 100,00,00,000 બિટ્સ એટલે...............

[A] KBPS [B] MBPS [C] GBPS [D] એક પણ નહિ

Ans.C

52. એક સેકન્ડમાં આશરે 1000 બિટ્સની ઝડપ માપવા માટેનો એકમ કયા નામથી ઓળખાય છે?

[A] GBPS [B] MBPS [C] KBPS [D] એક પણ નહિ

Ans.C

53. ઈ-કોમર્સમાં બિઝનેસ ટુ બિઝનેસને ટૂંકમાં કઈ રીતે ઓળખવામાં આવે છે?

[A] B2C [B] B2B [C] B TO C [D] B TO B

Ans.B

54. ગુજરાતી ભાષામાં ઈ-મેઈલ કયા નામથી ઓળખાય છે?

[A] વિજાણુ ઉપગ્રહ [B] વિજાણુ ટપાલ [C] વિજાણુ મેઈલ [D] એક પણ નહિ

Ans.B

55. દુનિયાની કોઈપણ એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે નિર્ધારિત સમયમાં ઈન્ટરનેટના માધ્યમથી વાતચીત કરી શકે તે પ્રક્રિયાને શું કહે છે?

[A] ઈ-મેઈલ [B] કોન્ફરન્સિંગ [C] સિસ્ટમ [D] ક્લિપીંગ

Ans.B

56. અંગત નામ તથા ક્ષેત્ર (DOMAIN) નામ ધરાવતા બંને ભાગ કયા મુખ્ય સરનામા સાથે સંકળાયેલા છે?

[A] DOTS [B] DNS [C] TCP/IP [D] એક પણ નહિ

Ans.B

57. નીચેનામાંથી કયું વેબ બ્રાઉઝર નથી?

[A] Neoplanet [B] Mosaic [C] Opera [D] Lycos

Ans.D

58. નીચેનામાંથી કયો ઈ-કોમર્સનો પ્રકાર નથી?

[A] B2C [B] B2B [C] C2C [D] A2B

Ans.D

59. રીંગ ટોપોલોજીમાં બે કમ્પ્યૂટરો કેવા પ્રકારની લૂપ સાથે જોડાયેલા હોય છે?

[A] પૂરક [B] બંધ [C] અલગ [D] એક પણ નહિ

Ans.B

60. આપણી ઉપર આવેલ ઈ-મેઈલને તરત જ જવાબ આપવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે?

[A] SEND [B] REPLY [C] ATTRIB [D] OK

Ans.B

61. સામાન્ય રીતે OSI મોડેલ કેટલા સ્તર (Layer) નો ઉપયોગ કરીને ચોક્કસ પ્રકારનું પરિણામ આવે છે?

[A] 6 [B] 5 [C] 4 [D] 7

Ans.D

62. ઈન્ટરનેટની મદદથી જે પણ ધંધાકીય વ્યવહારો શકય બન્યા છે તેને શું કહેવામાં આવે છે?

[A] બિઝનેસ [B] ઈ-ગવર્નન્સ [C] ઈ-કોમર્સ [D] ઈ-મેઈલ

Ans.C

63. _____ એ બુલેટીન બોર્ડ સેવા પ્રકારની ઈન્ટરનેટ પરની પ્રખ્યાત સમાચાર સેવા તરીકે પ્રચલિત છે.

[A] Usenet [B] Usemail [C] Usemet [D] Useinternet

Ans.A

64. નીચેનામાંથી કયું સોફ્ટવેર શોધ એન્જિન નથી?

[A] Yahoo [B] Google
[C] Lycos [D] Internet Explorer

Ans.D

65. ઈન્ટરનેટમાં કોઈપણ વેબપેજને રીફ્રેશ કરવા માટે કઈ ફંકશન કી નો ઉપયોગ થાય છે?

[A] F1 [B] F2 [C] F3 [D] F5

Ans.D

66. _____ પોતાના ગ્રાહકોને માલ-સામાનની ઓનલાઈન હરાજી કરવાની સગવડ પૂરી પાડે છે?

[A] Yahoo [B] Google [C] eBay [D] Amazon

Ans.C

67. ઈન્ટરનેટની શોધ કયા દેશે કરી?

[A] ભારત [B] રશિયા [C] ચીન [D] અમેરિકા

Ans.D

68. સામાન્ય રીતે ચિત્ર ફાઈલના એક્ષટેન્શન માટે______શબ્દનો ઉપયોગ થાય છે.

[A] GIF [B] GPJ [C] BMP [D] PDF

Ans.A

69. નીચે દર્શાવેલ નામમાંથી કયું નામ પ્રોટોકોલ તરીકે ઓળખાતું નથી?

[A] TCP/IP [B] HTTP [C] FTP [D] WWW

Ans.D

70. સામાન્ય રીતે IP ADDRESS_____બીટ્સ (BITS) નો બનેલો હોય છે

[A] 32 [B] 28 [C] 26 [D] 36

Ans.A

71. કોઈપણ દેશની લશ્કરની વેબસાઈટ માટે DOMAIN NAME ના કયા ક્ષેત્રનો ઉપયોગ થાય છે?

[A] .mil [B] .com [C] .las [D] .gov

Ans.A

72. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વેબસાઈટનું નામ શું છે

[A] dbaou [B] baou [C] dbaoua [D] baoua

Ans.B

73. એકબીજા સાથે સંકળાયેલ ઘટકોનો સમૂહ કયા નામથી ઓળખાય છે?

[A] ગ્રુપ [B] રીંગ [C] નેટવર્ક [D] સમૂહ

Ans.C

74. માહિતી પ્રત્યાયન માટેના નિયમોના ગણને કયા નામથી ઓળખવામાં આવે છે?

[A] કાયદો [B] રૂલ્સ [C] પ્રોટોકોલ [D] રેગ્યુલેશન

Ans.C

75. ઈન્ટરનેટના વિકાસમાં પાયાનું કામ કોણે કર્યું છે?

[A] IBM [B] MICROSOFT [C] PENTAGON [D] WIPRO

Ans.C

76. ઈન્ટરનેટમાં Mail ને લગતી માહિતી માટે કયા પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે?
[A] PPT [B] FTP [C] SMTP [D] HTTP
Ans.C

77. Usenet કોની સાથે સંબંધ ધરાવે છે?
[A] E-mail [B] BBS [C] FTP [D] Telnet
Ans.B

78. LAN અને WAN ની વચ્ચે કયો Network પ્રકાર આવે છે ?
[A] SAN [B] MAN [C] MEN [D] એક પણ નહિ
Ans.B

79. કયા પ્રકારની ટોપોલોજીમાં બધા જ કમ્પ્યૂટર મધ્યસ્થ નિયંત્રક સાથે જોડવામાં આવે છે ?
[A] બસ [B] સ્ટાર [C] મેશ [D] રીંગ
Ans.A

80. ભારતમાં કઈ કંપનીએ વાણિજ્ય હેતુ માટે ઈન્ટરનેટની સેવા શરૂ કરી ?
[A] VSNL [B] BSNL [C] DSNL [D] એક પણ નહિ
Ans.A

81. ઈન્ટરનેટ જોડવા માટે_____ની જરૂર પડે છે.
[A] CABLE [B] MOUSE [C] SCANNER [D] YAHOO
Ans.A

82. Network ના મુખ્ય કેટલા પ્રકાર છે?
[A] એક [B] બે [C] ત્રણ [D] ચાર
Ans.C

83. HTTP નું પૂરું નામ શું છે?
[A] Hyper Text Transfer Programm [B] Hyper Text Transfer Protocol
[C] Hyper Text Tools Programm [D] Hyper Text Programm
Ans.B

84. ડેટા પ્રત્યાયનની ઝડપ માટે_____એકમ વપરાય છે.
[A] BPS [B] MVP [C] MB [D] GB
Ans.A

85. કયા પ્રકારની ટોપોલોજીમાં જોડાણ ખરાબ હોય તો માત્ર તે જોડાણ પૂરતો જ વ્યવહાર અટકી જાય છે ?
[A] બસ [B] સ્ટાર [C] મેશ [D] રીંગ
Ans.B

86. કઈ પદ્ધતિમાં પ્રત્યાપનની ઝડપ 2 MBPS જેટલી મળે છે ?
[A] કો-એક્ષિયલ વાયર [B] ફાઈબર ઓપ્ટિક વાયર
[C] રેડિયો તથા માઈક્રોવેવ [D] ઉપગ્રહ
Ans.C

87. .gov ક્ષેત્ર નામ કોને લાગુ પડે છે?

[A] સરકાર [B] લશ્કર [C] શૈક્ષણિક સંસ્થા [D] સંગઠન

Ans.A

88. ભારત માટે ભૌગોલિક ડોમેઈન નામ શું છે?

[A] .acc [B] .de [C] .in [D] .ch

Ans.C

89. HTML માં ઈલેકટ્રોનિક દસ્તાવેજને શું કહેવામાં આવે છે ?

[A] વેબ [B] ઇ-મેઇલ [C] વેબપેજ [D] વેબસાઈટ

Ans.C

90. વેબપેજ કઈ ફાઈલ તરીકે Save થાય છે?

[A] FTP [B] WWW [C] HTML [D] WORD

Ans.C

91. IP એડ્રેસને યાદ રાખવું સરળ ન હોવાથી તેની જગ્યાએ DNS અપાય છે, તેના મુખ્ય ભાગો કેટલા છે?

[A] 1 [B] 2 [C] 3 [D] એક પણ નહિ

Ans.B

92. નીચેનામાંથી કયું સાધન સાંખ્યિક સંકેતોને [Digital] , અનુરૂપ સંકેતોમાં [Analog] તેમજ તેથી ઊલટું અનુરૂપ સંકેતોને સાંખ્યિક સંકેતોમાં રૂપાંતરિત કરે છે ?

[A] રાઉટર [B] હબ [C] મોડેમ [D] એક પણ નહિ

Ans.C

93. નેટવર્કમાં જોડાતા દરેક કમ્પ્યૂટરને એક અજોડ નંબર આપવામાં આવે છે તેનું નામ જણાવો.

[A] IP [B] DNS [C] IP એડ્રેસ [D] એક પણ નહિ

Ans.C

94. સર્વર માં રહેલ ફાઈલની નકલ આપણા અંગત કમ્પ્યૂટર પર કરવાની ક્રિયાને_____કહે છે.

[A] અપલોડ [B] ડાઉનલોડિંગ [C] બ્રાઉઝીંગ [D] એક પણ નહિ

Ans.B

95. ટેલીફોન લાઈન દ્વારા જો ઈન્ટરનેટ જોડાણ મેળવવું હોય તો_____સાધનનો ઉપયોગ કમ્પ્યૂટર અને ફોન લાઈન વચ્ચે જોડાણ માટે થાય છે.

[A] HUB [B] NTC [C] Modem [D] એક પણ નહિ

Ans.C

96. કઈ ટોપોલોજીમાં વર્તુળ માર્ગે એક જ દિશામાં ડેટાનું પ્રસારણ થાય છે ?

[A] બસ [B] સ્ટાર [C] રીંગ [D] મેશ

Ans.C

97. શોધ એન્જિન શું છે ?

[A] Hardware [B] Software [C] Firmware [D] એક પણ નહિ

Ans.B

98. કોઈપણ વેબસાઈટ નિહાળવા અંગત કમ્પ્યૂટર પર કેવા પ્રકારના સોફ્ટવેરની જરૂર પડે છે?

[A] કોમ્યુનિકેશન [B] ટેસ્ટીંગ પાથ [C] બ્રાઉઝર [D] વર્ડ

Ans.C

99. IE ના ટૂલબારમાં નીચેનામાંથી કયા ટુલ્સ બટન્સ આવેલા છે ?

[A] Refresh [B] Home [C] Favorites [D] આપેલ તમામ

Ans.D

100. નાની સંસ્થાઓમાં મોટેભાગે કયા પ્રકારની ટોપોલોજીનો ઉપયોગ થાય છે ?

[A] મેશ [B] સ્ટાર [C] ટ્રી [D] રીંગ

Ans.B

101. .edu ક્ષેત્ર નામ કોને લાગુ પડે છે?

[A] સરકાર [B] શૈક્ષણિક સંસ્થા [C] લશ્કર [D] સંગઠન

Ans.B

102. IE માં ભૂતકાળમાં જે કોઈ વેબસાઈટની મુલાકાત લીધી હોય તેની માહિતી મેળવવા કયા બટનનો ઉપયોગ થાય છે?

[A] Refresh [B] Home [C] History [D] Favorites

Ans.C

103. OutLook Express માં અગાઉ મોકલેલ વિજાણું ટપાલોનો સંગ્રહ કયા ફોલ્ડરમાં થાય છે?

[A] Inbox [B] Outbox [C] Send [D] Sent Items

Ans.D

104. ઈન્ટરનેટમાં જે ઈ-મેઈલ હજુ મોકલવાની બાકી છે, તેનો સંગ્રહ કયા ફોલ્ડરમાં થાય છે?

[A] Inbox [B] Outbox [C] Send [D] Attachment

Ans.B

105. કોઈપણ વેબસાઈટનું URL કયા બાર પર જોઈ શકાય છે ?

[A] ટાઈટલ [B] મેનુ [C] એડ્રેસ [D] સ્ટેટ્સ

Ans.C

106. નીચેના પૈકી કયું IP એડ્રેસ સાચું નથી?

[A] 202.54.45.38 [B] 218.60.75.156 [C] 210.60.75.160 [D] 205.60.75.256

Ans.D

107. Window 2000, XP, Linux જેવી વિવિધ પ્રકારની ઓપરેટીંગ સિસ્ટમ વચ્ચે માહિતીની આપ-લે માટે કયા પ્રોટોકોલની જરૂર પડે છે ?

[A] FTP [B] TCP/IP [C] POP [D] HTTP

Ans.B

108. ધંધાકીય વેબસાઈટમાં કયું ક્ષેત્રીય નામ ઉમેરાય છે?

[A] .business [B] .com [C] .trf [D] એક પણ નહિ

Ans.B

109. Ravi@yahoo.com માં yahoo.com શું છે?

[A] USP [B] કંપનીનું નામ [C] ISP [D] એક પણ નહિ

Ans.B

110. ઈન્ટરનેટનો સૌથી પ્રચલિત પ્રોટોકોલ કયો છે?

[A] HTTP [B] TCP/IP [C] POP [D] એક પણ નહિ

Ans.B

111. WWW નો સૌથી લોકપ્રિય પ્રોટોકોલ કયો છે?

[A] HTTP [B] TCP/IP [C] FTP [D] POP

Ans.A

112. _____ ને ડાઉનલોડ થતાં વધારે સમય લાગે છે.

[A] ગ્રાફિક ઈમેજ [B] સંગીત ફાઈલ

[C] ટેક્સ્ટ [D] ગ્રાફિક ઈમેજ અને સંગીત ફાઈલ

Ans.D

113. સરકારી વેબસાઈટના નામ પાછળ કયું Domain Name આવે છે?

[A] .com [B] .org [C] .gov [D] .edu

Ans.C

114. IE માં તત્કાલીન વેબપેજ પરથી અગાઉના વેબપેજ પર જવું હોય તો _____ બટનનો ઉપયોગ થાય છે.

[A] Forward [B] Back [C] Home [D] History

Ans.B

115. ઈ-મેઈલમાં નીચે આપેલ શબ્દોમાંથી કયા શબ્દનો ઉપયોગ થતો નથી?

[A] Send [B] Attachment [C] Web [D] New Mail

Ans.C

116. સૌથી વધુ ખર્ચાળ પણ સૌથી વધુ પ્રસાર આપતી નેટવર્ક પધ્ધતિ કઈ છે?

[A] Co-axial Cables [B] Satellite [C] Microwave [D] એક પણ નહિ

Ans.B

117. જ્યારે વિસ્તાર લગભગ 10,000 કિલોમીટરથી વધારે હોય ત્યારે નેટવર્કના કયા પ્રકારનો ઉપયોગ થાય છે?

[A] LAN [B] MAN [C] SAN [D] Internet

Ans.D

118. એક જ બિલ્ડીંગમાં કે એક જ વિસ્તારમાં આવેલ કમ્પ્યૂટરને જોડવા માટે નેટવર્કના કયા પ્રકારનો ઉપયોગ થાય છે?

[A] LAN [B] MAN [C] SAN [D] WAN

Ans.A

119. અલગ-અલગ શહેરના કમ્પ્યૂટરને જોડવા માટે નેટવર્કના કયા પ્રકારનો ઉપયોગ થાય છે?

[A] LAN [B] MAN [C] WAN [D] SAN

Ans.C

120. કમ્પ્યૂટરમાં નેટવર્ક સ્થાપિત કરતી વખતે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે?

[A] ખર્ચ [B] ઝડપ [C] ચોકસાઈ, અંતર [D] આપેલ તમામ

Ans.D

121. વેબપેજમાં સામાન્ય રીતે કઈ માહિતી હોય છે ?

[A] શાબ્દિક લખાણ [B] ગ્રાફિક્સ [C] હાયપર લિન્ક [D] આપેલ તમામ

Ans.D

122. નેટવર્ક ટોપોલોજી (Topology) ના મુખ્ય પ્રકાર કેટલા છે?

[A] ત્રણ [B] ચાર [C] પાંચ [D] છ

Ans.C

123. _____ એક વેબપેજને બીજી વેબપેજ સાથે સાંકળવાનું કાર્ય કરે છે ?

[A] WWW [B] Hyperlink [C] URL [D] એક પણ નહિ

Ans.B

124. સ્વિટ્ઝર્લેન્ડની કોઈ કંપનીની વેબસાઈટના નામ પાછળ કયું ભૌગોલિક નામ ઉમેરાય છે ?

[A] .CN [B] .CA [C] .DE [D] .CH

Ans.D

125. જર્મની માટે કયું ભૌગોલિક નામ ઉમેરાય છે?

[A] .GN [B] .GR [C] .DE [D] .CH

Ans.C

126. વ્યક્તિગત વેબસાઈટના નામ પાછળ કયું ડોમેઈન નેમ્સ વપરાય છે?

[A] .NOM [B] .NET [C] .INT [D] .ORG

Ans.A

127. અમેરિકા માટે કયું ભૌગોલિક નામ ઉમેરાય છે?

[A] .UK [B] .US [C] .CA [D] .AU

Ans.B

128. ચીનની કોઈ કંપનીની વેબસાઈટના નામ પાછળ કયું ભૌગોલિક નામ ઉમેરાય છે?

[A] .CN [B] .CH [C] .CA [D] .DE

Ans.A

129. કેનેડા માટે કયું ભૌગોલિક નામ ઉમેરાય છે?

[A] .CN [B] .CH [C] .CA [D] .CP

Ans.C

130. ઈ-મેઈલ માટે શું હોવું જરૂરી છે?

[A] કમ્પ્યૂટરનો માલિકી હક્ક [B] ઈ-મેઈલ એડ્રેસ

[C] ઈન્ટરનેટનું સભ્યપદ [D] ટેલીફોન

Ans.B

131. મેઈલ બોક્સ ક્યાં હોય છે?

[A] Mail Server [B] Mail Client [C] FTP [D] એક પણ નહિ

Ans.B

132. કયા પ્રકારની ટોપોલોજીમાં જો એક જોડાણ કાર્ય કરતું ન હોય તો અન્ય જોડાણોની મદદથી સંદેશાઓની આપ-લે કરી શકાય છે ?

[A] મેશ [B] બસ [C] રીંગ [D] સ્ટાર

Ans.A

133. WWW નું ટૂંકુ નામ નીચેનામાંથી કયું છે?

[A] 3W [B] W3 [C] W3C [D] 3WC

Ans.B

134. કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા WWW નું સંચાલન કરે છે?

[A] URL [B] W3C [C] W3 [D] એક પણ નહિ

Ans.B

135. નીચેનામાંથી કઈ-કઈ સેવા ઈન્ટરનેટ દ્વારા ઉપલબ્ધ બને છે?

[A] ઈલેક્ટ્રોનિક મેઈલ [B] ઈન્ટરનેટ ન્યુઝ

[C] ચેટિંગ અને વિડિયો કોન્ફરન્સ [D] આપેલ તમામ

Ans.D

136. ઈન્ટરનેટની કઈ સેવા દુનિયાના કોઈપણ ખૂણે બેઠેલી વ્યકિત સાથે તત્કાલ ચર્ચા કરવાની સવલત આપે છે?

[A] ઈ-મેઈલ [B] વિડીયો કોન્ફરન્સિંગ

[C] ચેટિંગ [D] વિડીયો કોન્ફરન્સિંગ અને ચેટિંગ

Ans.D

137. ઈન્ટરનેટ ઉપર ઓન-લોઈન ચેટિંગ માટે કઈ સવલત હોવી જોઈએ?

[A] IRC [B] SRC [C] ISP [D] એક પણ નહિ

Ans.A

138. HTTP://www.yahoo.com માં Yahoo શેનો નિર્દેશ કરે છે?

[A] પ્રોટોકોલ [B] વેબ [C] ટાઈપ [D] હોસ્ટ (યજમાન)

Ans.D

139. IP એડ્રેસના ચારભાગને કઈ નિશાની વડે જોડવામાં આવે છે?

[A] : [B] .[Dots] [C] @ [D] #

Ans.B

140. HTML ની મદદથી બનાવેલ વેબપેજ જોવા માટે શાનો ઉપયોગ થાય છે?

[A] ઈન્ટરનેટ એકસપ્લોરર [B] મોઝેઈક

[C] વિન્ડોઝ એકસપ્લોરર [D] ઈન્ટરનેટ એકસપ્લોરર અને મોઝેઈક

Ans.D

141. SMTP નું આખું નામ જણાવો.

[A] Smart Mail Transfer Protocol [B] Simple Mail Transfer Protocol

[C] Sensitive Mail Transfer Protocol [D] એક પણ નહિ

Ans.B

142. મોડેમનું પૂરું નામ જણાવો.

[A] Modulator/Demodulator [B] Modulation/Demodulation

[C] Modulat Demodulat [D] એક પણ નહિ

Ans.A

143. ઈ.સ. 1995 માં VSNL દ્વારા કઈ સેવાની શરૂઆત કરવામાં આવી છે?

[A] IETF [B] GIAS [C] IRTF [D] Inter NIC

Ans.B

144. ઈન્ટરનેટનું અસરકારક સંચાલક કઈ સંસ્થાઓ કરે છે?

[A] IETF [B] Inter NIC [C] IRTF [D] આપેલ તમામ

Ans.D

145. સ્વિટ્ઝરલેન્ડના જિનીવા ખાતે કઈ લેબોરીટરીમાં ટીમ બર્નસ લી એ WWW ની વ્યવસ્થા વિકસાવી?

[A] BERN [B] CERN [C] Inter NIC [D] એક પણ નહિ

Ans.B

146. નીચેનામાંથી કયું ડોમેઈન નેમ સહકારી એકમની વેબસાઈટનો નિર્દેશ કરે છે?

[A] .com [B] .net [C] .coop [D] .gov

Ans.C

147. નીચેનામાંથી કઈ વેબસાઈટ ઈન્ટરનેટના પ્રવેશદ્વાર તરીકે સેવાઓ આપે છે?

[A] Yahoo [B] Google [C] પોર્ટલ [D] એક પણ નહિ

Ans.C

148. નીચેનામાંથી કયું સાધન ડેટાના વહનમાર્ગ નક્કી કરવાનું કામ કરે છે?

[A] મોડેમ [B] રાઉટર [C] સર્ચ એન્જિન [D] એક પણ નહિ

Ans.B

149. OutLook Express માં ઈ-મેઈલ વાંચવા માટે કયા બટન પર ક્લિક કરવાની જરૂર પડે છે?

[A] New [B] Reply [C] Search [D] Send/Receive

Ans.D

150. નીચેનામાંથી કોણે WWW ની વ્યવસ્થા વિકસાવી છે?

[A] બીલ ગેટ્સ [B] ટીમ બર્નસ લી [C] જોન લી [D] ચાર્લ્સ બેબેજ

Ans.B

Practical Project

MS-Word

પ્રેક્ટીકલ-1

Word માં નીચેના લખાણને ટાઈપ કરો અને માગ્યા મુજબ ફેરફાર કરો.

B.R. Ambedkar

14 September 2010

(14 April 1891 — 6 December 1956), also known as *Babasaheb*, was an Indian jurist, political leader, Buddhist activist, philosopher, thinker, anthropologist, historian, orator, prolific writer, economist, scholar, editor, revolutionary and a revivalist for Buddhism in India. He was also the chief architect of the Indian Constitution. Born into a poor Mahar, then Untouchable, family, Ambedkar spent his whole life fighting against social discrimination, the system of *Chaturvarna* — the categorization of Hindu society into four *varnas* — and the Hindu caste system. He is also credited with providing a spark for the conversion of hundreds of thousands of Dalits with his Ambedkar (ite) Buddhism. Ambedkar has been honoured with the Bharat Ratna, India's highest civilian award.

Overcoming numerous social and financial obstacles, Ambedkar became one of the first "Outcast" to obtain a college education in India. Eventually earning law degrees and multiple doctorates for his study and research in law, economics and political science from Columbia University and the London School of Economics, Ambedkar returned home as a famous scholar and practiced law for a few years before publishing journals advocating political rights and social freedom for India's untouchables.

→ **સૂચનાઓ :**

1. ટાઈટલને WordArt ની Effect આપો.
2. માહિતીમાં ચિત્ર ઉમેરો.
3. Font ની Size–16 અને Font–Arial રાખો.
4. Philosopher, thinker, anthropologist શબ્દોને Bold, Italic ની Effect આપો.
5. "Indian Constitution" શબ્દની નીચે Underline ની Effect આપો.
6. માહિતીને Center Alignment ની અસર આપો.
7. ટાઈટલની નીચે તારીખ ઉમેરો.


❑ ટાઈટલને WordArt ની Effect આપો.

1. સૌપ્રથમ MS-Word ચાલુ કરીને ઉપરોક્ત માહિતી ટાઈપ કરવી. [Title ટાઈપ કરવું નહિ]

2. ત્યારબાદ Insert Menu માં Picture કમાન્ડ પર ક્લિક કરી, તેમાં જોવા મળતાં વિવિધ Options માંથી WordArt પર ક્લિક કરો. જેથી WordArt Gallery નું dialog box જોવા મળશે.




અહીં કોઈ Style Select કરીને OK બટન પર ક્લિક કરવી. જેથી Edit WordArt Text નું dialog box જોવા મળશે.




3. તેમાં Your Text Here ને બદલે B.R.Ambedkar ટાઈપ કરીને OK બટન પર ક્લિક કરવી. જેથી આપેલ ફોર્મેટ મુજબ તે ટાઈટલ જોવા મળશે.

❑ માહિતીમાં ચિત્ર ઉમેરો.

1. સૌપ્રથમ Insert Menu માં Picture કમાન્ડ પર ક્લિક કરી, તેમાં જોવા મળતાં વિવિધ Options માંથી ClipArt પર ક્લિક કરવી. જેથી Screen ની જમણી બાજુ ClipArt ની Task Pane જોવા મળશે.



2. તેમાં Organize Clips પર ક્લિક કરવી, જેથી Microsoft Clip Organizer નું ડાયલોગ બોક્સ જોવા મળશે.



3. અહીં, Collection List માંથી Office Collections પર ડબલ ક્લિક કરવી. જેથી Office Collections નું ડાયલોગ બોક્સ જોવા મળશે.



4. તેમાં વિવિધ કેટેગરીમાંથી યોગ્ય ચિત્ર Select કરીને Ctrl + C આપવું અને જ્યાં ચિત્રની જરૂર છે તે Text area માં Ctrl + V આપવું. જેથી Selected ચિત્ર કર્સર હશે ત્યાં જોવા મળશે.

નોંધ: તમારા કમ્પ્યૂટરમાં ડૉ.બી.આર.આંબેડકરનું ચિત્ર હશે તો જ તે ચિત્ર ઉમેરી શકાશે.

❑ **Font ની Size–16 અને Font–Arial રાખો.**

1. સૌપ્રથમ માહિતીને Select કરો.
2. ત્યારબાદ Formatting Toolbar પર જોવા મળતાં Font Tool માંથી Arial અને Size Tool માંથી 16 પર ક્લિક કરતાં માહિતી તે મુજબ જોવા મળશે.

❑ **Philosopher, thinker, anthropologist શબ્દોને Bold, Italic ની Effect આપો.**

1. સૌપ્રથમ ઉપરોક્ત લખાણને Select કરો.
2. ત્યારબાદ Formatting Toolbar માંથી **B** અને *I* Tool પર ક્લિક કરો. જેથી Bold અને Italic ની Effect જોવા મળશે.

→ **"Indian Constitution" શબ્દની નીચે Underline ની Effect આપો.**


1. સૌપ્રથમ ઉપરોક્ત લખાણને Select કરો.
2. ત્યારબાદ Formatting Toolbar માંથી U Tool પર ક્લિક કરો. જેથી લખાણની નીચે Underline ની Effect જોવા મળશે.

→ **માહિતીને Center Alignment ની અસર આપો.**


1. સૌપ્રથમ ઉપરોક્ત લખાણને Select કરો.
2. ત્યારબાદ Formatting Toolbar માંથી Center Align Tool પર ક્લિક કરતાં માહિતીમાં Center Alignment ની અસર જોવા મળે છે.

❑ **ટાઈટલની નીચે તારીખ ઉમેરો.**

1. સૌપ્રથમ જ્યાં તારીખ ઉમેરવી છે ત્યાં કર્સર રાખો.
2. ત્યારબાદ Insert Menu માં જઈને Data and Time કમાન્ડ પર ક્લિક કરો, જેથી તેનું ડાયલોગ બોક્સ જોવા મળશે.



3. અહીં, વિવિધ Format માંથી કોઈ એક Format Select કરીને OK પર ક્લિક કરતાં કર્સર હશે ત્યાં તારીખ જોવા મળશે.



પ્રેક્ટીકલ-2

Word માં નીચેના લખાણને ટાઈપ કરો અને માગ્યા મુજબ ફેરફારો કરો.

Swami Vivekananda

A spiritual genius of commanding intellect and power, Vivekananda crammed immense labor and achievement into his short life, 1863-1902. Born in the Datta family of Calcutta, the youthful Vivekananda embraced the agnostic philosophies of the Western mind along with the worship of science.

At the same time, vehement in his desire to know the truth about God, he questioned people of holy reputation, asking them if they had seen God. He found such a person in Sri Ramakrishna, who became his master, allayed his doubts, gave him God vision, and transformed him into sage and prophet with authority to teach.


After Sri Ramakrishna's death, Vivekananda renounced the world and criss-crossed India as a wandering monk. His mounting compassion for India's people drove him to seek their material help from the West. Accepting an opportunity to represent Hinduism at Chicago's Parliament of Religions in 1893, Vivekananda won instant celebrity in America and a ready forum for his spiritual teaching.

→ **સૂચનાઓ :**

1. Title ને WordArt ની Effect આપો.
2. માહિતીમાં ચિત્ર ઉમેરો.
3. માહિતીને ડાબી અને જમણી બાજુ સમાંતર રીતે ગોઠવો.
4. ઉપરોક્ત પેરેગ્રાફની માહિતી Upper Case માં ફેરવો.
5. પેરેગ્રાફનું Line Spacing 1.5 રાખો.
6. GENIUS શબ્દને Text Border અને સમગ્ર માહિતીને Page Border ની Effect આપો.
7. પેરેગ્રાફને ન્યુઝ પેપરની જેમ ત્રણ કોલમમાં ફેરવો અને બે કોલમ વચ્ચે લાઈન દર્શાવો.

❑ **ટાઈટલને WordArt ની Effect આપો.**

સૌપ્રથમ Word માં ઉપરોક્ત પેરેગ્રાફ ટાઈપ કરો. [Title ટાઈપ કરવું નહિ] ત્યારબાદ Title દર્શાવવા માટે Insert Menu → Picture → WordArt વિકલ્પ પર ક્લિક કરો. હવે, WordArt Gallery માંથી કોઈ એક સ્ટાઈલ પસંદ કરીને OK પર ક્લિક કરો. જેથી Edit WordArt Text નું ડાયલોગ બોક્સ જોવા મળશે.




તેમાં "Your Text Here" ની જગ્યાએ Swami Vivekananda ટાઈટલ ટાઈપ કરીને OK પર ક્લિક કરતાં તે ટાઈટલ Screen ઉપર જોવા મળશે, તેને યોગ્ય જગ્યાએ ગોઠવવું.

❑ **માહિતીમાં ચિત્ર ઉમેરો.**

1. સૌપ્રથમ Insert Menu માં Picture કમાન્ડ પર ક્લિક કરી, તેમાં જોવા મળતાં વિવિધ Options માંથી ClipArt પર ક્લિક કરવી. જેથી Screen ની જમણી બાજુ ClipArt ની Task Pane જોવા મળશે.
2. તેમાં Organize Clips પર ક્લિક કરવી, જેથી Microsoft Clip Organizer નું ડાયલોગ બોક્સ જોવા મળશે.

3. તેમાં Collection List માંથી Office Collections પર ડબલ ક્લિક કરવી. જેથી Office Collections નું ડાયલોગ બોક્સ જોવા મળશે.



4. તેમાં વિવિધ કેટેગરીમાંથી યોગ્ય ચિત્ર Select કરીને Ctrl + C આપવું અને જ્યાં ચિત્રની જરૂર છે તે Text area માં Ctrl + V આપવું. જેથી કર્સર હશે ત્યાં Selected ચિત્ર જોવા મળશે.

નોંધ: તમારા કમ્પ્યૂટરમાં જો વિવેકાનંદનું ચિત્ર હોય તો તે ઉમેરવું.

- **માહિતીને ડાબી અને જમણીબાજુ સમાંતર રીતે ગોઠવો.**


1. સૌપ્રથમ ઉપરોક્ત માહિતીને Select કરો.

2. ત્યારબાદ Formatting Toolbar માંથી Justify Tool પર ક્લિક કરતાં માહિતી ડાબી અને જમણીબાજુ સમાંતર રીતે ગોઠવાઈ જશે.

- **ઉપરોક્ત પેરેગ્રાફની માહિતી Upper Case માં ફેરવો.**

1. સૌપ્રથમ પેરેગ્રાફને Select કરો.


2. ત્યારબાદ Format Menu માં જઈને Change Case કમાન્ડ પર ક્લિક કરો. જેથી Change Case નું ડાયલોગ બોક્સ જોવા મળશે.



તેમાં UPPER CASE પર ક્લિક કરીને OK ક્લિક કરતાં પેરેગ્રાફ પ્રથમ એબીસીડી માં જોવા મળશે.

- **પેરેગ્રાફનું Line Spacing 1.5 રાખો.**


1. સૌપ્રથમ પેરેગ્રાફને Select કરો.
2. ત્યારબાદ Format Menu માં જઈને Paragraph કમાન્ડ પર ક્લિક કરો, જેથી Paragraph નું ડાયલોગ બોક્સ જોવા મળશે.



તેમાં Line Spacing પર ક્લિક કરીને 1.5 Lines select કરીને OK પર ક્લિક કરતાં Lines Spacing 1.5 જોવા મળશે. Default Line Spacing 1 હોય છે.

- **GENIUS શબ્દને Text Border અને સમગ્ર લખાણને Page Border ની Effect આપો.**

1. સૌપ્રથમ GENIUS શબ્દને Select કરો.
2. ત્યારબાદ Format Menu માં જઈને Borders and Shading કમાન્ડ પર ક્લિક કરો. જેથી Borders and Shading નું ડાયલોગ બોક્સ જોવા મળશે.




તેમાં Setting માં Box, Style:........, Color માં Blue Select કરીને Apply to : Text Select કરીને OK પર ક્લિક કરવું, જેથી Blue કલરની બોર્ડર જોવા મળશે.

→ **પેજ બોર્ડરની Effects આપવી :**

1. સૌપ્રથમ Format Menu માં જઈને Borders and Shading કમાન્ડ પર ક્લિક કરવી. જેથી જોવા મળતાં ડાયલોગ બોક્સમાં Page Border ના Tab પર ક્લિક કરો.


2. ત્યારબાદ Setting, Style, Color, Width Select કરીને છેલ્લે Apply To : Whole Document Select કરીને OK પર ક્લિક કરવું.




→ **પેરેગ્રાફને ત્રણ કોલમની Effect આપો.**

1. સૌપ્રથમ પેરેગ્રાફને Select કરો.

2. ત્યારબાદ Format Menu માં જઈને Columns કમાન્ડ પર ક્લિક કરો, જેથી Columns નું ડાયલોગ બોક્સ જોવા મળશે.



તેમાં Presets માંથી Three કોલમ પર ક્લિક કરો અને બે કોલમની વચ્ચે લાઈન દર્શાવવા માટે Line Between પર ક્લિક કરો અને છેલ્લે OK પર ક્લિક કરતાં પેરેગ્રાફ ત્રણ કોલમમાં જોવા મળશે.



પ્રેક્ટીકલ-3

વર્ડમાં નીચે મુજબ ટેબલ તૈયાર કરો.


No.	Surname	Name	Address	City
1	Shah	Pankaj	Saraspur	Ahmedabad
2	Patel	Sanjay	Naroda	Ahmedabad
3	Parmar	Ravindra	Chandkheda	Ahmedabad
4	Shah	Amit	Bapunagar	Ahmedabad
5	Patel	Ketan	Ranip	Ahmedabad

→ **સૂચનાઓ :**

1. No, Surname, Name વાળી ટાઈટલ લાઈનના Font ની Size-24 અને **B** Bold ની Effect આપો.
2. Surname કોલમને ચઢતાક્રમ [Ascending Order] માં ગોઠવો.
3. Name કોલમને Center Align ની Effect આપો.
4. No.5 ના વિદ્યાર્થીની Row દૂર કરો.
5. Auto Format નો ઉપયોગ કરી ટેબલને આકર્ષક બનાવો.

❑ **ટેબલ તૈયાર કરવું :**

1. વર્ડમાં 5 કોલમ અને 6 રો વાળું ટેબલ તૈયાર કરવા માટે ટેબલ મેનુમાં જઈને Insert Table કમાન્ડ પર ક્લિક કરો. જેથી Insert Table નું ડાયલોગ બોક્સ જોવા મળશે.



2. તેમાં Number of columns : 5 અને Number of rows : 6 select કરીને OK પર ક્લિક કરતાં 5 કોલમ અને 6 રોનું બ્લેન્ક [Blank] ટેબલ જોવા મળશે.

3. તેમાં ઉપરોક્ત ટેબલમાં દર્શાવ્યા મુજબ ડેટા ટાઈપ કરો. અહીં કોષ્ટકમાં Tab Key ની મદદથી એક પછી એક ખાનામાં જઈ શકીએ છીએ.

❑ **No, Name, Surname વાળી ટાઈટલ લાઈનના Font ની Size–24 અને 'B' Bold Effect આપો.**

1. સૌપ્રથમ No, Name, Surname વાળી Row [shift + → Key ની મદદથી] select કરો.


2. ત્યારબાદ Formatting Toolbar માંથી Size 24 અને **B** Tool પર ક્લિક કરો. જેથી ટાઈટલના Font 24 ની Size માં ઘાટા અક્ષરે જોવા મળશે.

❑ **Surname વાળી કોલમને ચઢતા ક્રમ [Ascending Order] માં ગોઠવો.**

1. સૌપ્રથમ ટેબલમાં ગમે તે સેલમાં કર્સર રાખો.

2. ત્યારબાદ Table Menu માં જઈને Sort કમાન્ડ પર ક્લિક કરો. જેથી Sort નું ડાયલોગ બોક્સ જોવા મળશે.

3. અહીં, Surname ને Ascending Order [ચઢતા ક્રમ] માં ગોઠવવું હોય તો Sort by માં Surname Select કરો અને Order માં ⊙ Ascending ઉપર ક્લિક કરીને, OK પર ક્લિક કરતાં Surname ચઢતા ક્રમમાં જોવા મળશે.




- ❑ **Name કોલમને Center Align ની અસર આપો.**

1. સૌપ્રથમ Name કોલમને [Shift + ↓ Key ની મદદથી] select કરો.
2. ત્યારબાદ Formatting Toolbar ની મદદથી Center Align પર ક્લિક કરતાં Name મધ્યમાં જોવા મળશે.

- ❑ **No.5 ના વિદ્યાર્થીની માહિતી [Row] દૂર કરો.**

1. સૌપ્રથમ No.5 ના વિદ્યાર્થીની Row Select કરો. આ માટે Table મેનુમાં જઈને Select → Row કમાન્ડ પર ક્લિક કરો.
2. ત્યારબાદ ફરીથી Table મેનુમાં જઈને Delete → Row કમાન્ડ પર ક્લિક કરતાં Selected Row દૂર થઈ જશે.



- ❑ **Auto Format સવલતનો ઉપયોગ કરીને ટેબલને આકર્ષક બનાવો.**

1. સૌપ્રથમ ટેબલમાં કોઈપણ જગ્યાએ કર્સર રાખો.
2. ત્યારબાદ ટેબલ મેનુમાં જઈને Table Auto Format કમાન્ડ પર ક્લિક કરો. જેથી Table Auto Format નું ડાયલોગ બોક્સ જોવા મળશે.

3. અહીં, જે પણ પ્રકારનું ફોર્મેટિંગ જરૂરી હોય તેને Select કરી OK પર ક્લિક કરતાં ટેબલ Selected Format મુજબ જોવા મળશે.

No.	Surname	Name	Address	City
3	Parmar	Ravindra	Chandkheda	Ahmedabad
2	Patel	Sanjay	Naroda	Ahmedabad
5	Patel	Ketan	Ranip	Ahmedabad
1	Shah	Pankaj	Saraspur	Ahmedabad
4	Shah	Amit	Bapunagar	Ahmedabad

પ્રેક્ટીકલ-4

વર્ડમાં નીચે મુજબ ટેબલ તૈયાર કરો.

Roll No.	Name	Course	Total
1	Ravi	Tally.ERP9	90
2	Tina	CCC	69
3	Sonu	MS-Office	74
4	Harsh	CCC	78
5	Dipak	Tally.ERP9	85

→ **સૂચનાઓ :**

1. Roll No. અને Name ની વચ્ચે Surname નું કોલમ ઉમેરો.
2. Roll No. ને Center Align ની Effect આપો.
3. Roll No. 4 અને 5 ની વચ્ચે નવી Row ઉમેરો.
4. Course ને ઉતરતા ક્રમમાં [Descending Order] ગોઠવો.

❑ **ટેબલ તૈયાર કરવું :**

વર્ડમાં 4 કોલમ અને 6 રો વાળું ટેબલ તૈયાર કરવા માટે સૌપ્રથમ Table મેનુમાં જઈને Insert Table કમાન્ડ પર ક્લિક કરો. જેથી Insert Table નું ડાયલોગ બોક્સ જોવા મળશે. તેમાં Number of columns : 4 અને Number of rows : 6 Select કરીને OK પર ક્લિક કરતાં નીચે મુજબ 4 કોલમ અને 6 રોનું બ્લેન્ક ટેબલ જોવા મળશે, તેમાં ઉપરોક્ત ડેટા ટાઈપ કરવો.

Roll No.	Name	Course	Total
1	Ravi	Tally.ERP9	90
2	Tina	CCC	69
3	Sonu	Ms-Office	74
4	Harsh	CCC	78
5	Dipak	Tally.ERP9	85

❑ **Roll No. અને Name ની વચ્ચે Surname નું કોલમ ઉમેરો.**

1. સૌપ્રથમ Name કોલમમાં કર્સર રાખો.
2. ત્યારબાદ Table મેનુમાં જઈને Select → Column કમાન્ડ પર ક્લિક કરો.
3. હવે, ફરીથી Table મેનુમાં જઈને Insert → Column To the Left વિકલ્પ પર ક્લિક કરો. જેથી Roll No. અને Name ની વચ્ચે નવું કોલમ જોવા મળશે.

❑ **Roll No. ને Center Align ની Effect આપો.**

1. સૌપ્રથમ Roll No. કોલમને Select કરો.
2. ત્યારબાદ Formatting Toolbar ની મદદથી ≣ Center Align પર ક્લિક કરતાં Roll No. મધ્યમાં જોવા મળે છે.

→ Roll No. 4 અને 5 ની વચ્ચે નવી Row ઉમેરો.

1. સૌપ્રથમ Roll No. 5 ઉપર કર્સર રાખો.
2. ત્યારબાદ Table મેનુમાં જઈને Select → Row કમાન્ડ પર ક્લિક કરો.
3. હવે, ફરીથી Table મેનુમાં જઈને Insert → Row Above વિકલ્પ પર ક્લિક કરો. જેથી Roll No. 4 અને 5 ની વચ્ચે નવી Row જોવા મળશે.

→ Course ને ઉતરતાં ક્રમમાં [Descending Order] ગોઠવો.

1. સૌપ્રથમ ટેબલમાં ગમે તે સેલમાં કર્સર રાખો.
2. ત્યારબાદ Table મેનુમાં જઈને Sort કમાન્ડ પર ક્લિક કરો. જેથી તેનું ડાયલોગ બોક્સ જોવા મળશે. તેમાં Course ને ઉતરતાં ક્રમ [Descending] માં ગોઠવવા માટે Sort by માં Course select કરો અને Order માં ⊙ Descending ઉપર ક્લિક કરીને OK પર ક્લિક કરતાં Course નું List ઉતરતા ક્રમમાં જોવા મળશે.

Roll No.	Surname	Name	Course	Total
1	Patel	Ravi	Tally.ERP9	90
5	Parmar	Dipak	Tally.ERP9	85
3	Modi	Sonu	Ms-Office	74
6	Shah	Rashmi	Ms-Office	70
2	Shah	Tina	CCC	69
4	Bhavsar	Harsh	CCC	78

નોંધ : *ટેબલમાં કમાન્ડની મદદથી સરવાળો [Total] કરવા માટે Table → Formula કમાન્ડનો ઉપયોગ થાય છે.*

પ્રેક્ટીકલ-5

નીચેનો પત્ર વર્ડમાં ટાઈપ કરો અને મેઈલ-મર્જની મદદથી ચાર વ્યક્તિઓને મોકલો.

Harsh R. Parmar


19, Samarth Duplex,
Nagarpalika Road,
Chandkheda- 382424.

To,


I am celebrating my birthday on the 5 December with a small party. Why don't you join me and some of our friend? Come to my place any time between 5:00 P.M. to 7:00 P.M. of Course, the earlier you come, the more fun we will have! Do Come!

Your friend,
Harsh

- સૌપ્રથમ Document File તૈયાર કરો, જેમાં એક સરખી માહિતી છે. આ File તૈયાર કરતી વખતે કોઈપણ Address ટાઈપ કરવું નહિ. ત્યારબાદ આ Document File ને Ravi નામ આપીને Save કરો.



હવે, Tools Menu માં જઈને Letters and Mailling કમાન્ડ પર ક્લિક કરો. તેમાં જોવા મળતાં Options માંથી Mail Merge કમાન્ડ પર ક્લિક કરો. જેથી જમણીબાજુ Mail Merge ની Task Pane જોવા મળશે.



Mail Merge ના કુલ 6 Steps છે :

1. પ્રથમ Steps માં Select Documnet type માં Letters પર ક્લિક કરવું.


   ⊙ Letters


   ⊙ E-Mail Message

   ⊙ Envelopes

   ⊙ Labels

   ⊙ Directory ત્યારબાદ Next પર ક્લિક કરવી.





2. ત્યારબાદ Select Starting Document માં ⊙ Use the Current Document Select કરીને Next પર ક્લિક કરવી.

3. હવે Select recipients માં ⊙ Type a New list પર ક્લિક કરીને Create પર ક્લિક કરવું. જેથી New Address List નું ડાયલોગ બોક્સ જોવા મળશે.


તેમાં Field Name માંથી બિનજરૂરી ફિલ્ડ દૂર કરવા માટે Customize બટન પર ક્લિક કરવું. જેથી Customize Address List જોવા મળશે. તેમાં જે ફિલ્ડની જરૂર નથી તે ફિલ્ડ Select કરીને Delete બટન પર ક્લિક કરવું. જેથી New Address List નું ડાયલોગ બોક્સ જોવા મળશે.

તેમાં જરૂરી ડેટા એન્ટ્રી કરવી. એક વ્યક્તિની એન્ટ્રી પૂરી થયા બાદ New Entry પર ક્લિક કરીને નવું ફોર્મ લાવવું આ રીતે જરૂરી એન્ટ્રી કરવી અને છેલ્લે Close પર ક્લિક કરવું. હવે, આ Address ટાઈપ કરેલ ફાઈલ (ડેટા ફાઈલ) ને અલગ નામ આપીને Save કરવી. જેથી Mail Merge Recipients નું બોક્સ આવશે. તેમાં OK પર ક્લિક કરવી. જેથી Mail Merge નું નવું Toolbar જોવા મળશે.




4. હવે, જ્યાં Field ઉમેરવાના છે તે જગ્યાએ કર્સર રાખો અને Mail Merge ના Toolbar માંથી Insert Merge Field પર ક્લિક કરી એક પછી એક ક્રમબદ્ધ Field કર્સર હોય ત્યાં ઉમેરતા રહો.

5. ત્યારબાદ, Mail Merge ના Toolbar માંથી Merge to New Document પર ક્લિક કરો. જેથી Merge to New Document નું ડાયલોગ બોક્સ જોવા મળશે.



6. અહીં, Merge records માં ⊙ All પર ક્લિક કરતાં, જેટલાં Address ટાઈપ કર્યા હશે એટલા Letters તૈયાર થઈ જશે.



વિભાગ-2 **Practical Project**

MS-Excel

પ્રેક્ટીકલ-1

નીચે આપેલ માહિતી ઉપરથી Total, Average, Maximum, Minimum માર્ક શોધો.

	A	B	C	D	E	F	G	H	I
1	No.	Name	Word	Excel	P.P.	Total	Average	Max.	Min.
2	1	Dipak	76	81	93	?	?	?	?
3	2	Tina	69	74	85				
4	3	Bhoomil	71	67	80				
5	4	Harsh	70	59	63				
6	5	Ramila	83	65	75				
7	6	Sonu	80	72	85				

❑ **Total Calculate કરવા માટે [સરવાળો કરવા] :**

1. સૌપ્રથમ F2 સેલ પર ક્લિક કરો.
2. ત્યારબાદ તેમાં = SUM (C2:E2) ટાઈપ કરીને એન્ટર પ્રેસ કરતાં 250 પરિણામ જોવા મળશે.
3. હવે, F2 સેલમાં કર્સર રાખીને 250 [Symbol] પર માઉસની ક્લિક પ્રેસ કરી રાખીને માઉસ નીચે તરફ drag કરવું. જેથી ઉપરની Formula ની Copy થઈને F3 થી F7 Cell માં સરવાળો જોવા મળશે.

❑ **Average Calculate કરવા માટે [સરેરાશ માર્ક શોધવા] :**

1. સૌપ્રથમ G2 સેલ પર ક્લિક કરો.
2. ત્યારબાદ તેમાં = Average (C2:E2) ટાઈપ કરીને એન્ટર પ્રેસ કરતાં 83.33 પરિણામ જોવા મળશે.
3. હવે, G2 સેલમાં કર્સર રાખીને 83.33 [Symbol] પર માઉસની ક્લિક પ્રેસ કરી રાખીને માઉસ નીચે તરફ drag કરવું. જેથી ઉપરની Formula ની Copy થઈને G3 થી G7 Cell માં સરેરાશ જોવા મળશે.

❑ **Maximum માર્ક શોધવા [સૌથી વધુ માર્ક શોધવા] :**

1. સૌપ્રથમ H2 સેલ પર ક્લિક કરો.
2. ત્યારબાદ તેમાં = Max (C2:E2) ટાઈપ કરીને એન્ટર પ્રેસ કરતાં 93 પરિણામ જોવા મળશે.

3. હવે, H2 સેલમાં કર્સર રાખીને 93 [Symbol] પર માઉસની ક્લિક પ્રેસ કરી રાખીને માઉસ નીચે તરફ drag કરવું. જેથી ઉપરની Formula ની Copy થઈને H3 થી H7 Cell માં સૌથી વધુ માર્ક જોવા મળશે.

❑ **Minimum માર્ક શોધવા [સૌથી ઓછા માર્ક શોધવા] :**

1. સૌપ્રથમ I2 સેલ પર ક્લિક કરો.
2. ત્યારબાદ તેમાં = Min (C2:E2) ટાઈપ કરીને એન્ટર પ્રેસ કરતાં 76 પરિણામ જોવા મળશે.
3. હવે, I2 સેલમાં કર્સર રાખીને 76 [Symbol] પર માઉસની ક્લિક પ્રેસ કરી રાખીને માઉસ નીચે તરફ drag કરવું. જેથી ઉપરની Formula ની Copy થઈને I3 થી I7 Cell માં સૌથી ઓછા માર્ક જોવા મળશે.

	A	B	C	D	E	F	G	H	I
1	No	Name	Word	Excel	P.P.	Total	Average	Max	Min
2	1	Dipak	76	81	93	250	83.33	93	76
3	2	Tina	69	74	85	228	76.00	85	69
4	3	Bhoomil	71	67	80	218	72.67	80	67
5	4	Harsh	70	59	63	192	64.00	70	59
6	5	Ramila	83	65	75	223	74.33	83	65
7	6	Sonu	80	72	85	237	79.00	85	72

પ્રેક્ટીકલ-2

નીચે પ્રમાણે વર્કશીટ તૈયાર કરો અને આપેલ સૂચનાઓનો અમલ કરો.

	A	B	C	D	E	F	G
1	Name	Sub-1	Sub-2	Sub-3	Total	Average	Grade
2	Ketan	80	85	90	?	?	?
3	Harsha	70	68	93			
4	Darshil	64	73	68			
5	Tanumati	53	55	50			
6	Falgun	73	60	67			
7	Chetan	84	65	59			
8	Rashmi	79	75	78			

❑ **સૂચનાઓ :**

1. Name અને Sub-1 ની વચ્ચે Surname નું એક કોલમ ઉમેરો.
2. નવું Insert કરેલ Surname નું કોલમ દૂર કરો.

3. Name નામના કોલમની Width 20 રાખો.

4. Name નામના કોલમને સેન્ટર અલાઈમેન્ટની અસર આપો.

5. કોલમ E2, F2 અને G2 માં અનુક્રમે Total, Average અને Grade શોધો.

6. આપેલ માર્કશીટને Auto Format ની અસર આપો.

7. Falgun નામના વિદ્યાર્થીની સંપૂર્ણ Row દૂર કરો.

❑ **Name અને Sub-1 ની વચ્ચે Surname નું એક કોલમ ઉમેરો.**

1. સૌપ્રથમ Sub-1 ઉપર કર્સર રાખો.

2. ત્યારબાદ Insert Menu માં જઈને Columns કમાન્ડ પર ક્લિક કરો. જેથી Name અને Sub-1 ની વચ્ચે એક નવું Blank Column જોવા મળશે. તેમાં Surname ટાઈપ કરવી.

	A	B	C	D	E	F	G	H
1	Name	Surname	Sub-1	Sub-2	Sub-3	Total	AVG.	Grade
2	Ketan	Shah	80	85	90	?	?	?
3	Harsha	Shah	70	68	93			
4	Darshil	Shah	64	73	68			
5	Tanumati	Patel	53	55	50			
6	Falgun	Patel	73	60	67			
7	Chetan	Parmar	84	65	59			
8	Rashmi	Parmar	79	75	78			

❑ **નવું Insert કરેલ Surname નું કોલમ દૂર કરવું.**

1. સૌપ્રથમ Surname ના કોલમમાં કર્સર રાખો.

2. ત્યારબાદ Edit Menu માંથી Delete કમાન્ડ પર ક્લિક કરો. જેથી Delete નું ડાયલોગ જોવા મળશે. તેમાં ⊙ Entire column પર ક્લિક કરો.

❑ **Name નામના કોલમની Width 20 રાખો.**

1. સૌપ્રથમ Name નામના કોલમમાં કર્સર રાખો.

2. ત્યારબાદ Format Menu માંથી Column કમાન્ડ પર ક્લિક કરી, તેમાં જોવા મળતાં વિવિધ Option માંથી Width પર ક્લિક કરો. જેથી Column Width નું ડાયલોગ બોક્સ જોવા મળશે.



તેમાં Default Column Width 8.43 જોવા મળશે. તેના બદલે Name કોલમની Width 20 ટાઈપ કરીને OK પર ક્લિક કરો. જેથી Name કોલમની Width 20 જોવા મળશે.

❑ **Name નામના કોલમને સેન્ટર અલાઈમેન્ટની અસર આપો.**

1. સૌપ્રથમ Name નામનું કોલમ સિલેક્ટ કરો.
2. ત્યારબાદ ફોર્મેટીંગ ટૂલબારમાંથી સેન્ટર અલાઈમેન્ટ ☰ ટૂલ પર ક્લિક કરતાં Name કોલમના બધા જ નામ સેન્ટરમાં જોવા મળશે.

❑ **કોલમ E2, F2 અને G2 માં અનુક્રમે Total Average અને Grade શોધો.**

→ **Total શોધવા માટે :**

1. સૌપ્રથમ E2 સેલ પર ક્લિક કરો.
2. ત્યારબાદ તેમાં = SUM (B2:D2) ટાઈપ કરીને એન્ટર પ્રેસ કરતાં 255 પરિણામ જોવા મળશે.
3. હવે, E2 સેલમાં કર્સર રાખીને 255 [Symbol] પર માઉસની ક્લિક પ્રેસર કરી રાખીને માઉસ નીચે તરફ drag કરવું. જેથી ઉપરની Formula ની Copy થઈને E3 થી E8 Cell માં સરવાળો જોવા મળશે.

❑ **Average શોધવા માટે :**

1. સૌપ્રથમ F2 સેલ પર ક્લિક કરો.
2. ત્યારબાદ તેમાં = Average (B2:D2) ટાઈપ કરીને એન્ટર પ્રેસ કરતાં 85 પરિણામ જોવા મળશે.
3. હવે, F2 સેલમાં કર્સર રાખીને 85 [Symbol] પર માઉસની ક્લિક પ્રેસ કરી રાખીને માઉસ નીચે તરફ drag કરવું. જેથી ઉપરની Formula ની Copy થઈને F3 થી F8 Cell માં સરેરાશ જોવા મળશે.

❑ **Grade શોધવા માટે :**

જો Average 60 કે તેથી વધુ હોય તો ... – "A" Grade

જો Average 50 કે તેથી વધુ હોય અને 60 થી ઓછી હોય તો ... – "B" Grade

જો Average 35 કે તેથી વધુ હોય અને 50 થી ઓછી હોય તો ... – "C" Grade

જો Average 35 થી ઓછી હોય તો ... – "Fail"

1. સૌપ્રથમ G2 સેલ પર ક્લિક કરો.
2. ત્યારબાદ તેમા = If (F2>=60, "A", If (F2>=50, "B", If (F2>=35, "C", "Fail"))) ટાઈપ કરીને એન્ટર પ્રેસ કરતાં A Grade જોવા મળશે.
3. હવે, G2 સેલમાં કર્સર રાખીને A [Symbol] પર માઉસની ક્લિક પ્રેસ કરી રાખીને માઉસ નીચે તરફ drag કરવું. જેથી ઉપરની Formula ની Copy થઈને G3 થી G8 Cell માં વિદ્યાર્થીના Grade જોવા મળશે.

	A	B	C	D	E	F	G
1	Name	Sub-1	Sub-2	Sub-3	Total	AVG.	Grade
2	Ketan	80	85	90	255	85	A
3	Harsha	70	68	93	231	77	A
4	Darshil	64	73	68	205	68	A
5	Tanumati	53	55	50	158	53	B
6	Falgun	73	60	67	200	67	A
7	Chetan	84	65	59	208	69	A
8	Rashmi	79	75	78	232	77	A


❑ **આપેલ માર્કશીટને Auto Format ની અસર આપો.**

1. સૌપ્રથમ માર્કશીટને સિલેક્ટ કરો.
2. ત્યારબાદ Format Menu માં જઈને Auto Format કમાન્ડ પર ક્લિક કરો.
3. તેમાં "Table Format" box માંથી જરૂરી Format Select કરી OK પર ક્લિક કરતાં માર્કશીટ તે Format મુજબ Change થઈ જશે.

	A	B	C	D	E	F	G
1	Name	Sub-1	Sub-2	Sub-3	Total	AVG.	Grade
2	Ketan	80	85	90	255	85	A
3	Harsha	70	68	93	231	77	A
4	Darshil	64	73	68	205	68	A
5	Tanumati	53	55	50	158	53	B
6	Falgun	73	60	67	200	67	A
7	Chetan	84	65	59	208	69	A
8	Rashmi	79	75	78	232	77	A

❑ **Falgun નામના વિદ્યાર્થીની સંપૂર્ણ Row દૂર કરો.**

1. સૌપ્રથમ Falgun નામના વિદ્યાર્થીની Row માં કર્સર રાખો.
2. ત્યારબાદ Edit Menu માં Delete કમાન્ડ પર ક્લિક કરો. જેથી Delete નું ડાયલોગ બોક્સ જોવા મળશે.
3. જેમાં ⊙ Entire row પર ક્લિક કરી OK પર ક્લિક કરતાં Selected Row દૂર થઈ જશે.



પ્રેક્ટીકલ-3

નીચે આપેલ વર્કશીટ તૈયાર કરો.

	A	B	C	D
1	Computer World			
2	Book	Cost	Quantity	Total Cost
3	Tally.ERP9	250	100	?
4	MS-Office	200	50	
5	DTP	225	150	
6	Internet	75	200	
7			Total	?

❑ **સૂચનાઓ :**

1. Computer World શબ્દને Merge and Center ની અસર આપો.
2. D3 સેલમાં Book ની Total Cost Formula (સૂત્ર)ના આધારે શોધો.
3. D7 સેલમાં Total Cost નું કુલ Total શોધો.
4. Total Cost કોલમને સેન્ટર અલાઈમેન્ટની અસર આપો.
5. આપેલ વર્કશીટને Auto Format ની અસર આપો.

❑ **Computer World શબ્દને Merge and Center ની અસર આપો.**

	A	B	C	D
1	Computer World			
2	Book	Cost	Quantity	Total Cost
3	Tally.ERP 9	250	100	?
4	Ms-Office	200	50	
5	DTP	225	150	
6	Internet	75	200	
7			Total	?

1. સૌપ્રથમ કોલમ A1 થી D1 સુધીના સેલ Select કરો.
2. ત્યારબાદ Formatting Toolbar માંથી Merge and Center Tool પર ક્લિક કરો. જેથી લખાણ Merge and Center Effect સાથે જોવા મળશે.

❑ **D3 સેલમાં Book ની Total Cost Formula (સૂત્ર)નાં આધારે શોધો.**

1. સૌપ્રથમ D3 સેલમાં કર્સર રાખો.
2. ત્યારબાદ તેમાં = B3*C3 અથવા

   = Product (B3:C3) ટાઈપ કરીને એન્ટર પ્રેસ કરતાં 25,000 પરિણામ જોવા મળશે. હવે, આ Formula ની + નિશાની દ્વારા Copy કરવી.

❑ **D7 સેલમાં Total Cost નું કુલ Total શોધો.**

1. સૌપ્રથમ D7 નામના કોલમમાં કર્સર રાખો.
2. ત્યારબાદ તેમાં = SUM (D3:D6) ટાઈપ કરીને એન્ટર પ્રેસ કરતાં **83,750** પરિણામ જોવા મળશે.

❑ **Total Cost કોલમને સેન્ટર અલાઈમેન્ટની અસર આપો.**

1. સૌપ્રથમ Total Cost કોલમ સિલેક્ટ કરો.
2. ત્યારબાદ ફોર્મેટીંગ ટૂલબારમાંથી સેન્ટર અલાઈમેન્ટ ટૂલ પર ક્લિક કરતાં Total Cost કોલમની માહિતી સેન્ટરમાં જોવા મળશે.

❑ **આપેલ માર્કશીટને Auto Format ની અસર આપો.**

1. સૌપ્રથમ માર્કશીટને સિલેક્ટ કરો.
2. ત્યારબાદ Format Menu માં જઈને Auto Format કમાન્ડ પર ક્લિક કરો. જેથી Auto Format નું ડાયલોગ બોક્સ જોવા મળશે. તેમાં કોઈ એક Format Select કરીને OK બટન પર ક્લિક કરતાં આપેલ Format મુજબ Work Sheet જોવા મળે છે.

	A	B	C	D
1	Computer World			
2	Book	Cost	Quantity	Total Cost
3	Tally.ERP 9	250	100	25000
4	Ms-Office	200	50	10000
5	DTP	225	150	33750
6	Internet	75	200	15000
7			Total	83750

પ્રેક્ટીકલ-4

નીચે પ્રમાણે આપેલ Employee's ડેટાબેઝ તૈયાર કરો અને આપેલ સૂચનાઓનો અમલ કરો.

	A	B	C	D
1	Name	Department	Designation	Salary
2	Pankajbhai	Sales	Manager	20000
3	Sanjaybhai	Sales	Assistant	9000
4	Bhrugesh	Production	Manager	18000
5	Dinesh	Production	Assistant	8000
6	Pinal	Purchase	Manager	17500

❑ **સૂચનાઓ:**

1. ઉપરોક્ત ડેટાબેઝને Name ફિલ્ડ પ્રમાણે ચઢતા ક્રમમાં [Ascending Order] ગોઠવો.
2. Data Form માં Assistant Designation હોય તેમની માહિતી જુઓ. તેમજ જેમની Salary 15,000 થી વધુ હોય તેવા રેકોર્ડ્ઝ જુઓ.
3. Auto Filter સગવડતાનો ઉપયોગ કરીને નીચે પ્રમાણે ક્વેરીની રચના કરો.


   [A] Department = Sales હોય તેવા રેકોર્ડ્ઝ જોવા છે.

   [B] Designation માં ફક્ત Manager ના જ રેકોર્ડ્ઝ જોવા છે.

   [C] ફક્ત Dinesh નામના વિદ્યાર્થીની માહિતી જોવી છે.

❑ **ડેટાબેઝને Name ફિલ્ડ પ્રમાણે ચઢતા ક્રમ [Ascending Order] માં ગોઠવો.**


1. સૌપ્રથમ Employee's ડેટાબેઝને select કરો.
2. ત્યારબાદ "Data Menu" માં જઈને Sort કમાન્ડ પર ક્લિક કરો. જેથી Sort નું ડાયલોગ બોક્સ જોવા મળશે.



3. જેમાં Sort by માં Name select કરીને Ascending Order ઉપર ક્લિક કરીને OK બટન પર ક્લિક કરવું, જેથી Name ચઢતા ક્રમમાં જોવા મળશે.

❑ **Data Form માં Assistant Designation હોય તેમની માહિતી જુઓ. તેમજ જેમની Salary 15,000 થી વધુ હોય તેવા રેકોર્ડ્ઝ જુઓ.**

1. સૌપ્રથમ Employee's ડેટાબેઝને select કરો.
2. ત્યારબાદ "Data Menu" માં જઈને Form કમાન્ડ પર ક્લિક કરો. જેથી Form નું ડાયલોગ બોક્સ જોવા મળશે.



3. Form માં Assistant Designation હોય તેમની માહિતી જોવા માટે Criteria માં Designation [Assistant] ટાઈપ કરીને [Find Next] બટન પર ક્લિક કરતાં ફક્ત Assistant Designation હોય તેમના જ Record જોવા મળશે.

Sheet3

Name: Dinesh
Department: Production
Designation: Assistant
Salary: 8000

2 of 5
New
Delete
Restore
Find Prev
Find Next
Criteria
Close

❑ **જેમની Salary 15,000 ઉપર હોય તેમના જ રેકોર્ડઝ જોવા માટે :**

આ માટે [Criteria] બટન પર ક્લિક કરી, Salary [> = 15000] ટાઈપ કરી Find Next પર ક્લિક કરતાં 15,000 ની ઉપર જેમની Salary હશે તેના જ રેકોર્ડ જોવા મળશે.

❑ **Auto Filter સગવડતાનો ઉપયોગ કરીને નીચે પ્રમાણે ક્વેરીની રચના કરો :**

[A] જેમનું Department Sales હોય તેવા રેકોર્ડઝ જોવા માટે :

1. સૌપ્રથમ Employee's ડેટાબેઝ select કરો.

2. ત્યારબાદ "Data Menu" માં જઈને Filter કમાન્ડ પર ક્લિક કરી, તેમાં જોવા મળતાં Option માંથી AutoFilter પર ક્લિક કરો. જેથી Work Sheet નીચે મુજબ જોવા મળશે.

	A	B	C	D
1	Name	Department	Designation	Salary
2	Bhrugesh	Production	Manager	18000
3	Dinesh	Production	Assistant	8000
4	Pankajbhai	Sales	Manager	20000
5	Pinal	Purchase	Manager	17500
6	Sanjaybhai	Sales	Assistant	9000

3. હવે, Department [▾] ← પર ક્લિક કરો. તેમાં Sales પર ક્લિક કરતાં ફક્ત Sales Department ના જ રેકોર્ડઝ જોવા મળશે.

	A	B	C	D
1	Name	Department	Designation	Salary
4	Pankajbhai	Sales	Manager	20000
6	Sanjaybhai	Sales	Assistant	9000

નોંધ: *Autofilter ની અસર દુર કરવા માટે Department પર ક્લિક કરી All ઉપર ક્લિક કરવું. જેથી બધા જ રેકોર્ડ જોવા મળશે.*

[B] જેમનું Designation ફક્ત Manager હોય તેમના જ Record જોવા માટે :

1. સૌપ્રથમ Employee's ડેટાબેઝ Select કરો.
2. ત્યારબાદ "Data Menu" માં જઈને Filter કમાન્ડ પર ક્લિક કરી, તેમાં જોવા મળતાં Option માંથી Autofilter પર ક્લિક કરો.
3. હવે, Designation ▾ ← પર ક્લિક કરી, તેમાં Manager પર ક્લિક કરતાં ફક્ત Manager Designation હશે તેના જ રેકોર્ડ્ઝ જોવા મળશે.

	A	B	C	D
1	Name	Department	Designation	Salary
2	Bhrugesh	Production	Manager	18000
4	Pankajbhai	Sales	Manager	20000
5	Pinal	Purchase	Manager	17500

[C] ફક્ત Dinesh નામના વિદ્યાર્થીની માહિતી જોવા માટે :

1. સૌપ્રથમ Employee's ડેટાબેઝ Select કરો.
2. ત્યારબાદ "Data Menu" માં જઈને Filter કમાન્ડ પર ક્લિક કરી, તેમાં જોવા મળતાં Option માંથી Autofilter પર ક્લિક કરો.
3. હવે, Name ▾ ← પર ક્લિક કરી, તેમાં Dinesh નામ પર ક્લિક કરતાં ફક્ત Dinesh નામના વિદ્યાર્થીની જ માહિતી જોવા મળશે.

	A	B	C	D
1	Name	Department	Designation	Salary
3	Dinesh	Production	Assistant	8000

પ્રેક્ટીકલ-5

નીચે પ્રમાણે વર્કશીટ તૈયાર કરો.

	A	B	C	D	E
1	Name	Maths	Science	English	Total
2	Ravindra	80	90	70	240
3	Tanumati	90	90	65	245
4	Satishbhai	73	64	59	196
5	Gangaben	78	62	53	193
6	Ramila	49	54	50	153
7	Sonu	65	70	71	206
8	Harsh	73	64	63	200


❑ **સૂચનાઓ:**

1. ઉપરોક્ત માર્કશીટને આધારે કોલમ ચાર્ટ તૈયાર કરો કે જેમાં, Name તેમજ વિવિધ Subject જેવા કે, Maths, Science અને English નો કોલમ ચાર્ટ તૈયાર કરો.
   - → Title તરીકે Marksheet ટાઈપ કરો. તેમાં X ધરી પર વિદ્યાર્થીના Name અને Y ધરી પર Mark ટાઈપ કરો.
   - → Legend ને ચાર્ટની ડાબી બાજુ દર્શાવો.
   - → ચાર્ટને Value સાથે નવી Sheet માં દર્શાવો.
2. Name અને Total નો Pie Chart તૈયાર કરો.
   - → તેમાં Title તરીકે Marksheet ટાઈપ કરો.
   - → Legend ને ચાર્ટની Top Site પર દર્શાવો.
   - → ચાર્ટને Category Name અને Percentage સાથે જે Sheet માં ડેટા છે તે જ Sheet માં દર્શાવો.

❑ **Name અને દરેક Subject [Maths, Science, English] નો કોલમ ચાર્ટ તૈયાર કરવા માટે :**


સૌપ્રથમ Name અને દરેક Subject સાથેની માહિતી Select કરો. ત્યારબાદ Insert Menu માંથી Chart કમાન્ડ પર ક્લિક કરો. જેથી Chart Wizard નું ડાયલોગ બોકસ જોવા મળશે. તેમાં મુખ્ય 4 Steps છે.

Step-1 Chart Type :




અહીં, Chart Type ના પ્રથમ Step માં Standard Types માં વિવિધ પ્રકારના 14 ચાર્ટ [Column, Bar, Line, Pie, XY, Area, Radar વગેરે] તૈયાર કરી શકાય છે. આપણે Chart Type માંથી Column Chart પર ક્લિક કરી, Chart Sub-type માં Column Chart નો પ્રકાર નક્કી કરી, Next > બટન પર ક્લિક કરવી. જેથી Chart Source Data નું ડાયલોગ બોક્સ જોવા મળશે.

Step-2 Chart Source Data :




અહીં, આપણે જે માહિતીનો ચાર્ટ તૈયાર કરવાનો હોય તેની Range આપવાની હોય છે. આપણે અગાઉથી જ Range Select કરેલી હોવાથી અહીં ફક્ત Next > બટન પર ક્લિક કરવી. જેથી Chart Options નું ડાયલોગ બોકસ જોવા મળશે.




Step-3 Chart Options :

અહીં, Chart title : માં Marksheet ટાઈપ કરવું અને Category (X) axia : માં Name તેમજ Value (Y) axia : માં Mark ટાઈપ કરવું. ત્યારબાદ Legend Tab (ટેબ) પર ક્લિક કરી, Legend ડાબી બાજુ Set કરવું.




હવે, Data Lables Tab પર ક્લિક કરી ☑ Value પર ક્લિક કરો.




ત્યારબાદ, Next > બટન પર ક્લિક કરો, જેથી Chart Wizard નું ચોથું અને છેલ્લું Step Chart Location જોવા મળશે.

Step-4 Chart Location :



અહીં, જો Chart ને Current Sheet માં જ ઉમેરવો [Insert] કરવાનો હોય તો "As Object In" Option Select કરવું અને જો Chart નવી sheet માં જ જોઈતો હોય તો "As New Sheet" Option Select કરવું. અહીં, આપણે ચાર્ટ નવી Sheet માં જોવાનો હોવાથી ⊙ As new sheet પર ક્લિક કરી Finish બટન પર ક્લિક કરો. જેથી Chart-1 નામની નવી sheet માં Column chart જોવા મળે છે.




❑ Name અને Total નો Pie Chart તૈયાર કરવા માટે :


સૌપ્રથમ Name અને Total કોલમ Select કરવા, આ માટે પ્રથમ ફક્ત Name નું કોલમ Select કરો. ત્યારબાદ Ctrl Key Press કરી રાખીને, Total નું કોલમ Select કરો. હવે, Insert Menu માંથી Chart કમાન્ડ પર ક્લિક કરો. જેથી Chart Wizard નું ડાયલોગ બોક્સ જોવા મળે છે. જેમાં Chart તૈયાર કરવા માટેના 4 Steps છે.

Step-1 Chart Type :

અહીં, Chart Type માં Pie અને તેનો Sub-type select કરીને Next > બટન પર ક્લિક કરો. જેથી Chart Source Data નું ડાયલોગ બોક્સ જોવા મળશે.




Step-2 Chart Source Data :




અહીં, આપણે અગાઉથી જ Range Select કરેલી હોવાથી ફક્ત Next > બટન પર ક્લિક કરો. જેથી Chart Options નું ડાયલોગ બોક્સ જોવા મળશે.


Step-3 Chart Options :



અહીં, Chart title માં Marksheet ટાઈપ કરવું. ત્યારબાદ Legend Tab (ટેબ) પર ક્લિક કરી Legend Top પર Set કરવું.




હવે, Data Lables Tab પર ક્લિક કરી Category Name, Value, Percentage ના Checkbox પર ક્લિક કરવી.



ત્યારબાદ, Next > બટન પર ક્લિક કરો. જેથી Chart Wizard નું ચોથું અને છેલ્લું Step Chart Location જોવા મળશે.

Step-4 Chart Location :



અહીં, Chart Location માં ચાર્ટ Current Sheet માં જોઈતો હોવાથી ⊙ As Object In પર ક્લિક કરી Finish બટન પર ક્લિક કરવું. જેથી Chart Current Sheet માં જ જોવા મળશે.




Chart
Chart Area
Name
Maths
SCI.
English
Total
Ravindra 80 90 70 240
Tanumati 90 90 65 245
Sathishbhai 73 64 59 196
Gangaben 78 62 53 193
Ramila 49
Sonu 65
Harsh 73
Marksheet
Ravindra
Tanumati
Sathishbhai
Gangaben
Ramila
Sonu
Harsh
Harsh 14%
Ravindra 17%
Sonu 14%
Tanumati 17%
Ramila
Sathishbh ai

વિભાગ-2 **Practical Project**

MS-PowePoint

પ્રેક્ટીકલ-1

1. **Slide - 1**

WEL COME
TO
SARASWATI COMPUTER CENTER
AHMEDABAD

2. **Slide - 2**

B.A.O.U.
• Degree Course
• Diploma Course
• Certificate Course

3. **Slide - 3**

DIPLOMA COURSE
• Diploma in Insurance
• Diploma in Tax Practice
• Diploma in Advance Accounting

3. **Slide - 4**

CERTIFICATE COURSE
• Certificate in Computer Concept
• Certificate in Human Rights
• Certificate in Teaching of English

→ **સૂચનાઓ :**


1. PowerPoint માં ઉપરોક્ત પ્રેઝન્ટેશન સ્લાઈડ તૈયાર કરો.
2. સ્લાઈડના લખાણ પર Formatting [Font, Size, Font Color] ની અસર આપો.
3. દરેક સ્લાઈડનું બૅકગ્રાઉન્ડ એક સમાન રાખો.
4. દરેક સ્લાઈડમાં Slide Transition ની Effect આપો.
5. દરેક સ્લાઈડમાં Animation ની Effect આપો.
6. Slide - 4 ની Duplicate સ્લાઈડ બનાવો.
7. અગાઉ બનાવેલ Duplicate સ્લાઈડ [Slide - 5] દૂર કરો.
8. પ્રેઝન્ટેશનને તમારું નામ આપીને Save કરો.
9. હવે, પ્રેઝન્ટેશન જુઓ.

પ્રેઝન્ટેશન


❑ પ્રેઝન્ટેશન-1 તૈયાર કરવું.

1. Slide - 1

નવું પ્રેઝન્ટેશન બનાવવા File Menu માં જઈને New કમાન્ડ પર ક્લિક કરો. હવે, જમણીબાજુ New Presentation ની Taskpane પર જોવા મળતાં વિવિધ ઓપ્શનમાંથી Blank Presentation પર ક્લિક કરવી. જેથી નીચે મુજબ Screen જોવા મળશે.



→ આ સ્લાઈડમાં Slide - 1 માં દર્શાવેલ માહિતી ટાઈપ કરવી.



→ એક સ્લાઈડ બનાવ્યા પછી પ્રેઝન્ટેશનમાં બીજી સ્લાઈડ ઉમેરવા માટે Insert Menu → New Slide અથવા Ctrl + M key press કરો. જેથી નવી Slide બનાવવા માટેના 24 Slide Auto Layout જોવા મળશે. તેમાં Title and Text Layout select કરવું.

નોંધ :- જો Slide Layout જોવા મળતું ના હોય તો Format Menu માં જઈને Slide Layout કમાન્ડ પર ક્લિક કરવી.

2. Slide - 2

B.A.O.U.

- Degree Course
- Diploma Course
- Certificate Course

→ હવે, નવી Slide ઉમેરવા માટે Insert Menu માં જઈને New Slide કમાન્ડ પર ક્લિક કરો.

3. Slide - 3

DIPLOMA COURSE

- Diploma in Insurance
- Diploma in Tax Practice
- Diploma in Advance Accounting

→ હવે, નવી Slide ઉમેરવા માટે Insert Menu માં જઈને New Slide કમાન્ડ પર ક્લિક કરો.

4. Slide - 4


CERTIFICATE COURSE

- Certificate in Computer Concept
- Certificate in Human Rights
- Certificate in Teaching of English

❑ **સ્લાઈડના લખાણ પર Formatting ની અસર આપો.**

પ્રથમ Slide ના લખાણમાંથી Title અને Text select કરો અને Formatting Toolbar માંથી Font - Arial, Size - 48 અને **B** એટલે કે Bold, ***I*** એટલે કે Italic ની Effect આપો. ત્યારબાદ Formatting Toolbar માંથી Font Color ના Tool પર ક્લિક કરીને Font નો કલર Blue select કરો.

❑ **દરેક સ્લાઈડનું બેક ગ્રાઉન્ડ એક સમાન રાખો.**



1. પ્રેઝન્ટેશનમાં Background ની અસર આપવા માટે Format Menu માંથી Background કમાન્ડ પર ક્લિક કરવી. જેથી Background નું ડાયલોગ બૉક્સ જોવા મળે છે.



2. અહીં, Background Fill માં by Default White Background જોવા મળે છે. તેના પુલડાઉન મેનુમાં ⌄ ક્લિક કરવી.

3. હવે, Fill Effect માંથી કોઈ એક Effect select કરીને (દા.ત., Two Colors પર ક્લિક કરી બે કલરો સિલેક્ટ કરવા) OK બટન પર ક્લિક કરવી.


4. ત્યારબાદ સમગ્ર પ્રેઝન્ટેશનમાં એક સમાન બેકગ્રાઉન્ડ રાખવા માટે Apply to All બટન પર ક્લિક કરવી. જેથી પ્રેઝન્ટેશનમાં રહેલ તમામ સ્લાઈડનું બેકગ્રાઉન્ડ એક સમાન રહેશે.



નોંધ : Background ની Effect આપતી વખતે Apply બટન પર ક્લિક કરવાથી ફક્ત Current Slide નું જ Background બદલાશે.

❑ સ્લાઈડમાં Slide Transition ની Effect આપવી :

Slide Show જોતી વખતે એક Slide પછી બીજી Slide કેવી રીતે અને કેટલા સમય પછી આવે તે નક્કી કરવા માટે Slide Transition કમાન્ડનો ઉપયોગ થાય છે. Slide Transition ની Effect આપવા માટે નીચે મુજબના Steps અનુસરવા.



1. સૌપ્રથમ જે Slide ને Transition Effect આપવી હોય તેને Select કરો.

   નોંધ : એક કરતાં વધારે સ્લાઈડ પસંદ કરવા Ctrl (કંટ્રોલ) કી Press કરી રાખી માઉસનાં ડાબીબાજુના બટનથી દરેક સ્લાઈડ પર ક્લિક કરો.

2. હવે, Slide Show મેનુમાં જઈને Slide Transition કમાન્ડ પર ક્લિક કરવી. જેથી જમણી બાજુ Slide Transition નું ડાયલોગ બોકસ જોવા મળશે.

3. અહીં, Apply to selected slides માં જોવા મળતી વિવિધ Effect માંથી (જેમ કે, Box In, Box Out, Wipe Down, Wipe Left, Wipe Right, While Up) કોઈ Effect select કરવી. અહીં, Box Out Effect select કરવી.


4. ત્યારબાદ, Speed drop-down બોકસની મદદથી Transition ની ઝડપ (Speed) select કરો. હવે, Sound drop-down બોકસની મદદથી યોગ્ય Sound select કરો.

5. ત્યારબાદ, જો માઉસની ક્લિક દ્વારા સ્લાઈડ શો જોવો હોય તો On Mouse Click વિકલ્પ select કરો અથવા સ્લાઈડ શો Automatically જોવો હોય તો તે મુજબ ટાઈમ Set કરો. હવે, Apply to All Slides બટન પર ક્લિક કરતાં દરેક સ્લાઈડમાં એકસમાન Slide Transition Effect જોવા મળશે.

❑ સ્લાઈડમાં Animation ની Effect આપવી :

Slide Show જોતી વખતે Slide માં રહેલ માહિતી (Text) કેવી રીતે આવશે તે નક્કી કરવા માટે Custom Animation કમાન્ડનો ઉપયોગ થાય છે. Custom Animation ની Effect આપવા માટે નીચે મુજબના Steps અનુસરવા.

1. સૌપ્રથમ Slide - 1 ના ટાઈટલ લખાણને Select કરો. ત્યારબાદ Slide Show મેનુમાં જઈને Custom Animation કમાન્ડ પર ક્લિક કરતાં જમણી બાજુ Custom Animation ની માહિતી જોવા મળે છે.



2. હવે, Custom Animation ના "Add Effect" બટન પર ક્લિક કરો. જેથી બીજું એક Sub-Menu ખૂલશે. જેમાં ચાર Option જોવા મળશે.

Entrance (શરૂઆત માટે)

Emphasis (ભાર મૂકવા માટે)

Exit (બહાર નીકળવા)

Motion Paths (ગતિના રસ્તા)

ઉપરોક્ત દરેક Option માં ઘણી બધી Effect જોવા મળે છે. તેમાંથી કોઈ એક Effect અથવા એકથી વધારે Effects select કરીને ▶ Play બટન પર ક્લિક કરતાં તે વિવિધ ઇફેક્ટ જોવા મળશે.

❑ **Slide - 4 ની Duplicate સ્લાઈડ બનાવો.**

પાવરપોઇન્ટમાં સરળતાથી Duplicate Slide બનાવી શકાય છે. પ્રેઝન્ટેશનમાં રહેલી Slide ની નકલ (Copy) કરવા માટેની ત્રણ રીત છે :

1. Ctrl + D

2. Insert Menu ⟶ Duplicate Slide

3. Edit Menu ⟶ Duplicate

Duplicate Slide બનાવવા માટે :

1. સૌપ્રથમ Slide - 4 પર ક્લિક કરો.

2. ત્યારબાદ Ctrl + D key press કરો અથવા Insert Menu માં જઈને Duplicate Slide કમાન્ડ પર ક્લિક કરો. જેથી Slide - 4 ની Duplicate સ્લાઈડ જોવા મળશે.




- ❑ **અગાઉ બનાવેલ Duplicate સ્લાઈડ (Slide - 5) દૂર કરવી :**

  1. સૌપ્રથમ Slide - 5 પર ક્લિક કરો.
  2. ત્યારબાદ Edit Menu માં જઈને Delete Slide કમાન્ડ પર ક્લિક કરો. જેથી Duplicate સ્લાઈડ દૂર થઈ જશે.

- ❑ **પ્રેઝન્ટેશનને તમારું નામ આપીને Save કરો.**

File Menu માં જઈને Save કમાન્ડ પર ક્લિક કરો, જેથી Save As નું ડાયલોગ બોકસ જોવા મળશે.



તેમાં પ્રેઝન્ટેશનને Ravi નામ આપીને Save કરો.

- **Slide Show જોવા માટે :**

પ્રેઝન્ટેશનની રજૂઆત કરવા માટે Slide Show કમાન્ડનો ઉપયોગ થાય છે. પાવરપોઇન્ટમાં બનાવેલ પ્રેઝન્ટેશન ત્રણ રીતે Run કરી શકાય છે.

1. F5
2. View ⟶ Slide Show
3. Slide Show ⟶ View Show

પ્રેક્ટીકલ-2

1. Slide - 1

Introduction
TO
COMPUTER
BY
Dipak

2. Slide - 2

Computer

¨ Hardware
¨ Software

Clipart

3. Slide - 3

Computer

Hardware	Software
• Monitor	• Tally.ERP9
• Keyboard	• MS-Word
• CPU	• MS-Excel
• Mouse	• MS-PowerPoint

PowerPoint માં ઉપરોક્ત પ્રેઝન્ટેશન તૈયાર કરો.

- **સૂચનાઓ :**

1. દરેક સ્લાઈડનું બેકગ્રાઉન્ડ અલગ-અલગ રાખો.
2. Slide - 2 માં Clipart Insert કરો.
3. દરેક સ્લાઈડમાં Slide Transition ની Effect આપો.
4. દરેક સ્લાઈડમાં Animation ની Effect આપો.
5. Slide Show Run કરો.

❑ પ્રેઝન્ટેશન તૈયાર કરવું.

1. Slide - 1 (Title Slide)


નવું પ્રેઝન્ટેશન બનાવવા File Menu માં જઈને New કમાન્ડ પર ક્લિક કરો. હવે, જમણી બાજુ જોવા મળતાં વિવિધ ઓપ્શનમાંથી Blank Presentation પર ક્લિક કરવી.

→ આ સ્લાઈડમાં Slide - 1 માં દર્શાવેલ માહિતી ટાઈપ કરવી.



→ એક સ્લાઈડ બનાવ્યા પછી બીજી સ્લાઈડ ઉમેરવા માટે Insert Menu → New Slide કમાન્ડ પર ક્લિક કરો. જેથી નવી Slide બનાવવા માટેના 24 Slide Layout જોવા મળશે. તેમાં Title, Text and ClipArt Layout Select કરવું.

2. Slide - 2 (Title, Text and ClipArt)




→ હવે, નવી Slide ઉમેરવા માટે Insert Menu માં જઈને New Slide કમાન્ડ પર ક્લિક કરો.

3. Slide - 3 (Title and 2-Column Text)

Computer	
Hardware	**Software**
• Monitor	• Tally.ERP 9
• Keyboard	• MS-Word
• CPU	• MS-Excel
• Mouse	• MS-Power Point

❑ **દરેક સ્લાઈડનું બેકગ્રાઉન્ડ અલગ-અલગ રાખો.**


1. પ્રેઝન્ટેશનમાં Background ની અસર આપવા માટે Format Menu માંથી Background કમાન્ડ પર ક્લિક કરવી. જેથી Background નું ડાયલોગ બૉક્સ જોવા મળે છે.





2. તેમાં Background Fill માં by Default White Background જોવા મળે છે. તેના ⌄ પુલડાઉન મેનુમાં ક્લિક કરવી.


3. અહીં, Fill Effect માંથી કોઈ એક Effect select કરીને OK બટન પર ક્લિક કરવી.




4. ત્યારબાદ સમગ્ર પ્રેઝન્ટેશનમાં અલગ-અલગ બેકગ્રાઉન્ડ રાખવા માટે Apply બટન પર ક્લિક કરવી. જેથી Selected Slide નું Background બદલાઈ જશે.

નોંધ : આ પ્રમાણે બીજી Slide નું Background બદલવું.

❑ **Slide - 2 માં Clipart Insert કરવા માટે :**




અહીં, Clipart પર Double Click કરવી. જેથી Select Picture નું ડાયલોગબૉક્સ જોવા મળે છે. તેમાંથી જરૂરી ચિત્ર Select કરીને OK બટન પર ક્લિક કરવી.





❑ **સ્લાઈડમાં Slide Transition ની Effect આપવી :**

1. સૌપ્રથમ જે Slide ને Transition Effect આપવી હોય તેને Select કરો.
2. હવે, Slide Show મેનુમાં જઈને Slide Transition કમાન્ડ પર ક્લિક કરવી. જેથી જમણી બાજુ Slide Transition નું ડાયલોગ બોક્સ જોવા મળશે.
3. અહીં, Apply to selected slides માં જોવા મળતી વિવિધ Effect માંથી Box In Effect select કરવી.
4. હવે, Apply to All Slides બટન પર ક્લિક કરતાં દરેક સ્લાઈડમાં એક સમાન Slide Transition Effect જોવા મળશે.




❑ **સ્લાઈડમાં Animation ની Effect આપવી :**

1. સૌપ્રથમ Slide - 1 ના ટાઈટલ લખાણને Select કરો. ત્યારબાદ Slide Show મેનુમાં જઈને Custom Animation કમાન્ડ પર ક્લિક કરતાં Custom Animation ની માહિતી જોવા મળે છે.
2. હવે, Custom Animation ના Add Effect બટન પર ક્લિક કરો. જેથી ચાર Option સાથેનું Sub-Menu જોવા મળે છે. તેમાંથી જરૂરી Effect select કરીને ▶ Play બટન પર ક્લિક કરતાં selected Effects ની અસર જોવા મળે છે.

❑ **Slide Show Run કરવા માટે :**

પ્રેઝન્ટેશનની રજૂઆત કરવા અથવા તૈયાર કરેલ પ્રેઝન્ટેશન Run કરવા માટે નીચે મુજબ ત્રણમાંથી કોઈ એક વિકલ્પનો ઉપયોગ કરવો.

1. F5
2. View $\longrightarrow$ Slide Show
3. Slide Show $\longrightarrow$ View Show



કસોટીપત્ર-1

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ

સત્રાંત પરીક્ષા

સમય : 3 કલાક **કુલ ગુણ : 140**

પાઠ્યક્રમ : ફાઉન્ડેશન [CCC-01], એપ્લીકેશન [CCC-02], ઈન્ટરનેટ [CCC-03]

પ્રશ્ન 1 થી 35 **ફાઉન્ડેશન (CCC-01)** **45 Minutes**

1. ડોસમાં બનાવેલ ડીરેકટરીને દૂર કરવા માટે .... કમાન્ડનો ઉપયોગ થાય છે.
   [A] MD [B] CD [C] RD [D] RD..
2. ટેપડ્રાઈવમાં ડેટા કયા સ્વરૂપે લખાય છે ?
   [A] ANALOG [B] DIGITAL [C] HYBRID [D] એક પણ નહિ
3. હાર્ડડિસ્કની ગતિ કલાકના કેટલા કી.મી. હોય છે. ?
   [A] 150 [B] 250 [C] 350 [D] 450
4. Start બટન કયા બાર ઉપર આવેલું હોય છે ?
   [A] ડેસ્કટોપબાર [B] ટાસ્કબાર [C] મેનુબાર [D] ટાઈટલબાર
5. બાયનરીમાં કેટલા ડિજીટ હોય છે ?
   [A] 0 [B] 1 [C] 3 [D] 2
6. ડેટા મૅનેજમેન્ટ માટે કઈ એપ્લીકેશનનો ઉપયોગ થાય છે ?
   [A] WORDSTAR [B] FOXPLUS [C] WORD [D] LOTUS 1-2-3
7. DOS માં બનાવેલી ફાઈલનું નામ બદલવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે ?
   [A] REN [B] DEL [C] COPY [D] XCOPY
8. કમ્પ્યૂટરમાં જે ભાગોને આપણે જોઈ શકીએ છીએ તે ભાગો કયા નામથી ઓળખાય છે ?
   [A] હાર્ડવેર [B] સૉફ્ટવેર [C] કમ્પાઈલર [D] OS
9. સ્ક્રીન સ્ક્રોલીંગને કામચલાઉ અટકાવવા કઈ કી નો ઉપયોગ થાય છે ?
   [A] STOP [B] PAUSE [C] END [D] SHIFT
10. નાનામાં નાના કમ્પ્યૂટર્સ તરીકે કયા પ્રકારના કમ્પ્યૂટર્સ ઓળખાય છે ?
   [A] PC [B] NOTEBOOK [C] PDA [D] LAPTOP

11. ઉચ્ચ ઘનતાવાળી ફ્લોપી ડિસ્કની સંગ્રહક્ષમતા કેટલી હોય છે ?

[A] 1.2 MB [B] 1.44 MB [C] 2.88 MB [D] 720 KB

12. નોટપેડ એપ્લીકેશનનું .... એક્ષટેશન હોય છે.

[A] .DOC [B] .TXT [C] .PDF [D] .EXE

13. વિન્ડોઝમાં ફોલ્ડરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ?

[A] ફાઈલ [B] બેચ ફાઈલ [C] ડીરેક્ટરી [D] એક પણ નહિ

14. ડૉસમાં બનાવેલ ફાઈલમાં સુધારા-વધારા કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે ?

[A] Copy con [B] Xcopy [C] Edit [D] એક પણ નહિ

15. ડૉસમાં બનાવેલ ડીરેક્ટરીને બદલવા માટે .... કમાન્ડનો ઉપયોગ થાય છે.

[A] MD [B] CD [C] RD [D] CLS

16. કમ્પ્યૂટર્સ .... અંકી પદ્ધતિ પર કામ કરે છે.

[A] ત્રિ [B] દ્વિ [C] દશાંશ [D] અષ્ઠ

17. .... ના સમૂહને રાખવાની જગ્યાને ફોલ્ડર કહે છે.

[A] સંગ્રાહક [B] સૉફ્ટવેર [C] ફાઈલ [D] પ્રોગ્રામ

18. એક જ બિલ્ડિંગ અથવા રૂમમાં જોડેલા કમ્પ્યૂટર્સમાં કયા નેટવર્કનો ઉપયોગ થાય છે ?

[A] WAN [B] MAN [C] SAN [D] LAN

19. CD-ROM ડ્રાઈવની ગતિ .... હોય છે.

[A] 40x [B] 48x [C] 52x [D] આપેલ તમામ

20. સામાન્ય રીતે નોટપેડ દ્વારા .... કાર્યો કરવામાં આવે છે.

[A] નાનો પ્રોગ્રામ લખવા માટેના [B] ગણતરી કરવા માટેના

[C] ફાઈલ સેવ કરવા માટેના [D] એક પણ નહિ

21. માઈક્રોપ્રોસેસરની ત્રીજી જનરેશન .... છે.

[A] 8088 [B] 80286 [C] 80386 [D] 80486

22. .... પ્રકારના પ્લોટર હોય છે.

[A] ફ્લેટ બેડ [B] ડ્રમ

[C] ફ્લેટ બેડ અને ડ્રમ [D] એક પણ નહિ

23. .... માં એનાલોગ ડેટા લખાય છે.

[A] ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ [B] ટેપ ડ્રાઈવ

[C] ઑડિયો કૅસેટ [D] આપેલ તમામ

24. નોટપેડ એપ્લીકેશનમાંથી ડાયરેક્ટ બહાર નીકળવા કઈ ફંકશન કી નો ઉપયોગ થાય છે ?

[A] Alt + F1 [B] Alt + F2 [C] Alt + F3 [D] Alt + F4

25. માઉસની ક્લિક બદલવા માટે કયા વિકલ્પમાં જવું પડે છે ?

[A] Windows [B] Control Panel [C] File [D] Font

26. રેન્ડમ એક્સેસ મેમરીનો સમાવેશનો કયા પ્રકારની મેમરીમાં થાય છે ?

[A] સેકન્ડરી [B] પ્રાયમરી [C] રીડ ઑન્લી મેમરી [D] રજિસ્ટર્સ

27. DVD સામાન્યત: વધુમાં વધુ એક્સેસ દર .... mbps ધરાવે છે.

[A] 5.3 [B] 6.3 [C] 8.3 [D] 9.3

28. જોય સ્ટીકનો સમાવેશ કયા સાધનોમાં કરવામાં આવ્યો છે ?

[A] બહિર્વેશ સાધનો [B] આગમન સાધનો [C] નિર્વેશ સાધનો [D] એક પણ નહિ

29. નીચેનામાંથી કઈ સમસ્યા કમ્પ્યૂટરમાં ઉદ્ભવે છે ?

[A] વિશ્વસનીયતા [B] ચોકસાઈ [C] કમ્પ્યૂટર ક્રાઈમ [D] સંગ્રહક્ષમતા

30. નોટપેડમાં નવી ફાઈલ બનાવવા માટેની શોર્ટકટ કી .... છે.

[A] Ctrl + O [B] Ctrl + N [C] Alt + N [D] Alt + O

31. આમાંની કઈ ચાલક પદ્ધતિ નથી ?

[A] Dos [B] Ws [C] Linux [D] Warp

32. નોટપેડ કયા પ્રકારનો પ્રોગ્રામ છે ?

[A] DTP [B] Utility [C] System Software [D] Database

33. .... એ રજિસ્ટર અને સ્મૃતિ સ્થાનોનાં સમૂહને સમાવે છે.

[A] ALU [B] CU [C] MU [D] ROM

34. રીસાઈકલ બિનની રચના કઈ બાબતને ધ્યાનમાં રાખી કરવામાં આવી છે ?

[A] કચરો મને આપો [B] દિલ સાફ રાખો

[C] સ્વચ્છતા રાખો [D] મનુષ્ય માત્ર ભૂલને પાત્ર

35. C નામની ડ્રાઈવમાં રહેલી બધી ફાઈલો તથા ફોલ્ડરને હારબંધ જોવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે ?

[A] DIR [B] DIR/S [C] DIR/W [D] DIR ??????

પ્રશ્ન 36 થી 105 **એપ્લીકેશન (CCC-02)** **90 Minutes**

36. પાવરપૉઈન્ટ એપ્લીકેશનમાં એકના જેવી જ બીજી સ્લાઇડ બનાવવા માટે કઈ શોર્ટકટ કી નો ઉપયોગ થાય છે ?

[A] Ctrl + D [B] Alt + D [C] Shift + D [D] Ctrl + Alt + D

37. પાવરપૉઈન્ટમાં બનાવેલી ફાઈલનું પ્રેઝન્ટેશન જોવા માટે કઈ ફંકશન કી નો ઉપયોગ થાય છે ?

[A] F3 [B] F5 [C] F7 [D] F4

38. પાવરપૉઇન્ટ એપ્લીકેશનમાં કાર્ટૂન દાખલ કરવા માટે કયા ઑપ્શનની જરૂર પડે છે ?

[A] CLIPART [B] WORDART [C] CLIPBOX [D] CLIPING

39. પાવરપૉઇન્ટ એપ્લીકેશનમાં એક કરતા વધારે સ્લાઈડને રો મુજબ જોવા માટે કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે ?

[A] SLIDE SORTER [B] SHORTER [C] NOTES [D] BOXES

40. વર્ડ-2000 એપ્લીકેશનમાં .... મેનુ આવેલા હોય છે.

[A] 10 [B] 12 [C] 09 [D] 13

41. વર્ડમાં બનાવેલી ફાઈલને SAVE કરવા માટે .... શોર્ટકટ કી નો ઉપયોગ થાય છે.

[A] Ctrl + C [B] Ctrl + V [C] Ctrl + S [D] Ctrl + Z

42. વર્ડમાં ખુલ્લી ફાઈલનું પ્રિન્ટ લેવા માટે .... ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે.

[A] ફોરમેટ [B] સ્ટાન્ડર્ડ [C] ટેબલ [D] એક પણ નહિ

43. વર્ડમાં તૈયાર કરેલી ફાઈલની પ્રિન્ટ આઉટ લેતા પહેલા પેજ લેઆઉટ કેવો લાગે છે તે જોવા માટે .... ઑપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે.

[A] PRINT PREVIEW [B] PRINT OUT [C] PRINT [D] એક પણ નહિ

44. વર્ડમાં SPELL CHECK કરવા માટે .... ફંકશન કી નો ઉપયોગ થાય છે.

[A] F1 [B] F2 [C] F7 [D] F4

45. વર્ડમાં લખેલ લખાણના ફોન્ટ નાના કરવા માટે .... શોર્ટકટ કી વપરાય છે.

[A] Shift + Ctrl + < [B] Shift + Ctrl + >

[C] Alt + Ctrl + < [D] એક પણ નહિ

46. વર્ડમાં બનાવેલ ફાઈલમાં કુલ કેટલા શબ્દો છે, કેટલી લાઈન છે, કેટલા પૅરેગ્રાફ છે તે વિગતો જાણવા માટે .... કમાન્ડનો ઉપયોગ થાય છે.

[A] AUTO CORRECT [B] SPELL CHECK [C] WORD COUNT [D] AUTO TEXT

47. વર્ડ એપ્લીકેશનમાં ટેબલ બનાવ્યા બાદ તેમાં રહેલ માહિતીને શોર્ટીંગ કરવા .... ઑપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે.

[A] SORT [B] CHANGE [C] SUM [D] HYPERLINK

48. વર્ડ એપ્લીકેશનમાં પિક્ચર દાખલ કરવા માટે .... ઑપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે.

[A] ક્લીપઆર્ટ [B] ફાઈલ [C] ચિત્ર [D] એક પણ નહિ

49. વર્ડ એપ્લીકેશનમાં અલગ-અલગ શેપમાં લખાતા શબ્દો .... ઑપ્શનની મદદથી લખાય છે.

[A] CLIP [B] WORDART [C] FILE [D] WORD CREATE

50. વર્ડ એપ્લીકેશનમાં દરેક પેજ ઉપર નંબર લખાઈને આવે તે માટે .... ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે.

[A] STATUS BAR [B] HEADER & FOOTER

[C] PRINT VIEW [D] એક પણ નહિ

51. વર્ડ એપ્લીકેશનમાં ડીલીટ કી ની મદદથી INSERT ON POINT થી કઈ બાજુનું લખાણ ભૂંસી શકાય છે ?

[A] જમણી [B] ડાબી [C] બંને [D] એક પણ નહિ

52. વર્ડ એપ્લીકેશનમાં DRAG અને DROP પધ્ધતિથી પસંદ કરેલ લખાણને ખસેડતી વખતે કઈ કી દબાવી રાખવી જરૂરી બને છે ?

[A] Ctrl [B] Alt [C] Shift [D] Alt + Ctrl

53. વર્ડ એપ્લીકેશનમાં ઓપન ફાઈલમાં ડૉક્યુમેન્ટની શરૂઆતમાં પહોંચવા કઈ કીનો ઉપયોગ કરવો પડે છે ?

[A] Ctrl [B] Ctrl + Home [C] Alt + Ctrl [D] Shift + Home

54. .... એ માઉસના જમણા બટનની શોર્ટકટ જેવો જ કમાન્ડ છે.

[A] SMART TAGS [B] SMART [C] SMART TABS [D] SMART TEGS

55. વર્ડ એપ્લીકેશનમાં ડૉક્યુમેન્ટ પ્રિન્ટ કરવા માટે કેટલા પ્રકારના ORIENTATION હોય છે ?

[A] 0 [B] 1 [C] 2 [D] 3

56. વર્ડ એપ્લીકેશનમાં ટેબલ મેનુમાં કોઈપણ FORMULA .... નિશાની સાથે જ શરૂ થાય છે.

[A] = [B] * [C] \ [D] /

57. વર્ડ એપ્લીકેશનમાં મેઈલ-મર્જના નામનું ટૂલબાર આવે છે, તેમાં જવા માટે કઈ શોર્ટકટ કી નો ઉપયોગ થાય છે ?

[A] Alt + F [B] Shift + F [C] Ctrl + F [D] Alt + Shift + F

58. ઈન્ટરનેટના ઉપયોગમાં લેવામાં આવતી દરેક ફાઈલ .... ની મદદથી એકબીજા સાથે જોડેલી હોય છે.

[A] હાઈપરલીંક [B] હાઈપરવર્ડ [C] હાઈપર ઍક્સેલ [D] હાઈપર નોટપેડ

59. વર્ડ એપ્લીકેશનમાં વારંવાર પુનરાવર્તીત થતા કામ માટે કયા ઑપ્શનનો સરળતાપૂર્વક ઉપયોગ કરી શકાય છે ?

[A] મેક્રો [B] ઓટોમેટીક [C] ઓટોઈફેક્ટ [D] ઓટો રાઈટર

60. વર્ડ એપ્લીકેશનમાં ઓપન ફાઈલને બંધ કરવા માટે કઈ શોર્ટકટ કી નો ઉપયોગ થાય છે ?

[A] Alt + F4 [B] Alt + F + O [C] Alt + F + N [D] Alt + F + C

61. સામાન્ય રીતે ઍક્સેલમાં એક બુકની અંદર કેટલી શીટ હોય છે ?

[A] 4 [B] 3 [C] 2 [D] 1

62. એક્સેલમાં ગાણિતીક પ્રક્રિયા કરવા માટે શરૂઆતમાં કયો સિમ્બોલ મૂકવામાં આવે છે ?

[A] ? [B] < [C] > [D] =

63. એક્સેલમાં આપણું કર્સર કયાં છે તે જોવા માટે કયા બારની જરૂર પડે છે ?

[A] ફોરમેટ બાર [B] ફોર્મ્યુલા બાર [C] ડેટા બાર [D] એક પણ નહિ

64. એક્સેલમાં બનાવેલ ટેબલની માહિતીને એસેન્ડીંગ ઑર્ડરમાં ગોઠવવા માટે કયા ઑપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે ?

[A] INDEX [B] START [C] SORT [D] DATA

65. એક્સેલમાં A2 નામના સેલમાં લખેલ લખાણમાં ફેરફાર કરવા માટે કઈ ફંકશન કી નો ઉપયોગ થાય છે ?

[A] F1 [B] F2 [C] F3 [D] F4

66. એક્સેલમાં એક કરતાં વધારે કૉલમને સિલેકટ કરવા કઈ કી પ્રેસ કરી રાખવી પડે છે ?

[A] Alt [B] Shift [C] Spacebar [D] Alt + Shift

67. એક્સેલમાં PIVOT TABLE WIZARD કેટલા સ્તરમાં પૂરું કરી શકાય છે ?

[A] 2 [B] 3 [C] 4 [D] 5

68. સામાન્ય રીતે એક્સેલમાં એક સેલની હાઈટ કેટલી હોય છે ?

[A] 12.75 [B] 13.75 [C] 14.75 [D] 15.75

69. એક્સેલમાં એક શીટમાંથી બીજી શીટમાં ડેટાની કોપી કરવા માટે પ્રથમ કયો સિમ્બોલ મૂકવો પડે છે ?

[A] $ [B] @ [C] # [D] &

70. એક્સેલમાં કરેલ ગાણિતીક પ્રક્રિયાઓની ફોર્મ્યુલા સંપૂર્ણપણે દૂર થાય તેને માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે ?

[A] CLEAR [B] FILL [C] SERIES [D] CUT

71. એકસેલમાં ડેટાને ફિલ્ટર કરવાની સરળ રીત કયા નામથી ઓળખાય છે ?

[A] AUTO FILTER [B] Advanced Filter

[C] FILTER [D] એક પણ નહિ

72. એકસેલમાં કોઈ ગાણિતીક પ્રક્રિયા કરતી વખતે નિર્ણાયાત્મક સ્થિતિ માટે કયા ફંકશનનો ઉપયોગ કરવામાં આવે છે ?

[A] Average [B] Sum [C] If [D] Count

73. એકસેલમાં ચોક્કસ પ્રકારના અંશે (ખૂણે) માહિતી લખવા કયા મેનુની જરૂર પડે છે ?

[A] FILE [B] FORMAT [C] EDIT [D] VIEW

74. એકસેલમાં શીટનું નામ બદલવા કયા ઑપ્શનની જરૂર પડે છે ?

[A] CUT [B] COPY [C] DELETE [D] RENAME

75. એકસેલમાં ચોક્કસ પ્રકારના ડેટા પ્રોટેકટ કરવા કયા ઑપ્શનનો ઉપયોગ થાય છે ?

[A] PROTECT [B] PROTECTION [C] SAVE [D] SAVE AS

76. સામાન્ય રીતે એકસેલમાં એક કોલમની પહોળાઈ (Width) કેટલી હોય છે ?

[A] 8.43 [B] 12.75 [C] 43.8 [D] 8.34

77. પાવરપૉઈન્ટમાં નીચેના પૈકી કઈ સુવિધાનો ઉપયોગ શકય છે ?

[A] Movie [B] Sound [C] Clipart [D] આપેલ તમામ

78. પાવરપૉઇન્ટ એપ્લીકેશનમાંથી બહાર નીકળવા કયા કમાન્ડનો ઉપયોગ થાય છે ?

[A] Alt + F + X [B] Alt + F + C [C] Alt + F + D [D] Alt + F + E

79. વર્કબુક એટલે .... નો સમૂહ.

[A] ફાઈલ [B] પત્ર [C] વર્કશીટ [D] તમામ

80. પાવરપૉઇન્ટમાં બનાવેલ એક ફાઈલની અંદર દરેકે દરેક સ્લાઈડમાં ચોક્કસ જગ્યાએ તારીખ અને સમય દર્શાવવા માટે કયા મેનુનો ઉપયોગ થાય છે ?

[A] VIEW [B] FILE [C] EDIT [D] HELP

81. પાવરપૉઇન્ટમાં બનાવેલ ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે ?

[A] .PPC [B] .PPPT [C] .PPT [D] .PXT

82. પાવરપૉઇન્ટ એપ્લીકેશનમાં કુલ કેટલા મેનુ હોય છે ?

[A] 9 [B] 8 [C] 7 [D] 10

83. એકસેલમાં ચોક્કસ પ્રકારની રો ને સંતાડવા માટે .... મેનુનો ઉપયોગ કરવામાં આવે છે.

[A] FILE [B] EDIT [C] VIEW [D] FORMAT

84. એકસેલમાં બનાવેલ માહિતીને એક જ ફિલ્ડ ઉપર ચોક્કસ પ્રકારના માળખામાં લેવા માટે .... ઑપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે.

[A] VIEW [B] INDEX [C] FILTER [D] એક પણ નહિ

85. એકસેલમાં લખાણને ત્રાંસા કરવા માટે કયા ઑપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે ?

[A] Ctrl + I [B] Ctrl + V [C] Ctrl + B [D] Ctrl + X

86. એકસેલમાં એક કરતાં વધારે કોલમની બરાબર વચ્ચે લખાણ લખવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે ?

[A] MERGE [B] CENTER [C] MACRO [D] MERGE and CENTER

87. એકસેલમાં આપોઆપ નંબર આવી જાય તેને માટે કયા ઑપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે ?

[A] AUTOFILL [B] AUTOFORM [C] AUTOLATE [D] AUTOMATIC

88. એકસેલમાં પાંચ વિષયના માર્કસનો કુલ સરવાળો શોધવા માટે કયા ફંકશનનો ઉપયોગ થાય છે ?

[A] SUM [B] TOTAL [C] COUNT [D] AVERAGE

89. પાવરપૉઇન્ટ એપ્લીકેશનમાં સ્લાઇડની અંદર રહેલા ચોક્કસ પ્રકારના લખાણને ઈફેકટ આપવા કયા ઑપ્શનની જરૂર પડે છે ?

[A] EFFECT [B] LAYOUT

[C] DESIGN [D] CUSTOM ANIMATION

90. એકસેલમાં કેટલા પ્રકારના ગ્રાફ દોરી શકાય છે ?

[A] 11 [B] 12 [C] 13 [D] 14

91. વર્ડ એપ્લીકેશનમાં કુલ કેટલા પ્રકારના BREAK ઑપ્શન હોય છે ?

[A] 1 [B] 8 [C] 7 [D] 5

92. વર્ડની કોઈપણ ફાઈલને માઉસની મદદથી ખોલવી હોય તો કેટલીવાર માઉસથી ક્લિક કરવી પડે છે ?

[A] 1 [B] 4 [C] 2 [D] 3

93. વર્ડ એપ્લીકેશનમાં સ્પેશ્યલ ફૉન્ટ ફોર્મેટીંગ ઈફેકટ કયા ઑપ્શનમાં જોવા મળે છે ?

[A] TEXT [B] BOOK [C] EFFECT [D] FONT

94. વર્ડ એપ્લીકેશનમાં Cut, Copy ઑપ્શન કયા મેનુમાં આવેલ હોય છે ?

[A] FILE [B] VIEW [C] FORMAT [D] EDIT

95. વર્ડ એપ્લીકેશનમાં બૉર્ડર બનાવવા માટે ઉપયોગમાં આવતું બૉર્ડર ટૂલ .... ટૂલબારમાં જોવા મળે છે.

[A] સ્ટાન્ડર્ડ [B] ફોરમેટ [C] ડ્રોઈંગ [D] એક પણ નહિ

96. વર્ડ એપ્લીકેશનમાં Cut કે Copy કરેલ માહિતી ક્યાં સ્ટોર થાય છે ?

[A] ક્લિપ બોર્ડ [B] ક્લિપઆર્ટ [C] વર્ડઆર્ટ [D] એક પણ નહિ

97. વર્ડ એપ્લીકેશનમાં નવું પેજ દાખલ કરવા માટે .... શોર્ટકટ કી નો ઉપયોગ થાય છે.

[A] Ctrl + Enter key [B] Alt + Enter key

[C] Shift + Enter key [D] Alt + Shift + Ctrl

98. વર્ડ એપ્લીકેશનમાં મેઇલ-મર્જ સંપૂર્ણપણે કરવા કેટલા સ્ટેપની જરૂર પડે છે ?

[A] 6 [B] 3 [C] 4 [D] 5

99. વર્ડમાં બિનજરૂરી અક્ષરોને દૂર કરવા કયા કમાન્ડનો ઉપયોગ થાય છે ?

[A] Backspace [B] Delete

[C] Backspace અને Delete બંને [D] એક પણ નહિ

100. વર્ડમાં છેલ્લે કરેલ ફેરફાર દૂર કરવા માટે .... ઑપ્શનનો ઉપયોગ થાય છે.

[A] REDO [B] READ [C] UNDO [D] DELETE

101. વર્ડમાં ખુલ્લી ફાઈલનું પ્રિન્ટ લેવા માટે .... ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે.

[A] ફોરમેટ [B] સ્ટાન્ડર્ડ [C] ટેબલ [D] એક પણ નહિ

102. વર્ડ એપ્લીકેશનમાં બનાવેલી ફાઈલનું એક્ષટેન્શન .... હોય છે.

[A] .EXE [B] .DOC [C] .XLS [D] .PPT

103. વર્ડ એપ્લીકેશનમાં સૌથી છેલ્લે આવેલ લાઈનને .... તરીકે ઓળખવામાં આવે છે.

[A] STATUS BAR [B] TITLE BAR [C] MENU BAR [D] TASK BAR

104. એકસેલમાં માહિતી ગુજરાતીમાં લખવા માટે .... ઑપ્શનમાં જવું પડે છે.

[A] FONT SIZE [B] FILTER [C] FONT [D] એક પણ નહિ

105. એકસેલમાં ન્યુમેરીક લખાણને ડાબી બાજુથી લખવા માટે .... સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવે છે.

[A] “ [B] ‘ [C] + [D] @

પ્રશ્ન 106 થી 140 **ઈન્ટરનેટ (CCC-03)** **45 Minutes**

106. ઈન્ટરનેટની શોધ કયા દેશે કરી ?

[A] ભારત [B] રશિયા [C] ચીન [D] અમેરિકા

107. સામાન્ય રીતે ચિત્રની ફાઈલના એક્ષટેન્શન માટે .... શબ્દનો ઉપયોગ થાય છે.

[A] GIF [B] GPJ [C] GAF [D] PDF

108. ઇ-મેઈલનું ઇન્ટરનેટના માધ્યમથી આદાન-પ્રદાન કરવા માટે .... નો ઉપયોગ થાય છે.

[A] POP [B] POMP [C] PIP [D] PSOT

109. વેબસાઈટના નામને કઈ રીતે ઓળખવામાં આવે છે ?

[A] URL [B] WEB [C] HTTP [D] એક પણ નહિ

110. ઇ-મેઇલમાં નીચે આપેલ શબ્દોમાંથી કયા શબ્દનો ઉપયોગ થતો નથી ?

[A] SEND [B] ATTACHMENT

[C] ROM [D] NEW MAIL

111. નીચે દર્શાવેલ નામમાંથી કયું નામ પ્રોટોકોલ તરીકે ઓળખાતું નથી ?

[A] TCP/IP [B] HTTP [C] FTP [D] www

112. સામાન્ય રીતે IP ADDRESS .... બીટ્સ (BITS) નો બનેલો હોય છે.

[A] 32 [B] 28 [C] 26 [D] 36

113. કોઈપણ દેશની લશ્કરની વેબસાઈટ માટે DOMAIN NAME કયા પ્રકારના ક્ષેત્રનો ઉપયોગ થાય છે ?

[A] .mil [B] .com [C] .las [D] .gov

114. .... એ બુલેટીન બોર્ડ સેવા પ્રકાની ઈન્ટરનેટ પરની પ્રખ્યાત સમાચાર સેવા તરીકે પ્રચલિત છે.

[A] USENET [B] USEMAIL [C] USEMET [D] USEINTERNET

115. ઈન્ટરનેટની મદદથી જે પણ ધંધાકીય વ્યવહારો શકય બન્યા છે તેને શું કહેવામાં આવે છે ?

[A] ઇ-ધંધો [B] ઇ-ગવર્નન્સ [C] ઇ-કોમર્સ [D] ઇ-મેઈલ

116. www.naukari.com વેબસાઈટ શેના માટે જાણીતી છે ?

[A] જીવનસાથી [B] પુસ્તકો [C] રોજગાર [D] સમાચાર

117. નીચેનામાંથી કયું વેબ બ્રાઉઝર નથી ?

[A] NEOPLANT [B] MOSAIC [C] OPERA [D] LYCOS

118. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વેબસાઈટનું નામ શું છે ?

[A] .dbaou [B] .baou [C] .dbaoua [D] .baoua

119. ઇ-મેઈલમાં કોઈ એક ફાઈલને જોડવી હોય તો તેને માટે કયા ઑપ્શનની જરૂર પડે છે ?

[A] BIDVU [B] ANOTHER [C] BIDAN [D] ATTACH MENT

120. સામાન્ય રીતે નેટવર્કમાં મધ્યસ્થ નિયંત્રકને .... તરીકે ઓળખવામાં આવે છે.

[A] HUB [B] HUBE [C] TEAM [D] CARD

121. એકબીજા સાથે સંકળાયેલ ઘટકોનો સમૂહ કયા નામથી ઓળખાય છે ?

[A] ગ્રુપ [B] રીંગ [C] નેટવર્ક [D] સમૂહ

122. કમ્પ્યૂટર નેટવર્ક સ્થાપિત કરવા કયા કાર્ડની જરૂર પડે છે ?

[A] LAN CARD [B] WAN CARD [C] NIC [D] MAN CARD

123. માહિતી પ્રત્યાયન માટેના નિયમોના ગણને કયા નામથી ઓળખાય છે ?

[A] કાયદો [B] રૂલ્સ [C] પ્રોટોકોલ [D] રેગ્યુલેશન

124. ઇન્ટરનેટના વિકાસમાં પાયાનું કામ કોણે કર્યું છે ?

[A] IBM [B] MicroSoft [C] Pentagon [D] Wipro

125. ઇન્ટરનેટમાં Mail ને લગતી માહિતી માટે કયા પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે ?

[A] PPP [B] FTP [C] SMTP [D] HTTP

126. USENET કોની સાથે સંબંધ ધરાવે છે ?

[A] E-mail [B] BBS [C] FTP [D] Telnet

127. amazon.com શાનું વેચાણ કરે છે ?

[A] કપડાં [B] બુકસ [C] પ્રવાસન [D] ઇન્ટરનેટ સેવા

128. નીચેના પૈકી કોણ શોધ ઍન્જિન નથી ?

[A] Yahoo [B] Opera [C] Google [D] Lycos

129. ભારતમાં કઈ કંપનીએ વાણિજ્ય હેતુ માટે ઇન્ટરનેટની સેવા શરૂ કરી ?

[A] VSNL [B] BSNL [C] DSNL [D] એક પણ નહિ

130. ઇ-કોમર્સમાં બિઝનેસ ટુ બિઝનેસને ટૂંકમાં કઈ રીતે ઓળખવામાં આવે છે ?

[A] B2C [B] B2B [C] B TO C [D] B TO B

131. એક સેકન્ડમાં આશરે ૧૦૦૦ બિટ્સની ઝડપ માપવા માટેનો એકમ કયા નામથી ઓળખાય છે ?

[A] GBPS [B] MBPS [C] KBPS [D] એક પણ નહિ

132. ઇન્ટરનેટ જોડવા માટે .... ની જરૂર પડે છે.

[A] CABLE [B] MOUSE [C] SCANNER [D] YAHOO

133. વેબસાઈટ નિહાળતા પ્રથમ જે પેજ આવે છે તે પેજ કયા નામથી ઓળખાય છે ?

[A] HOME PAGE [B] FIRST PAGE
[C] FRONT PAGE [D] FRONT LINE

134. નીચેનામાંથી કઈ ટોપોલોજીનો સમાવેશ નેટવર્ક ટોપોલોજીમાં થાય છે ?

[A] વાય ટોપોલોજી [B] બસ ટોપોલોજી
[C] લેન ટોપોલોજી [D] અમેરિકન ટોપોલોજી

135. ઇન્ટરનેટમાં કોઈપણ વેબપેજને રીફ્રેશ કરવા માટે કઈ ફંકશન કી નો ઉપયોગ થાય છે ?

[A] F1 [B] F5 [C] F3 [D] F2

136. નીચેની કઈ સાઈટ પોતાના ગ્રાહકોને માલ-સામાનની ઑનલાઈન હરાજી કરવાની સગવડ પૂરી પાડે છે ?

[A] YAHOO [B] GOOGLE [C] eBay [D] AMAZON

137. Network ને મુખ્ય કેટલા પ્રકાર છે ?

[A] એક [B] બે [C] ત્રણ [D] ચાર

138. HTTP નું પૂરું નામ શું છે ?

[A] Hyper Text Transfer Program [B] Hyper Text Transfer Protocol
[C] Hyper Text Tools Program [D] Hyper Text Program

139. ડેટા પ્રત્યાયનની ઝડપ માટે .... એકમ વપરાય છે.

[A] bps [B] mvp [C] mb [D] gb

140. ઇન્ટરનેટની મદદથી થતા ધંધાકીય વ્યવહારોને .... કહે છે.

[A] કોમર્સ [B] વ્યાપાર [C] ઈલેક્ટ્રૉનિક કોમર્સ [D] એક પણ નહિ

જવાબો કસોટીપત્ર – 1

1.	C	29.	C	57.	D	85.	A	113.	A
2.	B	30.	B	58.	A	86.	D	114.	A
3.	A	31.	B	59.	A	87.	A	115.	C
4.	B	32.	B	60.	D	88.	A	116.	C
5.	D	33.	A	61.	B	89.	D	117.	D
6.	B	34.	D	62.	D	90.	D	118.	B
7.	A	35.	A	63.	B	91.	C	119.	D
8.	A	36.	A	64.	C	92.	C	120.	A
9.	B	37.	B	65.	B	93.	D	121.	C
10.	C	38.	A	66.	B	94.	D	122.	C
11.	B	39.	A	67.	B	95.	B	123.	C
12.	B	40.	C	68.	A	96.	A	124.	C
13.	C	41.	C	69.	A	97.	A	125.	C
14.	C	42.	B	70.	A	98.	A	126.	B
15.	B	43.	A	71.	A	99.	C	127.	B
16.	B	44.	C	72.	C	100.	C	128.	B
17.	C	45.	A	73.	B	101.	B	129.	A
18.	D	46.	C	74.	D	102.	B	130.	B
19.	D	47.	A	75.	B	103.	A	131.	C
20.	A	48.	A	76.	A	104.	C	132.	A
21.	C	49.	B	77.	D	105.	B	133.	A
22.	C	50.	B	78.	A	106.	D	134.	B
23.	C	51.	A	79.	C	107.	A	135.	B
24.	D	52.	C	80.	A	108.	A	136.	C
25.	B	53.	B	81.	C	109.	A	137.	C
26.	B	54.	A	82.	A	110.	C	138.	B
27.	D	55.	C	83.	D	111.	D	139.	A
28.	C	56.	A	84.	C	112.	A	140.	C

વિભાગ-3 Theory Paper

કસોટીપત્ર-2

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ

સત્રાંત પરીક્ષા

સમય : 3 કલાક **કુલ ગુણ : 140**

પાઠ્યક્રમ : ફાઉન્ડેશન [CCC-01], એપ્લીકેશન [CCC-02], ઈન્ટરનેટ [CCC-03]

પ્રશ્ન 1 થી 35 **ફાઉન્ડેશન (CCC-01)** **45 Minutes**

1. કમ્પ્યૂટરમાં સી.પી.યુ.ની વિશેષતા .... છે.

   [A] ઉચ્ચ કાર્યક્ષમતા [B] સુસંગતતા [C] વિસ્તરણ [D] આપેલ તમામ

2. .... આઉટપુટ ડિવાઇસ નથી.

   [A] પ્રિન્ટર [B] પ્લોટર [C] સ્પીકર [D] કી-બોર્ડ

3. નોટપેડ એપ્લીકેશનમાં કોઈ માહિતીની કોપી કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે?

   [A] CTRL + C [B] CTRL + B [C] CTRL + V [D] CTRL + X

*4. C ડ્રાઇવમાં રહેલી બધી ફાઈલો તથા ફોલ્ડરોને હારબંધ જોવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે?

   [A] DIR [B] DIR/S [C] DIR/W [D] DIR/L

5. CRT નું પૂરું નામ શું છે?

   [A] કેથોડ રે ટ્યૂબ [B] કેમિકલ રે ટ્યૂબ [C] કેથોડ રેડ ટીમવર્ક [D] કેથોડ રે ટીમવર્ક

6. W3 સામાન્ય રીતે કેવી રીતે ઓળખવામાં આવે છે?

   [A] WEB [B] WEP [C] WAB [D] WAP

7. બમણી ઘનતા ધરાવતી ફ્લોપી ડીસ્કમાં .... Track/Inch હોય છે.

   [A] 40 TPI [B] 48 TPI [C] 50 TPI [D] 60 TPI

8. ડોસમાં બનાવેલ ફાઈલમાં સુધારા વધારા કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે?

   [A] COPY [B] ERASE [C] CANCEL [D] એક પણ નહિ

9. વિન્ડોઝમાંથી બહાર નીકળવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે ?

   [A] ALT + F4 [B] CTRL + F4 [C] ALT + F5 [D] CTRL + F5

10. નીચેનામાંથી કઈ ચાલક પદ્ધતિ નથી?

   [A] Linux [B] MAC [C] WORD [D] WINDOWS

*નોંધ : * (એસ્ટ્રીક) નિશાની સાથેના પ્રશ્નો આંબેડકર યુનિવર્સિટીના વિવિધ પેપરોમાં વારંવાર પૂછાય છે.*

11. .... એ બાષ્પીભૂત સંગ્રાહક તરીકે ઓળખાય છે.

[A] ROM [B] Floppy [C] Hard Disk [D] RAM

12. નીચે જણાવેલ કયા સોફ્ટવેરનો સમાવેશ ડેટા એનાલીસ સ્પ્રેડશીટમાં કરવામાં આવ્યો છે?

[A] DB2 [B] VENTURA [C] MS-WORD [D] SCO PROFESSIONAL

13. DOS માં ફોલ્ડરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ?

[A] ફાઈલ [B] બેચ ફાઈલ [C] ડિરેક્ટરી [D] એક પણ નહિ

14. વિન્ડોઝમાં નવો પ્રોગ્રામ Add કરવા માટે કયા વિકલ્પમાં જવું પડે છે ?

[A] WINDOWS [B] CONTROL PANEL [C] FILE [D] FONT

15. Title Bar પર નીચેનામાંથી કયું બટન હોય છે?

[A] Scrollbar [B] Minimize [C] Option [D] Check

16. Firmware શાનો ભાગ છે?

[A] CU [B] ALU [C] રજીસ્ટર [D] બાહ્ય સંગ્રાહક

17. નીચેના પૈકી કોનો વિસ્તાર સૌથી વધુ હોય છે?

[A] LAN [B] WAN [C] MAN [D] DAN

18. ઉચ્ચ ઘનતા ધરાવતી 3.5" ફ્લોપી ડ્રાઇવની સંગ્રહણ ક્ષમતા .... હોય છે.

[A] 1.2 MB [B] 1.44 MB [C] 2.88 MB [D] 750 KB

19. સ્ક્રીન સ્ક્રોલિંગને કામચલાઉ અટકાવવા કઈ કીનો ઉપયોગ થાય છે?

[A] STOP [B] PAUSE [C] END [D] SHIFT

20. બ્લેક એન્ડ વ્હાઇટ મોનિટર કયા નામથી ઓળખાય છે?

[A] Mono vga [B] Mono Crome [C] Mono Disk [D] Mono System

21. DVD સામાન્યતઃ ઓછામાં ઓછો એકસેસ દર .... ધરાવે છે.

[A] 50 Kbps [B] 6.3 Mbps [C] 60 Kbps [D] 9.3 Mbps

22. HYBRID પ્રકારના કમ્પ્યૂટરને કેવા પ્રકારના કમ્પ્યૂટર તરીકે પણ ઓળખવામાં આવે છે?

[A] મિશ્ર [B] ડીઝીટલ [C] એનાલોગ [D] એક પણ નહિ

23. COMMAND LINE INTERFACE ને ટૂંકમાં .... તરીકે પણ ઓળખવામાં આવે છે.

[A] CLI [B] CLR [C] CLA [D] એક પણ નહિ

24. નોટપેડમાં ફાઈલ ખોલવા માટેની શોર્ટકટ કી .... છે.

[A] CTRL + O [B] CTRL + N [C] ALT + N [D] ALT + O

25. ટેપ ડ્રાઇવમાં ડેટા કયા સ્વરૂપે લખાય છે?

[A] ANALOG [B] DIGITAL [C] HYBRID [D] એક પણ નહિ

26. સ્થાયી RAM ને .... તરીકે ઓળખવામાં આવે છે.
    [A] STATIC RAM [B] STANDARD RAM [C] SIMPLE RAM [D] SINGLE RAM
27. નીચેનામાંથી .... નો સમાવેશ ઈનપુટ ડિવાઇસ તરીકે થતો નથી.
    [A] કી-બોર્ડ [B] લાઇટ પેન [C] સ્ક્રીન(મોનીટર) [D] ટ્રેકબોલ
28. IBM નું પૂરું નામ શું છે?
    [A] International Business Mask [B] International Business Machine
    [C] International Binary Mask [D] International Board Mask
29. કી-બોર્ડમાં કુલ .... ફંકશન કી આવેલી હોય છે.
    [A] 8 [B] 10 [C] 12 [D] 14
30. હાર્ડડિસ્કની સરેરાશ ગતિ .... હોય છે.
    [A] 3600 rmp [B] 300 rmp [C] 300 rmp [D] 360 rmp
31. જોય સ્ટીકનો સમાવેશ કયા સાધનોમાં કરવામાં આવ્યો છે?
    [A] બહિર્વેશ સાધનો [B] આગમન સાધનો [C] નિર્વેશ સાધનો [D] એક પણ નહિ
32. લાઈન પ્રિન્ટર એક મિનિટમાં ઓછામાં ઓછી કેટલી લાઈન પ્રિન્ટ કરી શકે છે?
    [A] 500 [B] 400 [C] 600 [D] 700
33. વિન્ડોઝમાં વોલપેપરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
    [A] સ્ક્રીન સેવર [B] બેકગ્રાઉન્ડ [C] સેટિંગ્સ [D] એક પણ નહિ
34. Wordpad માં તૈયાર કરેલ ફાઈલ પાછળ કયું એક્ષટેન્શન લગાડવામાં આવે છે?
    [A] .FIL [B] .DOC [C] .EXE [D] .WRD
35. MS-DOS માં કોઈપણ કમાન્ડ વિશે વધુ માહિતી મેળવવા માટે કમાન્ડના નામ પછી .... સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે.
    [A] ! [B] # [C] $ [D] ?

પ્રશ્ન 36 થી 105 **એપ્લીકેશન (CCC-02)** **90 Minutes**

---

36. વર્ડ એપ્લીકેશનમાં બે લાઈન વચ્ચેનું અંતર વધારવા ઘટાડવા માટે .... ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે.
    [A] FONT [B] LINE [C] PARAGRAPH [D] SPACE
*37. વર્ડ એપ્લીકેશનમાં નવું પેજ દાખલ કરવા માટે .... શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે.
    [A] Ctrl + Enter key [B] Alt + Enter key
    [C] Shift + Enter key [D] Alt + Shift + Ctrl

38. વર્ડ એપ્લીકેશનમાં બનાવેલી ફાઈલને સેવ કરવા માટે .... શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે.

[A] Ctrl + O [B] Ctrl + S [C] Alt + S [D] Alt + O

39. વર્ડ એપ્લીકેશનમાં બનાવેલી ફાઈલને જોવા માટે .... શોર્ટ કીનો ઉપયોગ થાય છે.

[A] Ctrl + C [B] Ctrl + V [C] Ctrl + O [D] Ctrl + Z

*40. વર્ડ એપ્લીકેશનમાં Spell Check કરવા માટે .... ફંકશન કીનો ઉપયોગ થાય છે.

[A] F1 [B] F2 [C] F7 [D] F4

41. વર્ડ એપ્લીકેશનમાં લાલ રંગની લાઈનવાળા શબ્દ પર માઉસનું જમણું બટન Press કરતાં કયા શબ્દની યાદી બનાવતું શોર્ટકટ મેનુ બતાવે છે?

[A] સમાનાર્થી [B] ગ્રામર [C] સાચા [D] ખોટા

*42. વર્ડ એપ્લીકેશનમાં કુલ કેટલા પ્રકારના Break ઓપ્શન હોય છે?

[A] 7 [B] 8 [C] 6 [D] 5

*43. વર્ડ એપ્લીકેશનમાં ટેબલ મેનુમાં કોઈપણ Formula .... નિશાની સાથે જ શરૂ થાય છે.

[A] = [B] + [C] \ [D] /

44. વર્ડ એપ્લીકેશનમાં મેઈલ–મર્જ સંપૂર્ણપણે કરવા કેટલા સ્ટેપની જરૂર પડે છે? (MS-WORD 2003 મુજબ 6 Steps)

[A] 3 [B] 2 [C] 1 [D] 5

*45. સામાન્ય રીતે એકસેલમાં એક બુકની અંદર કેટલી શીટ આવેલી હોય છે?

[A] 4 [B] 3 [C] 2 [D] 1

46. એકસેલમાં ગાણિતિક પ્રક્રિયા કરવા માટે શરૂઆતમાં કયો સિમ્બોલ મૂકવામાં આવે છે ?

[A] ? [B] < [C] > [D] એક પણ નહિ

*47. એકસેલમાં આપોઆપ નંબર આવી જાય તેને માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે?

[A] AUTO FILE [B] AUTO FORM [C] AUTO LATE [D] AUTOMATIC

48. એકસેલમાં ચારથી પાંચ ફાઇલો ખુલ્લી હોય અને તે બધી જ ફાઇલોને એક જ ઓપ્શન થકી સેવ કરવામાં આવે તો તે ફાઇલનું એક્ષ્ટેન્શન શું હોય છે?

[A] .XLS [B] .XLM [C] .XLB [D] .XLW

49. એકસેલમાં સૌથી છેલ્લા સેલનું એડ્રેસ શું હોય છે?

[A] A65536 [B] IV1 [C] IV65536 [D] V65536

50. એકસેલમાં ગ્રાફ [Chart] માટેનો કમાન્ડ કયા મેનુમાં આવેલો છે ?

[A] View [B] Format [C] Tools [D] Insert

*51. સામાન્ય રીતે એકસેલમાં એક સેલની હાઇટ કેટલી હોય છે?

[A] 15.75 [B] 13.75 [C] 14.75 [D] એક પણ નહિ

52. એકસેલમાં સરેરાશ શોધવા માટે કયા ફંકશનનો ઉપયોગ થાય છે?

[A] AVERAGE [B] TOTAL [C] COUNT [D] SUM

53. એકસેલમાં ચોક્કસ પ્રકારની રો ને સંતાડવા માટે .... મેનુનો ઉપયોગ કરવામાં આવે છે.

[A] FILE [B] EDIT [C] VIEW [D] FORMAT

*54. એકસેલમાં ન્યુમેરિક લખાણને ડાબી બાજુથી લખવા માટે .... સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવે છે.

[A] " [B] ' [C] + [D] @

*55. વર્ડ એપ્લીકેશનમાંથી બહાર નીકળવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે?

[A] ALT + F + X [B] ALT + F + C [C] ALT + F + D [D] ALT + F + E

56. પાવરપોઇન્ટ એપ્લીકેશનમાં કેટલા પ્રકારના લે-આઉટ જોવા મળે છે?

[A] 20 [B] 24 [C] 21 [D] 25

57. MS-Word ની ફાઇલમાંથી કોઈ ચોક્કસ શબ્દ શોધવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે?

[A] Find [B] Paste [C] Go To [D] HyperLine

58. Textbox .... મેનુમાંથી ઈન્સર્ટ કરાવી શકાય છે.

[A] FORMAT [B] TOOLS [C] EDIT [D] INSERT

59. ટેબલમાં વધારાની ROW ઉમેરવા માટે .... Menu માં જવું પડે છે.

[A] Format [B] File [C] Insert [D] Table

60. Macro બનાવવા માટે .... મેનુનો ઉપયોગ કરવો પડે છે.

[A] Insert [B] Macro [C] Format [D] એક પણ નહિ

61. વર્ડમાં લખાણની Copy કરવા માટે .... ઓપ્શન હોય છે.

[A] Cut [B] Copy [C] Copy Matter [D] Save

62. શોર્ટકટ કી CTRL + B ના ઉપયોગથી લખાણને .... કરી શકાય છે.

[A] BLACK [B] BLUE [C] BOLD [D] BROWN

63. Excel માં Range નું નામ વધુમાં વધુ .... અક્ષરોનું હોઈ શકે.

[A] 255 [B] 256 [C] 8 [D] 11

64. પાવરપૉઈન્ટમાં Slide Layout જોવા માટેનો કમાન્ડ કયા મેનૂમાં આવેલો છે?

[A] View [B] Insert [C] Format [D] Tools

*65. Drag અને Drop પદ્ધતિથી પસંદ કરેલ Text ને ખસેડતી વખતે .... કી Press કરી રાખવી જરૂરી છે.

[A] ^ [B] Alt [C] ^ અથવા Alt [D] એક પણ નહિ

66. વર્ડમાં Default Marging ઉપરની તરફ કેટલું હોય છે?

[A] 1" [B] 1.50" [C] 1.25" [D] 2"

67. વર્ડમાં આવેલ .... વિકલ્પ ઓબ્જેક્ટને વર્ટીકલી શીશાત્મક અસર આપવા મદદ કરે છે.

[A] ફ્લિપ [B] રોટેટ [C] ટર્ન [D] એક પણ નહિ

68. Mail Merge માં નીચેનામાંથી કોનો ઉપયોગ ડેટા સોર્સ તરીકે થાય છે?

[A] DBASE [B] FOXPRO [C] Access [D] આપેલ તમામ

69. Theme ડાયલોગ બોક્સ કેટલા Option બતાવે છે?

[A] એક [B] બે [C] ત્રણ [D] ચાર

70. સ્પ્રેડશીટમાં 27 માં સ્તંભને .... થી ઓળખાય છે.

[A] CA [B] DD [C] AA [D] FB

71. Cell A1 અને B2 ની ક્મિંતનો સરવાળો કરવા માટે .... સૂત્રનો ઉપયોગ થાય.

[A] A1–B2 [B] A1+B2 [C] =A1–B2 [D] =A1+B2

72. નીચેનામાંથી કયા કન્ટ્રોલનો સમાવેશ ડાયલોગ બોક્સમાં થતો નથી?

[A] લિસ્ટ બોક્સ [B] લંબચોરસ બોક્સ [C] બટન્સ [D] ચેક બોક્સ

73. વર્ડમાં Undo કમાન્ડથી થયેલ ફેરફાર દૂર કરવા માટે .... ઓપ્શનનો ઉપયોગ થાય છે.

[A] REDO [B] READ [C] Clear [D] DELETE

74. વર્ડમાં લખેલ લખાણના ફોન્ટ મોટા કરવા માટે .... શોર્ટકટ કી નો ઉપયોગ થાય છે.

[A] Shift + Ctrl + < [B] Shift + Ctrl + >

[C] Alt + Ctrl + < [D] એક પણ નહિ

75. વર્ડ એપ્લીકેશનમાં પિક્ચર દાખલ કરવા માટે .... ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે.

[A] ક્લિપઆર્ટ [B] ફાઇલ [C] ચિત્ર [D] એક પણ નહિ

76. વર્ડ એપ્લીકેશનમાં શબ્દાકૃતિની આકર્ષક રજૂઆત .... ઓપ્શનની મદદથી થાય છે.

[A] CLIP [B] WORDART [C] FILE [D] WORD CREATE

77. વર્ડ એપ્લીકેશનમાં ઓપન ડોક્યુમેન્ટની છેક નીચેના ભાગ સુધી પહોંચવા કઈ કીનો ઉપયોગ કરવો પડે છે ?

[A] CTRL + HOME [B] CTRL + END [C] ALT + END [D] CTRL + PAGE UP

78. પાવરપોઈન્ટમાં ઓપન પ્રેઝન્ટેશનને બંધ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે?

[A] Alt+F+O [B] Alt+F+C [C] Alt+F+V [D] Ctrl+F+C

79. એકસેલમાં સામાન્ય રીતે સેલની Width કેટલી હોય છે ?

[A] 8.42 [B] 8.43 [C] 12.75 [D] 8.75

80. એકસેલમાં લખાણને ત્રાંસું કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે ?

[A] Ctrl + I [B] Ctrl + V [C] Ctrl + B [D] Ctrl + X

*81. એકસેલમાં A3 નામના સેલમાં લખેલ લખાણમાં ફેરફાર કરવા માટે કઈ ફંકશન કીનો ઉપયોગ થાય છે?

[A] F1 [B] F2 [C] F3 [D] F4

82. એકસેલમાં એક કરતાં વધારે કોલમને સિલેકટ કરવા કઈ કી પ્રેસ કરી રાખવી પડે છે?

[A] Alt [B] Shift [C] Spacebar [D] Alt + Shift

*83. એકસેલમાં PIVOT TABLE WIZARD કેટલા સ્તરમાં પૂરું કરી શકાય છે?

[A] 2 [B] 3 [C] 4 [D] 5

84. એકસેલ બીજા કયા નામથી ઓળખાય છે?

[A] WORD [B] ACCESS [C] AUTO [D] SPREAD SHEET

85. એકસેલમાં ચોક્કસ પ્રકારના ડેટા પ્રોટેકટ કરવા કયા મેનુનો ઉપયોગ થાય છે?

[A] Edit [B] Tools [C] Insert [D] Format

86. પાવરપોઇન્ટ એપ્લીકેશનમાં એકના જેવી જ બીજી સ્લાઇડ બનાવવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે?

[A] Ctrl+D [B] Alt+D [C] Shift+D [D] Ctrl+Alt+D

*87. પાવરપોઇન્ટમાં બનાવેલ ફાઇલનું એક્ષ્ટેન્શન શું હોય છે?

[A] .BMP [B] .PPPT [C] .PPT [D] .PXT

88. પાવરપોઇન્ટ એપ્લીકેશનમાં કુલ કેટલા મેનુ હોય છે?

[A] 9 [B] 8 [C] 7 [D] 10

89. વર્ડમાં માહિતી ગુજરાતીમાં લખવા માટે .... ઓપ્શનમાં જવું પડે છે.

[A] FONT SIZE [B] FILTER [C] FONT [D] એક પણ નહિ

90. એકસેલમાં વર્કશીટ ટેબનો ઉપયોગ જણાવો.

[A] ફાઈલને ઓપન કરવા [B] ફાઈલને સેવ કરવા

[C] એક વર્કશીટમાંથી બીજી વર્કશીટમાં જવા [D] આપેલ તમામ

*91. વર્ડ એપ્લીકેશનમાં બોર્ડર બનાવવા માટે ઉપયોગમાં આવતું બોર્ડર ટૂલ .... ટૂલબારમાં જોવા મળે છે.

[A] સ્ટાન્ડર્ડ [B] ફોરમેટ [C] ડ્રોઇંગ [D] એક પણ નહિ

*92. વર્ડ એપ્લીકેશનમાં અલાઇમેન્ટ સેટ કરવા માટે કયા ઓપ્શનમાં જવું પડે છે?

[A] TEXT [B] BOOK [C] FONT [D] PARAGRAPH

93. ઈન્ટરનેટના ઉપયોગમાં લેવામાં આવતી દરેક ફાઈલ .... ની મદદથી એકબીજા સાથે જોડેલી હોય છે.

[A] હાઈપરલીંક [B] હાઈપરવર્ડ [C] હાઈપરએકસેલ [D] હાઇપરરેન્જ

94. એકસેલ પ્રોગ્રામની વિન્ડોઝની પ્રથમ લાઈનને .... બાર તરીકે ઓળખવામાં આવે છે.

[A] ટાઇટલ [B] મેનુ [C] સ્ટેટસ [D] સ્ક્રોલ

95. ફાઈલની માહિતીને Organize કરતી વખતે .... Veiw ની જરૂર પડે છે.

[A] NORMAL [B] WEB & LAYOUT [C] PRINT LAYOUT [D] OUTLINE

96. નીચેનામાંથી કઈ વસ્તુ મેઈલ-મર્જ કમાન્ડથી થતી નથી ?

[A] Thesaurus [B] Spelling & Grammer

[C] Word Count [D] એક પણ નહિ

97. MS-EXCEL માં સિલેકટ કરેલ સેલમાં કન્ટેન્સની કોપી કરવા કયો કમાન્ડ ઉપયોગી છે?

[A] ફીલ [B] કોપી [C] ક્લિયર [D] એક પણ નહિ

98. એકસેલમાં .... ફંકશન દ્વારા આપેલ કિંમતોનો ગુણાકાર મેળવી શકાય છે.

[A] MOD() [B] MUL() [C] PRODUCT() [D] SUM()

99. .... ફંકશન આપેલ સંખ્યા પ્રમાણે અઠવાડિયામાં આવતો દિવસ જવાબ સ્વરૂપે આપે છે.

[A] NOW() [B] TODAY() [C] WEEKDAY() [D] DAY()

100. સેલમાં બાય ડીફોલ્ટ ટેક્સ્ટ .... બાજુ લખાય છે.

[A] ડાબી [B] જમણી [C] વચ્ચે [D] ઉપર તરફ

101. =ROUND(1522.1990,2) નો જવાબ .... મળશે.

[A] 1522.19 [B] 1522.1990 [C] 1522 [D] 1522.20

102. તમારું માહિતીપત્ર Printing વખતે કેવું દેખાશે તે જોવા માટે .... કમાન્ડ છે.

[A] Page Setup [B] Setup [C] Print Preview [D] Print area

103. વર્ડમાં ફાઇલનું નામ વધુમાં વધુ .... અક્ષરોનું લખી શકાય છે.

[A] 255 [B] 64 [C] 256 [D] 8

104. એકસેલમાં ડેટાને ક્રમમાં ગોઠવવા માટે મહત્તમ .... કળનો ઉપયોગ કરી શકાય છે.

[A] બે [B] ત્રણ [C] પાંચ [D] ચાર

105. પાવરપોઇન્ટમાં F5 ફંકશન કી નો ઉપયોગ શું છે?

[A] ફાઇલ બંધ કરવા [B] ફાઇલ ખોલવા

[C] ફાઇલને બદલવા [D] પ્રેઝન્ટેશન Run કરવા માટે

પ્રશ્ન 106 થી 140 **ઈન્ટરનેટ (CCC-03)** **45 Minutes**

106. નીચે દર્શાવેલ નામમાંથી કયું નામ પ્રોટોકોલ તરીકે ઓળખાતું નથી?

[A] TCP/IP [B] HTTP [C] FTP [D] URL

*107. સામાન્ય રીતે IP ADDRESS .... BITS (બિટ્સ) નો બનેલો હોય છે.

[A] 32 [B] 28 [C] 26 [D] 36

108. સરકારી વેબસાઇટ માટે Domain Name ના કયા પ્રકારના ક્ષેત્રનો ઉપયોગ થાય છે?
   [A] .mil [B] .com [C] .las [D] .gov
109. ઈંગ્લેન્ડ દેશની વેબસાઇટમાં છેલ્લે કયા પ્રકારના નામનો ડોમેઇન તરીકે ઉપયોગ થાય છે?
   [A] .in [B] .au [C] .uk [D] .de
110. દુનિયાની કોઈપણ એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે નિર્ધારિત સમયમાં ઈન્ટરનેટના માધ્યમથી વાતચીત કરી શકે તે પ્રક્રિયાને શું કહે છે?
   [A] ઈ-મેઈલ [B] કોન્ફરન્સિંગ [C] સિસ્ટમ [D] ક્લિપીંગ
111. નીચેનામાંથી કયો ઈ-કોમર્સનો પ્રકાર નથી?
   [A] B2C [B] B2B [C] C2C [D] C2D
112. કોઈપણ વેબસાઇટ નિહાળવા અંગત કમ્પ્યૂટર પર કેવા પ્રકારના સોફ્ટવેરની જરૂર પડે છે?
   [A] કમ્યુનિકેશન [B] ટેસ્ટીંગ પાથ [C] વેબ બ્રાઉઝર [D] એમ.એસ.વર્ડ
113. આખા વિશ્વમાં પુસ્તકોનું વધુમાં વધુ ઈન્ટરનેટની મદદથી વેચાણ કરતી વેબસાઇટ કઈ છે?
   [A] AMAZON [B] AMAZAN [C] AMEZON [D] AMAZEN
114. ફાઇબર ઓપ્ટિક વાયરમાં પ્રત્યાયનની ઝડપ વધુમાં વધુ .... MBPS જેટલી મળે છે.
   [A] 100 [B] 1000 [C] 10000 [D] 100000
115. APRA નામની સંસ્થાએ કઈ તારીખે કમ્પ્યૂટરનો નેટવર્કનો પ્રોજેક્ટ હાથ ધરવાની શરૂઆત કરી?
   [A] 02-04-2969 [B] 02-02-1969 [C] 02-03-1969 [D] 02-01-1969
*116. સામાન્ય રીતે ચિત્રની ફાઇલના એક્ષ્ટેન્શન માટે .... શબ્દનો ઉપયોગ થાય છે.
   [A] .GIF [B] .GPJ [C] .GAF [D] .PDF
117. ઇ-મેઈલનું ઈન્ટરનેટના માધ્યમથી આદાન-પ્રદાન કરવા માટે .... નો ઉપયોગ થાય છે.
   [A] POP [B] POMP [C] PIP [D] PSOT
118. ઈ-મેઇલમાં નીચે આપેલ શબ્દોમાંથી એક શબ્દનો ઉપયોગ થતો નથી ?
   [A] SEND [B] ATTACHMENT [C] Backup [D] NEW MAIL
119. આપણી ઉપર આવેલ ઈ-મેઈલને તરત જ જવાબ આપવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે?
   [A] SEND [B] REPLY [C] ATTRIB [D] OK
120. ઈ-કોમર્સમાં બિઝનેશ ટુ કસ્ટમરને ટૂંકમાં કઈ રીતે ઓળખવામાં આવે છે?
   [A] B2C [B] B2B [C] BTOC [D] BTOB
*121. એક સેકન્ડમાં આશરે 1000 બિટ્સની ઝડપ માપવા માટેનો એકમ કયા નામથી ઓળખાય છે?
   [A] GBPS [B] MBPS [C] KBPS [D] એક પણ નહિ

122. ISP નું પૂરું નામ શું છે?

[A] Internet Soft Product [B] Internet Service Providers

[C] Internet Spot Process [D] એક પણ નહિ

123. ઈન્ટરનેટ જોડવા માટે .... ની જરૂર પડે છે.

[A] CABLE [B] MOUSE [C] SCANNER [D] YAHOO

124. સામાન્ય રીતે LAN પ્રકારના નેટવર્કમાં કમ્પ્યૂટરો વચ્ચેનું ઓછામાં ઓછું અંતર .... મીટરનું હોય છે.

[A] 10 [B] 100 [C] 1000 [D] 10000

125. .... ને કમ્પ્યૂટર નેટવર્કના નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે.

[A] ઈન્ટ્રાનેટ [B] ઈન્ફ્રારેડ [C] ઈન્ટરનેટ [D] બ્લ્યુ ટુથ

126. ધંધાકીય વેબસાઇટ માટે DOMAIN NAME તરીકે કયા પ્રકારનો ઉપયોગ થાય છે ?

[A] .mil [B] .com [C] .las [D] .gov

127. ભારત દેશની વેબસાઈટમાં છેલ્લે કયા પ્રકારના નામનો ડોમેઈન તરીકે ઉપયોગ થાય છે?

[A] .in [B] .au [C] .uk [D] .de

128. નીચેનામાંથી કયો પ્રોટોકોલ વેબસર્વર અને વેબ કલાયન્ટ વચ્ચે માહિતી-સંચાર માટેનો પ્રોટોકોલ છે ?

[A] TCP/IP [B] TCP [C] HTTP [D] એક પણ નહિ

129. નીચેનામાંથી કયુ સોફ્ટવેર શોધ એન્જિન નથી?

[A] YAHOO [B] GOOGLE

[C] LYCOS [D] INTERNET EXPLORER

130. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વેબસાઇટનું નામ શું છે?

[A] www.dbaou.org [B] www.baou.org [C] www.dbaoua.com [D] www.Baoua.org

*131. ઈ-મેઈલમાં કોઈ એક ફાઇલને જોડવી હોય તો તેને માટે કયા ઓપ્શનની જરૂર પડે છે?

[A] And [B] ANOTHER [C] BIDAN [D] ATTACHMENT

132. સામાન્ય રીતે નેટવર્કમાં મધ્યસ્થ નિયંત્રકને .... તરીકે ઓળખવામાં આવે છે.

[A] HUB [B] HUBE [C] TEAM [D] CARD

133. ઈન્ટરનેટમાં કોઈપણ વેબ પેજને રિફ્રેશ કરવા માટે કઈ ફંકશન કીનો ઉપયોગ થાય છે?

[A] F1 [B] F5 [C] F3 [D] F2

134. નીચેનામાંથી કયું ઈ-મેઈલ કલાયન્ટ તરીકે જાણીતું સોફ્ટવેર છે?

[A] આઉટલુક એક્ષપ્રેસ [B] આઉટ એક્ષપ્રેસ [C] આઉટઈન એક્ષપ્રેસ

[D] આઉટલુક નેટસ્કેપ

135. ઈન્ટરનેટનું અસરકારક સંચાલન કઈ સંસ્થાઓ કરે છે ?

[A] IETF તથા IRTF [B] Inter NIC [C] ICANN [D] આપેલ તમામ

136. www.eBay.com વેબસાઇટ શેના માટે જાણીતી છે?

[A] જીવનસાથી [B] પુસ્તકો [C] ઓનલાઈન હરાજી [D] સમાચાર

137. ઈ-મેઈલમાં એક કરતાં વધારે વ્યક્તિઓને મેઈલ મોકલવા માટે કયો ઓપ્શન આપેલ છે?

[A] ACC [B] ANOTHER [C] BCC [D] એકપણ નહિ

138. રીંગ ટોપોલોજીમાં બે કમ્પ્યૂટરો કેવા પ્રકારના લૂપ સાથે જોડાયેલા હોય છે?

[A] પૂરક [B] બંધ [C] એકતા [D] એકપણ નહિ

139. ઈન્ટરનેટના દૂરસ્થિત કમ્પ્યૂટર પર લોગ-ઓન કરવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ થાય છે ?

[A] TCP/IP [B] FTP [C] Telnet [D] SMTP

140. વેબપેજ બનાવવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે?

[A] HTTP [B] HTML [C] HTMP [D] HTHL

જવાબો કસોટીપત્ર – 2

1.	D	29.	C	57.	A	85.	B	113.	A
2.	D	30.	A	58.	D	86.	A	114.	B
3.	A	31.	C	59.	C	87.	C	115.	D
4.	A	32.	A	60.	D	88.	A	116.	A
5.	A	33.	B	61.	B	89.	C	117.	A
6.	A	34.	B	62.	C	90.	C	118.	C
7.	B	35.	D	63.	A	91.	B	119.	B
8.	D	36.	C	64.	C	92.	D	120.	A
9.	A	37.	A	65.	A	93.	A	121.	C
10.	C	38.	B	66.	A	94.	A	122.	B
11.	D	39.	C	67.	B	95.	D	123.	A
12.	D	40.	C	68.	C	96.	D	124.	A
13.	C	41.	C	69.	C	97.	B	125.	C
14.	B	42.	A	70.	C	98.	C	126.	B
15.	B	43.	A	71.	D	99.	C	127.	A
16.	A	44.	A	72.	B	100.	A	128.	C
17.	B	45.	B	73.	A	101.	D	129.	D
18.	B	46.	D	74.	B	102.	C	130.	B
19.	B	47.	A	75.	A	103.	C	131.	D
20.	B	48.	D	76.	B	104.	B	132.	A
21.	C	49.	C	77.	B	105.	D	133.	B
22.	A	50.	D	78.	B	106.	D	134.	A
23.	A	51.	D	79.	B	107.	A	135.	D
24.	A	52.	A	80.	A	108.	D	136.	C
25.	B	53.	D	81.	B	109.	C	137.	C
26.	A	54.	B	82.	B	110.	B	138.	B
27.	C	55.	A	83.	B	111.	D	139.	C
28.	B	56.	B	84.	D	112.	C	140.	B

કસોટીપત્ર-3

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ

સત્રાંત પરીક્ષા

સમય : 3 કલાક | કુલ ગુણ : 140

પાઠ્યક્રમ : ફાઉન્ડેશન [CCC-01], એપ્લીકેશન [CCC-02], ઈન્ટરનેટ [CCC-03]

પ્રશ્ન 1 થી 35 ફાઉન્ડેશન (CCC-01) 45 Minutes

1. નીચેનામાંથી કઈ ઉચ્ચસ્તરીય ભાષા નથી?
   [A] C++, C [B] VB [C] JAVA [D] DBASE
2. નાનામાં નાના કમ્પ્યૂટર તરીકે કયું કમ્પ્યૂટર ઓળખાય છે?
   [A] PC [B] Laptop [C] PDA [D] NOTE BOOK
3. DOS માં બનાવેલ ફાઈલમાં સુધારા-વધારા કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે?
   [A] Copy [B] Erase [C] Cancel [D] Edit
4. DOS માં નવી ડિરેક્ટરી બનાવવા માટેનો કમાન્ડ કયો છે?
   [A] MD [B] Create [C] New [D] Copy Con
5. વર્ડ, એક્સેલ અને પાવરપોઇન્ટ એપ્લીકેશનમાં કેટલા મેનુ હોય છે?
   [A] 8 [B] 9 [C] 7 [D] 10

*6. CPU અને કમ્પ્યૂટરની આસપાસ નિયંત્રણનું કાર્ય કોણ કરે છે?
   [A] CU [B] ALU [C] Register [D] એક પણ નહિ

7. CD માં કેટલા MB ડેટા સંગ્રહી શકાય છે?
   [A] 650 [B] 850 [C] 550 [D] 450
8. એકબીજા સાથે જોડાયેલા કમ્પ્યૂટરના સમૂહને શું કહે છે?
   [A] MAC [B] નેટવર્ક [C] OS [D] આપેલ તમામ
9. કમ્પ્યૂટરની મેમરીનો નાનામાં નાનો યુનિટ કયો છે?
   [A] Byte [B] Bit [C] Byte અને Bit બંને [D] એક પણ નહિ
10. કમ્પ્યૂટરની ઝડપ શેમાં મપાય છે?
   [A] Bit [B] Byte [C] Bit અને Byte બંને [D] MIPS

*નોંધ : * (એસ્ટ્રીક) નિશાની સાથેના પ્રશ્નો આંબડકર યુનિવર્સિટીના વિવિધ પેપરોમાં વારંવાર પૂછાય છે.*

11. Desk Top ની સૌથી નીચેની બાજુમાં આવેલી પટ્ટીને શું કહે છે?
    [A] Titlebar [B] Taskbar [C] Menubar [D] Toolbar
12. GUI એટલે શું?
    [A] Graphical User Interest [B] Gega Byte Enteger
    [C] Graphical User Interface [D] Graph User Interest
13. સિસ્ટમની તારીખ અને સમય બદલવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે?
    [A] Control Panel [B] Network Places [C] My Computer [D] File Manager
14. મોડેમની ઝડપ શેમાં મપાય છે?
    [A] Mbps [B] Kbps [C] MB [D] Gbps
15. ઓડિયો કેસેટ રેકોર્ડરમાં ડેટા કયા સ્વરૂપે લખાય છે?
    [A] Analog [B] Digital
    [C] Analog અને Digital બંને [D] એક પણ નહિ
16. .... એ કમ્પ્યૂટરના દરેક સંસાધનોનું સંકલન અને વ્યવસ્થાપનનું કાર્ય કરે છે.
    [A] ALU [B] Registers [C] CU [D] RAM
17. RAM ના મુખ્ય પ્રકાર કેટલા છે ?
    [A] 3 [B] 2 [C] 4 [D] 5
18. .... માં સંગ્રહીત માહિતીને અલ્ટ્રાવાયોલેટ [UV] પ્રકાશનાં કિરણો દ્વારા વિનાશ કરી ફરીથી માહિતી લખી શકાય છે.
    [A] PROM [B] EPROM [C] EEPROM [D] RAM
19. ચતુર્થ ઘનતા [Quad Density] ધરાવતી ફ્લોપી ડીસ્કમાં .... TPI હોય છે.
    [A] 96 [B] 48 [C] 50 [D] 60
20. OCR નું પૂરું નામ શું છે?
    [A] Open Character Reader [B] Optical Character Reader
    [C] Optical Charter Reader [D] એક પણ નહિ
21. કમ્પ્યૂટર શટડાઉન કરવા માટેની શોર્ટકટ કી કઈ છે?
    [A] Alt+F4 [B] Shift+F10 [C] Ctrl+F4 [D] Ctrl+F1
22. CPU નું પૂરું નામ શું છે?
    [A] કમ્પ્યૂટર પ્રોસેસ યુનિટ [B] કમ્પ્યૂટર પ્રોગ્રેસ યુનિટ
    [C] કન્ટ્રોલ પ્રોસેસ યુનિટ [D] સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ

23. SCSI નો સંબંધ કોની સાથે છે ?

[A] CVD [B] DVD [C] HD Drive [D] LCD

24. નોટબુક કમ્પ્યૂટરમાં કયા પ્રકારનું મોનીટર ઉપયોગમાં લેવામાં આવે છે ?

[A] CRT [B] CDL [C] LCD [D] એક પણ નહિ

*25. CRT નું પૂરું નામ શું છે?

[A] કેમિકલ રે ટ્યૂબ [B] કેથોડ રે ટ્યૂબ [C] કોમન રોમ ટીપ [D] કેથોડ રે ટીમવર્ક

26. LCD નું પૂરું નામ શું છે?

[A] Liquid Crystal Display [B] Large Screen Display

[C] Large Crystal Display [D] એક પણ નહિ

27. HD નું પૂરું નામ શું છે?

[A] Hard Data [B] Hard Disk [C] A અને B બંને [D] એક પણ નહિ

28. Recycle bin ખાલી કરવા કયો વિકલ્પ ઉપયોગી છે?

[A] Delete Recycle Bin [B] Empty Recycle Bin

[C] Delete [D] Empty All

29. Windows Explorer માં કેટલા ભાગ આવેલા હોય છે?

[A] 1 [B] 2 [C] 3 [D] 4

30. DOS માં ફાઈલનું નામ બદલવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે?

[A] Ren [B] Copy [C] Con [D] આપેલ તમામ

31. Recylcel bin માંથી Delete કરેલ ફાઈલ પાછી મેળવવા માટે કયો વિકલ્પ ઉપયોગી છે ?

[A] Store [B] Restore [C] Undelete [D] એક પણ નહિ

32. કમાન્ડ આપવાનો સૌથી સરળ રસ્તો કયો છે?

[A] મેનુ [B] સ્ક્રોલ [C] ટાઈટલ [D] સ્ટેટ્સ

33. Help મેનુ ખોલવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે?

[A] Alt+H [B] Ctrl+W [C] Alt+Shift+H [D] Shift+H

34. હવામાનની આગાહી કરવા માટે કયા કમ્પ્યૂટરનો ઉપયોગ થાય છે ?

[A] સુપર કમ્પ્યૂટર [B] મીની કમ્પ્યૂટર [C] મેઈનફ્રેમ કમ્પ્યૂટર [D] પર્સનલ કમ્પ્યૂટર

35. DOS માં બનાવેલ ફાઈલનો અંત દર્શાવવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે ?

[A] F6 [B] Ctrl+Z [C] F6 અથવા Ctrl+Z [D] એક પણ નહિ

પ્રશ્ન 36 થી 105 **એપ્લીકેશન (CCC-02)** **90 Minutes**

*36. એકસેલમાં લખાણને ત્રાંસું કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે?

[A] Ctrl+I [B] Alt+I [C] Ctrl+U [D] એક પણ નહિ

37. વર્ડમાં લખાણને મધ્યમાં લાવવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે?

[A] Alt+C [B] Ctrl+C [C] Ctrl+E [D] Shift+E

*38. એકસેલમાં એક કરતાં વધારે કોલમની બરાબર વચ્ચે લખાણ લખવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે?

[A] Merge [B] Center [C] Macro [D] Merge and Center

39. વર્ડ એપ્લીકેશનમાં સ્પેશ્યલ ફોન્ટ ફોરમેટીંગ ઈફેકટ કયા ઓપ્શનમાં જોવા મળે છે?

[A] Text [B] Book [C] Effect [D] Font

*40. વર્ડ એપ્લીકેશનમાં Cut, Copy ઓપ્શન કયા મેનુમાં આવેલ હોય છે?

[A] File [B] View [C] Format [D] Edit

41. પાવરપોઈન્ટમાં Background ઓપ્શન .... મેનુમાં હોય છે.

[A] View [B] Format [C] Tools [D] Slide Show

42. Ms-Word માં Table મેનુના Convert ઓપ્શનમાં .... વિકલ્પ છે.

[A] 2 [B] 3 [C] 4 [D] એક પણ નહિ

43. Ms-Word ની ફાઇલમાં કેટલા પેજ, કેટલા પેરેગ્રાફ, કેટલી લાઈન અને કેટલા શબ્દો છે તે જાણવા માટે .... મેનુમાં ઓપ્શન છે.

[A] View [B] Format [C] Tool [D] Table

44. Ms-Word માં Macro નો અમલ કરવા .... શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે.

[A] Alt+F6 [B] Ctrl+F6 [C] Ctrl+F8 [D] Alt+F8

45. Excel માં ફાઈલને બીજા નામથી સેવ કરવા મેનુમાંથી કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે?

[A] Save [B] Ctrl+S [C] Save As [D] Save In

*46. એકસેલમાં ગાણિતિક પ્રક્રિયા કરવા માટે શરૂઆતમાં કયો સિમ્બોલ મૂકવામાં આવે છે ?

[A] ? [B] < [C] > [D] =

47. એકસેલમાં ચોક્કસ પ્રકારના કોલમને સંતાડવા માટે કયા મેનુનો ઉપયોગ કરવામાં આવે છે?

[A] Format [B] Insert [C] View [D] Help

48. એકસેલમાં ત્રણ વિષયની સરેરાશ શોધવા શોધવા માટે કયા ફંકશનનો ઉપયોગ થાય છે?

[A] SUM [B] TOTAL [C] COUNT [D] AVERAGE

*49. એકસેલમાં સૌથી છેલ્લા સેલનું એડ્રેસ શું હોય છે?

[A] A65536 [B] IVI [C] IV65536 [D] A1

*50. એક્સેલમાં એક કરતાં વધારે કોલમને સિલેક્ટ કરવા કઈ કી પ્રેસ કરવી પડે છે?

[A] Alt [B] Shift [C] Spacebar [D] Alt+Shift

51. વર્ડ એપ્લીકેશનમાં Bullets અને Numbering ટૂલ .... ટૂલબારમાં જોવા મળે છે.

[A] સ્ટાન્ડર્ડ [B] ફોરમેટ [C] ડ્રોઇંગ [D] એક પણ નહિ

52. Auto Text Option કયા મેનુમાં આવેલ છે?

[A] Insert [B] Tools [C] Format [D] એક પણ નહિ

53. વર્ડમાં ખુલ્લી ફાઇલની પ્રિન્ટ લેવા માટે .... ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે.

[A] ફોરમેટ [B] સ્ટાન્ડર્ડ [C] ટેબલ [D] એક પણ નહિ

*54. એક્સેલમાં ન્યુમેરિક લખાણને ડાબી બાજુથી લખવા માટે .... સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવે છે.

[A] " [B] ' [C] + [D] @

55. વર્ડમાં ફકરાને જસ્ટીફાઈ કરવા .... કમાન્ડનો ઉપયોગ થાય છે.

[A] Alt+J [B] Ctrl+G [C] Ctrl+J [D] એક પણ નહિ

*56. વર્ડમાં Spell Check કરવા માટે .... ફંકશન કીનો ઉપયોગ થાય છે.

[A] F2 [B] F4 [C] F5 [D] F7

57. વર્ડ એપ્લીકેશનમાં ટેબલ બનાવ્યા બાદ તેમાં રહેલ માહિતીને શોર્ટિંગ કરવા .... ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે.

[A] Sort [B] Change [C] SUM [D] HyperLink

58. વર્ડ એપ્લીકેશનમાં ટેબલ દાખલ કરવા માટે .... મેનુનો ઉપયોગ કરવામાં આવે છે.

[A] Edit [B] Table [C] Format [D] એક પણ નહિ

59. વર્ડ એપ્લીકેશનમાં એકસાથે એક કરતાં વધારે વ્યક્તિઓને પત્ર મોકલવાની રીત .... પદ્ધતિ તરીકે ઓળખાય છે.

[A] Mail Merge [B] Macro [C] Mail Macro [D] એક પણ નહિ

*60. વર્ડની કોઈપણ ફાઇલને માઉસની મદદથી ખોલવી હોય તો કેટલીવાર માઉસને ક્લિક કરવી પડે છે?

[A] 1 [B] 4 [C] 2 [D] 3

61. એક્સેલમાં શીટનું નામ બદલવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ?

[A] Rename [B] Change [C] Edit [D] પહેલા બંને

*62. એક્સેલમાં ચોક્કસ પ્રકારના ડેટા પ્રોટેક્ટ કરવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે?

[A] Protect [B] Protection [C] Save [D] Save As

63. એક્સેલમાં ગાણિતિક પ્રક્રિયાઓની ફોર્મ્યુલા સંપૂર્ણપણે દૂર થાય તે માટે કયો કમાન્ડ ઉપયોગી છે?

[A] Clean [B] Clear [C] Cls [D] Delete

*64. વર્કબુક એટલે .... નો સમૂહ.

[A] ફાઇલ [B] સેલ [C] વર્કશીટ [D] કોલમ

65. એકસેલમાં ચોક્કસ પ્રકારની રોને સંતાડવા .... મેનુનો ઉપયોગ થાય છે.

[A] Edit [B] Tools [C] File [D] Format

66. Excel માં ફાઈલને પ્રિન્ટ કરવા માટેની શોર્ટકટ કી .... છે.

[A] Ctrl+P [B] Alt+Ctrl+P [C] Ctrl+D [D] એક પણ નહિ

67. વર્ડમાં કર્સરને એક શબ્દ જમણી બાજુ ખસેડવા માટે .... શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે.

[A] Shift + → [B] Alt + → [C] Ctrl + R [D] Ctrl + →

68. Excel માં ચાલુ રોના પ્રથમ સેલમાં જવા માટે નીચેનામાંથી કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે?

[A] ← [B] Home [C] Ctrl+Home [D] Alt+Home

69. ચોક્કસ સેલ ઉપર જવા માટે Excel માં .... કમાન્ડનો ઉપયોગ થાય છે.

[A] F2 [B] F9 [C] F6 [D] Ctrl+G

70. પાવરપોઈન્ટમાં કુલ .... મેનુ હોય છે.

[A] 7 [B] 9 [C] 8 [D] 10

71. એકસેલમાં કોઈ ગાણિતિક પ્રક્રિયા કરતી વખતે નિર્ણયાત્મક સ્થિતિમાં કયા ફંકશનનો ઉપયોગ કરવામાં આવે છે?

[A] While [B] SUM [C] if [D] Count

72. સામાન્ય રીતે એકસેલમાં એક સેલની Height કેટલી હોય છે?

[A] 6.48 [B] 7.43 [C] 8.43 [D] 12.75

73. પાવરપોઇન્ટ એપ્લીકેશનમાં કાર્ટૂન દાખલ કરવા માટે કયા ઓપ્શનની જરૂર પડે છે?

[A] ClipArt [B] WordArt [C] ClipBox [D] Clipping

74. પાવરપોઇન્ટ એપ્લીકેશનમાં એક કરતાં વધારે સ્લાઇડને રો [Row] મુજબ જોવા માટે કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે?

[A] View [B] Slide Sorter [C] Notes [D] Boxes

*75. પાવરપોઇન્ટમાં બનાવેલ ફાઇલનું એક્ષ્ટેન્શન શું હોય છે?

[A] .PPC [B] .PPPT [C] .PPT [D] .PXT

76. વર્ડ એપ્લીકેશનમાં ઓપન ફાઇલમાં ડોકયુમેન્ટની શરૂઆતમાં પહોંચવા કઈ કીનો ઉપયોગ કરવો પડે છે?

[A] Ctrl [B] Ctrl+Home [C] Alt+Ctrl [D] Shift+Home

*77. વર્ડ એપ્લીકેશનમાં વારંવાર પુનરાવર્તન થતા કામ માટે કયા ઓપ્શનનો સફળતાપૂર્વક ઉપયોગ કરી શકાય છે?

[A] મેક્રો [B] ઓટોમેટીક [C] ઓટો ઇફેક્ટિવ [D] ઓટો રાઇટર

78. .... ઓપ્શન આપમેળે જ સામાન્ય ટાઇપીંગ અને સ્પેલિંગમાં થતી ભૂલો સુધારે છે.

[A] ઓટો ટેક્સ્ટ [B] ઓટો કરેકટ [C] ઓટો રાઇટર [D] ઓટો ઇફેકટ

79. વર્ડ એપ્લીકેશનમાં ઓપન ફાઇલને બંધ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે?

[A] Alt+F+O [B] Alt+F+C [C] Alt+F+N [D] Ctrl+F+C

80. એકસેલ એપ્લીકેશનનો સમાવેશ .... ગ્રુપમાં કરવામાં આવ્યો છે.

[A] MS-Word [B] MS-Excel [C] MS-Office [D] MS-Access

81. વર્ડ એપ્લીકેશનમાં Delete key ની મદદથી કઈ બાજુનું લખાણ ભૂંસી શકાય છે?

[A] ડાબી [B] જમણી [C] બંને [D] નીચેની

*82. વર્ડમાં ફાઈલ સેવ કરવા માટે .... કમાન્ડનો ઉપયોગ થાય છે.

[A] Alt+S [B] Ctrl+S [C] Ctrl+Shift+S [D] એક પણ નહિ

83. વર્ડ એપ્લીકેશનમાં પિકચર દાખલ કરવા માટે .... કમાન્ડનો ઉપયોગ થાય છે.

[A] ClipArt [B] Picture [C] ફાઇલ [D] એકપણ નહિ

84. વર્ડ એપ્લીકેશનમાં સૌથી છેલ્લે આવેલી લાઈનને કયા નામથી ઓળખવામાં આવે છે?

[A] Statusbar [B] Titlbar [C] Menu [D] Casebar

85. વર્ડમાં છેલ્લે કરેલ ફેરફાર દૂર કરવા .... કમાન્ડનો ઉપયોગ થાય છે.

[A] Read [B] Redo [C] Undo [D] Delete

86. Excel માં શીટ બદલવા માટેની શોર્ટકટ કી .... છે.

[A] Alt+PgDn [B] Ctrl+End [C] Ctrl+PgDn [D] એક પણ નહિ

87. Excel માં છેલ્લા કોલમનું નામ .... છે.

[A] Zz [B] IV [C] Az [D] એક પણ નહિ

*88. Excel માં .... પ્રકારના ચાર્ટ હોય છે.

[A] 14 [B] 11 [C] 16 [D] 15

89. Excel માં કોઈ રોને ફ્રીઝ[Freeze] કરવા માટેનું ઓપ્શન .... મેનુ રહેલું છે.

[A] Format [B] Window [C] Tools [D] એક પણ નહિ

90. Format Menu ઓપન કરવા માટે કી બોર્ડની મદદથી .... ઉપયોગમાં આવે છે.

[A] Alt+F+O [B] Ctrl+O [C] Alt+O [D] એક પણ નહિ

91. Excel માં અથવા Word માં Toolbar Screen ઉપર લાવવા માટેનું ઓપ્શન .... મેનુમાં છે.

[A] View [B] Format [C] Insert [D] એક પણ નહિ

92. Word માં સિસ્ટમ ડેટ ફાઇલમાં દાખલ કરવા માટેનું ઓપ્શન .... મેનુમાં છે.

[A] Edit [B] Tools [C] Table [D] Insert

93. Word માં ઈંચના માપ દર્શાવતી પટ્ટીને .... નામથી ઓળખવામાં આવે છે.

[A] Scale [B] Scrollbar [C] Ruler [D] એક પણ નહિ

*94. ફાઇલમાં રહેલા કોઈ શબ્દને શોધવા માટેની વર્ડમાં શોર્ટકટ કી .... છે.

[A] Ctrl+A [B] Ctrl+F [C] Alt+F [D] Ctrl+H

95. વર્ડમાં આખી ફાઇલને સિલેક્ટ કરવા માટે .... શોર્ટકટ કી ઉપયોગી છે.

[A] Alt+A [B] Ctrl+F [C] Shift+Ctrl+A [D] Ctrl+A

96. પાવરપોઇન્ટમાં બનાવેલ ફાઇલનું પ્રેઝન્ટેશન જોવા કઈ ફંકશન કી વપરાય છે?

[A] F5 [B] F7 [C] F10 [D] F12

*97. વર્ડ એપ્લીકેશનમાં ટેબલ મેનુમાં ફોર્મ્યુલા .... ચિહ્નથી શરૂ થાય છે.

[A] $ [B] + [C] = [D] એક પણ નહિ

*98. વર્ડ એપ્લીકેશનમાં અલગ-અલગ શેપથી લખાતા શબ્દો .... ઓપ્શનથી લખાય છે.

[A] Clip [B] WordArt [C] ClipArt [D] એક પણ નહિ

99. MS-Word માં ફોન્ટની ડિફોલ્ટ સાઇઝ .... હોય છે.

[A] 10 [B] 11 [C] 12 [D] 14

100. એકસેલમાં આલેખ બનાવવા માટે સૌપ્રથમ .... મેનુ જવું પડે છે.

[A] Edit [B] Insert [C] Graph [D] Format

101. વર્ડ એપ્લીકેશનમાં બાય ડિફોલ્ટ ફોન્ટ કયા હોય છે?

[A] Curior [B] Times New Roman

[C] Arial [D] Times

*102. વર્ડ એપ્લીકેશનમાં ફાઇલના અંતમાં જવા માટે .... કમાન્ડનો ઉપયોગ થાય છે.

[A] End [B] Ctrl+End [C] Ctrl+Shift [D] Ctrl+PgDn

103. Excel ફાઇલનું એક્ષ્ટેન્શન શું હોય છે?

[A] .DOC [B] .Exe [C] .Txt [D] .xls

*104. વર્ડમાં લખાણના ફોન્ટને મોટા કરવા માટે કયો કમાન્ડનો ઉપયોગ થાય છે?

[A] Shift + Ctrl + < [B] Alt + Ctrl + < [C] Shift + Ctrl + > [D] એક પણ નહિ

105. વર્ડ એપ્લીકેશનમાં દરેક પેજ ઉપર પેજ નંબર લખાઈને આવે તે માટે .... ઓપ્શનનો ઉપયોગ થાય છે.

[A] View [B] Statusbar [C] Header & Footer [D] એક પણ નહિ

પ્રશ્ન 106 થી 140 **ઈન્ટરનેટ (CCC-03)** **45 Minutes**

106. નીચેમાંથી એક સર્ચ એન્જિન નથી.
    [A] Yahoo [B] Google [C] Altavista [D] Mozilla

*107. ઈ-મેઇલમાં મેસેજ ઉપરાંત ફાઈલ મોકલવા માટે કયા બટનનો ઉપયોગ કરવામાં આવે છે?
    [A] Attachment [B] Send [C] New Mail [D] એક પણ નહિ

*108. ISP નું પૂરું નામ શું છે?
    [A] Internet Soft Product [B] Internet Service Providers
    [C] Internet Service Process [D] એક પણ નહિ

*109. ઈન્ટરનેટની મદદથી થતાં ધંધાકીય વ્યવહારોને .... કહે છે.
    [A] ઇલેક્ટ્રોનિક કોમર્સ [B] કોમર્સ
    [C] વ્યાપાર [D] એક પણ નહિ

110. ગુજરાતી ભાષામાં ઈ-મેઇલને કયા નામથી ઓળખવામાં આવે છે?
    [A] વિજાણુ ઉપગ્રહ [B] વિજાણુ ટપાલ [C] વિજાણુ ઈ-મેઈલ [D] એક પણ નહિ

*111. ઈ-મેઈલમાં એક કરતાં વધારે વ્યક્તિઓને મેઈલ મોકલવા માટે નીચેના પૈકી કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે?
    [A] Another [B] BCC [C] abc [D] એક પણ નહિ

*112. IP એડ્રેસ કેટલા બીટનું હોય છે?
    [A] 4-Bits [B] 8-Bits [C] 16-Bits [D] 32-Bits

113. Outlook Express શું છે?
    [A] Software [B] Hardware [C] Web [D] એક પણ નહિ

114. www.fabmert.com વેબસાઇટ શેના માટે જાણીતી છે?
    [A] જીવનસાથી પસંદગી [B] રોજગાર
    [C] પુસ્તકો, સંગીત [D] સમાચાર

115. ઈ-મેઈલમાં માહિતી તૈયાર થઈ ગયા બાદ તે માહિતી મોકલવા માટે કયા બટનનો ઉપયોગ કરવામાં આવે છે?
    [A] SEND [B] SEND ITEM [C] INBOX [D] CHECK

116. Modem નું પૂરું નામ શું છે?
    [A] Modulator Demodulator [B] Modulat Demodulat
    [C] Modulacator Demodulacator [D] એક પણ નહિ

117. નીચે દર્શાવેલ ઓપ્શનમાંથી એક ઓપ્શન નેટવર્કનો પ્રકાર નથી.

[A] LAN [B] MAN [C] WAN [D] SEN

118. સામાન્ય રીતે નિયમોનો સમૂહને કયા નામથી ઓળખવામાં આવે છે?

[A] પ્રોટોટાઈપ [B] પ્રોમોશન [C] પ્રોટોકોલ [D] એક પણ નહિ

119. ISO (Internation Standard Organization) ના OSI મોડેલને કેટલા લેયરમાં વિભાજિત કરવામાં આવ્યું છે?

[A] 5 [B] 6 [C] 7 [D] 8

120. નેટવર્કમાં જોડાતા દરેક કમ્પ્યૂટરને એક અજોડ નંબર આપવામાં આવે છે તેનું નામ શું છે?

[A] IP એડ્રેસ [B] INS [C] IPS [D] એક પણ નહિ

121. દરેક વેબસાઇટનું પ્રથમ પેજ કયા નામથી ઓળખાય છે?

[A] Front Page [B] House Page [C] Home Page [D] First Page

*122. ઈન્ટરનેટના ઉપયોગમાં લેવામાં આવતી દરેક ફાઈલ .... ની મદદથી એકબીજા સાથે જોડેલી હોય છે.

[A] હાઈપરવર્ડ [B] હાઈપર એક્સેલ [C] હાઈપરલીંક [D] હાઈપર નોટપેડ

*123. ભૂતકાળમાં જે કોઈ વેબ-સાઇટની મુલાકાત લીધી હોય, તેની માહિતી મેળવવા કયા બટનનો ઉપયોગ થાય છે?

[A] History [B] Information [C] Visit [D] Forward

124. ઈ-મેઈલ આઈડી કોણ ફાળવે છે?

[A] WAN [B] State Government
[C] Govt. of India [D] ISP

125. www એટલે ....

[A] World Wide Web [B] World Web Web
[C] Weather World Web [D] World Wide West

126. નેટવર્ક એટલે શું?

[A] કમ્પ્યૂટર સોફ્ટવેરનો સમૂહ

[B] કમ્પ્યૂટરનો સમૂહ

[C] એકબીજા સાથે સંકળાયેલ ઘટકોનો સમૂહ

[D] એક પણ નહિ

*127. નીચે દર્શાવેલ નામમાંથી કયું નામ પ્રોટોકોલ તરીકે ઓળખાતું નથી?

[A] TCP/IP [B] FTP [C] HTTP [D] WWW

128. 1969 તૈયાર થયેલ નેટવર્કનું નામ આપો.

[A] Internet [B] WWW [C] ARPANET [D] એક પણ નહિ

129. સામાન્ય રીતે ઈ-મેઈલ ID કેટલા ભાગમાં વહેંચાયેલું હોય છે?

[A] 1 [B] 2 [C] 3 [D] 4

130. ધંધાકીય વેબસાઇટમાં કયું ક્ષેત્રીય (Domain) નામ ઉમેરાય છે?

[A] Business [B] Trade [C] Trd [D] Com

*131. ઈન્ટરનેટમાં કોઈપણ વેબપેજને રિફ્રેશ કરવા માટે કઈ ફંકશન કીનો ઉપયોગ થાય છે?

[A] F4 [B] F5 [C] F6 [D] F2

132. સામાન્ય રીતે LAN પ્રકારના નેટવર્કમાં કમ્પ્યૂટરો વચ્ચેનું વધુમાં વધુ અંતર .... મીટરનું હોય છે.

[A] 100 [B] 10 [C] 50 [D] 1000

*133. .... ને કમ્પ્યૂટર નેટવર્કના નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે.

[A] ઈન્ટરનેટ [B] ઈન્ટ્રાનેટ [C] ઈન્ફ્રારેડ [D] એક પણ નહિ

134. અમેરિકા દેશની વેબસાઇટમાં કયા પ્રકારના નામનો Domain તરીકે ઉપયોગ થાય છે?

[A] .us [B] .ud [C] .uk [D] .ku

135. ઈ-કોમર્સમાં કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમરને ટૂંકમાં કઈ રીતે ઓળખવામાં આવે છે?

[A] C2C [B] C TO C [C] C2B [D] B2C

136. ડેટા પ્રત્યાપનની ઝડપ માટે .... એકમ વપરાય છે.

[A] bps [B] Mb [C] Gb [D] Mpvs

137. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વેબસાઈટનું (Domain) ક્ષેત્ર શું છે?

[A] .edu [B] .org [C] .net [D] .gov

*138. ઈન્ટરનેટની શોધ કયા દેશે કરી?

[A] ભારત [B] ચીન [C] જાપાન [D] અમેરિકા

139. નીચેનામાંથી કયું સોફ્ટવેર વેબબ્રાઉઝર નથી?

[A] Internet Explorer [B] Mozilla
[C] Netscape Navigator [D] Altavista

*140. વેબસાઇટનું સરનામું (નામ) કયા નામથી ઓળખાય છે?

[A] URL [B] WWW [C] Com [D] એક પણ નહિ

જવાબો કસોટીપત્ર – 3

1.	D	29.	B	57.	A	85.	C	113.	A
2.	C	30.	A	58.	B	86.	C	114.	C
3.	D	31.	B	59.	A	87.	B	115.	A
4.	A	32.	A	60.	C	88.	A	116.	A
5.	B	33.	A	61.	A	89.	B	117.	D
6.	A	34.	A	62.	B	90.	C	118.	C
7.	A	35.	C	63.	B	91.	A	119.	C
8.	B	36.	A	64.	C	92.	D	120.	A
9.	B	37.	C	65.	D	93.	C	121.	C
10.	D	38.	D	66.	A	94.	B	122.	C
11.	B	39.	D	67.	D	95.	D	123.	A
12.	C	40.	D	68.	B	96.	A	124.	D
13.	A	41.	B	69.	D	97.	C	125.	A
14.	A	42.	A	70.	B	98.	B	126.	C
15.	A	43.	C	71.	C	99.	C	127.	D
16.	C	44.	D	72.	D	100.	B	128.	C
17.	A	45.	C	73.	A	101.	B	129.	B
18.	B	46.	D	74.	B	102.	B	130.	D
19.	A	47.	A	75.	C	103.	D	131.	B
20.	B	48.	D	76.	B	104.	C	132.	D
21.	A	49.	C	77.	A	105.	C	133.	A
22.	D	50.	B	78.	B	106.	D	134.	A
23.	C	51.	B	79.	B	107.	A	135.	A
24.	C	52.	A	80.	C	108.	B	136.	A
25.	B	53.	B	81.	B	109.	A	137.	B
26.	A	54.	B	82.	B	110.	B	138.	D
27.	B	55.	C	83.	B	111.	B	139.	D
28.	B	56.	D	84.	A	112.	D	140.	A

કસોટીપત્ર-4

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ

સત્રાંત પરીક્ષા

સમય : 3 કલાક **કુલ ગુણ : 140**

પાઠ્યક્રમ : ફાઉન્ડેશન [CCC-01], એપ્લીકેશન [CCC-02], ઈન્ટરનેટ [CCC-03]

પ્રશ્ન 1 થી 35 **ફાઉન્ડેશન (CCC-01)** **45 Minutes**

1. વિજાણું યંત્રનું વિશિષ્ટ લક્ષણ .... છે.
   [A] ઝડપ [B] વિશ્વસનીયતા
   [C] ઝડપ અને વિશ્વસનીયતા [D] એક પણ નહિ
2. નિયંત્રણ એકમ એટલે ....
   [A] ALC [B] ALU [C] CPU [D] CU
3. મુખ્ય સ્મૃતિ અને CPU રજીસ્ટર વચ્ચે બફરનું કાર્ય કોણ કરે છે?
   [A] કેશસ્મૃતિ [B] RAM [C] ROM [D] એક પણ નહિ
4. બમણી ઘનતા ધરાવતી ફ્લોપી ડિસ્કમાં .... TPI હોય છે.
   [A] 92 [B] 96 [C] 42 [D] 48
5. DMP પ્રિન્ટરમાં .... ના સમૂહથી પ્રિન્ટ બનેલી દેખાય છે.
   [A] DOT [B] LINE [C] DOT અને LINE બંને [D] એક પણ નહિ
6. લાઈન પ્રિન્ટરમાં .... લાઈન એક મિનિટમાં પ્રિન્ટ થઈ શકે છે.
   [A] 500 થી 4500 [B] 500 થી 6000 [C] 1500 થી 4500 [D] 1500 થી 6000
7. કમ્પ્યૂટરની સ્ક્રીન પરના નાનામાં નાના બિંદુને .... કહે છે.
   [A] Point [B] DOT [C] Pixel [D] એક પણ નહિ
8. વીજપ્રવાહ અને તેના વોલ્ટેજ જેવા ભૌતિક વસ્તુના માપન માટે કયા કમ્પ્યૂટરનો ઉપયોગ થાય છે?
   [A] ડીઝીટલ [B] એનાલોગ
   [C] ડીઝીટલ અને એનાલોગ બંને [D] એક પણ નહિ

*નોંધ : * (એસ્ટ્રીક) નિશાની સાથેના પ્રશ્નો આબંડકર યુનિવર્સિટીના વિવિધ પેપરોમાં વારંવાર પૂછાય છે.*

9. UPS એ કયા પ્રકારનું સાધન છે?

[A] નિર્વેશ [B] બહિર્વેશ

[C] નિર્વેશ અને બહિર્વેશ બંને [D] એક પણ નહિ

10. POST નું પુરું નામ જણાવો.

[A] Power on Self Test [B] Power Online Self Test

[C] Power on Self Tune [D] Power on Site Test

*11. Windows માં Help મેળવવા કઈ ફંકશન કીનો ઉપયોગ થાય છે?

[A] F1 [B] F4 [C] F8 [D] F10

12. LAN પ્રકારનું નેટવર્ક .... વિસ્તાર સુધીનું હોઈ શકે છે.

[A] 100 Mitre [B] 1 Km [C] 10 Km [D] 500 Mitre

13. Windows માં ડીલીટ થયેલ ફાઈલ કયાં જાય છે?

[A] My Document [B] Recycle bin [C] Restore Box [D] એક પણ નહિ

14. નોટપેડ એ વિન્ડોઝનો .... પ્રકારનો પ્રોગ્રામ છે.

[A] યુટીલીટી [B] ગ્રાફીકસ [C] સીસ્ટમ [D] એક પણ નહિ

15. .... પ્રોગ્રામ એ વિન્ડોઝમાં નુકસાન કરે છે.

[A] યુટીલીટી [B] વાઈરસ [C] ગ્રાફીકસ [D] એક પણ નહિ

*16. DOS માં ડિરકટરી બનાવવા માટે કયો કમાન્ડ છે?

[A] CD [B] RD [C] MD [D] Copy con

17. 1 GB = ...

[A] 1024 KB [B] 1000 KB [C] 1000 MB [D] 1024 MB

18. પ્લોટર એ .... પ્રકારનું સાધન છે.

[A] નિર્વેશ [B] બહિર્વેશ [C] સિસ્ટમ [D] એક પણ નહિ

19. માઉસનો ઉપયોગ નીચેનામાંથી કયો છે ?

[A] ક્લિક [B] ડબલ ક્લિક [C] ડ્રેગ [D] આપેલ તમામ

20. RMB એ કયા સાધન સાથે જોડાયેલ શબ્દ છે?

[A] Mouse [B] Keyboard [C] Printer [D] Plotter

21. 1 MB બરાબર કેટલા?

[A] 1024 GB [B] 1024 KB [C] 1024 byte [D] એક પણ નહિ

22. DOS માં CLS કેવા પ્રકારનો કમાન્ડ છે?

[A] આંતરિક [B] બાહ્ય [C] ખાસ [D] એક પણ નહિ

23. નીચેનામાંથી કોણ CPU નો ભાગ છે ?

[A] ALU [B] CU [C] MU [D] આપેલ તમામ

24. MS-DOS માં કોઈ પણ કમાન્ડ વિશે વધુ માહિતી મેળવવા માટે કમાન્ડના નામ પછી કઈ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે?

[A] ! [B] # [C] ? [D] =

25. બાયનરીમાં કેટલા ડિજીટ હોય છે?

[A] 0 [B] 1 [C] 2 [D] 3

26. નીચેનામાંથી કઈ નાશવંત મેમરી છે?

[A] ROM [B] Harddisk [C] RAM [D] આપેલ તમામ

27. ડીજીટલ વર્સાટાઈલ ડીસ્ક ઓછામાં ઓછી કેટલી સંગ્રહક ક્ષમતા ધરાવે છે?

[A] 1.22 MB [B] 1.44 GB [C] 750 MB [D] 4.7 GB

28. DVD સામાન્યત વધુમાં વધુ એકસેસ દર કેટલા MBPS ધરાવે છે?

[A] 5.3 [B] 6.3 [C] 8.3 [D] 9.3

29. કમ્પ્યૂટરને વીજ પુરવઠો નિયમિત મળતો રહે તે માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?

[A] Modem [B] UPS [C] Scanner [D] Plotter

30. ફોટોગ્રાફને ડીઝીટલ સ્વરૂપમાં સંગ્રહ કરવા કયા સાધનનો ઉપયોગ થાય છે?

[A] Plotter [B] Modem [C] Scanner [D] આપેલ તમામ

*31. નીચેનામાંથી કયો Binary નો નાનામાં નાનો યુનિટ છે?

[A] KB [B] Bit [C] MB [D] Byte

32. અવાજને કમ્પ્યૂટરમાં ઈનપુટ કરવા માટે શાનો ઉપયોગ થાય છે?

[A] માઈક્રોફોન [B] હેડફોન [C] સ્પીકર [D] વુફર

33. ઉચ્ચ ગુણવત્તા ધરાવતા પ્રિન્ટીંગ માટે કયા પ્રિન્ટરનો ઉપયોગ થાય છે?

[A] ડોટ-મેટ્રીક્સ [B] લાઈન [C] ઈન્કઝેટ [D] લેઝર

34. કમ્પ્યૂટરમાં વીજપ્રવાહ ચાલુ કરતાં થતી પ્રક્રિયાને શું કહેવાય?

[A] પ્રોસેસિંગ [B] લોગીન [C] લોડીંગ [D] બુટિંગ

35. DOS માં સ્ક્રીન સ્ક્રોલીગને કામચલાઉ અટકાવવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે?

[A] STOP [B] PAUSE [C] END [D] STAY

36. MS-Word માં ઈન્સર્ટ પોઈન્ટ એટલે શું?

[A] પ્રથમ લાઈન [B] બ્લીન્કીંગ થતી નાની લાઈન

[C] Mouse પોઈન્ટર [D] એક પણ નહિ

37. અન્ડર લાઈન માટેનો ટૂલ કયા ટૂલબારમાં હોય છે?

[A] સ્ટાન્ડર્ડ [B] ફોર્મેટીંગ [C] ડ્રોઈંગ [D] ટેબલ

38. MS-Word માં કેટલા પ્રકારના Page View હોય છે?

[A] 3 [B] 5 [C] 2 [D] 7

39. Table માં એક સેલમાંથી બીજા સેલમાં જવા કઈ કી વપરાય છે?

[A] TAB [B] Ctrl [C] Spacebar [D] BackSpace

40. MS-Word માં શબ્દ સિલેક્ટ કરવા .... નો ઉપયોગ થાય છે.

[A] ક્લિક [B] ડાબી એરો કી [C] જમણી એરો કી [D] ડબલ ક્લિક

41. લેન્ડસ્કેપ એ .... કમાન્ડનો વિકલ્પ છે.

[A] Page Setup [B] Font [C] Paragraph [D] Table

42. Table માં List માં આપેલ આઈટમની સંખ્યા ગણવા .... નો ઉપયોગ થાય છે.

[A] Average [B] Count [C] Sum [D] એક પણ નહિ

43. MS-Word માં ગોળ દોરવા માટે .... ટૂલબારનો ઉપયોગ થાય છે.

[A] ગ્રાફિક્સ [B] પિક્ચર [C] ડ્રોઈંગ [D] એક પણ નહિ

44. લખાણ અને ચિત્રની વ્યવસ્થિત ગોઠવણી માટે .... નો ઉપયોગ થાય છે.

[A] Text Wrap [B] Average [C] Text Setting [D] એક પણ નહિ

*45. Mail Merge કમાન્ડમાં .... Steps હોય છે.

[A] 5 [B] 6 [C] 4 [D] 7

46. MS-Word માં કેટલા પ્રકારના સ્ક્રોલબાર હોય છે?

[A] 2 [B] 3 [C] 4 [D] 5

47. જે સેલમાં કર્સર હોય તે સેલને .... સેલ કહે છે.

[A] Current [B] Active [C] Main [D] એક પણ નહિ

48. તાર્કિક કાર્ય કરવા માટે નીચેનામાંથી કયા ઓપરેટરનો ઉપયોગ થાય છે?

[A] = [B] >= [C] બંને [D] એક પણ નહિ

*49. ગુણાકાર કરવા માટે કયા ફંકશનનો ઉપયોગ થાય છે?

[A] Power [B] Product [C] * [D] એકપણ નહિં

50. સેલ એડ્રેસને નિરપેક્ષ સેલ એડ્રેસ બનાવવા કયો ઓપરેટર ઉપયોગી છે?

[A] $ [B] >< [C] = [D] #

51. કોઈ કિંમત સૂત્રને પૂર્ણ કરવા જરૂરી છે, પરંતુ આપેલ ના હોય તો .... ભૂલ બતાવે છે.

[A] ### [B] #div/0! [C] #N/A [D] #Name?

52. વર્ડમાં બુલેટ ટૂલ કયા ટૂલબારમાં હોય છે?

[A] Formatting [B] Drawing [C] Picture [D] Standard

53. Undo કમાન્ડની શોર્ટકટ કી કઈ છે ?

[A] Ctrl+U [B] Ctrl+Y [C] Ctrl+Z [D] F1

54. MS-Excel માં આજની તારીખ મેળવવા કયું ફંકશન ઉપયોગી છે?

[A] Day [B] DATE [C] Today [D] એક પણ નહિ

55. MS-Excel = Round(15.8752,2) દ્વારા શો ઉત્તર મળે છે?

[A] 15.88 [B] 15.87 [C] 15.00 [D] એક પણ નહિ

56. કયા વિકલ્પ દ્વારા મહિનાઓના નામ આપો–આપ લાવી શકાય છે?

[A] Auto Currect [B] Auto Fill [C] Option [D] એક પણ નહિ

57. = 5^3 નો ઉત્તર .... થાય છે.

[A] 15 [B] 8 [C] 125 [D] 25

58. = FACT (5) નો ઉત્તર .... થાય.

[A] 120 [B] 125 [C] 25 [D] 240

59. MS-Word માં X^2 ટાઈપ કરવા માટે 2 ને .... અસર આપવી પડે.

[A] Underline [B] Strikethrough [C] Subscript [D] Superscript

60. આપણે સરવાળો કરવા .... ટૂલનો ઉપયોગ કરી શકીએ.

[A] Direct Sum [B] Auto Sum [C] Total [D] એક પણ નહિ

61. Slide ને Zoom કરવા કયા મેનુનો ઉપયોગ થાય છે?

[A] Edit [B] Insert [C] View [D] Slide Show

62. Slide માં Time Set કરવા કયા વિકલ્પનો ઉપયોગ થાય છે?

[A] Rehearse Timings [B] Time Date [C] Slide Show [D] એક પણ નહિ

63. Slide ને ઈફેક્ટ આપવા માટે .... વિકલ્પ છે.

[A] Slide Animation [B] Slide Transition

[C] Custom Animation [D] એક પણ નહિ

64. PowerPoint માં પ્રથમ સ્લાઈડ સામાન્ય રીતે .... સ્લાઈડ હોય છે.

[A] Text [B] Picture [C] Title [D] એક પણ નહિ

65. PowerPoint માં Header Footer .... સ્લાઈડમાં મૂકવામાં આવે છે, જેથી દરેક સ્લાઈડમાં તેની અસર જોવા મળે છે.

[A] Main Slide [B] First Slide [C] Master Slide [D] એક પણ નહિ

66. PowerPoint માં સ્લાઈડની ગોઠવણી બદલવા કયા View માં ફેરવવામાં આવે છે?

[A] Sorting [B] Slide Sorter [C] Arrange [D] એક પણ નહિ

67. પ્રેઝન્ટેશનને નાના કદની સ્લાઈડમાં પ્રિન્ટ કરવા કયા વિકલ્પનો ઉપયોગ થાય છે?

[A] Hand-out [B] Master [C] Slide [D] Page

68. Slide માં Movie ઉમેરવા કયા મેનુમાં જવું પડે?

[A] Insert [B] Slide Show [C] View [D] Format

69. ચાલુ Slide Show બંધ કરવા કઈ કી નો ઉપયોગ થાય છે?

[A] F2 [B] Enter [C] ESC [D] Del

70. Presentation ને જીવંત બતાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે?

[A] Custom Animation [B] Slide Sorter

[C] Formatting [D] એક પણ નહિ

*71. વર્ડ એપ્લીકેશનમાં ડોકયુમેન્ટ પ્રિન્ટ કરવા માટે કેટલા પ્રકારના Orientation હોય છે?

[A] 4 [B] 1 [C] 2 [D] 3

72. વર્ડમાં Tabs કમાન્ડ કેટલા પ્રકારના Alignment પ્રાપ્ય છે?

[A] 3 [B] 4 [C] 5 [D] 6

*73. વર્ડમાં બનાવેલ ફાઈલમાં કુલ કેટલા શબ્દો છે, કેટલી લાઈન છે, કેટલા પેરેગ્રાફ છે, તે વિગતો જાણવા માટે .... કમાન્ડનો ઉપયોગ થાય છે.

[A] Auto Correct [B] Spell Check [C] Word Count [D] Auto Text

*74. વર્ડ એપ્લીકેશનમાં બોર્ડર બનાવવા માટે કયા મેનુમાં જવું પડે છે?

[A] સ્ટાન્ડર્ડ [B] ફોર્મેટ [C] ડ્રોઈંગ [D] ઈન્સર્ટ

*75. વર્ડ એપ્લીકેશનમાં લાલરંગની લાઈનવાળા શબ્દ પર માઉસનું જમણું બટન Press કરતાં કયા શબ્દની યાદી દર્શાવતું શોર્ટકટ મેનુ બતાવે છે?

[A] સમાનાર્થી [B] ગ્રામર [C] સાચા શબ્દ [D] ખોટા શબ્દ

76. વર્ડ એપ્લીકેશનમાં ફકરાને ડાબે અને જમણે બંને બાજુથી ગોઠવવા માટે કયું અલાઈનમેન્ટ ઉપયોગી છે?

[A] Left [B] Right [C] Center [D] Justify

77. વર્ડ એપ્લીકેશનમાં Mail-Merge વિકલ્પ કયા મેનુમાં પ્રાપ્ય છે?

[A] Table [B] Tools [C] Insert [D] Format

78. વર્ડ એપ્લીકેશનમાં કર્સરને કોઈ ચોક્કસ પેજ પર લઈ જવા માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે?

[A] Go TO [B] Move [C] Paste [D] Replace

79. વર્ડમાં માર્જીન બદલવા માટે કયો વિકલ્પ ઉપયોગી છે?

[A] રૂલર [B] પેઈઝ સેટ અપ

[C] રૂલર અને પેઈઝ સેટ અપ બંને [D] એક પણ નહિ

80. વર્ડ એપ્લીકેશનમાં બનાવેલ કોષ્ટકમાં ગાણિતીક કાર્યો કરવા માટે Table Menu માંથી કયા વિકલ્પનો ઉપયોગ થાય છે?

[A] Autosum [B] Formula [C] Equation [D] Sum

*81. એકસેલમાં આપોઆપ નંબર આવી જાય તેને માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે?

[A] Auto File [B] Automatic [C] Auto Fill [D] એક પણ નહિ

82. સ્પ્રેડશીટમાં 52માં સ્તંભને કયા નામથી ઓળખવામાં આવે છે?

[A] BA [B] BZ [C] AA [D] AZ

83. એકસેલમાં આપણું કર્સર હાલમાં કયા સેલમાં છે તે જોવા માટે કયા બારની જરૂર પડે છે?

[A] ફોર્મેટ બાર [B] ફોર્મ્યુલા બાર [C] સ્ટાન્ડર્ડ બાર [D] એક પણ નહિ

84. એકસેલમાં કુલ કેટલા સ્તંભ આવેલા હોય છે?

[A] 65536 [B] 65535 [C] 255 [D] 256

*85. એકસેલમાં ડેટાને ક્રમમાં ગોઠવવા માટે મહત્તમ કેટલી કળનો (ફિલ્ડ) ઉપયોગ કરી શકાય?

[A] 2 [B] 3 [C] 4 [D] 5

86. એકસેલમાં નંબર પ્રકારનો ડેટા કઈ બાજુથી અલાઈન થાય છે?

[A] જમણી [B] ડાબી [C] મધ્ય [D] આપેલ તમામ

87. 5 મી હાર અને ચોથા સ્તંભનું નામ કયું હોય છે?

[A] E4 [B] 4E [C] D5 [D] 5D

88. એકસેલમાં છેલ્લા સ્તંભનું નામ કયું હોય છે?

[A] AZ [B] ZZ [C] VI [D] IV

89. એકસેલમાં Replace વિકલ્પની શોર્ટકટ કી કઈ છે?

[A] CTRL+F [B] ALT+F [C] CTRL+H [D] ALT+H

90. એકસેલમાં નીચેનામાંથી શું હોતું નથી?

[A] Rular bar [B] Formatting Toolbar [C] Titlebar [D] Draw bar

91. એકસેલમાં સાપેક્ષ સેલ એડ્રેસ લખવા માટે પ્રથમ કઈ નિશાની કરવી પડે છે?

[A] $ [B] # [C] ; [D] =

*92. પાવરપોઈન્ટ એપ્લીકેશનમાં એકના જેવી જ બીજી સ્લાઈડ બનાવવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે?

[A] CTRL+D [B] ALT+D [C] Shift+D [D] Ctrl+Alt+D

93. પાવરપોઈન્ટ એપ્લીકેશનમાં કયા View માં આવેલ સ્લાઈડને રેકોર્ડ કરેલ ટાઈમ મુજબ જોઈ શકાય છે?

[A] Normal [B] Slide Sorter [C] Slide Show [D] Notes Page

94. પાવરપોઈન્ટ એપ્લીકેશનમાં Slide Design વિકલ્પ કયા મેનુમાં આવેલ છે?

[A] View [B] Format [C] Insert [D] Slide Show

95. પાવરપોઈન્ટ એપ્લીકેશનમાં આવેલ Custom Animation માં Effect કેટલા ભાગમાં વિભાજીત થયેલ છે?

[A] 2 [B] 3 [C] 4 [D] 5

96. પાવરપોઈન્ટ એપ્લીકેશનમાં બનાવેલ પ્રેઝન્ટેશનને સતત ચાલુ રાખવા કયા વિકલ્પનો ઉપયોગ થાય છે?

[A] Continue [B] Infinit [C] Kiosk [D] Circular

97. પાવરપોઈન્ટ એપ્લીકેશનમાં બનાવેલ પ્રેઝન્ટેશનમાં આપણી Slide ને Animation Effect આપવા કયા વિકલ્પનો ઉપયોગ થાય છે?

[A] Custom Animation [B] Slide Transition

[C] Animation [D] Effect

98. પાવરપોઈન્ટ એપ્લીકેશનમાં કોઈ ચોક્કસ માહિતીને Animation વખતે એક-એક અક્ષર પ્રમાણે Animation કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે?

[A] All at once [B] By word [C] By latter [D] એક પણ નહિ

99. પાવરપોઈન્ટમાં નોંધ પ્રકારની માહિતી લખવા માટે કયા View નો ઉપયોગ થાય છે?

[A] Normal [B] Slide Sorter

[C] Notes Page [D] Slide Show

100. પાવરપોઈન્ટમાં બનાવેલ પ્રેઝન્ટેશન જોવા માટે કયા મેનુમાંથી Slide Show વિકલ્પ પસંદ કરવામાં આવે છે?

[A] View [B] Slide Show

[C] Edit [D] Format

101. Text ને Format કરવાના જુદા-જુદા Shortcut Button કયા બારમાં જોવા મળે છે?

[A] Format bar [B] Formula bar

[C] Format Menu [D] એક પણ નહિ

102. MS-Word માં Document માં સુધારા-વધારા (Editing) કરવા માટેના જરૂરી કમાન્ડસ કયા મેનુમાં હોય છે?

[A] Window [B] Edit [C] Help [D] એક પણ નહિ

103. Document માં હાંસીયાની ગોઠવણી નક્કી કરવા માટે શેનો ઉપયોગ થાય છે?

[A] Format Bar [B] Menu Bar [C] Rular Bar [D] File Menu

*104. MS-Word માં નવી ફાઈલ ખોલવા માટે કઈ Short Cut Key વપરાય છે?

[A] Ctrl+N [B] Ctrl+S [C] Ctrl+O [D] Ctrl+X

105. MS-Word માં ફાઈલ સંબંધીત પ્રક્રિયાઓ કરવાના કમાન્ડસ કયા મેનુમાં હોય છે?

[A] Window [B] Help [C] Edit [D] File

પ્રશ્ન 106 થી 140 **ઈન્ટરનેટ (CCC-03)** **45 Minutes**

*106. KBPS નું પુરું નામ .... છે.

[A] Kilo Bits Per Second [B] Kilo Byte Per Second

[C] Kilo Bits Permanent Second [D] એક પણ નહિ

107. નેટવર્ક સ્થાપિત કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ?

[A] જોડાણનો ખર્ચ [B] કમ્પ્યૂટર્સ વચ્ચેનું અંતર

[C] ડેટા-માહિતીની આપ-લેની ઝડપ [D] આપેલ તમામ

108. જર્મની દેશ માટેના ડોમેઈનનું નામ .... છે.

[A] .in [B] .ch [C] .de [D] .ge

*109. સરકારી સંસ્થાઓની Website માટે .... નો ઉપયોગ થાય છે.

[A] .gov [B] .gove [C] .government [D] એક પણ નહિ

110. ઈન્ટરનેટ બેન્કિંગ સેવાઓ એ .... નું ઉદાહરણ છે.

[A] .B2B [B] B2C [C] C2C [D] એક પણ નહિ

111. ઓનલાઈન બુકસ્ટોલની એક વેબસાઈટ નીચેમાંથી કઈ છે તે જણાવો?

[A] google.com [B] amazon.com [C] yahoo.com [D] Discovery.org

112. ઈન્ટરનેટમાંની વેબસાઈટ નિહાળવા વપરાતા સોફ્ટવેરને શું કહે છે?

[A] વેબ બ્રાઉઝર [B] પ્રેઝન્ટેશન [C] Email [D] એક પણ નહિ

*113. વેબ-પેજ નિહાળવા માટેની વિનંતી નવેસરથી આપવા .... બટનનો ઉપયોગ થાય છે.

[A] Back [B] Forward [C] Refresh [D] એક પણ નહિ

114. વેબસાઈટનું સરનામું શોધવા માટે .... બટનનો ઉપયોગ થાય છે.

[A] Search [B] Find [C] Favorites [D] એક પણ નહિ

115. વેબ-પેજની ફાઈલ .... તરીકે Save કરી શકાય છે.

[A] MS Word File [B] HTTP [C] HTML [D] એક પણ નહિ

116. વારંવાર વપરાતા વેબપેજને .... તરીકે સંગ્રહ કરી શકાય છે.

[A] Memory [B] Favorites [C] History [D] એક પણ નહિ

117. શોધ એન્જિન તરીકે .... નો ઉપયોગ થાય છે.

[A] Google.com [B] Yahoo.com

[C] Google અને Yahoo બંને [D] એક પણ નહિ

*118. નીચેનામાંથી કઈ નેટવર્ક ટોપોલોજી નથી?

[A] બસ ટોપોલોજી [B] મેશ ટોપોલોજી [C] લેન ટોપોલોજી [D] એક પણ નહિ

119. E-mail ID ના બે વિભાગને .... થી જોડવામાં આવે છે.

[A] @ [B] $ [C] = [D] ~

120. અગાઉ મોકલેલા ઈમેઈલ .... ફોલ્ડરમાં સંગ્રહ થાય છે.

[A] Send [B] Sent Items [C] Inbox [D] એક પણ નહિ

121. DNS નું પુરું નામ જણાવો.

[A] Direct Network Service [B] Direct Name System

[C] Domain Name Service [D] Domain Name System

122. OSI Model .... સંસ્થા દ્વારા તૈયાર કરાયેલ છે.

[A] IBM [B] IEEE [C] ISO [D] ISRO

*123. સામાન્ય રીતે ચિત્ર ફાઈલ એક્ષટેન્શન .... હોય છે.

[A] .PDF [B] .BMB [C] .JPE [D] .GIF

124. .... ટોપોલોજીમાં માત્ર એક જ થડ હોય છે, શાખાઓ હોતી નથી.

[A] રીંગ [B] બસ [C] મેશ [D] સ્ટાર

125. કમ્પ્યૂટર નેટવર્ક સ્થાપિત કરવા માટે દરેક કમ્પ્યૂટરમાં કયું કાર્ડ નાખવામાં આવે છે ?

[A] ડીસ્પ્લે કાર્ડ [B] સીમ કાર્ડ [C] નેટવર્ક ઈન્ટરફેસ કાર્ડ [D] મોડેમ કાર્ડ

126. નીચેનામાંથી કયો ઈ-કોમર્સનો પ્રકાર નથી?

[A] B2C [B] B2B [C] C2C [D] G2G

*127. નીચેનામાંથી કયું વેબ બ્રાઉઝર નથી?

[A] OPERA [B] SAFARI [C] LYCOS [D] NEOPLANT

128. કઈ ટોપોલોજીમાં બે કમ્પ્યૂટરો બંધ લૂપ સાથે જોડાયેલા હોય છે?

[A] બસ ટોપોલોજી [B] સ્ટાર ટોપોલોજી [C] રીંગ ટોપોલોજી [D] મેશ ટોપોલોજી

*129. વેબસાઈટના નામને કઈ રીતે ઓળખવામાં આવે છે?

[A] HTTP [B] URL [C] UPS [D] POP

130. કઈ ટોપોલોજીમાં જો લૂપમાં કોઈ કારણસર ભંગાણ પડે તો સમગ્ર નેટવર્કમાં પ્રત્યાયન બંધ થઈ જાય છે?

[A] મેશ [B] ટ્રી [C] રીંગ [D] સ્ટાર

131. ઈન્ટરનેટના જોડાણ માટે કમ્પ્યૂટર અને ટેલિફોન વચ્ચે કયું સાધન જોડાયેલું હોય છે?

[A] મોડેમ [B] HUB [C] સર્વર [D] એક પણ નહિ

132. ઓસ્ટ્રેલિયા દેશની વેબસાઈટમાં છેલ્લે કયા પ્રકારના નામનો ડોમેઈન તરીકે ઉપયોગ થાય છે?

[A] .IN [B] .AU [C] .UK [D] .de

133. જો તમારી પાસે વેબસાઈટનું ચોક્કસ સરનામુ ન હોય તો કોની મદદથી શોધી શકાય છે?

[A] ફાઈન્ડ [B] ફેવરીટ [C] હિસ્ટરી [D] શોધ એન્જિન

134. નીચેનામાંથી કયો 32 બીટ્સનો IP નંબર સાચો છે?

[A] 25.22.0.256 [B] 256.0.22.25

[C] 255.255.255.255 [D] 0.256.200.300

135. Website માટે બનાવવામાં આવતા પેજ કયા સ્વરૂપે હોય છે?

[A] Document [B] Web Page [C] Website [D] એક પણ નહિ

136. ઈન્ટરનેટના વિકાસમાં કઈ સંસ્થાએ પાયાની કામગીરી કરી છે?

[A] ISRO [B] BAOU [C] ARPA [D] એક પણ નહિ

137. નીચેની પૈકી કોનો વિસ્તાર સૌથી વધુ હોય છે?

[A] LAN [B] WAN [C] MAN [D] RAN

*138. Internet ના Server માં રહેલો Data આપણા અંગત કમ્પ્યૂટરમાં લાવવાની ક્રિયાને શું કહે છે?

[A] Upload [B] Download [C] Copy [D] એક પણ નહિ

139. IP એડ્રેસના ચાર વિભાગોને .... નિશાની વડે જોડવામાં આવે છે.

[A] * [B] @ [C] . [D] #

140. ફાઈબર ઓપ્ટિક વાયરમાં Data નું વહન કયા સ્વરૂપે થાય છે?

[A] વિદ્યુત [B] પ્રકાશ [C] તરંગ [D] આપેલ તમામ

જવાબો પેપર-4

1.	C	29.	B	57.	C	85.	B	113.	C
2.	D	30.	C	58.	A	86.	A	114.	A
3.	A	31.	B	59.	D	87.	C	115.	C
4.	D	32.	B	60.	B	88.	D	116.	B
5.	A	33.	D	61.	C	89.	C	117.	C
6.	A	34.	D	62.	A	90.	D	118.	C
7.	C	35.	B	63.	B	91.	D	119.	A
8.	B	36.	B	64.	C	92.	A	120.	B
9.	C	37.	B	65.	C	93.	B	121.	D
10.	A	38.	B	66.	B	94.	B	122.	C
11.	A	39.	A	67.	A	95.	C	123.	D
12.	D	40.	D	68.	A	96.	C	124.	B
13.	B	41.	A	69.	C	97.	A	125.	C
14.	A	42.	B	70.	A	98.	C	126.	D
15.	B	43.	C	71.	C	99.	C	127.	C
16.	C	44.	A	72.	C	100.	A	128.	C
17.	D	45.	B	73.	C	101.	D	129.	B
18.	B	46.	A	74.	B	102.	B	130.	C
19.	D	47.	B	75.	C	103.	C	131.	A
20.	A	48.	C	76.	D	104.	A	132.	B
21.	B	49.	B	77.	B	105.	D	133.	D
22.	A	50.	A	78.	A	106.	B	134.	C
23.	D	51.	D	79.	C	107.	D	135.	B
24.	C	52.	A	80.	B	108.	C	136.	C
25.	C	53.	C	81.	C	109.	A	137.	B
26.	C	54.	C	82.	D	110.	B	138.	B
27.	D	55.	A	83.	B	111.	B	139.	C
28.	D	56.	B	84.	D	112.	A	140.	B

કસોટીપત્ર-5

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ

સત્રાંત પરીક્ષા

સમય : 3 **કલાક** | **કુલ ગુણ** : 140

પાઠ્યક્રમ : **ફાઉન્ડેશન** [CCC-01], **એપ્લીકેશન** [CCC-02], **ઇન્ટરનેટ** [CCC-03]

પ્રશ્ન 1 થી 35 | **ફાઉન્ડેશન (CCC-01)** | **45 Minutes**

1. ઓપ્ટીકલ ડીસ્ક તરીકે .... નો સમાવેશ થતો નથી.

   [A] WORM [B] DVD [C] CDROM [D] Floppy Disk

2. ઓપ્ટીકલ ફાઈબરનો ઉપયોગ વધુમાં વધુ .... માં થાય છે.

   [A] Software [B] Hardware [C] Network [D] એક પણ નહિ

*3. સામાન્ય રીતે હાર્ડડિસ્કની ગતિ કલાકના .... કિ.મી. હોય છે.

   [A] 250 [B] 350 [C] 150 [D] 450

4. પ્રથમ પેઢીના કમ્પ્યૂટરમાં .... નો ઉપયોગ થતો હતો.

   [A] ચીપ [B] ટ્રાન્ઝિસ્ટર [C] વેક્યુમ ટ્યુબ [D] એક પણ નહિ

5. ફક્ત વાંચી શકાય તેવી મેમરીનું ટૂંકું નામ શું છે ?

   [A] RAM [B] ROM [C] CAM [D] BAM

6. ઓડીયો કેસેટ રેકોર્ડરમાં ડેટા કયા સ્વરૂપે લખાય છે ?

   [A] Analog [B] Digital

   [C] Analog અને Digital બંને [D] એકપણ નહિ

7. DIL નું પુરું નામ જણાવો.

   [A] Direct In Line [B] Direct Inter Line

   [C] Dual In Line [D] Dual Inter Line

8. Computer ને ફરીથી ચાલુ કરવા માટે કી-બોર્ડ ની કઈ કી વપરાય છે ?

   [A] Ctrl + S [B] Ctrl + F4 [C] Ctrl + Alt + Del [D] Shift + Alt

9. Wordstar એ .... છે.

   [A] શબ્દ પ્રક્રિયક [B] વિન્ડો [C] Hardware [D] એક પણ નહિ

*નોંધ : * (એસ્ટ્રીક) નિશાની સાથેના પ્રશ્નો આબંડકર યુનિવર્સિટીના વિવિધ પેપરોમાં વારંવાર પૂછાય છે.*

10. નીચેનામાંથી કયો વિભાગ કમ્પ્યૂટરનું મગજ ગણાય છે ?

[A] CPU [B] Disk [C] I/O Drives [D] Memory

11. 1 MB = ... KB થાય છે.

[A] 10000 [B] 100 [C] 10 [D] 1024

12. પ્રોગ્રામ માટે નક્કી કરેલ ચિહ્નને .... કહેવાય.

[A] આઈકોન [B] ડેસ્કટોપ [C] ટાસ્ક [D] ચાલક પધ્ધતિ

13. Windows ના Desktop પર શું જોવા મળે છે ?

[A] Folder [B] Icon [C] File [D] આપેલ તમામ

14. .... એ ચાલક પધ્ધતિ પ્રકારનું સોફ્ટવેર છે ?

[A] DOS [B] MAC [C] WARP [D] આપેલ તમામ

15. DVD ની સંગ્રહ ક્ષમતા સામાન્યતઃ .... છે.

[A] 2 GB થી 4.7 GB [B] 4.7 GB થી 17 GB

[C] 650 MB થી 4.7 GB [D] 650 MB થી 17 GB

16. DIR એ કયા પ્રકારનો DOS કમાન્ડ છે ?

[A] આંતરિક [B] બાહ્ય [C] સંયુક્ત [D] એક પણ નહિ

17. માઈક્રોપ્રોસેસરનું ત્રીજું જનરેશન જણાવો.

[A] 30386 [B] 80386 [C] 80286 [D] 80486

18. .... એ ઈન્ટરનેટ બ્રાઉઝર છે.

[A] Netscape Navigator [B] MS-Word

[C] Notepad [D] CorelDraw

*19. કમ્પ્યૂટરની કાર્યશૈલીનું લક્ષણ કયું છે ?

[A] ચોક્કસાઈ [B] ઝડપ [C] વિશ્વસનીયતા [D] આપેલ તમામ

*20. CD ROM Drive ની ગતિ .... હોય છે.

[A] 48x [B] 40x [C] 52x [D] આપેલ તમામ

21. DOS માં ડિરેકટરી બદલવા કયો આદેશ આપવામાં આવે છે ?

[A] MD [B] CD [C] OK [D] Edit

*22. DOS માં બનાવેલ Directory ને દૂર કરવા .... કમાન્ડનો ઉપયોગ થાય છે.

[A] MD [B] RD [C] CD [D] CL

23. કી-બોર્ડમાં કુલ .... ફંકશન કી આવેલી હોય છે.

[A] 10 [B] 11 [C] 12 [D] 13

24. DOS માં બનાવેલ ડિરેક્ટરીને Windows ની પરિભાષામાં કયા નામથી ઓળખવામાં આવે છે ?

[A] File [B] Folder [C] Program [D] એક પણ નહિ

25. DOS માં નવી ફાઈલ બનાવવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે ?

[A] Copy Con [B] COPY [C] XCOPY [D] આપેલ તમામ

*26. વિન્ડોઝમાંથી બહાર નીકળવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે ?

[A] Alt + F4 [B] Ctrl + F4 [C] Alt + F5 [D] Ctlr + F5

27. ડોટ-મેટ્રીક્સ પ્રિન્ટરની ઝડપ લગભગ .... CPS સુધીની હોય છે.

[A] 40 થી 1000 [B] 400 થી 1000 [C] 50 થી 1000 [D] 500 થી 1000

28. DOS માં બનાવેલ ફાઈલને દૂર કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે ?

[A] CD [B] Del [C] Erase [D] RD

29. ખૂબ જ ઉચ્ચ ઘનતા ધરાવતી ફ્લોપી ડ્રાઈવની સંગ્રહ ક્ષમતા .... હોય છે.

[A] 1.2 MB [B] 750 MB [C] 1.44 MB [D] 2.88 MB

30. .... એકમ એક ટ્રાફિક પોલીસ જેવું કાર્ય કરે છે.

[A] ALU [B] CU [C] રજિસ્ટર્સ [Registers] [D] Cache

31. .... એ રજિસ્ટર અને સ્મૃતિ સ્થાનોનાં સમૂહને સમાવે છે.

[A] ALU [B] CU [C] Cache [D] આપેલ તમામ

32. ડીજીટલ વર્સેટાઈલ ડીસ્ક [DVD] ઓછામાં ઓછો .... એકસેસ દર ધરાવે છે.

[A] 50 Kbps [B] 60 Kbps [C] 9.3 Mbps [D] 4.7 Mbps

33. નોટબુક કમ્પ્યૂટરમાં .... નો ઉપયોગ થાય છે.

[A] CRT [B] LCD [C] CTR [D] એક પણ નહિ

34. ડોટ-મેટ્રીક્સ પ્રિન્ટરની ઝડપ .... માં મપાય છે.

[A] Kbps [B] LPS [C] CPS [D] LPM

*35. મોડેમની ઝડપ શેમાં મપાય છે ?

[A] Kbps [B] Mbps [C] bps [D] Gbps

36. Ruler (રૂલર) માં Tabs Alignment કેટલા પ્રકારે આપી શકાય છે ?

[A] પાંચ [B] છ [C] ત્રણ [D] ચાર

37. Page Setup કમાન્ડમાં કેટલા Tab [વિકલ્પ] આવેલાં છે ?

[A] બે [B] છ [C] ચાર [D] ત્રણ

38. વર્ડ એપ્લીકેશનમાં બે લાઈન વચ્ચેનું અંતર વધારવા ઘટાડવા માટે .... ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે.

[A] Space [B] Line [C] Font [D] Paragraph

39. પેરેગ્રાફ કમાન્ડ .... મેનુમાં હોય છે.

[A] File [B] Format [C] Tools [D] Insert

40. સામાન્ય રીતે Document કેટલા View માં જોઈ શકાય છે ?

[A] 3 [B] 5 [C] 2 [D] 1

41. વર્ડમાં પેરેગ્રાફ ગોઠવવા માટે .... અલાઈમેન્ટ હોય છે.

[A] એક [B] ચાર [C] ત્રણ [D] બે

42. વર્ડ પ્રોગ્રામમાં ઓફિસ આસિસ્ટન્ટનો ઉપયોગ કરવા માટે કઈ કી વાપરવામાં આવે છે ?

[A] F5 [B] F7 [C] F8 [D] F1

43. વર્ડમાં ટૂલબારનું કાર્ય કયું છે ?

[A] સમગ્ર દસ્તાવેજમાં ફરવાની છૂટ આપે છે

[B] હાલનો સમય દર્શાવે છે

[C] જ્યાં લખાણ દાખલ કરી શકાય તે સમય દર્શાવે છે

[D] કમાન્ડ ચલાવવાનો ટૂંકો માર્ગ છે

44. એકસેલની એક વર્કબુકમાં કુલ કેટલા મેનુનો ઉપયોગ થાય છે ?

[A] 6 [B] 7 [C] 8 [D] 10

45. Excel માં ફોર્મ્યુલા બાર કેટલા ભાગમાં વહેંચાયેલ છે ?

[A] 1 [B] 2 [C] 3 [D] 4

46. એકસેલમાં ગ્રાફ દોરવાનું ટૂલ કયા મેનુમાં (ટૂલબારમાં) આવેલ છે ?

[A] Formatting [B] View [C] Draw [D] Standard

47. Excel માં Validation કમાન્ડ .... Menu હોય છે.

[A] Format [B] Tools [C] Data [D] Insert

48. Excel માં નીચે દર્શાવેલ કઈ લાક્ષણિકતાનો સમાવેશ થતો નથી ?

[A] Text [B] Worksheet [C] Database [D] Graphics

49. એક સૂત્ર યોગ્ય રીતે પૂર્ણ ન થયું હોય તો .... ભૂલ આવે.

[A] #N/A [B] FALSE [C] #REF [D] #NAME?

50. Excel માં MACRO બનાવવા માટે કયા મેનુનો ઉપયોગ થાય છે ?

[A] Format [B] Tools [C] Data [D] એક પણ નહિ

51. ફાઈલની સાઈઝ .... માં મપાય છે.

[A] mm [B] Point [C] Inch [D] Character

52. AutoFill વિકલ્પ માટે .... મેનુનો ઉપયોગ કરવામાં આવે છે.

[A] Insert [B] Tools [C] Format [D] Fill

*53. એકસેલમાં છ વિષયના માર્કની સરેરાશ શોધવા માટે .... ફંકશનનો ઉપયોગ કરવામાં આવે છે.

[A] = AVERAGE [B] = SUM [C] = IF [D] = COUNT

54. Excel નો ઉપયોગ જણાવો.

[A] પત્ર તૈયાર કરવા માટે [B] ચિત્રો દોરવા

[C] કોષ્ટક સ્વરૂપની ગણતરી કરવા [D] એક પણ નહિ

55. પાવરપોઈન્ટમાં જે પેજ દેખાય છે તે પેજ કયા નામથી ઓળખાય છે ?

[A] Sheet [B] Slide [C] Page [D] Book

56. View Show ઓપ્શન .... મેનુમાં હોય છે.

[A] View [B] Insert [C] Slide Show [D] Format

57. સ્લાઈડ શો દરમ્યાન અંતિમ સ્લાઈડ બાદ તરત જ પ્રથમ સ્લાઈડ આવે તેને .... કહેવાય.

[A] કન્ટીન્યુ શો [B] કાયસ્ક શો [C] કન્વર્ટ [D] બ્લેન્ક

58. વર્ડમાં Change Case કમાન્ડમાં કેટલા વિકલ્પ છે ?

[A] 3 [B] 4 [C] 5 [D] 6

59. MS-Word માં બે લાઈન વચ્ચે જગ્યા છોડવા કયા મેનુમાં જવું પડે ?

[A] Insert [B] View [C] Format [D] Tools

60. WordArt ની સગવડતા કયા મેનુમાં હોય છે ?

[A] Insert [B] View [C] Format [D] એક પણ નહિ

61. MS Excel માં બનતી ફાઈલને .... પણ કહે છે.

[A] Workbook [B] Document [C] Chart [D] Table

62. વર્કશીટનું નામ બદલવા કયા મેનુમાં જવું પડે ?

[A] Insert [B] View [C] Format [D] Data

63. લખાણના Font બદલવા કયા ટૂલબારનો ઉપયોગ થાય છે ?

[A] સ્ટાન્ડર્ડ [B] ફોર્મેટીંગ [C] ડ્રોઈંગ [D] ટેબલ

64. નીચેનામાંથી કયું મેનુ MS-Word માં જોવા મળતુ નથી ?

[A] View [B] Data [C] Tools [D] Table

65. Chart ની વ્યવસ્થા કયા પ્રોગ્રામમાં જોવા મળે છે ?

[A] MS-Word [B] MS-Excel [C] MS-PowerPoint [D] આપેલ તમામ

66. Formulabar એ .... પ્રોગ્રામમાં જોવા મળે છે.

[A] MS-Excel [B] MS-Windows [C] MS-Word [D] એક પણ નહિ

*67. PowerPoint માં કેટલા પ્રકારના Slide Layout હોય છે ?

[A] 14 [B] 20 [C] 24 [D] 30

68. વર્ડમાં તૈયાર કરેલી ફાઈલને પ્રિન્ટઆઉટ લેતાં પહેલા પેજ લેઆઉટ કેવું લાગે છે તે જોવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે ?

[A] Page Setup [B] Print Out [C] Print Preview [D] Print

*69. વર્ડ એપ્લીકેશનમાં Find Command ની શોર્ટકટ કી કઈ છે ?

[A] Ctrl + H [B] Alt + H [C] Ctrl + F [D] Alt + F

*70. વર્ડ એપ્લીકેશનમાં મેઈલ-મર્જ સંપૂર્ણ કરવા કેટલા સ્ટેપની જરૂર પડે છે ?

[A] 5 [B] 6 [C] 7 [D] 8

71. એક્સેલની Sheet નું Background બદલવા માટેનો કમાન્ડ કયા મેનુમાં છે ?

[A] View [B] Insert [C] Format [D] Tools

*72. એક્સેલમાં ગ્રાફ કેટલા પ્રકારના દોરી શકાય છે ?

[A] 13 [B] 14 [C] 15 [D] 16

*73. એક્સેલમાં છેલ્લા Cell નું Address કયું હોય છે ?

[A] A65536 [B] A65535 [C] IV65536 [D] IV65535

74. પાવરપૉઇન્ટ એપ્લીકેશનમાંથી બહાર નીકળવા કયા કમાન્ડનો ઉપયોગ થાય છે ?

[A] Alt + F + C [B] Alt + F + X [C] Ctrl + F + C [D] Ctrl + F + X

75. MS-Word માં મેનુબારના મેનુને કાર્યરત કરવા માટે અંડરલાઈન (Underline) વાળા શબ્દ સાથે કઈ Key Press કરવામાં આવે છે ?

[A] Alt [B] Ctrl [C] Shift [D] Del

76. Macro Run કરવા માટે કઈ શોર્ટકટ કી નો ઉપયોગ થાય છે ?

[A] Alt + F2 [B] Ctrl + R [C] F7 [D] Alt + F8

*77. વર્ડ 2003 માં મેઈલ મર્જમાં બનાવેલ સરનામાનો સમૂહ .... એપ્લીકેશનમાં સંગ્રહ થાય છે.

[A] વર્ડ [B] એકસેસ [C] એકસેલ [D] એક પણ નહિ

78. પાવરફુલ સ્પ્રેડશીટ સોફ્ટવેર તરીકે કઈ એપ્લીકેશન જાણીતી છે ?

[A] MicroSoft Excel [B] Lotus [C] QPRO [D] Wordstar

*79. એકસેલમાં A2 નામના સેલમાં લખેલ લખાણમાં ફેરફાર કરવા માટે કઈ ફંકશન કીનો ઉપયોગ થાય છે ?

[A] F4 [B] F1 [C] F3 [D] F2

80. એકસેલમાં Column ની Width બદલવા માટે કયા મેનુનો ઉપયોગ થાય છે ?

[A] View [B] Insert [C] Format [D] Tools

81. એકસેલમાં ચોક્કસ પ્રકારની રો ને સંતાડવા .... મેનુનો ઉપયોગ કરવામાં આવે છે.

[A] VIEW [B] EDIT [C] FILE [D] FORMAT

*82. પાવરપૉઈન્ટની મદદથી જે ફાઈલ બનાવી એ તેનું સેકન્ડરી નામ .... હોય છે.

[A] .XLS [B] .PPT [C] PNP [D] PPS

83. પાવરપોઈન્ટમાં સ્લાઈડની અંદર રહેલા ચોક્કસ પ્રકારના લખાણને ઈફેકટ આપવા કયા ઓપ્શનની જરૂર પડે છે ?

[A] Layout [B] Custom Animation

[C] Design [D] Effect

84. વર્ડ એપ્લીકેશનમાં Drag અને Drop પદ્ધતિથી લખાણને પસંદ કરવા કઈ કી Press કરી રાખવી જરૂરી છે ?

[A] Ctrl [B] Alt [C] Shift [D] Alt + Ctrl

85. કયું ઓપ્શન આપમેળે જ સામાન્ય ટાઈપીંગ અને સ્પેલીંગમાં થતી ભૂલો સુધારે છે ?

[A] ઓટો ટેકસ્ટ [B] ઓટો કરેકટ [C] ઓટો રાઈટર [D] ઓટો ઇફેકટ

*86. વર્ડ એપ્લીકેશનમાં પુનરાવર્તીત કાર્ય માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ?

[A] ઓટો ટેકસ્ટ [B] ઓટો કરેકટ [C] મેક્રો [D] એક પણ નહિ

*87. વર્ડ એપ્લીકેશનમાં મેઈલ-મર્જ કરતાં મેઈલ-મર્જ નામનું ટૂલબાર આવે છે, તેમાં જવા માટેની શોર્ટકટ કી કઈ છે ?

[A] Alt + C [B] Shift + F [C] Ctrl + F [D] Alt + Shift + F

88. વર્ડ એપ્લીકેશનમાં બે કોલમ વચ્ચેનું સ્પેસીંગ કેટલું હોય છે ?

[A] 1" [B] 0.75" [C] 0.25" [D] 0.5"

*89. વર્ડ એપ્લીકેશનમાં ડોકયમેન્ટને પ્રિન્ટ કરવા માટે કેટલા પ્રકારના ORIENTATION હોય છે ?

[A] 2 [B] 3 [C] 4 [D] 5

90. વર્ડ કયા પ્રકારનો પ્રોગ્રામ છે ?

[A] વર્ડ પ્રોસેસર [B] ઓપરેટીંગ સીસ્ટમ

[C] સ્પ્રેડશીટ [D] આપેલ તમામ

91. વર્ડમાં Undo કમાન્ડની વિરુદ્ધ અસર માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે ?

[A] Repeat [B] Redo [C] Delete [D] Cancel

92. પાવરપૉઈન્ટમાં Help માટે કઈ ફંકશન કી નો ઉપયોગ થાય છે ?

[A] F1 [B] F2 [C] F5 [D] F7

93. નીચેનામાંથી કોના ઉપર પેજ નંબર, લાઈન નંબર, કોલમ વગેરેની સ્થિતિ જોવા મળે છે ?

[A] સ્ટાન્ડર્ડ ટૂલબાર [B] રૂલરબાર [C] સ્ટેટ્સબાર [D] ફોર્મેટીંગ ટૂલબાર

94. વર્ડના દસ્તાવેજમાં ડ્રોઈંગ ટૂલબાર ઉમેરવા માટે કયા મેનુનો ઉપયોગ કરશો ?

[A] Edit [B] View [C] Insert [D] Format

95. Find, Replace, Go To કમાન્ડ કયા મેનુમાં આવેલ છે ?

[A] File [B] Edit [C] View [D] Insert

96. માઉસની મદદથી ટ્રિપલ-ક્લિક કરવાથી શું પસંદ થાય છે ?

[A] શબ્દ [B] વાકય [C] ફકરો [D] ડોકયુમેન્ટ

97. વર્ડ દસ્તાવેજમાં કયા મેનૂની મદદથી ટેબલ ઉમેરી શકાય છે ?

[A] File [B] Insert [C] Tools [D] Table

*98. Word માં બિનજરૂરી અક્ષરોને દૂર કરવા કઈ કીનો ઉપયોગ થાય છે ?

[A] Delete [B] Backspace

[C] Ins [D] Delete અને Backspace બંને

99. Word માં Cut કે Copy થયેલ માહિતી કયાં સ્ટોર થાય છે ?

[A] Office Clipboard [B] Word Clip [C] Paste [D] એક પણ નહિ

100. Word માં ચિત્ર ઉમેરવા .... મેનૂમાં આવેલ Picture કમાન્ડનો ઉપયોગ થાય છે.

[A] Insert [B] Format [C] Edit [D] View

101. પાવરપોઈન્ટમાં નીચેના પૈકી કઈ સુવિધાનો ઉપયોગ શકય છે ?

[A] Sound [B] Movie [C] Clipart [D] આપેલ તમામ

102. Speaker's Note બનાવવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે ?

[A] Excel [B] Word [C] PowerPoint [D] Wordpad

103. પ્રેઝન્ટેશનમાં ડિઝાઈન, માહિતી, રંગ બધી જ વસ્તુઓ જાતે તૈયાર કરવા માટે કોની પસંદગી કરશો ?

[A] ઓટો કન્ટેન્ટ વિઝાર્ડ [B] માહિતીઓ

[C] આઉટલાઈન [D] બ્લેક પ્રેઝન્ટેશન

104. કયા વ્યૂમાં સ્ક્રીનમાં સમાઈ શકે એટલી સ્લાઈડ નાના-નાના ભાગમાં તેના ઓરીઝનલ ફોર્મેટમાં જોવા મળે છે ?

[A] Normal [B] Slide Sorter [C] Outline View [D] Slide View

105. પાવરપોઈન્ટમાં દરેક સ્લાઈટમાં બેકગ્રાઉન્ડ એક સરખું રાખવા માટે કયા Option નો ઉપયોગ થાય છે ?

[A] Apply [B] Apply to All [C] All Slide [D] એક પણ નહિ

પ્રશ્ન 106 થી 140 **ઈન્ટરનેટ [CCC-03]** **45 Minutes**

106. સંખ્યાકીય સંકેતોને અનૂરૂપ સંકેતોમાં ફેરવવા માટે કોનો ઉપયોગ થાય છે ?

[A] VDU [B] SCANNER [C] MODEM [D] PRINTER

107. ઈ-મેઈલ તૈયાર કરીને .... ને આપવામાં આવે છે.

[A] એપ્લીકેશન સર્વર [B] મેઈલ સર્વર [C] સર્વરને [D] મોનીટરને

108. વેબસાઈટના નામમાં .org લખવામાં આવે તેનો અર્થ તે સાઈટ કેવા પ્રકારની છે, તેનો ખ્યાલ આવતો હોય છે ?

[A] સંગઠન [B] સરકારી [C] શૈક્ષણિક [D] એક પણ નહિ

109. નીચે દર્શાવેલ એપ્લીકેશનમાં કઈ એપ્લીકેશન વેબ-બ્રાઉઝર તરીકે ઓળખાય છે ?

[A] ઈન્ટરનેટ એક્ષપ્લોરર [B] ઈન્ટરનેટ રિલેચિટ

[C] ઈન્ટરનેટ [D] એક પણ નહિ

*110. કમ્પ્યૂટર પરથી માહિતી વેબ-સર્વર પર મોકલીએ ત્યારે તે કયા નામથી ઓળખાય છે ?

[A] Return [B] Download [C] Upload [D] Send

111. ઈ-મેઈલ માટે શું હોવું જરૂરી છે ?

[A] ઈ-મેઈલ એડ્રેસ [B] ફોન નંબર [C] મકાન [D] એક પણ નહિ

112. ઈન્ટરનેટ રિલે ચિટ નામનું સોફ્ટવેર શા માટે વપરાય છે ?

[A] કોન્ફરન્સિંગ [B] ટેલનેટ [C] એફ.ટી.પી. [D] એક પણ નહિ

113. શોધ (સર્ચ) એન્જિન એક પ્રકારનું .... છે.

[A] હાર્ડવેર [B] સોફ્ટવેર [C] ફર્મવેર [D] હ્યુમનવેર

114. OSI મોડેલમાં સમાવિષ્ટ એક કરતાં વધુ નિયમોના ગણને શું કહેવાય છે ?

[A] પ્રોટોકોલ [B] નેટવર્ક [C] ટોપોલોજી [D] બ્રાઉઝર

115. ફાઈબર ઓપ્ટિક વાયરમાં પ્રત્યાયનની ઝડપ વધુમાં વધુ કેટલા Mbps જેટલી મળે છે ?

[A] 100 [B] 1000 [C] 10,000 [D] 1,00,000

*116. ભૂતકાળમાં જે કોઈ વેબસાઈટની મુલાકાત લીધી હોય તેની માહિતી મેળવવા કયા બટનનો ઉપયોગ થાય છે ?

[A] History [B] Home [C] Search [D] Favorites

*117. જ્યારે મેઈલની સાથે કોઈક ફાઈલને પણ મોકલવી હોય તો કયું બટન Press કરવામાં આવે છે ?

[A] Add [B] Join [C] Attachment [D] Add File

*118. ઈન્ટરનેટમાં ઈ-મેઈલનું આદાન પ્રદાન કરવા .... નો ઉપયોગ થાય છે.

[A] HTTP [B] FTP [C] POP [D] આપેલ તમામ

119. તૈયાર કરેલા ઈ-મેઈલ મોકલવા માટે .... બટનનો ઉપયોગ થાય છે.

[A] Attachment [B] Send [C] Forward [D] એક પણ નહિ

120. .... એ ઈ-મેઈલ ક્લાયન્ટ સોફ્ટવેર છે.

[A] Internet Explorer [B] Outlook Express

[C] Mozila [D] એક પણ નહિ

*121. IP એડ્રેસની સંખ્યા આશરે .... જેટલી થાય છે.

[A] 4 લાખ [B] 256 [C] 4 અબજ [D] 4 કરોડ

122. નીચેનામાંથી કયો પ્રોટોકોલ નથી ?

[A] WWW [B] HTTP [C] FTP [D] TCP

123. TCP/IP નું પુરું નામ શું છે ?

[A] ટ્રાન્સફર કંટ્રોલ પ્રોટોકોલ/ઈન્ટરનેટ પ્રોવાઈડર

[B] ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ/ઈન્ટરનેટ પ્રોટોકોલ

[C] ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ/ઈન્ટરફેસ પ્રોવાઈડર

[D] એક પણ નહિ

124. ravi@yahoo.com માં yahoo.com શું છે ?

[A] ઈમેઈલ સર્વિસ પ્રોવાઈડર [B] USP

[C] ઉપભોક્તાનું નામ [D] ISP

*125. Network ના મુખ્ય પ્રકાર કેટલા છે ?

[A] એક [B] બે [C] ત્રણ [D] ચાર

*126. ઈન્ટરનેટના વિકાસમાં પાયાનું કામ કોણે કર્યુ છે ?

[A] IBM [B] Pentagon [C] Microsoft [D] Wipro

127. મંદિર, કલબ, હોસ્પિટલ જેવી સંસ્થાઓના નામની પાછળ કયું Domain Name આવે છે ?

[A] .com [B] .edu [C] .org [D] .net

128. BBS (બુલેટીન બોર્ડ સેવા) પ્રકારની ઈન્ટરનેટ પરની પ્રખ્યાત સમાચાર સેવા તરીકે શું પ્રચલિત છે ?

[A] Usenet [B] Usemail [C] BBC [D] એક પણ નહિ

129. નીચેના પૈકી કોણ સૌથી વધુ ઝડપી છે ?

[A] Kbps [B] Mbps [C] bps [D] Gbps

130. આપણાં ઘરમાં ટેલીવિઝન સેટમાં કયા કેબલનો ઉપયોગ થાય છે ?

[A] કો-એક્ષિયલ [B] ફાઈબર [C] માઈક્રોવેવ [D] સેટેલાઈટ

*131. .... એ અગાઉ મોકલેલ વિજાણુ ટપાલોનો સંગ્રહ કરી રાખે છે.

[A] Inbox [B] Outbox [C] Sent Items [D] Address

132. કોઈપણ કારણસર જરૂરી વેબપેજ મેળવવા માટેની વિનંતી નવેસરથી મોકલવા માટે .... બટનનો ઉપયોગ થાય છે.

[A] Favorites [B] Refresh [C] Search [D] History

133. નીઓપ્લાન્ટ, મોઝેક, નેટસ્કેપ કોમ્યુનીકેટર .... છે.

[A] સર્ચ એન્જિન [B] વેબ સર્વર [C] વેબ બ્રાઉઝર [D] વેબસાઈટના એડ્રેસ

134. Fabmert.com વેબસાઈટનું ક્ષેત્ર કયું છે ?

[A] સમાચાર, માલ-સામાન [B] પુસ્તકો-સંગીત

[C] રોજગાર માહિતી [D] આપેલ તમામ

*135. eBay ઈલેક્ટ્રોનિક કોમર્સની .... પ્રકારની સેવા છે.

[A] B2B [B] B2C [C] C2C [D] G2C

136. .... સોફ્ટવેરના ઉપયોગથી વિશ્વમાં ક્યાંય દૂર-સ્થિત કમ્પ્યૂટર સાથે સંપર્ક સાધી શકાય છે.

[A] બુલેટિન બોર્ડ સેવા [BBS] [B] ટેલનેટ [Telnet]

[C] યુઝનેટ [Usenet] [D] ચેટિંગ

*137. કમ્પ્યૂટરના વેબસર્વરમાંથી આપણા કમ્પ્યૂટર માહિતી કે ફાઈલ ની નકલ કરવાની પ્રક્રિયાને શું કહે છે ?

[A] અપલોડ [B] ડાઉન લોડિંગ [C] ટેલનેટ [D] યુઝનેટ

138. કઈ ટોપોલોજીમાં તમામ કમ્પ્યૂટર્સ એક જ પ્રત્યાયન માધ્યમનો ઉપયોગ કરે છે ?

[A] મેક્ષ [B] રીંગ [C] બસ/ટ્રી [D] સ્ટાર

139. કઈ ટોપોલોજીમાં મધ્યસ્થ નિયંત્રકમાં ખામી હોય તો સમગ્ર નેટવર્ક બંધ થઈ જાય છે ?

[A] રીંગ [B] સ્ટાર [C] બસ [D] મેક્ષ

140. કમ્પ્યૂટર નેટવર્ક સ્થાપિત કરવાની કઈ પદ્ધતિમાં પ્રત્યાયનની ઝડપ 100 Mbps થી 1000 Mbps જેટલી હોય છે ?

[A] કો-એક્ષિયલ વાયર [B] ફાઈબર ઓપ્ટિક વાયર

[C] રેડિયો તથા માઈક્રોવેવ [D] ઉપગ્રહ

જવાબો કસોટીપત્ર – 5

1.	D	29.	D	57.	B	85.	B	113.	B
2.	C	30.	B	58.	C	86.	C	114.	A
3.	C	31.	A	59.	C	87.	D	115.	B
4.	C	32.	B	60.	A	88.	D	116.	A
5.	B	33.	B	61.	A	89.	A	117.	C
6.	A	34.	C	62.	C	90.	A	118.	C
7.	C	35.	B	63.	B	91.	B	119.	B
8.	C	36.	A	64.	B	92.	A	120.	B
9.	A	37.	D	65.	D	93.	C	121.	C
10.	A	38.	D	66.	A	94.	B	122.	A
11.	D	39.	B	67.	C	95.	B	123.	B
12.	A	40.	B	68.	C	96.	C	124.	A
13.	D	41.	B	69.	C	97.	D	125.	C
14.	D	42.	D	70.	B	98.	D	126.	B
15.	B	43.	D	71.	C	99.	A	127.	C
16.	A	44.	D	72.	B	100.	A	128.	A
17.	B	45.	B	73.	C	101.	D	129.	D
18.	A	46.	D	74.	B	102.	C	130.	A
19.	D	47.	C	75.	A	103.	D	131.	C
20.	D	48.	D	76.	D	104.	B	132.	B
21.	B	49.	A	77.	B	105.	B	133.	C
22.	B	50.	B	78.	A	106.	C	134.	B
23.	C	51.	D	79.	D	107.	B	135.	C
24.	B	52.	B	80.	C	108.	A	136.	B
25.	A	53.	A	81.	D	109.	A	137.	B
26.	A	54.	C	82.	B	110.	C	138.	C
27.	A	55.	B	83.	B	111.	A	139.	B
28.	B	56.	C	84.	A	112.	A	140.	B

વિભાગ-3 પ્રાયોગિક પરીક્ષા

પ્રાયોગિક પરીક્ષા પેપર - 1 કુલ ગુણ : 100

Q.1 તમારા જન્મ દિવસ નિમિત્તે ચાર મિત્રોને આમંત્રણ આપવું છે. Mail-Merge નો ઉપયોગ કરી નીચેનો સંદેશો તેઓને મોકલી આપો. **[30]**

> To,
>
> <<Name>>
>
> <<Address1>>
>
> <<Address2>>
>
> <<City>>
>
> Dear........,
>
> I am Celebrating MY Birthday on the 25th July with a small party. Why don't You join Me and Some of our friend ? Come to My place any time between 6:00 PM and 9:00 PM of course, the earliear You come, the More fun we will have! Do Come!
>
> Your Friend,
>
> SONU

Q.2 નીચે આપેલા Table ને MS-Excel માં બનાવી દર્શાવ્યા પ્રમાણેની અસર આપો. **[30]**

Ravi Agency			
Year	Sales	Purchase	Profit
2005-06	2000	1200	?
2006-07	3500	2800	
2007-08	5500	4500	
2008-09	6000	5300	
2009-10	7000	5000	
Total			

→ **સૂચનાઓ :**

- Font = Arial Black
  Size = 16
- Formula
  Profit = Sales–Purchase
- Sort Data Profit With Ascending Order

Q.3 જર્નલ **[20]**

Q.4 વાયવા (મૌખિક પ્રશ્નો) **[20]**

પ્રાયોગિક પરીક્ષા પેપર – 2 કુલ ગુણ – 100

Q.1 MS-Word માં નીચેના લખાણને ટાઈપ કરી સૂચના મુજબ કાર્ય કરો. [40]

Gautam Buddha

Buddha Means 'the enlightened one.' And Gautam Buddha was one of the greatest religious teachers that the world has seen. His teachings Expounded in Buddhism, are immensely popular in Burma, Chine, Japan and Other South Eastem Countries.

Siddhartha was made to lead a very sheltered life as the astrologers had predicted that he would give up wordly pleasures to follow a different path. The King wanted to avoid that at all costs and so did not let him out of the palace. He hoped that siddartha would one day become king.

→ **સૂચનાઓ :**

1. Font – Couriear New, Style – Italic, Size = 14
2. Title ને WordArt ની Effect આપો.
3. 'the enlightened one' ને Bold દર્શાવો.
4. ઉપરોક્ત પેરેગ્રાફને ડાબી અને જમણી બાજુ સમાંતર ગોઠવો.
5. પેરેગ્રાફનું 1.5 Line Spacing રાખો.
6. પેજનું Background Pink રાખો.
7. પેરેગ્રાફને ન્યુઝ પેપરની જેમ ત્રણ કોલમમાં ફેરવો અને બે કોલમ વચ્ચે લાઈન દર્શાવો.

Q.2 MS-Excel એપ્લીકેશનમાં નીચે મુજબ માહિતી ટાઈપ કરી, સૂચના મુજબ જવાબ આપો. [20]

Name	Department	Designation	Salary
Ravi	Admine	Manager	22,000
Sanjay	Sales	Manager	19,500
Pankaj	Purchase	Assistant	9,800
Bhrugesh	Sales	Assistant	10,500
Dinesh	Production	Assistant	7,000
Pinal	Sales	Assistant	7,500
Dipti	Purchase	Manager	18,000

→ **સૂચનાઓ :**

1. ઉપરોક્ત ડેટાબેઝને Name ફિલ્ડ પ્રમાણે ચઢતા(Ascending) ક્રમમાં ગોઠવો.
2. Auto Filter ની મદદથી Department = Sales હોય તેવા રેકોર્ડ્ઝ મેળવો.
3. Department = Sales અને Salary > 8,000 હોય તેવા રેકોર્ડ્ઝ મેળવો.
4. Salary નું Grand Total મેળવો.

Q.2 MS-PowerPoint માં પ્રેઝન્ટેશન તૈયાર કરી નીચે દર્શાવેલ સૂચના મુજબ કાર્ય કરો. **[20]**

Slide - 1

WEL COME
TO
SARASWATI COMPUTER
CENTRE

Slide - 2

Courses
- MS-Office
  CCC
  Tally.ERP9
  DTP

Slide - 3

SARASWATI	
MS-Office	• CCC
- Windows	- Dos
- Dos	- Internet
- Word	- Word
- Excel	- Excel
- PowerPoint	- PowerPoint

Slide - 4

FAS
Tally9
Tally.ERP9
Ex[Tata]
ચિત્ર

→ **સૂચનાઓ :**

1. સ્લાઈડમાં રહેલ લખાણમાં Formattiong નીચે મુજબ કરો.
   Font-Size : 12, Font Style : Italic, Font : Arial,
   Color : Pink
2. Slide–4 માં ClipArt ઉમેરો.
3. Slide–4 ની Duplicate સ્લાઈડ બનાવો.
4. બનાવેલ Duplicate સ્લાઈડ [Slide–5] દૂર કરો.
5. દરેક સ્લાઈડમાં Slide Transition ની Effect આપો.
6. દરેક સ્લાઈડને Animation ની Effect આપો.
7. સ્લાઈડને Save કરો.

Q.4 મૌખિક પરીક્ષા [Viva] **[20]**

પ્રાયોગિક પરીક્ષા પેપર – 3 કુલ ગુણ – 100

Q.1 MS-Word માં નીચે પ્રમાણે ડોકયુમેન્ટ Tab ની મદદથી તૈયાર કરો. **[30]**

No	Name	Course	Total
1	Dipak	CCC	69
2	Tina	Tally	74
3	Bhoomil	MS-Office	83
4	Harsh	CCC	78
5	Sonu	DTP	87

નીચે પ્રમાણે Tab Set કરવાના છે :

Column	Tab Position	Alignment	Leader
No	1"	Right	None
Name	1.5"	Left	None
Course	4"	Right	------
Total	5.5"	Decimal	None

→ **સૂચનાઓ :**

1. WordArt ની મદદથી Deep Computer Center ટાઈટલ ટાઈપ કરો.
2. ClipArt ની મદદથી લખાણની નીચે કમ્પ્યૂટરનું ચિત્ર દર્શાવો.
3. ચિત્રની નીચે Com ટાઈપ કરતાં Computer ટાઈપ થઈ જાય તેવી Effect Auto Correct ની મદદથી દર્શાવો.
4. માહિતીને તમારા નામથી Save કરો.

Q.2 નીચે જણાવેલ Slide ની મદદથી પાવરપૉઈન્ટમાં પ્રેઝન્ટેશન તૈયાર કરી સૂચના મુજબ કાર્ય કરો. **[30]**

Slide - 1

Introduction
To
Computer
By
Ravindra

Slide - 2

COMPUTER
- Hardware
- Software

Slide - 3

Hardware
- Monitor
- Keyboard
- CPU
- Mouse

Slide - 4

Software
- MS-Word
- MS-Excel
- MS-PowerPoint
- Tally.ERP9

→ **સૂચનાઓ :**

1. દરેક Slide માં અલગ-અલગ Slide Design Apply કરો.
2. દરેક Slide માં Custom Animation ની Effect આપો.
3. દરેક Slide પર Slide Transition ની Effect આપો.
4. દરેક Slide પર 2 second નો ટાઈમ Set કરો.
5. પ્રેઝન્ટેશનને તમારા નોંધણી નંબરથી Save કરો.

Q.3 જર્નલ **[20]**

Q.4 મૌખિક પરીક્ષા [Viva] **[20]**

પ્રાયોગિક પરીક્ષા પેપર – 4 કુલ ગુણ – 100

Q.1 MS-Excel એપ્લીકેશનમાં નીચે મુજબ માહિતી દાખલ કરી પ્રશ્નોના ઉત્તરો આપો. [20]

	A	B	C	D
1	Tina Corporation			
2	Item	Cost	Quantity	Total Cost
3	PEN	8	20	?
4	PENCEL	4	25	
5	NOTE BOOK	12	50	
6	SHRPNER	5	80	
7			Total	

→ **સૂચનાઓ :**

1. સૂત્રની મદદથી Total Cost શોધો.
2. Row-1 માં દર્શાવેલ Title ને Merge અને Center Alignment ની અસર આપો.
3. સેલ B4 ની કિંમત 4 ને બદલે 10 કરો.
4. દરેક કોલમની પહોળાઈ એકસમાન 20 ની રાખો.
5. Total Cost કોલમને સેન્ટર અલાઈમેન્ટની Effect આપો.
6. આપેલ વર્કશીટને ઓટો ફોર્મેટની અસર આપો.

Q.2 MS-Word માં નીચેનો પત્ર ટાઈપ કરી સૂચનાઓ પ્રમાણે કાર્ય કરો. [40]

Harsh R. Parmar
19, Samarth Duplex,
Nagarpalika Road,
Chandkheda–382424.
25th August–2010.

To,
The Editor,
The India Express,
Ahmedabad.
Sir,

Sub : Complaint about nuisance of loud speakers at night.

I shall be obliged if you allow me to make the following appeal to the authorities, through the columns of your paper.

The Marriage season is in full swing now. In some of the Marrige-parties it is a practice to entertain the guests at a mandap with records played with the help of loud-speakers. This Practice May be good for entertainment, but it is certainly a nuiscance to others who are living in the locality near by. The records are played without stop from the morning to late at night. Even students get disturbed by the noise. We can not read and study. I request the authorities, there fore, to put a ban on the public playing of records; after Mid-Night, By so doing the people who are disturbed on all days woudl breathe a sign of relief, when they are not compelled to hear the noise of the songs.

Your Truly,
Haresh R. Parmar

→ **સૂચનાઓ :**

1. પ્રથમ Address ને જમણી બાજુ Set કરો.
2. Sub ની માહિતી ઘાટા અક્ષરોમાં દર્શાવો.
3. પત્રનું ગ્રામર ચકાસો.
4. પત્રને ડાબી અને જમણી બાજુ સમાંતર રીતે Set કરો.
5. પત્રને સેવ કરો.

Q.3 જર્નલ **[20]**

Q.4 મૌખિક પરીક્ષા [Viva] **[20]**

પ્રાયોગિક પરીક્ષા પેપર – 5   કુલ ગુણ – 100

Q.1 MS-Word માં નીચે આપેલ માહિતી ટાઈપ કરી સૂચના મુજબ કાર્ય કરો. **[40]**

There is an enduting tenderness in the love of a Mother for her Son transcends all other affections of the heart. It is neither to be chilled by selfishness nor dauted by danger, nor weakened by worthlessness nor stifled by ingratitude. She will sacrifice every comfort to this convenience. She will surrender every pleasure to his enjoyment. She will glory in his name and exult in his prosperity and if disgrace overtakes him he will be the dearer to her for misfortune and if disgrace settles upon his name, she will still love and cherish him in spite of his disgrace. If the entire world beside cast him off, she will be the entires world to him.

→ **સૂચનાઓ :**

1. આપેલ પેરેગ્રાફને WordArtની મદદથી Mother's Love હેડિંગથી સેન્ટરમાં દર્શાવો.
2. ઉપરોક્ત માહિતીમાં લખાણ માટે ફોન્ટની ગોઠવણી આ પ્રમાણે કરો–

   Font : Arial Black, Size : 14, Color = Blue
3. ઉપરોક્ત માહિતીમાં લાઈન સ્પેસિંગ ડબલ કરો.
4. ઉપરોક્ત માહિતીને Justify ની Effect આપો.
5. ઉપરોક્ત માહિતીમાં સ્પેલ ચેક કરીને જો સ્પેલીંગની ભૂલો હોય તો તે દૂર કરો.
6. ઉપરોક્ત માહિતીના તમામ અક્ષરો કેપીટલ લેટરમાં દર્શાવો.

Q.2 MS-Excel માં નીચે આપેલ માહિતી ટાઈપ કરી આપેલ સૂચના મુજબ કાર્ય કરો. **[20]**

	A	B	C	D	E	F	G
1	No.	Name	Dept.	Basic	DA	HRA	Net Total
2	1	Deepak	Sales	8,500	?	?	?
3	2	Tina	Accounts	10,000			
4	3	Ketan	Purchase	7,200			
5	4	Harsha	Accounts	6,500			

→ **સૂચનાઓ :**

1. No, Name, Dept., Basic, DA, HRA અને NET TOTAL ને ઘાટા અક્ષરોમાં દર્શાવો.
2. DA – Basic ના 30 % ગણો.
3. HRA – Basic ના 20 % ગણો.
4. NET TOTAL માટે Basic, DA અને HRA નો સરવાળો કરો.
5. ઉપરોક્ત ટેબલને આકર્ષક દર્શાવો.

Q.3 નીચે જણાવેલ Slide ની મદદથી પાવરપોઈન્ટમાં પ્રેઝન્ટેશન તૈયાર કરી સૂચના મુજબ કાર્ય કરો. **[20]**

Slide - 1

WEL COME
TO
B.A.O.U.
AHMEDABAD

Slide - 2

B.A.O.U.
Degree Course
Diploma Course
Certificate Course

Slide - 3

Degree Course
B.A.
B.Com.
M.A.

Slide - 4

Diploma Course
Diploma in Insurance
Diplomain in Tax Practice
Diploma in Advance Accounting

→ **સૂચનાઓ :**

1. સ્લાઈડના લખાણ પર Formatting [Font, Size, Font Color] Set કરો.
2. બીજી Slide માં Clipart ઉમેરો.
3. તમામ સ્લાઈડનું બેકગ્રાઉન્ડ એક સમાન રહે તેવી Effect આપો.
4. સ્લાઈડમાં Slide Transition ની Effect આપો.
5. ફંકશન કી ની મદદથી સ્લાઈડ શો સ્ક્રીન પર દર્શાવો.

Q.4 મૌખિક પરીક્ષા [Viva] **[20]**

હિંદ સ્વરાજ પેપર - 1

કુલ ગુણ : 35

1. કઈ લાગણી હિંદમાં ઉત્પન્ન થયેલી તમે જુઓ છો ?

   [A] પરતંત્રતાની [B] સંસ્થાનની [C] સામ્રાજ્યની [D] સ્વરાજની

2. કયા અંગ્રેજે લખાણો લખી, આપણને (સ્વરાજ માટે) જગાડ્યા છે ?

   [A] ક્લાઈવે [B] માઉન્ટ બેટને [C] હેસ્ટિંગ્સે [D] મિ.હ્યુમે

3. પ્રો.ગોખલેને આપણે કેવા ગણવા જોઈએ ?

   [A] દેશનેતા [B] કોંગ્રેસના નેતા [C] સ્વરાજના સ્તંભ [D] મવાલપક્ષના નેતા

4. ગાંધીજીના મતે બંગાળાના ભાગલાથી અંગ્રેજી વહાણમાં શું પડ્યું છે ?

   [A] ભાગલો પડ્યો છે [B] પાણી ભરાયું છે

   [C] પવન ભરાયો છે [D] માછલાં ભરાયા છે

5. કોણ હંમેશા કહેતા કે હિન્દુસ્તાનમાં અસંતોષ ફેલાવવાની જરૂર છે ?

   [A] મિ.હ્યુમ [B] કર્ઝન [C] વેડરબર્ન [D] વેલેસ્લી

6. અંગ્રેજો આપણી સાથે કેવી રીતે વર્તે છે ?

   [A] માનપૂર્વક [B] ઉદ્ધતાઈથી [C] સહાનુભૂતિપૂર્વક [D] સ્વજનની માફક

7. ગાંધીજીના મતે ઈંગ્લેન્ડની પાર્લામેન્ટના મેમ્બરો કેવા છે ?

   [A] આડંબરિયા અને સ્વાર્થી [B] નિસ્પૃહી અને નિસ્વાર્થી

   [C] સેવાભાવી અને તેજસ્વી [D] લોકસેવક અને પ્રામાણિક

8. પાર્લામેન્ટ કેવા માણસોને લાયક નથી રહી ?

   [A] નાસ્તિક [B] આસ્તિક [C] વિશ્વાસુ [D] ધર્મિષ્ઠ

9. ગાંધીજીના મતે જો હિંદુસ્તાન અંગ્રેજોની નકલ કરે તો શું થઈ જાય ?

   [A] નકલી [B] વિકસીત [C] સમૃદ્ધ [D] પાયમાલ

10. ઈંગ્લેન્ડની સ્ત્રીઓને કયા ભટકવું પડે છે ?

    [A] બજારમાં [B] જંગલમાં [C] શેરીઓમાં [D] રસ્તા પર

11. અંગ્રેજો આપણા દેશમાં શા માટે આવ્યા હતા ?

    [A] ફરવા [B] રાજ્ય કરવા [C] વેપાર કરવા [D] યુદ્ધ કરવા

12. અંગ્રજોના આગમન સમયે, હિન્દુ-મુસલમાન વચ્ચે શું ચાલતું હતું ?

[A] શિક્ષણ ની આપ-લે [B] હુંસાતુંસી [C] વેર [D] મૈત્રી

13. ગાંધીજીના મતે અંગ્રેજોનો પરમેશ્વર કોણ છે ?

[A] પૈસો [B] સત્તા [C] કીર્તિ [D] આઝાદી

14. ધર્મ આપણને શું શીખવે છે ?

[A] દૂન્યવી વસ્તુ વિશે ઉત્સાહી રહેવું

[B] દુન્યવી વસ્તુ વિશે મંદ રહેવું

[C] ધાર્મિક વસ્તુ વિશે મંદ રહેવું

[D] નાસ્તિક રહેવું

15. સુધારો કેવો રોગ છે ?

[A] ચેપી [B] અદશ્ય [C] બીનચેપી [D] જીવલેણ

16. અફીણથી કઈ બાબતની ખબર પડી ?

[A] તેના કેફની [B] તેના ફાયદાની [C] તેના ગેરફાયદાની [D] તેના વ્યસનની

17. દુનિયાના કોઈપણ ભાગમાં એક પ્રજાનો અર્થ ... એમ થયો નથી.

[A] એક રિવાજ [B] એક ભાષા [C] એક દેશ [D] એક ધર્મ

18. ગાંધીજીના મતે ગૌરક્ષા પ્રચારિણી સભા, તે કેવી સભા ગણાવી જોઈએ ?

[A] ગામ રક્ષા પ્રચારિણી [B] ગૌવધ પ્રચારિણી

[C] ગોબર રક્ષા પ્રચારિણી [D] ગૌવંશરક્ષા પ્રચારિણી

19. ગાંધીજીના મતે હિંદું-મુસ્લિમ એકતા માટે શું કરવું જોઈએ ?

[A] બંને કોમોમાં વિશ્વાસ સ્થાપવો પડશે [B] દોસ્તી વધારવી પડશે

[C] અંતર વધારવું પડશે [D] અંતર ઘટાડવું પડશે

20. અદાલતો આવવાથી માણસો કેવા બન્યા ?

[A] ડરપોક [B] ભીરું [C] બાયલા [D] સ્વાર્થી

21. બીજા રાષ્ટ્રો નાશ પામ્યા, ત્યારે હિંદુંસ્તાન કેવું છે ?

[A] પડી ભાગ્યું છે [B] વિકાસ પામ્યું છે

[C] ગુલામ રહ્યું છે [D] તળિયે મજબૂત છે

22. માણસની વૃત્તિ કેવી છે ?

[A] અચળ [B] અડગ [C] ચંચળ [D] પરિવર્તન શીલ

23. કોણે હિંદી સુધારાને બાળકની જેમ વળગી રહેવું ઘટે છે ?

[A] હિંદના નેતાઓએ [B] અંગ્રેજોએ

[C] હિંદના હિતેચ્છુઓએ [D] પશ્ચિમના સુધારકોએ

24. આપણી ગુલામી જાય તો હિંદુંસ્તાનની ગુલામી ગઈ એમાં કઈ વ્યાખ્યા મળે છે ?

[A] સ્વચ્છંદતાની [B] સ્વરાજ્યની [C] સુધારાની [D] સંરક્ષણની

25. મેઝિની અને ગેરિબાલ્ડી બંને ... હતા.

[A] પૂજનીય [B] તિરસ્કૃત [C] દેશદ્રોહી [D] પરમાર્થી

26. કોણે દરેક ઈટાલિયનને હથિયાર આપ્યા ?

[A] ગેરિબાલ્ડીએ [B] મેઝિનીએ [C] નેપોલિયને [D] અમીને

27. અંગ્રેજોએ મારામારી કરીને ક્યારે વોટના વિશેષ હકો લીધા ?

[A] ઈ.સ. 1947 [B] ઈ.સ. 1833 [C] ઈ.સ. 1857 [D] ઈ.સ. 1930

28. ‘દયા ધરમકો મૂલ હે’, ‘દેહ મૂલ અભિમાન’ પંક્તિ કોની છે ?

[A] રૈદાસ [B] તુલશીદાસ [C] મીરાંબાઈ [D] કબીર

29. ‘જેઓ તલવાર ચલાવે છે, તેમનું મોત ... થી થાય છે.’

[A] બંદૂકથી [B] તોપથી [C] તલવારથી [D] ઝેરથી

30. સત્યાગ્રહ કોના કરતાં વધારે કામ કરે છે ?

[A] તોપબળ [B] આત્મબળ [C] દયાબળ [D] હથિયારબળ

31. જેમ બ્રહ્મચર્યની જરૂર છે, તેમ શું લેવાની જરૂર છે ?

[A] દિશા [B] મહાવ્રત [C] વૈરાગ્ય [D] ગરીબાઈ

32. અંગ્રેજી કેળવણીનો પાયો કોણે રચ્યો ?

[A] વેલેસ્લીએ [B] મિન્ટોએ [C] મેકોલેએ [D] મોર્લેએ

33. હિંદુંસ્તાનનો આર્થિક ઈતિહાસ પુસ્તક કોનું છે ?

[A] મિ. રોમેશચંદ્ર દત્ત [B] મિ. વ્યોમેશ ચંદ્ર દત્ત

[C] મિ. ચંદ્ર દત્ત [D] મિ. બોઝ

34. સંચાએ કોને ઉજ્જડ કરવા માંડ્યું છે ?

[A] ઈંગ્લેન્ડને [B] યુરોપને [C] રશિયાને [D] જાપાનને

35. હિંદના સ્વરાજ માટે કોના ઉપર જ ભરોસો રાખવો ?

[A] લશ્કર ઉપર [B] દારૂગોળા ઉપર [C] સત્યાગ્રહ ઉપર [D] સંચાકામ ઉપર

જવાબો પેપર-1

1.	D	8.	D	15.	B	22.	C	29.	C
2.	D	9.	D	16.	C	23.	C	30.	A
3.	C	10.	C	17.	D	24.	B	31.	D
4.	A	11.	C	18.	B	25.	A	32.	C
5.	A	12.	C	19.	A	26.	A	33.	A
6.	B	13.	A	20.	C	27.	B	34.	B
7.	A	14.	B	21.	D	28.	B	35.	C

હિંદ સ્વરાજ પેપર - 2 કુલ ગુણ : 35

1. સ્વરાજ માટેનું વાતાવરણ કોણે તૈયાર કર્યું હતું ?

   [A] રાણી વિક્ટોરીઆએ [B] વાઈસરોય

   [C] દાદાભાઈએ [D] જુવાનિયા હિંદીઓએ

2. પ્રો.ગોખલે તો કહે છે કે... પાસે આપણે ઘણું શીખવાનું છે.

   [A] મિ. હ્યુમ [B] અંગ્રેજો [C] શહીદો [D] હિંદીઓ

3. ગાંધીજીના મતે ખરી જાગૃતિ કયારથી આવી ?

   [A] ચૌરીચોરાના હિંસક બનાવથી [B] કોમી ઝઘડાથી

   [C] બંગાળાના ભાગલાથી [D] અંગ્રેજોના સુધારાથી

4. ગાંધીજીના મતે બંગભંગ વખતે હિંદુસ્તાનમાં થયેલ ... એ પણ ઠીક કહેવાય.

   [A] સત્યાગ્રહ [B] શાંતિ [C] અશાંતિ [D] કાનુન ભંગ

5. ગાંધીજીના મતે સ્વરાજ સમજવું કેવું લાગે છે ?

   [A] રોમાંચક [B] સહેલું [C] મુશ્કેલ [D] આનંદદાયક

6. ગાંધીજીના મતે તે વખતની ઈંગ્લેન્ડની પાર્લામેન્ટ કેવી હતી ?

   [A] ગુલામ [B] ખરાબ

   [C] સારી [D] વાંઝણી અને વેશ્યા

7. એક મહાન લેખકે ઈંગ્લેન્ડની પાર્લામેન્ટને કયું નામ આપ્યું હતું ?

   [A] દુનિયાની વાતૂડી [B] વાંઝણી [C] વેશ્યા [D] મૂંગી

8. જે દેશમાં નિષ્પક્ષ છાપાં ન હોય તે દેશના માણસોની સ્થિતિ કેવી થાય છે ?

   [A] સમૃધ્ધ [B] બેહાલ [C] વિકાસશીલ [D] વૈભવી

9. યુરોપની પ્રજા કેમ પાયમાલ થઈ રહી છે ?

   [A] આજકાલના સુધારાને કારણે [B] વિકાસને કારણે

   [C] વૈભવને કારણે [D] એશ–આરામને કારણે

10. ઈંગ્લેન્ડમાં કેટલી સ્ત્રીઓ પેટને અર્થે ગધ્ધામજૂરી કરે છે ?

    [A] વીસ લાખ [B] ત્રીસ લાખ [C] ચાલીસ લાખ [D] દશ લાખ

11. માણસો કયારે પોતે સળગાવેલા અગ્નિમાં બળી મરશે ?

[A] નજીક જશે ત્યારે [B] બાજુમાં જશે ત્યારે

[C] સુધારાની હડફેટમાં આવશે ત્યારે [D] સુધારાનો વિરોધ કરશે ત્યારે

12. કોણે અંગ્રેજી વેપારીને ઉત્તેજન આપ્યું ત્યારે તેઓ પગ પેસારો કરી શકયા ?

[A] રાજાઓએ [B] વેપારીઓએ [C] હિંદીઓએ [D] ઈંગ્લેન્ડના લોકોએ

13. 'ચાંદમાં સોનું છે કે નહીં !' આ પ્રશ્ન કોને પૂછવામાં આવ્યો હતો ?

[A] મિ. ગ્લેડસ્ટન [B] મિ.ચેમ્બરલેન [C] પ્રેસિડન્ટ ક્રૂગર [D] મિ. કલાઈવ

14. કોણ કાવાદાવા કરી આપણને રીઝવે છે અને આપણી પાસેથી કામ લે છે ?

[A] હિંદીઓ [B] અંગ્રેજો [C] ફ્રેન્ચો [D] અમેરિકનો

15. હિંદુસ્તાનની અત્યારે કેવી દશા છે ?

[A] સંઘર્ષપૂર્ણ [B] સારી [C] રાંકડી [D] નિર્બળ

16. ગાંધીજીના મતે રેલ્વેથી કયો રોગ ફેલાય છે ?

[A] મરકી [B] કેન્સર [C] એઈડ્સ [D] લકવો

17. માણસ શેના ઉપયોગ કરી ખુદા ને ભૂલેલ છે ?

[A] ધર્મનો [B] નીતિનો [C] ગાડાનો [D] રેલવેનો

18. આપણે અન્ય ધર્મના માણસ પ્રત્યે કયારે વેરભાવ ન રાખીશું ?

[A] સાચો ધર્મ આવશે ત્યારે [B] તિરસ્કાર કરીશું ત્યારે

[C] નિંદા કરીશું ત્યારે [D] ખરું જ્ઞાન વધતું જશે ત્યારે

19. જો હિંદુ-મુસલમાન વચ્ચે ત્રીજો માણસ તકરાર કરાવી શકે તો તેમને આપણે શું કહીશું ?

[A] પાકા હૈયાના [B] મજબૂત બાંધાના [C] સમજવાળા [D] કાચા હૈયાના

20. ગાંધીજીના મતે કોણે હિંદુસ્તાનને ગુલામી અપાવી છે ?

[A] દાક્તરે [B] ખેડૂતે [C] વેપારીએ [D] વકીલે

21. કોણ બે જણ મસિયાઈ ભાઈ છે ?

[A] ખેડૂત-વેપારી [B] વકીલ-જજ [C] દાક્તર-દર્દી [D] વકીલ-અસીલ

22. યુરોપના લોકો કોના જેવી ભૂલો પોતે નહીં કરે, એવું ગુમાન કરે છે ?

[A] રોમ અને ગ્રીસ [B] હિંદુસ્તાન [C] અમેરિકા [D] રશિયા

23. હિંદ સુધારો કેવો છે ?

[A] નિરીશ્વરી [B] સેશ્વરી [C] આધ્યાત્મિક [D] અનૈતિક

24. હિંદીઓમાં કઈ તાકાત છે ?

[A] ઘેરામાંથી છૂટવાની [B] વહીવટ દૂર કરવાની
[C] કુધારા લાવવાની [D] વિરોધ કરવાની

25. આપણે અંગ્રેજોના સુધારાને શું કર્યું છે, તેથી તે ભારતમાં રહી શકે છે ?

[A] ગ્રહણ કર્યા છે [B] ફેરફાર સુચવ્યો છે
[C] વિરોધ કર્યો છે [D] ફગાવી દીધો છે

26. કયા દેશની દશા હિંદની દશા કરતાં જુદી હતી ?

[A] જર્મની [B] ઈંગ્લેન્ડ [C] ઈટાલી [D] જાપાન

27. જે ખૂન કરીને રાજ્ય ભોગવશે તે પ્રજાને શું કરવાના નથી ?

[A] દુ:ખી [B] સુખી [C] આબાદ [D] બરબાદ

28. અંગ્રેજોએ જે કંઈ મેળવ્યું છે, તે કેવી રીતે મેળવ્યું છે ?

[A] હથિયારથી [B] મારામારી કરીને [C] અહિંસક રીતે [D] સમજાવટથી

29. ગાંધીજીના મતે ખરા હક્ક શેનામાંથી મળી શકે ?

[A] લડવાથી [B] વિનંતી કરવાથી [C] ફરજ બજાવવાથી [D] માંગવાથી

30. 'ઈતિહાસ' નો શબ્દાર્થ કયો છે ?

[A] તરજાુયો [B] 'આમ થઈ ગયું' [C] કહાણી [D] કોલાહલ

31. ઈતિહાસ કઈ ઘટનાની નોંધ લેતો નથી ?

[A] સ્વાભાવિક [B] હિંસક [C] અશાંત [D] તોફાની

32. સત્યાગ્રહ એ કેવી તલવાર છે ?

[A] સર્વધારી [B] બેધારી [C] બુઠ્ઠી [D] તિક્ષ્ણ

33. 'તે માણસને ખરી કેળવણી મળી છે કે જેની બુદ્ધિ શુદ્ધ છે, શાંત છે ને ન્યાયદર્શી છે,' આ વિધાન કોનું છે ?

[A] વેલેસ્લી [B] હક્સ્લી [C] ગાંધીજી [D] પ્રો.ગોખલે

34. કયો સપાટો લાગ્યો તેથી હિંદુસ્તાન પાયમાલ થયું ?

[A] કેળવણીનો [B] સંચાકામનો [C] અંગ્રેજોનો [D] સ્વાર્થી લોકોનો

35. પૈસા માણસને કેવો બનાવે છે ?

[A] પૈસાદાર [B] રાંક [C] સમૃદ્ધ [D] બળવાન

જવાબો પેપર-2

1.	C	8.	B	15.	C	22.	A	29.	C
2.	B	9.	A	16.	A	23.	B	30.	B
3.	C	10.	C	17.	D	24.	A	31.	A
4.	C	11.	C	18.	D	25.	A	32.	A
5.	C	12.	C	19.	D	26.	C	33.	B
6.	D	13.	C	20.	D	27.	B	34.	B
7.	A	14.	B	21.	B	28.	B	35.	B

હિંદ સ્વરાજ પેપર - 3 કુલ ગુણ : 35

1. હિંદ સ્વરાજ ક્યારે લખાયું હતું ?

   [A] 1925 [B] 1922 [C] 1920 [D] 1908

2. હિંદ સ્વરાજની પ્રસ્તાવનામાં ગાંધીજીએ કયા છાપાનું નામ આપ્યું છે ?

   [A] આર્યન પાથ [B] હરિજન

   [C] ઈન્ડિયન ઓપિનિયન [D] લંડન ઓપિનિયન

3. ગાંધીજીના મતે કોણે આપણને ચાબખા માર્યા છે અને જગાડ્યા છે ?

   [A] મિ.હ્યુમ [B] લોર્ડ લોવિયન [C] લોર્ડ એન્ડ્રુઝ [D] વેલેસ્લી

4. ગાંધીજીના મતે પ્રજાને તૈયાર કરવા કોણ 20 વર્ષ ભિખારી સ્થિતિમાં રહ્યાં છે ?

   [A] પ્રો. ગોખલે [B] લોકમાન્ય તિલક

   [C] મહાદેવ દેસાઈ [D] રાજા રામમોહન રાય

5. ગાંધીજીના મતે કૉંગ્રેસ મારફતે સ્વરાજનું બીજ રોપનાર કોણ હતા ?

   [A] દીનબંધુ એન્ડ્રુઝ [B] જસ્ટીસ બદરુદ્દીન

   [C] રાજા રામમોહન રાય [D] ગોખલે

6. ગાંધીજીના મતે અંગ્રેજોના કયા નિર્ણયથી હિંદ જાગ્યું છે ?

   [A] બંગાળના ભાગલા [B] અંગ્રેજોની નીતિ

   [C] મીઠા ઉપરનો વેરાનો [D] કરવેરો

7. ગાંધીજીના મતે બંગાળના ભાગલાથી લોકોમાં કયા પ્રકારની તાકાત ઊભી થઈ છે ?

   [A] જુસ્સો [B] આશા [C] લડાઈ [D] સ્વતંત્રતા

8. ગાંધીજીના મતે તે વખતે ઈંગ્લેન્ડની પાર્લામેન્ટ કેવી હતી ?

   [A] ગુલામ [B] ખરાબ [C] સારી [D] વાંઝણી અને વેશ્યા

9. કોણે કૉંગ્રેસના હેતુ પાર પાડવા માટે પોતાનાં તન, મન અને ધન આપેલાં છે ?

   [A] પ્રો.ગોખલે [B] મિ.હ્યુમ

   [C] જસ્ટીસ બદરુદ્દીન [D] સર વિલિયમ વેડરબર્ન

10. ગાંધીજીના મતે કંપનીને લાભ મળવાનું ખરું કારણ શું ?

[A] હિંદું-મુસલમાન વચ્ચેનું વેર [B] હિંદું-મુસ્લિમ દોસ્તી

[C] હિંદું-મુસ્લિમ અંતર [D] એકતા

11. નેપોલિયનના મતે અંગ્રેજ પ્રજા કેવી પ્રજા છે ?

[A] વ્યાપારી પ્રજા [B] લડાયક [C] શાંત [D] અભિમાની

12. હિંદ સ્વરાજ પુસ્તક ગાંધીજીએ મૂળ કઈ ભાષામાં લખ્યું હતું ?

[A] અંગ્રેજી [B] હિન્દી [C] ગુજરાતી [D] સંસ્કૃત

13. ગાંધીજીના મતે અંગ્રેજોએ રેલવે શા માટે સ્થાપી હતી ?

[A] મદદ કરવા [B] વેપાર કરવા [C] કાબૂ રાખવા માટે [D] વિકાસ કરવા

14. હિંદ સ્વરાજ પુસ્તક ગાંધીજીએ શેમાં બેસીને લખ્યું હતું ?

[A] આગબોટ [B] વિમાન [C] રેલ્વે [D] બસ

15. ગાંધીજીના મતે ઇસ્પિતાલો શેની જડ છે ?

[A] પાપની [B] વિકાસની [C] મદદની [D] અંધશ્રદ્ધાની

16. ગાંધીજીના મતે હિંદુંસ્તાનનું તળિયું કેવું છે ?

[A] મજબૂત [B] નબળું [C] તૂટેલું [D] જડ

17. ગાંધીજીના મતે પ્રાચીન ભારત કેવું હતું ?

[A] સ્પર્ધાત્મક [B] હરીફાઈ વગરનું [C] સ્વતંત્ર [D] તટસ્થ

18. પ્રાચીન ભારતમાં કોણ ઊંચું ગણાતું ?

[A] ક્ષત્રિયો [B] વ્યાપારીઓ [C] રાજાઓ [D] ઋષિયો

19. ગાંધીજીના મતે મેઝિની કોણ હતો ?

[A] ઈટાલીનો મહાત્મા [B] યોદ્ધો [C] નેતા [D] સંત

20. ગેરિબાલ્ડી કોણ હતો ?

[A] યોદ્ધો [B] નેતા [C] મહાત્મા [D] સંત

21. ઈટાલીમાં કોણ રાજ્ય કરતું હતું ?

[A] અમેરિકા [B] ઓસ્ટ્રેલિયા [C] ઓસ્ટ્રીયા [D] ઈંગ્લેન્ડ

22. ગાંધીજી અંગ્રેજોના જુલમની સામે ઝઝુમવાની જેમ દેશી રાજ્યોના જુલમ સામે શું કરવાનું કહેતા ?

[A] ઝઝૂમવાનું [B] શાંત રહેવાનું [C] લડવાનું [D] ગુલામ રહેવાનું

23. ગાંધીજીનું સ્વદેશાભિમાન કોને આધીન છે ?

[A] કર્મ [B] સ્વરાજ [C] સત્ય [D] ધર્મ

24. આપણું સ્વરાજ્ય કેવું હોય ?

[A] પંચકોણ [B] ત્રિકોણ [C] ચતુષ્કોણ [D] અષ્ટકોણ

25. કોંગ્રેસે કોના જેવું સ્વરાજ ઇચ્છ્યું છે ?

[A] અમેરિકા [B] કેનેડા [C] બ્રિટન [D] ઈટાલી

26. બંગાળના ભાગલા વખતે બંગાળીઓએ કોને વિનંતી કરી હતી ?

[A] લોર્ડ વિલિયમ બેન્ટિક [B] લોર્ડ કર્ઝન

[C] વેલેસ્લી [D] ડેલ હાઉસી

27. કઈ કોંગ્રેસ વખતે લગભગ મારામારી પણ થઈ હતી ?

[A] સુરત [B] મુંબઈ [C] અમદાવાદ [D] કલકત્તા

28. બંગાળના ભાગલા રદ કરવા એ કઈ માંગણી બરાબર છે ?

[A] સ્વરાજ [B] સ્વપક્ષ [C] સ્વહક [D] સ્વસત્તા

29. આપણા આગેવાનોમાં બે તડાં થયા છે : એક મોડરેટ ને બીજા ...

[A] ટોલરેટ [B] સાયન્ટીસ્ટ [C] એકસ્ટ્રીમિસ્ટ [D] કોલમનિસ્ટ

30. અશાંતિ શબ્દ કોંગ્રેસકાળમાં કઈ રીતે ઓળખાતો ?

[A] ઓનેસ્ટ [B] ડિસકનેકટ [C] ડિસ્કન્ટેન્ટ [D] અનરેસ્ટ

31. કેનેડા અને બોઅર લોકોએ શેના આધારે રાજસત્તા મેળવી હતી ?

[A] તલવાર [B] કલમ [C] દારૂગોળો [D] અહિંસા

32. હિંદ સ્વરાજ પુસ્તક કોના માટે લખાયું હતું ?

[A] હિંદીઓના હિંસાવાદી સંપ્રદાય

[B] દક્ષિણ આફ્રિકામાંના હિંસાવાદી વિચાર ધરાવનાર વર્ગને જવાબરૂપે

[C] અંગ્રેજો

[D] હિંદીઓના હિંસાવાદી સંપ્રદાય અને દક્ષિણ આફ્રિકામાંના હિંસાવાદી વિચાર ધરાવનાર વર્ગને જવાબદારરૂપે

33. હિંદ સ્વરાજ પુસ્તકમાં કુલ કેટલા પ્રકરણો છે ?

[A] 10 [B] 15 [C] 20 [D] 16

34. મુખ્ય પ્રધાન સત્તાના તોરમાં _____ રહે છે.

[A] બેધ્યાન [B] ગુલતાન [C] મશગૂલ [D] મગ્ન

35. કોના હિસાબે સુધારો તે કુધારો છે ?

[A] ભારતીય લેખકો [B] રશિયન લેખકો

[C] અંગ્રેજ લેખકો [D] જર્મન લેખકો

જવાબો પેપર-3

1.	D	8.	D	15.	A	22.	A	29.	C
2.	C	9.	D	16.	A	23.	C	30.	C
3.	A	10.	A	17.	B	24.	D	31.	C
4.	A	11.	A	18.	D	25.	B	32.	D
5.	B	12.	C	19.	A	26.	B	33.	C
6.	A	13.	B	20.	A	27.	A	34.	B
7.	D	14.	A	21.	C	28.	A	35.	C

હિંદ સ્વરાજ પેપર - 4 કુલ ગુણ : 35

1. હિંદ સ્વરાજ પુસ્તકમાં શેની સખત ઝાટકણી છે ?

   [A] આધુનિક સુધારાની [B] પૂર્વના સુધારાની [C] પ્રાચીન સંસ્કૃતિની [D] ત્રણેયની

2. હિંદ સ્વરાજ ગ્રંથ કેવો છે ?

   [A] બીજરૂપ [B] સારરૂપ [C] બન્ને [D] એક પણ નહિ

3. બંગાળનો પવન કયાં પહોંચ્યો છે ?

   [A] ઉત્તરમાં પંજાબ [B] મદ્રાસ ઈલાકામાં

   [C] કન્યાકુમારી ભુશિર સુધી [D] આપેલ તમામ

4. યુરોપના સુધારામાં શેની વાત નથી ?

   [A] ઢોંગની [B] નીતિ અને ધર્મની [C] અનીતિની [D] શરીર સુખની

5. યુરોપના સુધારાથી શા માટે દૂર રહેવાનું જરૂરી છે ?

   [A] શયતાની રાજ્ય હોવાથી [B] સડાવાળો હોવાથી

   [C] નાશકારક હોવાથી [D] ત્રણેય કારણો હોવાથી

6. બધા ધર્મો શું શીખવે છે ?

   [A] દુન્યવી વસ્તુઓ વિષે મંદ રહેવું [B] ધાર્મિક વસ્તુઓ વિષે ઉત્સાહી રહેવું

   [C] દુન્યવી લોભની હદ બાંધવી [D] આપેલ તમામ

7. ગાયની રક્ષા કરવાનો એક જ ઉપાય કયો છે ?

   [A] મુસલમાનભાઈની પાસે હાથ જોડવા [B] ગાયને જતી કરવી

   [C] પોતાનો પ્રાણ લેવો [D] મુસલમાનનો પ્રાણ લેવો

8. વકીલે શું કર્યું છે ?

   [A] હિંદુસ્તાનને ગુલામી અપાવી છે [B] હિંદુ મુસલમાનના કજિયા વધાર્યા

   [C] અંગ્રેજી સત્તા વધારી [D] આપેલ તમામ

9. અંગ્રેજી સત્તાની મુખ્ય ચાવી કઈ છે ?

   [A] વકીલો [B] અદાલત [C] જડ્જો(જજો) [D] દાક્તર

10. ભલાઈનો ડોળ ઘાલનાર દાક્તરો કરતાં કોણ સારું ?

[A] હોમિયોપથ [B] યુનાની [C] ઠગવૈદ્ય [D] હકીમ

11. હિંદુસ્તાન તળિયેથી કોના કરતાં મજબૂત છે ?

[A] જાપાન [B] ઈજીપ્ત [C] ગ્રીસ [D] આપેલ તમામ

12. ફરજ બજાવવી એટલે શું ?

[A] નીતિ પાળવી

[B] મન ઈન્દ્રિયોને વશ રાખવી

[C] નીતિ પાળવી અને મન ઈન્દ્રિયોને વશ રાખવી બંને

[D] એક પણ નહિ

13. સ્વરાજ સ્વપ્નવ્‌ત નથી તો શું છે ?

[A] મનથી માનીને બેસી રહેવાનું [B] જણે જણે ભોગવવાનું

[C] પોતે ચાખવાનું [D] એક પણ નહિ

14. દેશી રજવાડા પ્રજાને શું કરે છે ?

[A] કચડે છે [B] અધમતાથી લોકોને પીડે છે.

[C] પ્રજા પર જુલ્મ કરે છે [D] આપેલ તમામ

15. કયું બળ અવિનાશી છે ?

[A] હથિયારબળ [B] સત્તાબળ

[C] દયાબળ કે આત્મબળ [D] એક પણ નહિ

16. સત્યાગ્રહમાં શેનાથી અભય થવાનું છે ?

[A] ખોટા માનથી [B] મરણથી [C] રાજદરબારથી [D] આપેલ તમામ

17. સ્વરાજ લેવા ખાતર ગાંધીએ પોતાનું શું અર્પણ કરવા કહ્યું ?

[A] સ્વમાન [B] બચત [C] દેહ [D] શક્તિ

18. હિંદ સ્વરાજ અંગ્રેજી અનુવાદની પ્રસ્તાવના ગાંધીજીએ લખી આપ્યાનું વર્ષ કયું છે ?

[A] ઈ.સ.1911 [B] ઈ.સ.1921 [C] ઈ.સ.1909 [D] ઈ.સ.1914

19. કોના શિક્ષણ પ્રમાણે આ શયતાની રાજ્ય ગણાય ?

[A] કુરાન [B] પેગમ્બર મહંમદ [C] હિંદુ ધર્મ [D] બાઈબલ

20. હિંદુ ધર્મ પ્રમાણે શયાતાની રાજ્યની એટલે...

[A] સત્‌કાળ [B] દ્વાપરકાળ [C] કળિકાળ [D] ત્રેતાકાળ

21. અંગ્રેજોનું _____ જોઈને ભારતીયોને મોહ થયો.

[A] પિત્તળ [B] તાંબુ [C] રૂપું [D] સોનું

22. જાપાનમાં કયો વાવટો ઊડે છે ?

[A] ભારત [B] કેનેડા [C] રશિયા [D] અંગ્રેજી

23. મુસલમાનો કોની પાસેથી અમુક હક માગે છે ?

[A] લોર્ડ મિન્ટો [B] લોર્ડ વેલેસ્લી [C] લોર્ડ મોર્લે [D] લોર્ડ ડેલહાઉસી

24. ગાંધીજીના મતે ચોરને ચોર સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ ?

[A] ક્ષમા કરવાથી [B] સાચા ધંધે વળગાડવો જોઈએ

[C] સમજાવવાથી [D] શુષ્ક વ્યવહાર

25. ગાંધીજીના મતે દુનિયાની હિસ્ટ્રી કેવી છે ?

[A] રાજાઓની [B] કોલાહલની કહાણી

[C] ગુલામોની [D] પ્રજાની

26. ગાંધીજીના મતે સત્યાગ્રહી કેવો હોય છે ?

[A] દૃઢ અને આત્મબળ ધરાવનારો [B] ઢીલો

[C] નબળો [D] સશક્ત

27. ગાંધીજીના મતે હિંદુસ્તાન શું છે ?

[A] રાજકારણીઓ [B] ગુલામો [C] કરોડો ખેડૂતો [D] વ્યાપારીઓ

28. ગાંધીજીએ રાજસ્થાનની રૈયતનો રાજા સામે થવાનો કયો રસ્તો દાખલો દર્શાવ્યો છે ?

[A] રૈયતે ગામ ખાલી કર્યું તેનો [B] લડવાનો

[C] પડી રહેવાનો [D] ગુલામ રહેવાનો

29. ગાંધીજીના મતે સત્યાગ્રહ માટે શું કરવું જોઈએ ?

[A] શરીર કસવાની જરૂર છે [B] શરીર નબળા રહેવાનો

[C] લડાઈ કરવા તૈયાર રહેવાનો [D] શક્તિ વધારવાનો

30. ગાંધીજીના મતે બ્રહ્મચર્ય એ કેવું વ્રત છે ?

[A] ભક્તિ [B] સમાધાન [C] અણુવ્રત [D] મહાવ્રત

31. ગાંધીજીના મતે ગરીબાઈ ધારણ કરવી એટલે શું?

[A] પૈસાનો લોભ ન રાખવો [B] સ્વાર્થી બનવું

[C] દાન કરવું [D] ખર્ચ ન કરવો

32. ગાંધીજીના મતે સત્યાગ્રહી માટે શું મહત્ત્વનું છે ?

[A] જુસ્સાવાળું હોવું જોઈએ [B] બ્રહ્મચર્ય

[C] અભયતા [D] બહાદુરી

33. ગાંધીજીના મતે અંગ્રેજી કેળવણીથી શું થશે ?

[A] પ્રજા સાક્ષર થશે
[B] પ્રજાને મદદ થશે
[C] પ્રજાનો વિકાસ થશે
[D] પ્રજા ગુલામ થશે

34. ગાંધીજીના મતે મેકોલેએ કેળવણીનો પાયો શા માટે રચ્યો ?

[A] સ્વતંત્ર થવા માટે
[B] ગુલામી દૃઢ કરવા માટે
[C] શિક્ષણના વ્યાપ માટે
[D] વિકાસ માટે

35. ગાંધીજીના મતે સ્વરાજ શું છે ?

[A] પીઠબળ
[B] સ્વતંત્રતા
[C] લોકોનું રાજ
[D] મનનું રાજ્ય

જવાબો પેપર-4

1.	A	8.	D	15.	C	22.	D	29.	A
2.	A	9.	B	16.	D	23.	C	30.	D
3.	D	10.	C	17.	C	24.	A	31.	A
4.	B	11.	D	18.	B	25.	B	32.	C
5.	A	12.	C	19.	B	26.	A	33.	D
6.	D	13.	B	20.	C	27.	C	34.	B
7.	A	14.	D	21.	C	28.	A	35.	C

હિંદ સ્વરાજ પેપર - 5 કુલ ગુણ : 35

1. ગાંધીજીના મતે ધનાઢ્ય માણસ શું કરશે ?

[A] પૈસા કમાશે [B] વિકાસ કરશે

[C] સ્વદેશી વાપરશે અને તેનો પ્રચાર કરશે [D] યંત્રો બનાવશે પ્રચાર કરશે

2. ગાંધીજીના મતે લોકોએ શું કરવું જોઈએ ?

[A] ગુલામીમાંથી મુક્ત રહેવું જોઈએ

[B] ભગવાન રાખે તેમ રહેવું જોઈએ

[C] લોકો કહે તેમ કરવું જોઈએ

[D] બીજાનો વિચાર કર્યા સિવાય પોતે સાચા માર્ગ ઉપર ચાલવું જોઈએ

3. અદાલતો આવવાથી માણસો કેવા બન્યા ?

[A] બાયલા [B] સ્વાર્થી [C] ડરપોક [D] ભીરુ

4. આપણે કયા પાણીના માછલીમાં છીએ ?

[A] કોરટ દરબારરૂપી [B] ગુલામીરૂપી [C] સ્વરાજરૂપી [D] સ્વાભિમાનરૂપી

5. યુરોપના લોકો શેમાંથી શીખે છે ?

[A] અમેરિકાના પુસ્તકોમાંથી [B] રોમના પુસ્તકોમાંથી

[C] ગ્રીકના પુસ્તકોમાંથી [D] રોમ અને ગ્રીકના પુસ્તકોમાંથી

6. આપણે જગતને શેનાથી માપીએ છીએ ?

[A] દમડીના માપથી [B] દ્રવ્યથી [C] ત્રાજવાથી [D] પૈસાથી

7. અંગ્રેજો જો _____ થઈને રહે તો આપણે તેનો સમાસ કરી શકીએ છીએ.

[A] ગુલામ [B] હિંદી [C] વેપારી [D] વિદેશી

8. કોની ધારણા જેવું ઈટાલીમાં ન થયું ?

[A] અમીન [B] મેઝિની [C] નેપોલિયન [D] ગેરિબાલ્ડી

9. વિકટર ઈમેન્યુઅલના મતે ઈટાલી એટલે...

[A] ઈટાલીના ખેડૂતો [B] ઈટાલીના લોકો [C] ઈટાલીના રાજા [D] મેઝિની

10. આપણે _____ સુધારારૂપી ભાંગ પીધી છે.

[A] ખરાબ [B] ગંદા [C] નીચ [D] અધમ

11. હિંદુસ્તાનને કોણે કંગાલ બનાવ્યું છે ?

[A] રેલવે [B] વકીલો [C] દાક્તરો [D] આપેલ તમામ

12. _____ એ આધુનિક સુધારાની જીવની નિશાની છે.

[A] ટી.વી. [B] કમ્પ્યૂટર [C] સંચો [D] ઈન્ટરનેટ

13. આપણા દેવતા કયા દેશના સંચામાં ઘડાઈને આવે છે ?

[A] જર્મન [B] અમેરિકા [C] બ્રિટન [D] જાપાન

14. કઈ વસ્તુ હિંદને સદે તેવી નથી ?

[A] હથિયાર [B] દારૂગોળો [C] ગુલામી [D] ગરીબી

15. મોગલ બાદશાહને ભરમાવનાર કોણ હતું ?

[A] વેપારી [B] વકીલ [C] તબીબ [D] જજ

16. પશ્ચિમના સુધારાનું વલણ કોના તરફ વધારે હતું ?

[A] નીતિ દૃઢ કરવા [B] અનીતિ દૃઢ કરવા

[C] વિશ્વાસ દૃઢ કરવા [D] એક પણ નહિ

17. સ્વરાજ મેળવવા જે કાંઈ કરવું એ આપણું _____ છે.

[A] કર્તવ્ય [B] સ્વપ્ન [C] મન [D] કારણ

18. હિંદી સુધારાને આંચ નથી આવી ત્યારે બીજા બધા સુધારા...

[A] ખોટા પડ્યા [B] અટકી ગયા [C] અટવાઈ ગયા [D] રગદોળાઈ ગયા

19. પશ્ચિમના એક લેખકે વકીલ દાકતર ધંધા સંદર્ભે શું બનાવ્યું છે ?

[A] હોટલ [B] બગીચો [C] હોસ્પિટલ [D] ઝાડ

20. કોણે જે આપ્યું હોય તે ધાસ્તીથી આપ્યું હોય એવો સંભવ છે ?

[A] મુસલમાનો [B] લોર્ડ મોર્લે [C] લોર્ડ કર્ઝન [D] મિ.હ્યુમ

21. ગાંધીજીને યંત્રો સામે શા માટે વાંધો હતો ?

[A] તેનો દુરુપયોગ [B] ધનનો લાભ

[C] તેની ઘેલછા [D] બેરોજગારી વધારનાર

22. ગાંધીજીના મતે પાર્લામેન્ટ કેવી છે ?

[A] વાંઝણી [B] વેશ્યા

[C] વાંઝણી અને વેશ્યા [D] એક પણ નહિ

23. સત્યાગ્રહ _____ હોવાથી તેની નોંધ લેવામાં આવતી નથી.

[A] અસ્વાભાવિક [B] સ્વાભાવિક [C] મુશ્કેલ [D] સરળ

24. યુરોપના સુધારાની નિશાની કઈ છે ?

[A] સસ્તો સંદેશાવ્યવહાર [B] વધારે વાર ખાવાનું

[C] વધુ ઈસ્પિતાલો [D] આપેલ તમામ

25. મેકોલોએ હિંદીને શું ગણેલા ?

[A] નિર્ભય [B] જુસ્સાવાળા [C] નામર્દ [D] અધમ

26. ધર્મધૂતારાએ કયા ધૂતારા કરતા સારા છે ?

[A] દુન્વયી [B] ગુલામ [C] લોભી [D] અધાર્મિક

27. જ્યારે અંગ્રેજો હિંદુસ્તાનમાં ન હતા ત્યારે આપણે કેવા હતા ?

[A] જુદી જુદી પ્રજા [B] એક પ્રજા [C] જુદી રહેણીવાળા [D] મૂર્ખ

28. ગાંધીજીના મતે હથિયાર ધારણ કરવા એટલે શું ?

[A] પવિત્ર ભૂમિને રાક્ષસી બનાવવી [B] વિનાશ માટે

[C] કોઈની હત્યા કરવી [D] ભૂમિના વિકાસ માટે

29. વકીલનો ધંધો શું શીખવે છે ?

[A] નીતિ [B] સમાધાન [C] ઝઘડો [D] અનીતિ

30. ગાંધીજીના મતે સત્યાગ્રહ શા માટે કરવો જોઈએ ?

[A] શરીર કસવાની જરૂર છે [B] ગતિ વધારવાનો

[C] લડાઈ કરવા તૈયાર રહેવાનો [D] શરીરને નબળા કરવાનો

31. ગાંધીજીના મતે અક્ષરજ્ઞાન શું છે ?

[A] ધ્યેય [B] કેળવણી [C] હથિયાર [D] સાધન

32. પશ્ચિમની કેળવણી શું લાવે છે ?

[A] અભિમાન [B] પ્રતિષ્ઠા [C] આત્મવિશ્વાસ [D] ગુલામી

33. સ્વરાજ ભોગવવું એટલે શું ?

[A] બીજા પર રાજ કરવું [B] ગુલામીમાંથી સ્વતંત્ર થવું

[C] આપણી ઉપર આપણે રાજ ભોગવવું [D] એક પણ નહિ

34. સત્યાગ્રહની ચાવી શેમાં છે ?

[A] સુખ ભોગવવામાં

[B] લડતા રહેવામાં

[C] દુઃખ ભોગવવામાં

[D] આપણને કોઈનો જુલમ બંધન કરી શકતો નથી

35. જ્ઞાનની આપણે _____ નથી કરવાની.

[A] બંદગી [B] પૂજા [C] મૂર્તિપૂજા [D] પ્રાર્થના

જવાબો પેપર-5

1.	D	8.	B	15.	C	22.	C	29.	D
2.	D	9.	C	16.	B	23.	B	30.	A
3.	B	10.	D	17.	A	24.	D	31.	C
4.	D	11.	D	18.	D	25.	C	32.	A
5.	D	12.	C	19.	D	26.	A	33.	C
6.	A	13.	A	20.	B	27.	B	34.	D
7.	B	14.	B	21.	D	28.	A	35.	B